

શ્રી ચદ્રાવિજય

ગુરૂ પણ્થપત્ર

દાદાસાહેબ, ભાવનગર,

ફોન : ૦૨૭૮-૨૪૨૫૨૨૨

૩૦૦૧૮૫૬

મયને ઓળખો

ભાગ ૨ ને



લેખક

મુનિ વિદ્યાવિજય

શ્રી વિજયધર્મસૂર્તિ જૈન પ્રથમાગ્રા પુષ્પ ૧૪.

સમયને ઓળખો.

ભાગ ૨ ને.

લેખક —

મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી.

પ્રથમ આવૃત્તિ ૧૦૦૦

વીર સં. ૨૪૬૦. ધર્મ સં. ૧૨. વિ. સં. ૧૮૬૦.

કિ. ૦-૧૦-૦.

પ્રકાશક—દીપચંદ બાંદ્યા, મંત્રી, શ્રી વિજયધર્મસુરિ નૈન
અંથમાળા. છાટા સરાઝા, ઉજાનૈન.


—ઃ દ્રવ્યસહાયકો ॥ —

૧ સ્વ૦ ખાઈ કેવળીના સ્મરણુથ
તેમના પતિ, શોઠ નેમચંદ કચરાલાઈ
શામળાની પોળ, અમદાવાદ.

૨ સ્વ૦ શોઠ ભીખાલાઈ જેચંદના સ્મરણુથ
તેમના પુત્ર શોઠ દલપતલાઈ જેચંદલાઈ
મોધર-ડાકોરની (આણુંદ)

મુદ્રક—શા. ગુલાખચંદ લલ્લભાઈ, શ્રી મહોદ્ય પ્રીન્ટિંગ પ્રેસ,
દાણુંપીઠ—ભાવનગર.

श्री विजयधर्मसूरि.



उद्धर्ता तत्त्वशास्त्राणां हर्ता जातीयपापनाम् ।
ग्रन्थकृद् धर्मधृद् ज्ञानी धर्मसूरिभूद् गुणी ॥

श्री भद्राद्य प्रेस-भावनगर.

અતુકે મહિંકા

૩૭ ધર્મભાવના.	૧
૩૮ સહકાર.	૧૨
૩૯ શું નૈન સૂત્રોમાં માંસાહારનું વિધાન છે ?	૨૦
૪૦ સામાજિક બન્ધનો.	૪૧
૪૧ સામાજિક ઉત્તીતિ.	૫૧
૪૨ સમય ધર્મ.	૬૫
૪૩ સિદ્ધપુત્ર.	૮૦
૪૪ અહિંસાનું અજર્ણું.	૮૨
૪૫ "	૧૦૭
૪૬ મિક્ષુકો મિક્ષુકં દૃષ્ટ્વા ।	૧૧૮
૪૭ સુધ્યારો.	૧૩૧
૪૮ જગતી જનવરોની હિંસા.	૧૪૨
૪૯ સદેશ.	૧૫૬
૫૦ મહાવીર-જયન્તી.	૧૬૨
૫૧ વિદ્યાર્થી કે વિવાહાર્થી.	૧૭૧
૫૨ વિદ્યાનોની ઝોટ.	૧૮૧
૫૩ ધન પ્રણાલી.	૧૮૮
૫૪ સામાજિક પતન.	૨૦૦
૫૫ ચુવકોને !	૨૧૦
૫૬ ધર્મ અને સમાજ પર સમયનો પ્રલાવ.	૨૧૮



પ્રકાશકનું નિવેદન.



સાહિત્ય એ જીવનનો માર્ગદ્રષ્ટા છે. જે સાહિત્ય હૃદયની લાગ-
ખુલ્લોએ અને જગતના સૂક્ષ્મ અનુભવ પણી જન્મે છે, તે અનેકનું
કલ્યાણું કરવામાં સહાયભૂત થાય છે. આજે આવા સાચા સાહિત્યની
જગતને ભૂખ ઉધ્દી છે. તે, કોઈપણ જાતના ધાર્મિક કે સામ્પ્રદાયિક
અલિનિવેશ સિવાયના, પરન્તુ જગતની કુંચીઓ સમજવતા સાહિત્યને
કંખી રહ્યું છે. આવા સાહિત્યનું સર્જન કુયાં છે ?

અમારી ગ્રંથમાળા આવી જાતના સાહિત્યને જનસમાજ સમક્ષ
રણું કરવાના મનોરથો સેવી રહી છે. અને અમને જણાવતાં હર્ષ થાય
છે કે-કુંક સમયમાંજ એણે જનતાસમક્ષ ૧૩ પુરતકો ધરી દીધાં છે
અને ચૌદસું પુણ્ય મુનિરાજશ્રી વિદ્યાવિજયજીની કૃતિનું આ ધરાય છે.

મુનિરાજશ્રી વિદ્યાવિજયજી નૈત જગતના એક સ્વતંત્ર અને
સુધારક વિચારવાળા સમયર લેખક અને વક્તા છે, એ જણાવવાની
હવે ભાગ્યેજ જરૂર રહે છે. એમના કેટલાયે ગ્રંથોએ સમાજમાં જે
આદર મેળવ્યો છે, એ કોઈથી અનાણ્યું નથી. ‘સમયને એણાએ,’
નામના પુરતકો ૧ લો. ભાગ થોડા વખત ઉપર બહાર પડેલો, તેની
પહેલી આવતી પણી, અમારે તેની બીજી આવતી પણું બહાર પાડવી
પડી છે, અને ‘સમયને એણાએ’ નો બીજો ભાગ પણ અમે
જનતાની સમક્ષ મૂકીએ છીએ.

‘ સમયને એળાએ ’ના પહેલા અને થીજા ભાગમાં મુનિરાજશ્રી વિદ્યાવિજ્યજીના, તે એજસ્વી અને પ્રભાવશાળા લેખાનો સંશેષ છે, કે જે લેખો ‘ ધર્મધ્વજ ’ માં નિયમિત રીતે તેમણે લખ્યા હતા. પહેલા ભાગમાં ૧ થી ૩૬ સુધીના લેખો આપવામાં આવ્યા છે, જ્યારે આ થીજા ભાગમાં ૩૭ થી ૫૬ સુધી.

વાંચકો જોઈ શકશો કે— મુનિરાજશ્રી વિદ્યાવિજ્યજીના આ ૫૬ લેખામાં આવતી કાલના પડધાએ છે, જીવનની સમસ્યાઓના સુંદર ઉકેલ છે; સમાજના અધઃપતન માટેની લાલખતી છે, સાધુજીવનના સુધારાએ માટેની ઉત્ત્ર પરન્તુ આવશ્યક અને આદરણીય સૂચનાઓ છે. ટૂંકમાં કંઈએ તો આજના સામાજિક જીવનને કોતરી ખાતી રૂઢીએ રહ્યાબેનો નિર્ભિક બળવો છે. પ્રત્યેક લેખમાંથી સુધારણાની ઉત્ત્રતા અને ધગથ તરી આવે છે.

અમારી સંપૂર્ણ ખાતરી છે કે—મુનિરાજશ્રી વિદ્યાવિજ્યજનો ‘ સમયને એળાએ ’નો સંદેશ જૈનસમાજના જીવનમાં ઉપયોગી નિવડશે, અને તેમણે પ્રત્યેક લેખમાં, જૈનજીવન સાથે જોડો સંબંધ ધરાવતા પ્રશ્નો પર કરેલી નિડર ચર્ચા ઉપર જૈન સમાજ ધ્યાન આપી સુધારાના માર્ગ વળશે.

“ લેખાનો સંશેષ અને તેની પ્રેસ ડોપી કરી આપનાર ભાઈ શાન્તિલાલ બલાભીદાસ દેખગામવાળાનો આભાર માનીએ છીએ. ”

શ્રીવિજ્યધર્મસુરિ જૈન અંથમાળા.

છાટા સરાક્ષા, ઉજાનૈન.

૧-૧-૩૪.

દીપચંદ ખાંડિયા.

મંત્રી.

સમયને ઓળખો.

ભાગ ૨ નો.



मुनिश्री विद्याविजयजी महाराज.

श्री मહोदय प्रेस-भावनगर.

(૩૭)

ધર્મ ભાવના.

‘ધર્મ ભાવના’ એજ આર્યવર્તના મનુષ્યોનું ભૂષણું છે. યુરોપના દેશવાસીઓ કરતાં ભારતવાસીઓમાં કંઈ વિશેષતા હોય તો તે, યુરોપવાસીઓ! પૈછાદિક ભાવોની ઉજ્જ્વલિમાં રાતદિવસ રચ્યા પરચ્યા રહે છે, જ્યારે ભારતીય લેઙ્ગે સાધન પુરતા પૈછાદિક ભાવને પોષવા સાથ ‘ધર્મભાવના’ ના ધ્યેયને છોડતા નથી. ટુંકમાં કહીએ તો ‘ધર્મભાવના’ એ ભારતીય મનુષ્યોનો મુદ્રાલેખ છે. અહુધા ભારતમાં જન્મ લેનારના સંસ્કારો જોઈશું તો આપણું જણાશો કે-તેનામાં

સ્વભાવિક દ્વારા નમૃતા, વિવેક, પ્રેમભાવ અને ધર્મની પ્રવૃત્તિઓ તરફ અભિદ્યા જરૂર હેખાશે. જો કે, બધી કોમોમાં જન્મ લેનારાઓમાં એક સરખો આ ભાવ નહિં હોય, તો પણ લગભગ સનાતનધર્મી—જૈન વિગેરે એવી ઉચ્ચ જાતિની કોમોમાં તો આ ભાવ અવશ્ય મહોટા ભાગે હેખાશે જ.

આણક જન્મયા પછી માતા-પિતાની સાથે બહાર જવા લાગે છે, ત્યારથી તે માતાપિતાની ભાવનાનું અનુકૂલણું કરતું જોવાશે. ભલે, તેનામાં એ સમજવાની શક્તિ નાહ હોય, કે આ શું થાય છે? આ કિયા શા માટે કરવામાં આવે છે? તેમ છતાં એ એટલું તો જરૂર સમજે છે કે—આ અમારા શુરૂ છે. શુરૂને મા નમસ્કાર કરે છે માટે મારે પણ કરવા જોઈએ. મા મંદિરમાં જય, અને જે પ્રમાણે તે કરે, તે પ્રમાણે તે બાળક પણ કરે છે. ધણી વખત તો એવાં બાળકો જોવામાં આવે છે કે જેનામાં, આપણે જાણ્યો એ જરા પણ સમજશક્તિ નથી, સાવ બાળક—એ ત્રણ વર્ષની ઉમરનું બાળક હોય, એવાં પણ માતા-પિતાની ગેરહાજરીમાં મંદિરમાં પહોંચ્યી જય છે, અને ભગવાનની મૂર્ત્તિની રહામે મીંટ માંડીને બેસી રહે છે. આ પૂર્વ જન્મના સંસ્કારો નહિં તો બીજું શું છે? ધણા એવા બાળકો આપણે જોઈશું કે—જેનામાં સ્વભાવિક વિનયખુદ્ધિ હોય છે. કોઈ આચ્યું, ગચ્છું, તે વખતે હુથ જોરવા, પ્રણામ કરવા, વિગેરે નિયમો સાચવે છે. આ પણ સંસ્કારોનું પરિણામ છે.

કહેવાની ભતલખ કે—‘ધર્મભાવના’ એ ભારતીય મનુષ્યોનો જન્મસિદ્ધ મુદ્રાવેખ છે, આદર્શ છે. આ બાદ્યાવસ્થાના સંસ્કારોને જે તેવું ને તેવું પોષણ મળતું રહે છે, તો તે કાયમ રહે છે. પરંતુ એજ બાળક જ્યાં જરા મોટું ધ્યું, સ્કુલમાં ભણવા લાગ્યું, સંસારની હવામાં અફડાવા લાગ્યું, ત્યાં તેના સંસ્કારોમાં શિધિતતા પ્રવેશવા લાગે છે. એ બદ્ધ્યાંએની નિર્દેખતામાં હવે ઉણુપ આવવા લાગે છે. આવા સંચોરોમાં જે સંસ્કારી માતા-પિતા કે ડોઝ વડીલના આશ્રય નીચે જ્યાં સુધી રહેવાનું હોય છે, ત્યાં સુધી તો તેની તે ધર્મભાવના લગભગ કાયમજ રહે છે, પરંતુ નચીબ ચોગે કાં તો એવા સંસ્કારી ધર્મભાવનાવાળાં માતપિતાજ ન હોય, કિંવા એવા માતાપિતાનો વિરહુ ધાય તો તે બાળક-ચુવાનીના દ્વારમાં પ્રવેશ કરવા તૈયાર થયેલો બાળક સ્વાભાવિક જ પોતાની ધર્મભાવનાને ખોવા લાગે છે. એટલુંજ નહિ પરંતુ એની આસપાસ યદિ એવાજ નાસ્તિક-શ્રદ્ધાદીન ચુવકો ફરી વળેલા હોય છે, તો તો તેની ધર્મભાવનાનું નામો નિશાન સરખું પણ રહેવા પામતું નથી.

આજ ચુવક જ્યાં સુધી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણું—કેળવણી લેતો હોય છે, ત્યાં સુધી તો કંઈકે એનામાં આસ્તિકતા, ધર્મશ્રદ્ધા, વિનય, વિવેક, સલ્લયતાનાં ચિહ્ન નજરે પડશે. પરંતુ જ્યાં તે ઉચ્ચ કેળવણી, એટલે કે એજચ્યુએટ થવું, છંગુનીયરી, ડાક્ટરી આહિનો અલ્યાસ કરવો, આ કેળવણીમાં

પ્રવેશ કરે છે, એટલે એઓની ધર્મભાવના ભાગ્યે જ કોઈ ભાગ્યશાળીમાં જોવામાં આવે છે. અહિ પણ, એટલું તો ખર્દુજ છે કે જેના જન્મથી સારાજ સંસ્કારો પડેલા હોય છે અને ઉત્તરોત્તર અવસ્થામાં ધર્મભાવનાની પુષ્ટિ મળેલી હોય છે, એતો બ્રેન્થ્યુ-એટ થાય કે સેલીસીટર થાય, વડીલ થાય કે બેરીન્ટર થાય, ડાક્ટર થાય કે ક્લેક્ટર થાય, એની ધર્મભાવના એની એજ કાયમ રહેશે. એની કિયાલિઝિતા એવીને એવીજ ચણકૃતી જ જોવાશે. એનાં વિનય-વિવેક-સહયતા-નમૃતા અધુંચે એવુંને એવુંજ દેખાશે. પરન્તુ કમનસીએ કેને બાલ્યા-વસ્થામાં કે પછીની અવસ્થામાં અને છેવટે ઉચ્ચ કેળવણીની અવસ્થામાં બણ્ણા સારા સંસ્કારોનું સાધન નથી રહેતું, એવા-ઓમાંથી તો કવચિતજ કોઈ ધર્મભાવનાવાળો યુવક રોક્યો પણ જડશે. અને તેટલા જ માટે એક અંગાળી વિદ્ધાને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે “ અત્યારના કહેવાતા કેળવાયલાઓમાં સેંકડે પંચાણું ટકા નાસ્તિક હોય છે. ”

આવી ઉચ્ચ કેળવણી આપતી કોઈ કોલેજમાં ચાલ્યા જાઓ, અથવા એજ વિદ્યાર્થીઓની બોર્ડિંગનું નિરીક્ષણ કરવાને ચાલ્યા જાઓ, ભાગ્યે જ કોઈ યુવક હુશે કે જે હાથ જેડીને પ્રણામ સરખો પણ કરશે. તમે બોર્ડિંગના મકાનમાં ફૂરતા રહો, અને એ યુવકો બુટ પહેરીને ઉધાડા માથે ગમે તે રીતે ચમચમ કરતાં તમારી અડ્ફેટમાં આવીને આમ તેમ ફોડતા-ફૂરતા રહેશો, પરન્તુ કોઈ હાથ સરખો નહિં જોડે.

એક આગન્તુક મનુષ્યને હાથ જોડવા, પ્રણામ કરવા, એ તો ધર્મભાવનાનું તો શું, પરન્તુ એક વ્યવહારનું જ પ્રથમ પગથીયું છે, એનો પણ અભાવ એચોમાં મોટે ભાગે જોવાય છે. જવા દોં તે સામાન્ય ગૃહસ્થની વાત. સાધુઓ-મુનિરાજે પણ જો કોઈ એવી સંસ્થામાં પ્રવેશ કરી જય છે, તો તેઓને પણ હાથ જોડવા સરખો વિનય નહિ બતાવવાવાળી સંસ્થા મેં જોઈ છે અને તે નૈન સંસ્થા.

આવી સંસ્થાએ જોવાના પ્રસંગો પ્રાપ્ત ધવા વખતે મને આર્યસમાજનાં ગુરુકુળ કે આપણી પ્રાચીન પદ્ધતિથી ચાલતી શાળાએ ચાંદ આવે છે. આર્યસમાજના ગુરુકુળમાં કોઈ સાધુ તો શું, એક સામાન્યમાં સામાન્ય ગૃહસ્થ જ એના કુંપાઉન્ડમાં કેમ ન પ્રવેશ કરે, સહાયે મળતો બાળક કે ચુવક, સુપ્રીનટેન્ડેન્ટ કે પ્રીન્સીપલ-કોઈ પણ હશે, અવશ્ય, આગન્તુકને દેખતાની સાથે કહેશે “નમસ્તે”. પહેલો નમસ્તે શણ્ણ તો તેમનો ખરો જ, તે પછી ‘શા માટે પધારવું થયું છે.’? ‘સંસ્થાનું નિરીક્ષણ કરશો’? વિગેરે પૂછી લઈ તે કાર્યમાં તેઓ પ્રવૃત્ત થશે.

સ્વાલ્પાવિક રીતે આપણો અંતરાત્મા એમજ કહે છે કે કેળવણીનો દરજનો જેમ જેમ વધતો જય, તેમ તેમ પોતાની કર્ત્તવ્યદિશાનું લાન વધારે થવું જોઈએ. હું કોણ છું? કઈ હુદે આવ્યો છું? મારા માતા પિતા પ્રત્યે માર્ઝ શું કર્ત્તવ્ય છે? દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે મારે કેવો વર્તાવ

રાખવો જોઈએ ? જે દેશનું લોહી મારી નસોમાં વહે છે, જે હેશનું અજ મારા પેટમાં છે, અને જે દેશની શક્તિ મારા બાહુમાં છે, એ હેશને માટે મારે શું કરવું જોઈએ ? જે પવિત્ર ધર્મમાં હું ઉછર્યો છું, એ ધર્મ-એ સમાજને માટે મારે કેટલો લોંગ આપવો જોઈએ ? ઉચ્ચ કેળવણી લેતા યુવકમાં આ વિચારોનો ઉદ્ભાવ અને તેને યોગ્ય કિયાઓમાં પરણિતપણું વધારે થવું જોઈએ. તેના અદલે એ ઉચ્ચ કેળવણી લેતા યુવકોમાં સામાન્ય વ્યવહારિક-જન્ય કિયાઓનો પણ અભાવ-અને તેમ છતાં પણ તેઓમાં મહોઠી મહોઠી વાતોના હવાઈ કિલ્લા ઉસા થતા જોઈએ છીએ, લારે તો તે ઉપર આપણને અનેક પ્રકારની કદ્દપનાઓ કરવાના અવકાશ મળે છે.

ભારતના યુવકો સાવ શુષ્ક-ધર્મભાવનાહીન અને કિયા-કંડથી સર્વથા વિમુખ થતા જય છે, એનું કારણ શું ? શું એ ઉચ્ચ કેળવણીનો પ્રભાવ છે ? અથવા શું એવી સંસ્થાઓમાં એવી ધર્મભાવનાને પોષવા તરફ લક્ષ્ય જ અપાતું નહિં હોય ? અથવા તો શું ત્યાં સંસ્કારો જ એવા પાડવામાં આવતા હોશે ? આ કદ્દપનાઓ એ સ્વાલાવિક કદ્દપનાઓ છે. આમાં કર્દી કદ્દપના સાચી છે, એનો નિર્ણય કરવો બધુ કઠિન છે, તેમ છતાં એટદું તો ચોક્કસ છે કે-જે તે નવયુવકો-ઉચ્ચ કેળવણી લેતા યુવકો-ને પણ એમની ધર્મભાવના પુષ્ટ થાય-વધે અને તેઓ પોતાનું કર્તાય સમજે-બુદ્ધી બુદ્ધી વ્યક્તિઓ પ્રત્યે એમનું શું

કર્તાબ્ય રહેલું છે, એ સમને, એવાં સાધનો મેળવી આપવામાં આવે તો મને લાગે છે કે-આજના તે ચુવકોમાં ‘એમાં શું?’ એવા વિચારો ઉત્પન્ન થઈને, એ વિચારોના આધારથી જે શુષ્કતા આવે છે અથવા ખીજ શાફ્ટોમાં કહીએ તો ધાર્મિક ભાવનાથી અધઃપતન થાય છે, એવું અધઃપતન થવાનો પ્રસંગ તો નજ આવે. ઓડીંગો દ્વારા આપણા ચુવકોને કેળવણી આપાવવાનો હેતુ શો છે? એજ કે-તેએ એક સાથે રહે, એક સાથે ખાય પીએ અને તેઓની કેળવણીની સાથે એમની ધર્મભાવના કાયમ રહે, એવા ઉપાયો લઈ શકાય અને તેને માટેજ સમાજ હુંદરો કે લાખો રૂપિયાનું ખર્ચ કરે છે. પરન્તુ આટલું ખર્ચ કરવા છતાં પણ, અને આટલા પ્રયત્નો લેવા છતાં પણ, જે આપણા ચુવકો ધર્મથી વિસુખ જ થતા રહે-ઉચ્ચ કેળવણીના ઘેનમાં દેવ-ગુરુ-ધર્મ-પિતા-દેશ પ્રત્યેની પોતાની ફરજને લુલી જ જય, બદ્દે આપણે ધાણી વખત લોકો દ્વારા સાંલળીએ છીએ તેમ, તેએ પરમાત્માની મૂર્તિ-ઓને એક પ્રકારનાં રમકડાં અને ગુરુએને પણ કંઈ રીજજ ન સમને, તો પછી સમાજના એ પ્રયત્નની સાર્થકતા શી? અને તેટલા જ માટે મારો તો એ નાના મત છે કે ઉચ્ચ કેળવણી આપવી જરૂરની છે, અત્યારે રાજકુરી વિષયોમાં પણ ભાગ લેવાવાળા તૈયાર કરવાની જરૂર છે, અને તે સમય પ્રમાણે ઉચ્ચ કેળવણી લેશે તોજ થશે, તે બધી વાત સાચી; પરન્તુ તેઓની ધર્મભાવના નષ્ટ ન થાય, અને તેઓ દેશ-સમાજ-ધર્મ-માતા-પિતા અને દેવ ગુરુ પ્રત્યેનું પોતાનું કર્તાબ્ય

સમજતા થાય, એવા પ્રયત્નો તો ખાસ કરીને કરવા જ જોઈએ. જે ચુંબકો ઉપર આપણે આપણી સમાજની ભવિષ્યની ઉત્તીલિનો આધાર રાખીએ છીએ, તેજ ચુંબકો જ્યાં સુધી અલ્યાસ કરવો હોય—કેળવણી લેવી હોય ત્યાં સુધી સમાજની જાયે સંબંધ રાખે, અને કહાય તેથી વધારે રાખે તો—જ્યાં સુધી તેમને પોતાના ધંધામાં પગ પસારવો હોય ત્યાં સુધી રાખે, અને તે પછી હેવ, ગુરુ, ધર્મ, કે સમાજ, ઉપકારી કે અનુપકારી કેન્દ્રને પણ ન છોડે, એતો ખરેખર કુમનસીખી જ કહી શકાય. એવી સ્થિતિમાં તેઓ ન આવે, સમાજનો ખરચેલો પૈસો ખરખાદ ન જય, એને માટે અલ્યાસની અવસ્થામાંથી જ તેમની ધર્મભાવનાઓ મજબુત રહે-વધતી રહે, એવા પ્રયત્નો કરવાની જરૂર છે.

એક તરફ જેમ આપણા ચુંબકોમાં આવી રીતે ધર્મભાવના શુષ્ટ થતી જાય છે, તેવી રીતે યીજુ તરફથી આપણા મહોટા ધનાદ્યોના ધરોમાં પણ ધર્મભાવનામાં શુષ્ટતા વધતી જ જાય છે. સુંખદી કે અમદાવાદ જેવા શહેરોમાં શહેરથી ૫-૨૫ કે ૫૦ માર્ગલિંગ ફૂર બંગલાઓમાં રહેનારા શેડીઓઓ વર્ષમાં એક દ્વિવસ પણ લાગ્યે જ ગુરૂએ પાસે જતા જેવાતા હોય છે. અને અધુરામાં પુરુષોને જે પાર્શ્વવતી મનુષ્યો લોકુર મળેલા હોય છે, તો તો તેઓની ધર્મભાવના તો ફૂર રહી, પરન્તુ તેથી આગળ વધીને તેઓમાંના કેટલાક તો લક્ષ્યાલક્ષ્યનો કે પેયા-પેયનો પણ વિવાર ફૂર મૂકી હે છે. આવા અનેક શેડીયાઓનાં નામો સાંલગ્નવામાં આવે છે. સમાજની કુમનસીખીનું આ

પારણું નહિ તો ખીજું શું છે ? વધારે ખુખી તો એ છે કે તેમ છતાં પણ તેઓ પોતાને જૈન સમાજના નેતા-આગેવાન કહેવરાવે છે, અને જૈન સમાજ તેઓની લક્ષ્મી પર મુખ્ય બની આગેવાન માની મંહિરાની મિલકતના દસ્તીઓ બનાવવાને પણ તૈયાર રહે છે. અસ્તુ, ગમે તેમ, પરંતુ આવા ધનાઢ્યોમાં પણ ધર્મભાવના દ્વિક્ષે દ્વિક્ષે કુમ થતી રહી છે અને તેનું જ પરિણામ છે કે અત્યારે કેટલાકોમાં તો જૈનત્વ સરખું પણ શોધ્યું જરૂર તેમ નથી. આ સ્થિતિ સુધારવા માટે પણ પ્રયત્ન કરવાની જરૂર છે. આ ધનાઢ્યોનું તો ધ્યું તે ધ્યું, પરંતુ તેઓએ પોતાની સંતતિ ધર્મભાવનાથી રહિત ન બને, તેને માટે ચીવટ રાખવાની જરૂર છે. તેઓને એવા સંસ્કારોમાં ઉછેરવાની જરૂર છે કે જેથી એઓના ધર્મસંસ્કારો કાયમ રહે, અને ઉત્તરોત્તર ઉજ્ઞત ધાય.

મને લાગે છે કે-જેમ આજના યુવકો, પોતાની ડેળવણીને પીસ્તાલીસે આગમ અને ચારે વેદ માનીને તેના ઘેનમાં મસ્ત રહી ધર્મકર્મથી ફર રહે છે, તેવીજ રીતે આ ગૃહુદ્યો-ધનાઢ્યો પણ પોતાની લક્ષ્મીના મહમાં કહાય. એમ સમજતા હશે કે-‘હુવે અમારે શું બાકી છે કે જેથી અમારે ધર્મભાવના રાખવી-ધર્મદ્વિયાએ કરવી. અમને તો બધું પ્રાપ્ત થયું છે. એને લોગવવું એજ અમારું કર્તવ્ય છે’. પરંતુ તેઓ ભૂલી જાય છે કે-પુણ્યની પૂર્ણાહૃતમાં આજનો લક્ષાધિપતિ-કોટચાધીશ કે અધ્યાત્માધિપતિ કાલનો લિખારી

છે. એ લક્ષ્મીના ભરોસે રહેવું એ લયંકર ભૂલ છે. ભૂલવું જોઈતું નથી કે-લક્ષ્મી એ પુષ્ટયતું પરિણામ છે. ખરી વસ્તુ સંસારમાં ધર્મભાવના જ છે. અને તેને પોતાના જીવનતું ધ્યેય અનાવવું જોઈએ અને જે માણુસ એના ઉપર મુસ્તાક રહે છે, તેજ પોતાના આ જીવનમાં પણ સાચે આનંદ અનુભવી શકે છે.

આ ‘ધર્મભાવના’ જૈન સમાજમાં જાગતી-જીવતી રહેતો જૈન ધર્મની અને સમાજની ઉજ્જવલતા છે. આપણી દરેક જાતની સંસ્થાઓમાં ‘ધર્મભાવના’ નું સાધન અવશ્ય રાખવું જોઈએ છે. અને તોજ આજના ભાળકો કિયાકંડમાં અભિ-રૂચિવાળા રહેશે. ભલે તે થોડા વખતને માટે એ કિયાઓનું મહૃત્વ ન સમજતા હોય, પરન્તુ જે કરતા રહેશે, તો જરૂર કેંઠી વખત એનું મહૃત્વ સમજશે, અને તેમાં વધારે રસ મેળવશે. તેવી રીતે આજના ચુંબકો ભલે સમજુને કરે, પરન્તુ કરે જરૂર. તેઓ સમજવા માટે પ્રયત્ત કરે, પરન્તુ જે તે તરફથી સર્વથા વિમુખ થઈ જશે, તો અત્યારે આપણે ધણુઓને માટે સાંભળીએ છીએ તેમ નાસ્તિકતાની છેક છેલ્લી પાયરીએ આવી પડશે. ધર્મભાવના ન કેવળ કિયાલિઝિશનિયાને સાથે જ સુંખંખ રાખે છે. તેઓમાં ભક્ષ્યાલક્ષ્યનો-પેયાપેયનો પણ વિચાર રહેવેલા જોઈએ. કર્તાચાર્યાકર્તાચ્યતું ભાન હોવું જોઈએ. હું તો એ ચુંબકોને એજ કહું છું કે અત્યારની વિજા-ની દૃષ્ટિ પણ જૈન સિદ્ધાન્તોનો-જૈન કિયાઓનો-જૈન

ત્રતોનો જે અલ્યાસ કરવામાં આવશે, તો તે બધામાં અર્થાતું જૈનધર્મની એક એક આજ્ઞામાં સાર્થકતા જણુશે, મહત્વ જણુશે, ઉપ્યોગીતા જણુશે અને સત્યતા સમજશે.

આવા ઉત્તમ નિયમેનું પણ પાદન કરવાથી આપણે વિમુખ રહીએ, આપણે એ કિયાએ તરફ આલર્દ્યે ન રાખીએ, આપણે એ સિદ્ધાન્તો ઉપર શ્રદ્ધા ન રાખીએ, તો તે આપણી ખરેખર કમનસીધીજ કહી શકાય.

પ્રાન્તે આપણા ભાગકેમાં, ચુવકેમાં અને ધનાઢ્યોમાં ધર્મભાવના જાત થાય, અને તેઓ સાચી ધર્મમૂર્તિએ અને, એજ અંતઃકરણુથી ધૃચ્છી વીરમું છું:



(૩૮)



‘સહકાર’ એ સંસ્કૃતમાં આંખાના વૃક્ષનું નામ છે.
અર્થात् ‘સહકાર’ એટલે આમ્ર અને આમ્રનું ક્રણ કેરી એ
આ કળીયુગનું અમૃતક્રણ. બધાં ક્રણોમાં આમ્રક્રણ—કેરી એ
ઉત્તમ ક્રણ કહેવાય છે. સુતરાં, ‘સહકાર’ અમૃતને ઉત્પન્ન
કરનારી વસ્તુ છે. જ્યાં ‘સહકાર’ છે,—પ્રેમ છે—સંપ છે—
એકતા છે—સહાનુભૂતિ છે, ત્યાં અમૃતજ જરે. અમૃત જેટલો જ
આનંદ થાય. જ્યારે તેથી વિપરીત, અસહકાર એટલે અમૃ-
તથી ઉલદું—વિષ—ઝેર—હુઃખ. જ્યાં અસહકાર, ત્યાં વૈર—ઝેર
સિવાય ખીલું ન હોય. અતએવ હુઃખ હોય.

સુખના અલિલાધીએ, આ એમાંથી કેનેં સ્વીકાર કરે, એ કહેવાની હવે જરૂર નથી રહી. સામાજિક કે ધર્મિક, વ્યવહારીક કે કૌદુર્ભિક-કોઈપણ જતનું સુખ મેળવવા ચાહતા હોઈએ-આપણા વ્યવહારમાંથી અમૃતનો આસ્ત્રાદ કેવા ચાહતા હોઈએ-કેરીની મીઠાશ ચાખવા ચાહતા હોઈએ તો આપણે સહકારવૃક્ષજ વાવવું જોઈએ. પરન્તુ આપણે કરી રહ્યા છીએ તેથી ઉલટું. ચાહીએ છીએ અમૃતનો આસ્ત્રાદ કેવાને-કેરી ખાવાને, પરંતુ વાવીએ છીએ અસહકાર વૃક્ષ. આ વૃક્ષ હુંખ આપનારે. આ વૃક્ષ ખાવળનું વૃક્ષ. આપણી આમ ઉલટી પ્રવૃત્તિ થઈ રહી છે, એ કોઈ પણ વિચારક જોયા સિવાય નહિ રહી શકે.

સામાજિક દિશિએ વિચાર કરીએ તો જૈનસમાજમાં અસહકારનાં બીજ ઠેકણે ઠેકણે વવાયાં છે. અને તેનું જ એ પરિણામ છે કે આપણે સહકારકળા-કેરીની મીઠાશ મેળવી શકતા નથી-ચાખી શકતા નથી. સમાજના પ્રત્યેક અંગોનું અવલોકન કરે. છે ક્યાંય સહકારની છાયા !

એ ભાઈએ એક બીજના સહકારથી-સહાનુભૂતિથી કામ ન કરે, એ કુદુંએ એક બીજની સાથે સહકાર ન રાખે, એ ગાંધીવાળા એક બીજમાં અસહકારની આડ ઉલ્લી કરે, ચાવત્ મહાવીરને માનવાવાળા જુદા જુદા ક્રિકાએ શ્વેતાંધર, દિગ્ંભર, સ્થાનકવાસી, તેરાપંથી વિગેરે એક બીજની સાથે સહકાર ન કરે, આ ખંધી કુમનસીધી નહિ તો બીજું

શું છે ? અને એ કમનસીથીનાં—એ અસહકારનાં કેવાં હૃષ પરિણ્ણામો આપણે લોગવી રહ્યા છીએ, એ કોઈથી અજાણ્યું છે કે ?

જૈન સમાજનું સુખ્ય અંગ—સાધુ સાધ્વી. એમાં કેટલો અસહકાર છે ? એક સાધુ એક કામ કરે, એને બીજે અનુમોદશે નહિં, બલ્કે ચુપ પણ નહિં રહે, પરન્તુ તે પોતાની શક્તિને ઉપયોગ તે કાર્યને તોડી પાડવામાંજ કરશે. એક સાધુ એક ગામ ને ઉપરેશ આપી ગયા હોય, એથી વિપરીત જ બીજા આવીને ઉપરેશ આપશે. એક સાધુ, અપવિત્ર કેશર વાપરવાની ના પાડશે, તો બીજે પવિત્ર કે અપવિત્રનો ખ્યાલ હૂર કરાવી તેને વાપરવાનીજ હિમાયત કરશે. એક સાધુ સાધારણ ખાતાની પુષ્ટિ કરશે, તો બીજે તેના ઉપરેશને કાપવા માટેજ હેવદ્વય વધારવાની હિમાયત કરશે. એક શુદ્ધ વસ્ત્રો વાપરવાની હિમાયત કરશે, તો બીજે તેનું ખંડન કરશે. એક જ્ઞાન પ્રચારની આવશ્યકતા બતાવશે, તો બીજે ખાસ ઈરાદા પૂર્વક જ—ઉજમણું—ઉપધાન અને સંઘી કાઢવા તરફ જોર દેશે. એક કોઈ સંસ્થા માટે કોઈ ગૃહસ્થને ઉપરેશ આપશે, તો બીજે તેને ના પાડશે. સાધુઓની આ સ્થિતિથી સમાજની ત્રિશંકુ જેવી સ્થિતિ થાય, એમાં આક્ર્ષ્ય શું છે ? હું તો કહું છું કે સહકાર કરવો તો હૂર રહ્યો, સાધુઓ એક બીજના કાર્યમાં વિધનભૂત ન થાય, તો પણ ગનીમત છે. “પદ્મા પાપ ન કર્યું, તો પુણ્ય કર્યું સો વાર ” એવું અત્યારે મનાય. પરંતુ સાધુઓ

કે જેમના ઉપરેશ ઉપર આખી સમાજના કલ્યાણનો આધાર
છે, તેઓ પોતાના આપસના અસહકારથી આગા સમાજની
દશા કેવી કંઠંગી કરી મૂકે છે, એનાં ઉદાહરણો આપવાની
જરૂર છે શું ? આવી અવસ્થામાં સમજુ ગૃહસ્થો-કે જેઓ
કોઈના રાગાન્ધ બન્યા નથી-તેઓ તો કોઈ પણ કાર્ય પોતાની
સુનસરી ઉપર જ કરે છે. તમે ‘ગમે તેમ ઉપરેશ આપો,
અમે અમારું મનતું ધાર્યું કરીશું.’ ‘અમારા ગામના સંઘની
અતુકૂળતા-વિચાર પ્રમાણે ધરો.’ કમનસીએ જો સાધુ પોતાના
વિચાર પ્રમાણે કરવાનો આચરણ કરવા જાય છે, તો તે સાધુને
ગૃહસ્થો રૈકડુંજ પરખાવે છે. આવી સ્થિતિમાં સાધુની કિમત
વધે છે કે ધરે છે, એનો વિચાર તેઓએ કરવો ધરે છે. આ
ખંડું એક ‘અસહકાર’ ના પરિણામે ખને છે. જો સાધુઓના
ઉપરેશમાં-વ્યવહારમાં-વર્તનમાં સહકાર હોય, એક ભીજની
સહાતુભૂતિ હોય, તો કેટલું સુંદર કામ થઈ શકે ?

આ જ દશા ગૃહસ્થોની છે. ગૃહસ્થોમાં ખાસ કરીને આ-
ગોવાનોએ-ધનાદ્વોએ જો એક ભીજની સાથે સહકાર રાખ્યો
હત, તો આજે સમાજની આ દશા ન થાત. ગૃહસ્થોમાં, એક
શેડીયો ભીજ શેડીયાની ચઢતી જોઇ શકતો નથી. એક
ગૃહસ્થ એક કામ કરે, એને ભીજે જરૂર વખોડે-સંઘનાં કાર્યોમાં
એક ગૃહસ્થ એક વિચાર ભકે, તેને ભીજે તોડવાજ તૈયાર
થાય. એક મંહિરના એ ગૃહસ્થો ટ્રેસ્ટી હોય, તો તે એમાં
પણ સહકાર ન મળે. એક પેઢીમાં એ ચાર ગૃહસ્થો વહીવટ
કરતા હોય, તો તેમાં એ એક ભીજનો અસહકાર.

ગૃહસ્થેામાં એક વર્ગ એવો છે કે-જેઓ ‘કેળવાયલા’ આના નામે ઓળખાય છે. આ ‘કેળવાયલાઓ’ ની તો ગતિ જ અજખ છે. ‘સંપ’ ‘ઔકય’ ‘સહકાર’ ‘પ્રેમ’ ના ખણું તેમનાં સાંલળો તો જણે ગગન ગજવે, પરન્તુ તે પોતે એક ભીજાઓ સાથે ‘સહકાર’ ન સાધે. તેઓ જેમને ‘જૂના વિચાર’ ના ‘અભણીયા’ ગણે છે, તેમની પાસે મતલખ સાધવી હોય લારે તો તે હોડતા જય, અને ખુશામદ કરે, પરન્તુ પાછળ તો તેઓને “જૂના ટેરા અને ‘ગાડરિયા પ્રવાહમાં તણુંતા’ માને. આ કેળવાયલાઓમાં કેટલાક તો પોતાને ‘જાનના સમુદ્ર’ સમજે છે. હું ધારી વણત લખી ગયો છું તેમ-તેઓ પોતાનાથી કોઈમાં પણ ‘વધુ જ્ઞાન’ સમજતા નથી, જેતા નથી અને આના પરિણામે તેઓ ભીજાની સાથે ‘સહકાર’ કરવાથી ફૂર રહે છે. પોતાની પહોં જેવડી ભૂલા, અંધાધુંધી અને મહોટી મહોટી પોદો કોઈ બહાર પાડશો, એ લયથી ભીજાઓના અછતા ફૂષળો ભીજાઓની આગળ ગાવામાં પોતાની કેળવણીની સાર્થકતા સમજે છે.

હું કેળવણીનો હિમાયતી છું. કેળવણી ઉપર સમાજની ઉત્ત્રતિનો મહોટો આધાર માનું છું. ચુવકો એ દેશની અને સમાજની આશાઓ છે, એમ સમનું છું, છતાં આજના એજ ચુવકો કે કેળવાયલાઓમાં જ્યારે ધણું ખરાઓમાં દંબિકતાનો દરિયો ઉછળતો જેઉ છું, એજ કેળવાયલાઓના

વચ્ચેનોમાં અને વર્ચનોમાં આકાશ-પાતાળનું અંતર જોઉં છું, ‘સહકારની’ સુંદરતા સમજવા છતાં ‘અસહકાર’ નાં આનંદોલનો જોઉં છું, ત્યારે તે પામરો ઉપર હ્યા તો આવે છે તે આવેજ છે, પરન્તુ સમજનાં કાર્યોને મારે ભેટામાં ભેટી ‘નિરાશા’ મારી આગળ ખડી થાય છે. બીજુ સમજના કેળવાયલાએ, જ્યારે પોતાની આપ-સની મતલિન્નતાએને વળગી રહીને પણ એક બીજાથી ‘સહકાર’ સાધે છે, ત્યારે આપણું કેળવાયલાએ નજીવી મતલિન્નતાએને એક મહાન હુસ્તમનાવટનું સ્વરૂપ આપી, એક બીજાથી અસહકાર-અસહકારજ નહિં, પરન્તુ તેથી પણ આગળ વધીને એક પ્રકારનું વૈર ઉલ્લું કરવા મથી રહે છે. આના જેવો હુંઘનો વિષય બીજો કર્યો હોઈ શકે ? કેળવાયલાએ—આચા કેળવાયલાએ તો તે છે કે-જેએ સમજમાં શાન્તિ ફેલાવે, એક બીજાનાં કાર્યોમાં ઉદારતાથી વર્તાવ કરે. જ્યાં અજ્ઞાનજન્ય અધડાએ હોય, ત્યાં એ અધડાએને—એ અજ્ઞાનતાએને હૂર કરવા પ્રયત્ન કરે.

આપણી સંસ્થાએ પણ આપસમાં સહકાર નથી સાધી શકતી. એનું કારણ પણ મને તો ઉપર કંઈ તે જ-કેળવા-યલા અથવા કહેા કે તે તે સંસ્થાએના કાર્યકર્તાએની સંકુચિતતાનું પરિણામ જણાય છે. જ્યે દરેક સંસ્થાના કાર્યકર્તાએ પોતપોતાના હસ્તકની સંસ્થા મારે પ્રગતિના પ્રયત્નો કરે, પરન્તુ તેણે બીજુ સંસ્થાને ધક્કો પહેંચાડવા

સમયને ઓળખો.

પ્રયત્ન કરવો, એ નરી મૂર્ખતા નહિં તો બીજું શું કહી શકાય ? અદ્વકે ખરી વાત તો એ છે કે, જુદી જુદી દિશામાં કામ કરનારી સંસ્થાઓ ભલે જુદી જુદી દિશામાં કામ કરે, આજે સમાજ તો દરેક વિષયમાં ભૂખી છે, ગમે તે દિશાથી વિદ્યાનો પ્રચાર કરવો અત્યારે સમાજને લાલદાયક જ છે, પરન્તુ તે તે દિશાઓમાં કામ કરનારી સંસ્થાઓને પોતાથી ઘનતો તન-મન-ધનથી યોગ હેવો, ‘સહકાર’ કરવો, એજ ડાદ્યા માણુસોનું કર્તાંય છે. પરન્તુ એમ તો ન જ થવું જોઈએ કે પોતાની પોલો ઉધાડી પડવાના લયથી કે ગમે તે કારણે બીજી સંસ્થા માટે લોકોમાં ફુર્ઝાવ ઉલ્લોક કરવો.

દુંકમાં કહીએ તો આજે સમાજનાં પ્રત્યેક અંગો એક બીજાના અસહકારથી છિન્નલિન્ન થઈ રહ્યાં છે ! એક પણ કર્યામાં જોઈતી સર્કણતા મળતી નથી, એનું કારણું ‘અસહકાર’ સિવાય બીજું કંઈ જ નથી. મુનિરાજે આજે એક બીજાનો ‘સહકાર’ કરે-અરે વધારે નહિં તો તેવળ જરૂરી જરૂરી વિષયોમાંજ સહકાર કરે, તો મારી શ્રક્ષા છે કે ધડીના છફ્ટા લાગમાં જૈન સમાજમાં નવું જ ચૈતન્ય લાવી શકાય. આજે સમાજના ધનાઢ્ય આગેવાનો જો એક બીજાનો ‘સહકાર’ સાધે, અને પોતાના પક્ષપાતનાં ચશમાં નીચે ઉતારી હે, તો જે મુનિસિબલેન થવું આજે અશક્ય કે અસંભવિત જેવું હેખાય છે, તે મુનિસિબલેન થાડાજ વખતમાં ભરાયેલું જેવા આપણે લાગ્યશાળી થઈ શકીએ. આજે સમાજનો

કેળવાયલો વર્ગ પોતાનું અલિમાન હર કરી સમાજનાં બીજા
અંગો—સાધુઓ અને સમાજના આગેવાનોની સાથે ‘સહકાર’
કરે તો થોડા વખતમાં આપણી સંસ્થાઓ આદર્શ સંસ્થાઓ
ખની સમાજનું મુખ ઉજાવલ કરવા ભાગ્યશાળી ખની શકે.
આને આપણી આણુંદળ કદ્વાણુંણની પેઢી અને કોન્ફરન્સ
જો એક બીજાનો ‘સહકાર’ સાથે તો આપણાં એક એક તીર્થીનું
સંરક્ષણ થવા સાથ સમાજમાંથી અનેક કુર્ચિવાજો હર થઈ શકે.
જ્યારે આપણી ભમાપારી જે પોતાનો ભમત્વ હર મૂકી
એક બીજાનો ‘સહકાર’ કરે, તો જરૂર તેઓ પોતાની
થતી મરકરીઓમાંથી બગવા સાથ સમાજનાં કેટલાંચે કાર્યો
સુચારુ રૂપે ચલાવવામાં ભાગ્યશાળી થઈ શકે.

મુનિરાજે ચેતો ! ગૃહસ્થો ચેતો ! કેળવાયલાઓ ચેતો !
આપણું અસહકારથી આપણે ધાણું ખોયું છે, અને એઈ
રહ્યા છીએ. સમાજને ઉત્તીત બનાવવી હોય, સમાજનું મુખ
ઉજાવલ કરવું હોય, જૈન સમાજની પૂર્વીય કીર્તિને પાઠી
મેળવવી હોય, તો એક બીજાનો સહકાર કરો. ભમત્વને
મૂકી હો અને સમાજનું કદ્વાણું કરવા કમર કરો. જુઓ
વિજય તમારા હાથમાં છે. શાસનહેવ સર્વને સહયુદ્ધિ
આપો, એજ અંતિમ પ્રાર્થના.

(૩૯)

શું જૈન સૂત્રોમાં માંસાહારનું વિધાન છે ?

પુરાતત્ત્વમંહિર—અમદાવાદથી પ્રગટ થતા ‘પુરાતત્ત્વ’ ના ઉલ પુસ્તકના રથા અંકમાં અધ્યાપક ધર્માન્દંડ ક્રૈસ્ટનીનો, બુદ્ધચરિત્ર લેખમાળાના ટમા લેખાંકમાં ‘માંસાહાર’ સંખાંધી લેખ પ્રગટ થયો છે. આ લેખમાં અધ્યાપક મહાશયે એ ખતાવવા પ્રયત્ન કર્યો છે કે—બુદ્ધના સમયમાં જેમ બુદ્ધ અને બુદ્ધના લિક્ષુકો માંસાહાર કરતા હતા, તેમ શ્રમણો (જૈન સાધુઓ) પણ કરતા હતા. અને આ વાતની પુષ્ટિમાં તેમણે આચારાંગસૂત્ર નો એક પાઠ તેમજ દરશવેકાલિકસૂત્ર ની એ ગાથાઓ આપી છે.

શું જૈન સ્ત્રોમાં માંસાહારનું વિધાન છે ?

આપણે, તેમણે આપેલા પઠો ઉપર વિચાર કરીએ તે પહેલાં, એક વાત વિચારી લેવી ઘટે છે.

‘અહિસા’ ‘દ્વા’ કે ‘માંસાહારનિષેધ’ ના સંખાંધમાં જૈન સમાજ, જૈન ધર્મ કે જૈન સ્ત્રોની-સિદ્ધાન્તોની કે જ્યાતિ છે, એ કોઈથી અલાહુની નથી. જૈનથિયે! નું આરીકાઈથી અદ્યયન કરતાર પોકારી ઉઠે છે કે—‘અહિસા’ ના સંખાંધમાં જૈન ધર્મની ભરાભરી દુનિયાનો એક ખાણું ધર્મ કરી શકે તેમ નથી. યદ્યપિ મહાવીરહેવનો સમય પચીસસો વર્ષ ઉપરનો છે, તેમ છતાં, તે પછીના અંધકારો અને ટીકાકારોએ અહિસાની-માંસાહારનિષેધની કે ઉદ્ઘોષણા કરી છે, એ મહાવીરનાં સ્ત્રોને અતુસરીનેજ. મહાવીર અને મહાવીરના સાધુઓનાં આચરણને અવલંખીનેજ, નહિં કે પહેલાં હતું કંઈ અને તેમણે બતાવ્યું કંઈ. જો વસ્તુતાઃ મહાવીરહેવના સાધુઓ—નર્થીયા માંસાહાર કરતા હતા, તો ટીકાકારો અને અંધકારોની કલમો આટલા દરળને અહિસા અને માંસાહારનિષેધનું પ્રતિપાદન નજ કરી શકી હત. આતું ઉદાહરણ એજ મહાવીરહેવના સમકાલીન યુદ્ધ અને યુદ્ધસાધુઓનું છે. ‘બૈદ્ધ ધર્મ’ પણ અહિસા ધર્મમાં માનનારો હોવા છતાં યુદ્ધસમય પછીના અંધકારો ન એટલું અહિસા કે માંસાહાર નિષેધનું પ્રતિપાદન કરી શક્યા કે ન હિંસા અને માંસાહારનો ત્યાગ પણ કરી શક્યા છે. કહેવાની કંઈજ જરૂર નથી કે—પશ્ચાત્કાલીન પુરુષો અને

શાસ્કો ઉપર, પૂર્વીંચ પુરુષો અને પૂર્વીંચ શાસ્કોની અસર અવશ્ય પડે છે. એ સૌ કોઈ કબૂલ કરી શકશે કે—યાહિ મહાવીર અને મહાવીરના સાધુઓમાં આજથી પચીસસેં વર્ષ ઉપર પણ જે માંસાહારનો પ્રચાર હત, તો આજે થોડા ધણા અંશમાં પણ જૈનોમાં—જૈન સાધુઓમાં માંસાહારનો પ્રચાર અવશ્ય દેખાત. પૂર્વ સમયના આચાર-વિચાર અને શાસ્ક્રપ્રતિપાદ વિષયોની અસરનું બીજું ઉફાડરણ હિંદુ જનતાનું પણ છે.

હિંદુઓમાં હેવીઓ આગળ અપાતા લોગો, યજ-યાગા-હિમાં થતો પશુવધ એ પૂર્વના રિવાજે અને થયેલાં શાસ્ક વિધાનોની અસરનું પરિણામ નથી શું ?

આપણો આ અનુભવ અદ્યાપક કૌસભીજીના એ મન્ત્રયને સ્વીકારવા માટે સારુ ના પાડે છે કે—“ તે વખતે જૈન સાધુઓમાં માંસાહારની પ્રથા હતી. ”

જૈન-મહાવીર અને તેમના સાધુઓ ચુસ્ત અહિંસાના ઉપાસક અને પ્રકાશક હતા, એ વાત ખુદ અદ્યાપકજીના શાખાથી પણ સિદ્ધ થાય છે. તેઓ પૃ. ઉરજમાં લખે છે—

“ તેજ પ્રમાણે પોતાથી પરોક્ષ કે અહેતુપૂર્વક થયેલી હિંસા, એ હિંસા નથી, એમ બુદ્ધ લગવાન કહેતા. દાખલા તરીકે—આપણે દીવો કરીએ અને તેના ઉપર પડીને જીવડાં મરી જાય, તો તે હિંસા નથી થતી, એમ તેમનું કહેવું

શું જૈન સૂત્રોમાં માંસાહારનું વિધાન છે ?

હતું. તે ઉપરથી જૈન શ્રમણો પણ તેમને નાસ્તિક (અક્ષિ-
યાવાદી) કહેતા. ”

આનો અર્થ સ્પષ્ટ છે કે-જૈન શ્રમણો પોતાથી
પરોક્ષ થયેલી હિંસાને પણ હિંસા માનતા.

જેઓ આટલે સુધી હિંસા માનતા, તેઓ બીજાઓ
પકાવેલું પણ માંસ સ્વીકાર કરે એ શું ખની શકે અર્થું ?

એક બીજુ વાત પણ ઉપરની વાતને પુષ્ટ કરે છે.
અધ્યાપકનું લખે છે કે-

“ જૈન શ્રમણ બીજાના ઘરનું આમંત્રણ બીજાનું સ્વી-
કારતા નહિં. ગમે તે અજ્ઞ, તેમને માટે જે તૈયાર કરવામાં
આવ્યું હોય, તો તેને તેઓ નિષિદ્ધ ગણુતા. અને હજુ
પણ ગણે છે; કારણ કે-તે તૈયાર કરતી વખતે અભિના લીધે
થાડી ઘણી પણ હિંસા થાય છેજ, અને તેનો સ્વીકાર કર-
વાથી શ્રમણે તે હિંસાને અનુમોદન આપ્યા જેવું થાય.
અહિંસાની વ્યાપક વ્યાપ્યા બુદ્ધ લગ્બાનને પસંદ નહોતી.
જાણી કેઠને ફૂરતાથી પ્રાણિઓનો વધ ન કરવો, એટલું જ
તેમનું કહેવું હતું.”

આમાં પણ તે વખતના જૈન શ્રમણોની અહિં-
સા સંખ્યાંથી વ્યાપકતા સ્પષ્ટ જાણ્યા છે. વ્યાપક અહિં-
સાને માનનાર માંસાહાર કરે, એ કેમ માની શકાય ? અસ્તુ,

હવે આપણે જૈન સૂત્રોના તે તે પાડો, કે કે પાડો ઉપરથી શ્રીયુત અધ્યાપકલ અને બીજા કેટલાક લેખકો “જૈન સૂત્રોમાં માંસાહારનું વિધાન” જહેર કરે છે, તે પાડોનું ભારીકાદ્ધી અવલોકન કરીએ.

જૈન સૂત્રોમાં માંસાહારના વિધાન સંખ્યા કે પાડો અતાવવામાં આવે છે, તેમાં મુખ્ય પાઠ આચારાઙ્ગસૂત્રનો છે તે પાઠ આ છે:—

સે ભિક્ખૂ વા ભિક્ખુણી વા સેઝં પુણ જાણેજ્ઞા વહુ-
અદ્વિયં મંસં વા મચ્છં વા બહુકંટક.....ત્યાંથી લઈને

સંલાણએ મંસગં મચ્છગં ભોજા અદ્વિયાંદ્ર કંટએ ગહાય સે
ત્તમાયાએ એંગંતમવક્કમેજ્ઞા અવક્કમેત્તા અહેરજ્ઞામર્થહિલંસિ વા
અદ્વિરાસિસિ વા કિદૃરાસિસિ વા તુસરાસિસિ વા ગોમયરાસિસિ
વા અણયરસિ વા તહપ્પગારસિ થંડિલંસિ પડિલેહિય પડિ-
લેહિય પમજિય પમજિય તઓ સંજયમેબ પમજિય પમ-
જિય પરિઠવેજ્ઞા ।

(ભાષુવાળું આચારાંગ સૂત્ર, પૃ. ૮૧-૮૨)

ઉપરના આખા પાઠની ભતલખ એ છે કે બહુકંટમય
મત્સ્ય કે બહુ અસ્થિમય માંસ મળે, તો સાધુ સાધિંદે લેવું
નહીં, અને એવા બહુ કંટકમય મત્સ્ય કે અસ્થિમય માંસના
આપનાર ગૃહસ્થને ગૃહસ્થને નિષેધ કરવો, અને કેવળ અસ્થિ

કંઈક સિવાયનું મત્સ્ય કે માંસ માંગવું. તેમ છતાં જે તે જબરદસ્તીથી પાત્રમાં નાખે તો આરામમાં કે ઉપાશ્રયમાં ગમે ત્યાં એકાન્તમાં જઈને માંસ અને મત્સ્યનો ઉપલોગ કરીને કાંઠા તથા હૃદકાં કેાઈ બાળેલી જમીન ઉપર, હૃદકાંના રાશી ઉપર, કાટ ખાઈ ગયેલા જૂના લોઠાના દગલા ઉપર અથવા એવી નિર્દેખ જમીન ઉપર-જગા સાક્ષી કરીને-સંચયમ પૂર્વીક ભૂકવા.

મોટે ભાગે આજ પાડના આધારે કેટલાક લોકો માંસાહારના વિધાન સંબંધી આરોપ મૂકે છે. પરન્તુ કોઈ પણ વિષયનો નિર્ણય કરવામાં એકલી શુંતિ-શાસ્ત્રનો જ આશ્રય દેવો વ્યાજખી નથી. શુંતિની સાથે 'ચુક્તિ' અને 'અનુભૂતિ' પણ મેળવવાં ઘટે છે. અર્થાત શુંતિ, ચુક્તિ અને અનુભૂતિ આ ત્રણે દ્વારા જે નિર્ણય થાય, એજ નિર્ણયને 'સાચો નિર્ણય' સમજવો જોઈએ, અને કદાચિત ચુક્તિની પણ પુષ્ટિ મળી, પરન્તુ તેની સાથે અનુભૂતિ ઘટાવવી જોઈએ. આપણો અનુભવ શું કહે છે, તે પણ જોવો જોઈએ. આમ ત્રણેનો ચોંગ મળે ત્યારેજ નિશ્ચય દર્શ શકે.

ઉપરના પાઠમાંજ નહિ; ખીન પણ જે પાડો આપ-છુને તેવા લાગતા હોય, તે સંબંધી ઉપરની ત્રણે રીતે વિચાર કરવો જોઈએ.

સૌથી પહેલાં ઉપરના પાઠની સાથેના આગલા પાછલા અધિકારના પ્રસંગનેજ જોવાની કોઈ તકલીફ લેતું નથી.

એ ધ્યાનમાં રાખવાનું છે કે આ એક આપવાદિક પ્રસંગ છે. એટલે કે કોઈ મહાવિકિત પ્રસંગમાં આ વસ્તુએ અહણું કરવા માટે લખ્યું છે. અને તે પણ અહાર પરિલોાગને માટે-શરીર ઉપર લગાવવાને માટે. નહિં કે આવાને માટે. ટીકાકારે આ સંબંધી સ્પષ્ટ ભુલાસે કર્યો છે. ટીકાકારના શબ્દો આ છે:—

“યस્ય ચોપાદાનं કચિદ् લુતાદ્યુપશમનાર્� સદ્ગૈયોપદે-
શતો વા બાદ્યપરિભોગેન સ્વેદાદિના જ્ઞાનાદ્યુપકારકત્વાત्
ફલવદ્ દૃષ્ટં, ભુજિશ્વાત્ બહિઃપરિભોગાર્થે, નાભ્યવહારાર્થે,
પદાતિભોગવત् ।”

અર્થાતઃ—કયારેક લૂતાદ્યુપશમનાર્થ રોગની શાન્તિને માટે કુશલ વૈદ્યના આહેશથી, અહાર લગાડવાને માટે માંસ-મત્સ્ય અહણું કરે, પણ તે ખાવાને માટે નહિં,—અહિં ‘લુજ’ ધાતુ ‘અહિંપરિલોાગ’ અર્થમાં છે. નેવી રીતે કે—‘પદાતિભોગ’ આદિ શબ્દોમાં ‘લુજ’ ધાતુને અર્થ ‘આવું’ એવો નહિં પરન્તુ ‘અહાર લગાવવું’ એ અહણું કરવાનો છે.

ઉપર કહ્યા પ્રમાણે મહા લયંકર રોગના કારણે અને કોઈ કુશલ વૈદ્ય ખતાવે તોજ અહારના ઉપયોગને માટે તે વસ્તુ લેવા માટે કહેવામાં આવ્યું છે, અને તે પણ મહા અપવાદ માગે.

શું જૈન સૂત્રોમાં માંસાહારનું વિધાન છે?

એક વાત ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે અને તે એક-ચાહે હિંદુ ધર્મના વેહો કહો કે ચાહે જૈનોના પિટક અંથો કહો, અને ચાહે જૈનોનાં આગમ કહો-દરેકનો મૂળ અલ્યાસ કરતી વખતે ટીકાઓનો આશ્રય લીધા સિવાય કોઈને પણ ચાલી શકે તેમ નથી. જે વસ્તુઓનું મૂળ હજારો વર્ષ ઉપર ઉત્પત્ત થયું છે, એ વસ્તુઓના મૂળ શખોને અત્યારના પ્રચલિત શખોની સાથે ઘટાવીને અર્થ કરવામાં ભોગે લાગે ભૂલજ થવાનો પ્રસંગ રહે છે અને અર્થનો અનર્થ થવાનો જ સંલવ છે.

આ સિવાય એક બીજુ બાબત પણ ધ્યાનમાં લેવાની છે. અતિ પ્રાચીન મૂળ અંથોમાં-દાખલા તરીકે જૈન આગ-મોમાં-એક જ પ્રકારનાં સૂત્રોની ગુંથણી નથી હોતી. કેટલુંક વર્ણન ભય ભૂચક કે વૈરાય સૂચક હોય છે, જ્યારે કેટલુંક વર્ણન માત્ર વર્ણનાત્મક જ હોય છે. આગમના અલ્યાસિયો, જ્યાં સુધી શુરૂ ગમતાપૂર્વક-કોઈ ગીતાર્થ શુરૂ પાસે એવો અલ્યાસ ન કરે, ત્યાં સુધી તે સૂત્રોના રહુસ્યને ન સમજ શકે, એ બનવા જોગ જ છે. આગમનું એ વચન છે કે—

ગુરુમર્ઝાહિણા સવે સુત્તત્વા ।

શુરૂ ભતિને આધીન સર્વ સૂત્રાર્થ છે.

માત્ર વ્યાકરણના નિયમોને જાણી લીધા, એટલા માત્રથી સૂત્રોનાં રહુસ્યો પ્રાપ્ત કરી લીધાં, એ માનવું ભૂલ લરેલું

સમયને ઓળખો.

છે. અસ્તુ કુમમાં કુમ આ બન્ને બાબતોનું લક્ષ્ય રાખીને જે સૂત્રોનું અવલોકન થાય, તો ગેર સમજુતી ઓધીજ ઉલ્લી થાય, એવું મારું નમ્ર મન્ત્રથ્ય છે.

ડૉ. જેકોણી જેવા વૃદ્ધ વિદ્ધાને પણ આ વિષયમાં જે ભૂલ થાય ખાધી હતી, એ વાત, જેધેપુરમાં સ્વગીય શુરુદેવ શ્રીવિજયધર્મસૂરીશ્વરજી મહારાજના સમજવવાથી તેમને માલૂમ પડી હતી. અને તેથીજ તેમણે પોતાના તે વિચારો ફેરફાયા હતા. અસ્તુ,

અધ્યાપક કૌસરભીજુંએ આચારાંગના ઉપર્યુક્ત પાઠને મળતીજ દર્શાવેકાલિક સૂત્રની એ ગાથાએ આપી છે. આ બન્ને ગાથાએના ઝારાંશ ઉપરના જ પાઠને મળતો છે. અને તેવીજ રીતે તેની ટીકામાં શ્રી હરિલદ્રસૂરિએ સ્પષ્ટ ખુલાસો કર્યો છે. તે ગાથાએ અને ટીકા આ છે—

બહુઅદ્ધિયં પોગલં અણમિસં વા બહુકંટયં ।

અતિથિયં તિંદુયં બિલ્લં, ઉચ્છુખણં ય સંબર્લિ ॥ ૭૩ ॥

અષ્ટે સિઆ ભોયણજાએ, બહુઉજ્જ્વયધમ્મિયં ।

દેંતિઅં પઢિઆઇકખે ન મે કાપછ તારિસં ॥ ૭૪ ॥

અ ૦ ૫.

અર્થાત्—બહુ અસ્થિમય માંસ, બહુ કંટકમય મત્સ્ય, અસ્થિવૃક્ષ ફુલ, ખીલીપત્રનું ફળ, શેરડી, શાદમલિ, આવી જતના પદાર્થો—જેમાં ખાવાનો લાગ ઓછો અને ફેંકી

હેવાનો વધારે હોય-આપનારીને ‘તે મને યોગ્ય નથી’ એમ કહુને નિષેધ કરે.

આના ઉપર શ્રી હરિલદ્રસૂરિ મહારાજ કહે છે કે—

‘ અયં કિલં કાલદ્વયેક્ષયા ગ્રહણે પ્રતિષેધઃ ।

અહિ ‘કાલ’ શબ્દથી પુરાતત્ત્વના સમ્પાદકે તે લેખની નોટમાં ‘હુકાળ વિગેરે’ અતાવેલ છે, પરન્તુ તે ઠીક નથી. ‘કાળ’ શબ્દથી ‘સમય’ વિશેષ સમજવો જોઈએ છે. અને ‘સમયવિશેષ’ એટલે ડેઈ મહાન् લયંકર-લૂતાદિ રોગના સમયે, તે વસ્તુ અહુણું કરવાની ૧૩૨ પડે તો, હરિલદ્રસૂરિ મહારાજ કહે છે કે-એવા અતિકંટકમય મત્સ્ય કે અતિ અસ્થિલય માંસનો સાધુ નિષેધ કરે. શ્રીહરિલદ્રસૂરિ વધુ ખુલાસો એમ પણ કરે છે કે—

“ અન્યે ત્વભિયધતિ—વનસ્પત્યધિકારાત् તથાવિધ—ફલભિધાને એતે ” અર્થાત् આ પ્રસંગ વનસ્પતિ સંખ્યી હોવાથી તે પણ એક જાતનાં વનસ્પતિનાં ઇણોનાં નામો છે. તેઓ કહે છે કે—

‘ અતિથિં ’ અસ્થિકવૃક્ષફલમ् ।

‘ તિંદુયં ’ તેંદુરુકી ફલમ्, ઇતિ ॥

એટલે એ તો નક્કીજ છે કે ઉપરના પાડો ઉપરથી “ જૈન સાધુએ માંસ-મત્સ્યનું લક્ષણું કરતા હતા. ” એમ ને કહેવામાં આવે છે તે હુંખુક છે.

ધ્યાનમાં રાખવાનું છે કે—આવી રીતે લૂતાડિ—રૈગાડિ કારણે પણ ચોમાસામાં તો તે વસ્તુએ દેવાને પણ નિષેધ છે.

કલ્પસૂત્ર—સુવોધિકા દીકામાં નવમા ક્ષણુમાં કહ્યું છે—

યद્વારિ મધુ ૧ મદ્ય ૨ માંસ ૩ નવનીત ૪ વર્જનં યાવજ્જીવં અસ્ત્યેવ, તથાપિ અત્યંતાપવાદદશાયાં બાહ્યપરિભોગાદ્યર્થે કદા-ચિદ્ભૂત ગ્રહણેડપિ ચતુર્માસ્યાં સર્વથા નિષેધઃ ॥

ભગવાન મહાવીરે તો જૈન સાધુઓને—પોતાના સાધુ-ઓને એવા માર્ગમાં ચાલવાનો—અરે, ચાલવાનો જ નહિ, ચાલવાનું મન પણ કરવાનો નિષેધ કર્યો છે કે—જ્ઞાનં મત્સ્ય—માંસ વેચાતું હોય.

આ ભતલણનો અચારાંગસૂત્ર માં અને નિશીથસૂત્ર માં આ પાડ છે.

“મંસખલં મચ્છુખલં વા ઇચ્છાઇ જાવ ણો અમિસંધારેજ”

હું આપણે ભગવતી સૂત્રના તે પાડ ઉપર દૃષ્ટિપાત કરીએ કે ને પાડમાંના શફ્ટો તિર્યંચ પ્રાણુની ભ્રાંતિમાં નાખે છે, પરન્તુ વસ્તુતઃ તે શફ્ટોના અર્થો બીજ જ છે.

મગવતી સૂત્ર, શતક ૧૫, પૃષ્ઠ ૧૨૬૬ માં આ પાડ છે:-

“તત્થ ણ રેવતીહ ગાહાવઇએ મમ અદ્રાએ દુંબે કવોયસરીરા ઉપકંખડીયા, તેહિ નો અદ્રો અત્થિ । સે અણે પારિયાસિએ મજારકડે કુકુંડમંસએ, તમાહરાહિ, તેણં અદ્રો” ઇત્યાદિ ।

શું જૈન સૂત્રોમાં માંસાહારનું વિધાન છે ?

આના અર્થને વિચારવા પહેલાં કયા પ્રસંગનો આ પાઠ છે, તે વિચારીએ.

મહાવીર સ્વામીના શિષ્યાભાસ ગોશાલાએ જ્યારે ભગવાનના ઉપર તેજેલેશ્યા મૂકી, ત્યારે ભગવાનને તેના તાપથી-ગરમીથી ભરડો થઈ ગયો. આ જેઠને સિંહા આણુગાર ધણો હુઃખી થયો અને માલુકદ્ધિ નામના વનમાં જઈને રોવા લાગ્યો. ભગવાને જ્ઞાનથી જાણી લીધું અને સાધુને મોકદી સિંહા અનગારને પોતાની પાસે ઓલાવી કર્યું:- “ હે સિંહા અનગાર, તું ચિંતા ન કરીશ. હું હજી સોલ વર્ષ જીવવાનો છું. ”

ઇત્યાદિ કહીને ઉપરની વાત કહેવામાં આવી છે. એટલે કે-

“ તત્ (મેટિગ નગરમાં) ગૃહપતિની પત્ની રેવતીએ આરા માટે એ કુષ્માંડ તૈયાર કર્યાં છે, તેને લઈશ નહિ, કિન્તુ વાયુશમનને માટે થીજોરાપાક છે, તે ક્ષેવો. ”

ઉપરના પાઠનો આ અર્થ છે. પરન્તુ અનલિઙ્ગ ડેટલાક ક્ષેક્ષા ઉપરના પાઠમાં આવેલા ‘ દુવે કપોયસરીરા નો અર્થ એ કુપોતશરીર કરે છે અને કુઙ્કુડમંસએ નો અર્થ ‘કુઙ્કુડ માંસ’ કરે છે, પરન્તુ આ અર્થી ઉચ્ચિત નથી. શ્રીમાન અસ્યદેવસૂરિ મહારાજ કહે છે કે.

“ દુવે કવોયા ઇત્યાદિ શ્રૂયમાણમેવાર્થે કેચિદ્દ મન્યન્તે”

અર્થात् કેટલાક લોકો ‘દુવે કવોયા’ ઈત્યાદિ જેવા શબ્દો છે તેવાજ અર્થ કરે છે. પરંતુ આગળ ચાલીને ટીકાકારે એનો વાસ્તવિક અર્થ આમ કર્યો છે:-

“કપોતકः પક્ષિવિશેષस્તદ્વદ્ભે ફલે, વર્ણસાધર્મ્યાત्, તે કપોતે કૃષ્માણ્ડે, હૃસ્વે કપોતે કપોતકે, તે ચ તે શરીરે ચ વન-સ્પતિજીવદેહત્વાત् કપોતશરીરે, અથવા કપોતકશરીરે ઇવ ધૂસરવર્ગસાધર્મ્યાદેવ; કપોતકશરીરે કૃષ્માણ્ડફલે એવ તે ઉપસ્કૃતે સંસ્કૃતે, ‘તેહિં ણો અદ્વોત્તિ’ બહ્વપાયત્વાત्।”

અર્થात्—‘કુપોત’ પક્ષિ વિશેષ (કણુતર) નું નામ છે. તેના જેવા વર્ણવાળા એ ઝલ-કુષ્માણ્ડ ઝલ, એવા પકાવેલા એ કુષ્માણ્ડ ઝલનું અમને પ્રયોજન નથી. (‘કુત્સિતાલ્યાજ્ઞાતે’ સિદ્ધહેમ વ્યાકરણુના ૭-૩-૩૩ મા સૂત્રથી અહૃપ નહુાના અર્થમાં ‘કુપુ’ પ્રત્યય આવ્યો છે.) કારણ કે (તે આધાકુમી હોવાથી) તેમાં ધણ્ણો હોષ છે.

વળી પણ ટીકાકારે વિશેષ સમાસ કરીને કહ્યું છે-

‘કુપોતકુ’ એ ડોડાનું નામ છે અને ‘શરીર’ એ ઝલનું નામ છે. અથવા ધૂસરવર્ણના જેવું હોવાથી ‘દુવે કવોયસરીરા’ નો અર્થ ‘એ ડોડાના ઝલ’ એવાજ અર્થ થાય છે, તે તૈયાર કરેલાં છે, તે મારે ન કહ્યે, કારણ કે આધાકુમી હોવાથી ખણું પાપનું કારણ છે.

આમ કહીને પછી કુકુડમાંસ મંગાવ્યું. અહીં પણ દીકાડારે કરેલો ખુલાસો ધ્યાનમાં લેવો ધરે છે.

મૂલ સ્તુતમાં પાડ છે. મજારકડે કુકુડમંસએ, તમાહગહિ,
તેણ અણી ।

દીકાડાર કહે છે કે—‘અહીં પણ ‘શ્રુયમાણ અર્થ’ જ
કેટલાક કરે છે, પરન્તુ તે ડીક નથી.’

“માર્જારો વાયુવિશેષસ્તદુપદમનાય કૃતં સંસ્કર્ત માર્જારકૃતમ्”

અર્થात् ‘માર્જાર’ નામના વાયુથી શાન્તિને માટે તૈયાર કરેલી વસ્તુ ‘માર્જારકૃત’ કહેવાય અથવા ‘માર્જાર’ એટલે ‘વિરાલ’ નામની વનસ્પતિ વિશેષ, તેનાથી તૈયાર કરેલ, તે પણ ‘માર્જારકૃત’ કહેવાય અને કુકુડમાંસ નો અર્થ છે ‘ખીન્દેરાપાડે’

અહીં એક વાત વિચારવા જરૂરી છે. લગ્નાનું મહાવીર-સ્વામીને આ વસ્તુની આવશ્યકતા પોતાને થયેલા ‘મરડો’ ના રોગની શાન્તિને માટે પડી હતી. મરડો અતિ ગરમીથી થાય છે અને થયો હતો. આવી અવસ્થામાં કોઈ પણ ઠંડા ઉપયારો જ ઉપયોગી થઈ શકે, એ હોમીટું છે. ‘માંસ’ જેવા અતિ ગરમ અને ગરીષ્ઠ પદાર્થો તેના રોગને માટે વધારે નુકસાનકર્તા જ થાય. હા, કોડાનો યા ખીન્દેરાનો સુરળ્યો આપી શકાય, કારણું કે આ દ્વારા ઠંડાં છે—ઠંડક કરનારાં છે. એટલે બુદ્ધિયી પણ આપણે વિચારી શકીએ

કે આ પ્રસંગ ‘માંસાહાર’ માટે છે જ નહિ અને તેટલા માટે ટીકાકારે તે શબ્દોનો અર્થ ‘વનસ્પતિ’ માં કોણ છે તે વ્યાજ્યણી છે.

ધ્યાનમાં રાખવું જોઈએ છે કે શબ્દો, કેવળ એકજ અર્થને સૂચ્યવાનારા નથી હોતા. શબ્દોના અર્થો ધણ્ણા હોય છે અને એક એક શબ્દના અનેક અર્થો ન થતા હત તો આજે ‘કોશ’ જેવું સાહિત્યનું એક અંગજ હૃદાતિ ન જોગવતું હત.

ઉપરના શબ્દોના અર્થો જેમ ટીકાકારે ‘વનસ્પતિ’ વિશેષમાં કર્યા છે તેવીજ રીતે પ્રાચીન કોશોમાં પણ તે શબ્દોના અર્થો ‘વનસ્પતિ’ વિશેષમાં કર્યા છે.

નિર્ણયસાગર ગ્રેસમાં પ્રકાશિત અમિધાનસંગ્રહ નામના સંઘર્ષમાં ‘નિવણ્ડુ’ નામક કોશ છપાયો છે, તેના ૧૩૬-૧૪૦ કિલોકમાં આ શબ્દો છે—

“ પારાવતે તુ સારામ્લો રક્તમાલઃ પરાવતઃ
આરેવતઃ સારફલો મહા પારાવતો મહાન् ।
કપોતાણ તુલ્યફલો...”

આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે—કપોત એ અણુકુદ્ય-
કુદ્યનું નામ છે. આવીજ રીતે કુકુટ શબ્દ પણ તેજ
નિવણ્ડુ ના ઉપર મા કિલોકમાં છે.

“ શ્રીવારકઃ શિતિવરી વિતુનઃ કુકુટઃ શિતિ ” ।

આ કોશાજ જ્યારે તે શાખ્દો વનસ્પતિ વિશેપને માટે સ્પષ્ટ બતાવે છે, તો પણ હવે નિશ્ચિત ધાર્ય છે કે-જે લોકો જૈનસૂત્રોમાં માંસાહારનો પાઠ જોકા રહ્યા છે તેઓ ભ્રાન્તિમાં છે.

ઉપરનાજ શાખ્દો નહિ, પ્રાચીન અથોમાં એવા અનેક શાખ્દો છે કે જે અત્યારે કંઈ બીજી જ અર્થમાં વપરાતા હોય છે. ત્યારે, અત્યારે જે અર્થમાં તે શાખ્દો વપરાતા હોય, તે અર્થમાં તે શાખ્દો લક્ષ્યજવાથી મહાન् અનર્થ ઉત્તે ધાર્ય, એ હેઠીતું જ છે. હું થોડાક એવા શાખ્દો આપું છું કે જે એવીજ રીતે જુદા જુદા અર્થમાં વપરાયા છે.

‘મજારવા’ શાખ્દ પ્રકૃટ અર્થમાં ‘બિલાડી’ અર્થમાં છે પરન્તુ ભગવતી સૂત્રના ૨૧ મા શતકમાં સુધ્યપર્ણ વનસ્પતિના અર્થમાં મૂક્યો છે. ‘એરાવળ’ ધર્નદના હાથીનું નામ છે, પરન્તુ પન્નવણ સૂત્રમાં ‘લકુચ્છળ’ ના અર્થમાં મૂક્યો છે. ‘મંડુકી’ એ હેડકીનું નામ પ્રસિદ્ધ છે, પરન્તુ ઉપાસ-ગદદાંગ સૂત્રમાં આણુંં શ્રાવકના અધિકારમાં આણુંં શ્રાવક વનસ્પતિનું પરિમાણ કરતાં ‘મંડુકી’ ની છુટ રાખે છે. કારણું કે-મંડુકી એ ‘કેડી’ નામની વનસ્પતિનું નામ છે.

આ અર્થી સ્વતંત્ર કદ્યપનાથી કરવામાં આવ્યા છે અથવા આવે છે, એમ નથી; નિઘણુ આહિ સંસ્કૃત-પાકૃત કોશોમાં પણ એના વનસ્પત્યાહિ અર્થી અતાંબ્યા છે.

આતો સૂત્રોમાં આવેલા શાખદોની વાત થઈ, સંસારમાં પણ એવા અસંખ્ય શાખદો પ્રચલિત છે કે જેના જુદા જુદા અર્થી થાય છે. દાખલા તરીકે—

‘રાવણ’ દશાનતું નામ છે તેવી રીતે ‘તંહુક’ ઇલનું પણ નામ છે, ‘પતંગ’ ચૌરેન્દ્રિય જીવનું નામ છે, તેમ ‘મહુડાં’ તું પણ નામ છે. ‘તાપસપ્રિયા’ તાપસની ખીનું નામ છે, તેમ ‘દ્રાક્ષા’ તું પણ નામ છે, કચ્છપ કાચબાતું નામ છે, તેમ ‘નંદીરૂણી વૃક્ષનું’ પણ નામ છે, ‘ગોજિબા’ ગાયની જીલનું નામ છે, તેમ ‘ગોઝી’ તું નામ છે. ‘માંસલ’ માંસવાળાનું—અતિપુષ્ટનું નામ છે. તેમ ‘કાલ્પિંગડા’ તું પણ નામ છે. ‘વિમ્બી’ સર્વ વિશેષને કહે છે, તેમ ‘કષ્ણદૂરી’ નામના શાકનું પણ નામ છે. ‘ચતુષ્પદી’ ચાર પગવાળા (પશુ) ને કહે છે, તેમ ‘ભીંડા’ ને પણ કહે છે.

કેટદ્વા શાખદો લખવા ? ચારે તરફનું જાન મેળવ્યા સિવાય અર્થાત્ ચારે તરફની પરિસ્થિતિ જાણ્યા વિના એક તરફજ લક્ષ્ય કરીને જે નિશ્ચય કરવામાં આવે, તો મહાન् અનર્થ થવાની જ સંલાવના રહે. પંજાબનો એક માણુસ ગુજરાતમાં જય, અને પ્રસંગોપાત વાત નિકળતાં કહે કે— હમારે વહોં કૂકડી બહુત હોતી હૈની, ઔર હમ લોગ વિશેષતઃ કૂકડી ખાતે હૈની ! ગુજરાતનો વાણીયો આ સાંભળીને દિગ્ભૂટ જ થઈ જય, પણ જે દિગ્ભૂટ થઈને ચૂપચાપ એસી રહે, અને અજે ત્યાંથી છુટા પડે તો પેલા ગુજરાતીના મનમાં અવર્થ એ

શું હેનસૂત્રોમાં માંસાહારનું વિધાન છે ?

ભાવના રહીજ જય છે કે પંચભના લોકો—વાણિયા ગણું કુકડી ખાય છે. પરન્તુ ધ્યાનમાં રાખવું જોઈએ કે પંચભનામાં માર્કાઈ ને કુકડી કહે છે. જો આ જાન પાત્ર થયું હોય તો પેલા ગુજરાતીને ભડકવા કેવું નજ રહે.

‘પોપરા’ શબ્દ ગુજરાતમાં પ્રસિદ્ધ છે પરન્તુ તેજ પોપરા શબ્દ માગવામાં કોઈ ઓલે—ચણુંના ઐતરમાં ઉલેલી કોઈ બાઈને રસ્તે જતો મુસાફર એમ કહે છે કે—બાઈ એક આનાના પોપરા આપતો, તો તે બાઈ પોપરાના બદલામાં ગાળોનો વરસાદ જ વરસાવે.

પૂર્વ દેશમાં ‘શાક’ ને ‘તરકારી’ જ કહે છે, ગુજરાતમાં ‘તરકારી’ શબ્દ નથી ઓલાતો.

કહેવાની મતલબ કે કોઈપણ શબ્દનો એકજ અર્થ કરીને નિર્ણય ખાંધવામાં ઘણી ભૂલ થવાની સંભાવના રહે છે. સૂત્રોમાં આવેલા કેટલાક શબ્દોમાં પણ રહેલું આ રહુસ્ય ન સમલય, ત્યાં સુધી નિર્ણય ખાંધવો વ્યક્તાથી નથી. પરન્તુ કેટલાક હિગમણર લાઈએ પણ, કે જેએ પ્રાચીન સૂત્રોને ન માનતાં આધુનિક અંગ્રેઝ ઉપર જ પોતાના સાહિત્યનો પુલ ઉલ્લાકરે છે, તેએ વૈતાભર સૂત્રોનો કોઈપણ ગીતાર્થ શુરૂપાસે અસ્થાસ કર્યા વિના, અરે, અક્ષર પણ સંસ્કૃત=પ્રાકૃતનું કદાચ જાન ન ધરાવતા હોય એવા પણ, વૈતાભરે ઉપર ‘માંસાહાર’ નો આરોપ મૂકવા તૈયાર થાય છે. પરન્તુ એવા કુપ્રમંડુકો તો ખરેખર અનધિકાર એષાજ કરે છે. વિક્રતાની

ગંધ નહિ હેવા છતાં બીજાની વાહે પોતે પણ અકવાહ કરવા તૈયાર થવું, એના જેવી મૂર્ખતા બીજી કદ્દી શકાય ! એવા લેખકો ઉપરના વિવેચનથી સમજી શકયા હશે કે જેએ સ્વેતાંધરો ઉપર માંસાહારનો આરોપ મૂકવા તૈયાર થાય છે, તેએ કેવા બ્રમભાં છે.

જે મહાવીરે અહિંસાનો અંડા ફરકાવ્યો છે, જે મહાવીરે મનુષ્ય માત્રની જ સાથે નહિ, જગતન! પ્રાણિમાત્રની સાથે મૈત્રીભાવથી રહેવાની ઉદ્ઘોષણા કરી છે, જે મહાવીર નિશ્ચયની સાથે વ્યવહારનું પાલન કરવાનો પણ ઉપરેશ આપે છે, એ મહાવીર પોતાના સાધુઓને માંસાહારની દૂટ આપે ખરા કે ?

ધ્યાન પૂર્વક જેવામાં આવે તો મધુ, માંસ, માંખણ અને મદ્દિરાને વારંવાર અભક્ષ્ય તરીકે ઓળખાંવ્યાં છે. પ્રવચન-સારોહ્નારમાં માંસને પ્રત્યેક અવસ્થામાં સળુવ ખતાવેલ છે. સૂયગડાંગસૂત્રના બીજા કુતસ્કંધના છુંા આર્દ્રકુ અધ્યયનની ૩૭-૩૮ ગાથાઓમાં માંસાહાર કરનારાઓનું વર્ણન આપી, પછી કહેવામાં આવ્યું છે કે —

જે યાવિ ભૂંંતિ તહ્પગાર
સેવંતિ તે પાવમજ્જાણમાણા ।
મણં ન એં કુસલં કરંતી
વાયાવિ એસા બુદ્ધા ઉ મિચ્છા ॥ ૩૯ ॥

અર્થાત—જેએ તથાપ્રકારનો આહાર કરે છે, લોજન

શું જૈનસ્તોમાં માંસાહારનું વિધાન છે ?

કરે છે, તે પાપને નહિ જાણુનારા અનાર્થ માણુસો તેની જેવા કરે છે—તેનું થહુણ કરે છે. પરંતુ કુશલ મનુષ્યો—માંસભક્ષણુમાં રહેતા પાપને જાણુનારા મનુષ્યો! તેની અભિજાપારિપ મન પણ ન કરે. અરે એવી વાણી પણ એમને ભુડી થઈ ગયેદી હોય છે. મિથ્યા છે. અર્થાત् એવી વાણી પણ બાલતા નથી.

આ પ્રમાણે ન કેવળ માંસાહારનો જ નિષેધ કરવામાં આવ્યો છે, સમસ્ત પ્રાણીઓએ ઉપરની દ્વાના કારણે સાવદ્ધ આરંભ સમજુને મહાવીરના સાધુઓએ ઉદ્દિષ્ટ—હાનને મારે પરિકલ્પેતા આહારનો પણ ત્યાગ કરવો જોઈએ. આ મતલબને કહેનારી ગાથા તે પછીની જ છે. તે આ રહી—

સવ્વેસિં જીવાણ દયદૃયાએ
સાવજ્જદોસં પરિવજ્જયંતા ।
તસ્સંકિણો ઇસિણો નાપુતા
ઉદ્દિભક્તં પરિવજ્જયંતિ ॥


આ ખધાં પ્રમાણો ઉપરથી એક ખાળક પણ સમજ શકે એવું ચોખ્યું થયું છે કે, જેએ એમ ખતાવે છે કે જૈન સ્તોમાં માંસાહારનું વિધાન છે, તેએ યા તો જૈન ધર્મ ઉપરના દેખથી કહે છે, અથવા તો તેએ જૈનસ્તોના રહસ્યોથી હજ્ઞૂ હજારો કોશ ફર છે.

કોઈ પણ વિષયનો પૂરો અલ્યાસ કર્યા વિના એકાએક

ચોક્કસ અલિપ્રાય ખાંધવો અને એ અલિપ્રાય જગત સમક્ષ નિશ્ચયડ્રેપે જણેર કરવો, એ મહુા અજ્ઞાનતા છે. જૈનસૂત્રો, એ તો ધ્યાનો સાગર છે. જૈનસૂત્રો, એ અહિસાનાં રતનેઃ છે. ચેના એક એક વર્ણમાંથી અહિસાની એજસ્તિતા ચમકી રહી છે. અને પારખવાની શક્તિ જેઠાંએ. ભલભલા મહાનું પુરષો પણ એ સૂત્રોનાં સંપૂર્ણ રહસ્યોને નથી મેળવી શકતાં, તો પછી પામર લુદોની શી કથા? ધ્યાનમાં રાખવાનું છે કે મહાવીરના સૂત્રોનો—એક એક સૂત્રનો એકજ અર્થ નથી ધતો પરન્તુ એગસ્સ સૂત્રસ્સ અનન્ત અથો એક એક સૂત્રના અનન્ત અર્થો રહેલા છે. મહાવીરના સૂત્રોમાં રહેલી વિશાળતાને પામવાની આપણી શક્તિ ન જ હોય. એને માટે તો મહાનું ગોતાર્થ—બહુશુત ગુરુઓનાં વર્ષો સુધી યાસાં સેવીયે, તો ચે સમુદ્રમાંથી બિંદુ મેળવવું પણ મુશ્કેલ થાય.

આ વિષય અતિ ગંભીર છે. વિચારણીય છે. આને માટે હજ્યું પણ અનેક પ્રમાણો સૂત્રોમાંથી મળી આવે છે. અને મારી ધર્છા છે કે જરા વિશેષ સમય મળે તો ઉપર વધારે પ્રકાશ પડાવો.

શાસનદેવ એવો સમય જલહી પ્રાસ કરાવે, એટલું ધર્છી વિરમું છું.



(૪૦)

સામાજિક અન્ધનો.

સમાજ અને ધર્મનું અત્યારે કેટલું બધું એકીકરણ થઈ ગયું છે, એ હવે કોઈથી અભાગ્યું નથી. એશક, ધર્મ એ એક નિરાળીજ વસ્તુ છે, તેમ છતાં ધર્મ અને સમાજની અની ગયેલી ધનિષ્ઠતાના કારણે તે બન્નેની એક ભીજ ઉપર અસર થયા વિના નથીજ રહેતી. અને તેટલાજ માટે એમ કહેવું જોઈએ કે સામાજિક નિયમોની સંકુચિતતા કે ઉદારતા, એ ધર્મના પ્રગારમાં વિધાતક કે ઉત્તેજક અવશ્ય થાય છે, આજે હું એક આવાજ વિષય તરફ જૈન સમાજનું ધ્યાન ખેંચવા ચાહું છું.

આ વિષયના મૂળ ભુદ્ધા ઉપર આવું, તે પહેલાં એક વાતની ખાતરી કરી લેવી ઉચિત છે. અને તે એ કે જૈન સમાજ-અર્થાત્ જૈનધર્મના અનુયાયીઓની સંખ્યા હિન્પત્રિ-દિન વધે છે કે ધટે છે. સામાન્ય રીતે બધા એમ જરૂર જાણે છે કે-જૈનોની સંખ્યા જરૂર ધટે છે, પરન્તુ કેટલી અને બીજી ડામોની સાથે સુકાળકામાં કયાં સુધી તેની પરિસ્થિતિ આવી છે, એ જાણવાને માટે નીચેના પ્રામાણિક આંકડા બધાને સહાયભૂત થશે.

ધર્મ	૧૯૦૧	૧૯૧૧	૧૯૨૧
સનાતની	૨૦૭,૦૫૦,૫૫૭,	૨૧૭,૩૩૭,૬૪૩,	૨૧૬,૨૫૦,૬૨૦,
આર્થિકસમાજ	૬૨,૪૧૬,	૨૪૩,૪૪૫,	૪૬૭,૫૭૮,
અદ્ધસમાજ	૪૦૫૦,	૫,૫૦૪,	૬,૩૮૮
સીગી	૨,૧૬૫,૩૩૯,	૩,૦૧૪,૪૬૬,	૩,૨૩૮,૮૦૩
જૈન	૧,૩૩૪,૧૪૮,	૧,૨૪૮,૧૮૨,	૧,૧૭૮,૫૬૬
ખોષ્ટ	૬,૪૭૬,૭૫૬	૧૦,૭૨૧,૪૪૩,	૧૧,૫૭૧,૨૬૮
પારસી	૬૪,૧૬૦,	૧૦૦,૦૬૬,	૧૦૧,૭૭૮
મુસલમાન	૬૧,૪૫૮,૦૭૭,	૮૬૬,૬૪૭,૨૬૬,	૬૮,૭૩૫,૨૩૩
શ્રીસ્તી	૨,૬૨૩,૨૪૧,	૩,૮૭૬,૨૦૩,	૪,૭૫૪,૦૬૪
ડાકલીયા	૮,૪૮૪,૧૪૮,	૧૦,૨૬૫,૧૬૮,	૬,૭૭૪,૬૧૧
નાના સંપ્રદાય વાળા	૧૨૬,૮૦૦,	૧૩૭,૧૦૧,	૧૮,૦૦૪

ઉપરના આંકડાઓમાં કાળા ટાઈપમાં આપેલા આંકડાઓ તરફ હું વાયકોનું ખાસ કરીને ધ્યાન ઘેંચું છું.

૧૯૦૧ ની મર્હુમશુમારી પછીના એ હસકાચ્ચોમાં આર્યસમા-
જુઓ પોણુચાર લાખ વધ્યા. જૌઝો લગભગ એકવીસ લાખ
વધ્યા, મુસલમાનો પોણીત્રેસઠ લાખ વધ્યા. અને કિશ્ચીયનો
આટાર લાખ ઉપર વધ્યા. ખરી રીતે ઉપરના આંકડાઓ
જેતાં લગભગ બધાએ ધર્મવાળાઓની સંખ્યા થાડી યા ધણી
૧૯૦૧ પછીના વીસ વર્ષોમાં વધેલી જ જોવાય છે. જ્યારે
એકજ કમનસીથ જૈનકોમ છે તે-જેની સંખ્યા ૧૯૦૧
પછીના વીસ વર્ષોમાં-માત્ર એ જ હસકાચ્ચોમાં ન કંઈપી શકાય
તેટલી ઘટી છે. હોઠલાખ કરતાં વધારે સંખ્યા ઘટી છે.

જે સમાજ પ્રતિવર્ષ હુન્દરે બદ્દે લાખો ડાખિયા ઉજ-
મણું, ઉપધાન, સંધ અને સાધર્મિ વાત્સલ્યાદિ ધર્મભાવનાનાં
કાર્યોમાં ખરચે, તે ડોમની સંખ્યા પ્રતિવર્ષ ઘટતીજ રહે,
અને બધે હસકાચ્ચોમાં ‘લાખ’ના હિસાબે સંખ્યા ઘટે, એ
ખરેખર કમનસીથી નહિ તો બીજું શું કહી શકાય? આવી
રીતે સંખ્યા ઘટતી જ રહે, તો ચોક્કસ વર્ષોમાં તેનું શું પરિ-
ણુામ આવે, એ સમજાવવાની જરૂર છે ખરી? શું ધૂમધામોમાં
રાચી-માચી રહેનારા શાસનધોરીઓ કોઈ દિવસ આ પ્રશ્નનો
વિચાર કરે છે ખરા? આટલી આટલી ધામધૂમો-આટલી આ-
ટલી સખાવતો અને આટલા આટલા ઉપરેશકો-ત્યાગી ઉપ-
રેશકો વિચારવા છતાં જૈનસમાજની-જૈન ધર્માનુયાધીઓની
સંખ્યા નથી વધતી, બદ્દે હિન્દુપ્રતિહિન ઘટી રહી છે’ અનાં
કારણો શોધવાની કોઈ તકલીફ ઉઠાવે છે કે? અથવા જે જે
કોમો આગળ વધી રહી છે, એ કોમો-એ સમાજે કયાં સાધનો
કારા પોતાના અનુયાધીઓ વધારી રહી છે એ સાધનો ઉપર કોઈ

હિવસ વિચાર સરખોકર્યો છે અરે ? જે એસંખ્યી વિચાર સરખો પણ નથી કરવામાં આવતો, અને ‘સમયને ઓળખો’ ની વીરહાક તરફ બિલકુલ બેદરકારીજ કરવામાં આવે, તો પણી શાસનના શુલેચ્છક કે સમાજના નેતા હોવાનો દાવો કરવો નિરર્થક નથી શું ? જૈનધર્મ એ ચુનિવર્સલ ધર્મ છે, જગન્માન્ય ધર્મ છે, આગામ વધતા વિજાનની સાથે બિલકુલ મળતા સિદ્ધાન્તોવાળો ધર્મ છે. છતાં તેની સંખ્યા ન વધે, પ્રત્યુત ઘર્તીજ રહે, એનાં કંઈપણ ગુણ કારણો હોવાંજ જોઈએ, એ કોઈથી પણ ના પાડી શકાય એવી ખાખત નથી. આવાં અનેક કારણમાંનું એક કારણ—સામન્જિક અંધારણોની સંકુચિતતા એ એક પ્રભલ કારણ હું મારા નભ્રમત પ્રમાણે માતું છું. અત્યારની લગ્જલત આખીયે જૈન સમાજમાં સામન્જિક અંધારણો એટલાં અધાં સંકુચિત અનાવવામાં આવેલાં છે, કે જેના કારણે હજારો જૈનધર્મને પ્રશંસનારાએ! જૈનધર્મમાં આવતાં સકોચાય છે. એટલુંજ નહિ પરન્તુ હજારો જૈન ધમાતુયાયિએ જૈનધર્મથી વિમુખ થઈને ધૃતર ધર્મોમાં ભળી જાય છે. કહેવાની કંઈ આવસ્થયકતા નથી કે ધર્મ એ એક આત્મીય વસ્તુ હોવા છતાં, ગૃહસ્થોને પોતાના ‘વ્યવહાર’ તરફ પહેલાં લક્ષ્ય આપવું પડે છે. આવી અવસ્થામાં જૈનધર્મમાં નવા આવનારા મનુષ્યો સાથે જે જૈનો પોતાનીજ કોમના એક જૈનખંડુ જેટલો અધિકાર નજ આપે, એની સાથે એટલાજ પ્રકારની છૂટ ન રાખવામાં આવે, તો તેઓ પોતાનો સંસાર—વ્યવહાર કેમ

ચલાવે, એ એક વિચારણીય પશુ છે. જે સમાજમાં આ છૂટ નથી, અર્થાત પોતાના ધર્મમાં દાખલ થનાર-પોતાના ધર્મના તમામ આચારોને શુદ્ધ રીતે પાલન કરનાર કોઈપણ માણુસની સાથે, ભગવાન મહાવીરના અસલ સિદ્ધાન્તો પ્રમાણે, જૈન ધર્મની ઉદારતાલરી નીતિ પ્રમાણે, જે વ્યવહારિક તમામ છૂટ ન આપવામાં આવે તો પછી તે જૈન ધર્મમાં આવીને પોતાનો વ્યવહાર જ કેમ ચલાવી શકે ?

પ્રારંભમાં આપેલા આંકડાઓમાં જે જે કોમોએ પ્રગતિ કરી છે-પોતાના ધર્મનુયાયિઓની સંખ્યા વધારી છે, એ આ ઉદારતાના પરિણામે છે, એ કોઈ પણ શોધક જેયા સિવાય નહિં રહી શકે. જૈનો-સામાજિક નિયમોમાં જે આ ઉદારત તત્ત્વ દાખલ કરે તો મારી ખાતરી છે કે-ખીલુ કોઈ-પણ કોમની હુરિકાઈમાં જૈનો આગળ વધી આવે.

આ પ્રમાણે ઉદારત તત્ત્વ દાખલ કરવામાં અથવા ખીલુ શાખાઓમાં કંદુએ તો, કોઈપણ દેશ કે કોઈપણ જાતિના માણુસને જૈનધર્મમાં દાખલ કરી તેની સાથે તમામ પ્રકારની છૂટ કરવામાં ધર્મના સિદ્ધાન્તોને-નિયમોને પણ કોઈ પણ જાતનો બાધ આવતો નથી. જૈનધર્મ તો પોકાર કરીને કહે છે —

અન્નદેશજાયા અન્નાહારવદ્ધયસરીરા

જિનસાસણ પવના સવ્વે તે બન્ધવા ભણિઆ ।

અર્થાત અન્યાન્ય દેશમાં ઉત્પજ્ઞ થયેલ અને અન્યાન્ય આહારથી વાદ્ધત શરીરવાળા હોય, પરન્તુ જે તે જિનશાસનને પ્રાપ્ત થયેલ છે—જૈનધર્મમાં આવેલ છે, તો તે બધા બાન્ધવોન છે. લાઈજ છે. અર્થાતું જાતિભાઈ તરીકે તેની સાથે તમામ પ્રકારનો વ્યવહાર કરવામાં કોઈપણ જાતની અડગણું નથી.

અરે, હું કયાં જૈનધર્મમાં નવા દાખલ થનારાઓની વાત ઉપર ઉત્તરી ગયો ! જૈન સમાજના સમાજિક બંધારણેનું ક્ષેત્ર એટલું બધું તો સંકુચિત થઈ ગયું છે કે કેનેના કારણે આજે ડેમોની ડેમો જૈન ધર્મથી વિમુખ બની એઠી છે, નાગર, મોઢ, મણિયાર અને ભાવસાર વિગેરે કેટલીઓ ડેમોની રહોઠી સંખ્યા—લગભગ બધાયે લોકો આજે જૈનધર્મથી વિમુખ થઈ અન્ય ધર્મેમાં લણી ગયેલ કયાં આપણે નથી જેતા ? શા માટે ? કેવલ સમાજના સંકુચિત નિયમોથી. બીજું કંઈ પણ કારણું આગળ કરી શકાય તેમ નથી. આ સંકુચિતતાનાં કારણે હજુ પણ હિન પ્રતિહિન જૈન ધર્મનું યાયિએ. ધીરધર્મેમાં લણી રહ્યા છે. આપણી સંકુચિતતા તો જરા જુઓ—

ધાર્મિક દૃષ્ટિએ જેતાં—વૈતાંભિર, દિગભિર, સ્થાનકવાસી, તેરાપંથી અને તેમાં પણ ગર્છો અને મતોના અનેક લેદો, ધર્માલિમાની લોકો, એકજ જૈનધર્મને આરાધનારા—એકજ મહાવીરને માનનારા—પૂજનારા, પરન્તુ જુદા જુદા વાડામાં

રહેલાઓની સાથે એટી વ્યવહાર ન કરે ? કેટલી અકુ-
સોસની વાત ! ઐર, જવા દો તે જુદા જુદા વાડાઓની
વાત. એકજ શૈવેતાંમણર કે હિગમણર, સ્થાનકવાની કે તેરા-
પંથીના વાડામાં રહેલા ઓસવાલ, પોરવાલ, શ્રીમાલ, અથ-
વાલ, ખાઉલવાલ, જ્યસવાલ, પદ્લીવાલ વિગેરે રહેવાતા લોકો
પણ એક ખીણની સાથે સંબંધ નહિં જોડે. આથીયે જરા આગળ
વધો. ઓસવાલ, પોરવાલ, શ્રીમાલ, ખાઉલવાલ જ્યસવાલ,
પદ્લીવાલ વિગેરેમાં પણ વીસા, દસા, પાંચા અને અઢીયા
વિગેરેના લેદો એટલે એઓમાં પણ વીસો વીસાનેજ શોધે
અને દસો દસાને. એક ખીણની સાથે તેઓ પણ ન જોડાય.
ઠીક. વીસા, દસા, પાંચા, અને અઢીયામાં પણ પાછો એકડો.
આ એકડાએ તો ખરેખર ગજખ જ કર્યો છે. ધારો કે કોઈ
પ્રાન્તમાં પાંચસો ધર વીસા ઓસવાળનાં છે. તે લોકોમાં પણ
કેટલાયે એકડા ખંધાઈ ગયા હુશે. અર્થાતું પચાસ પચાસ કે
સો સો ધરના એકડામાં-ખલ્કે કોઈ કોઈ સ્થાને તો સત્તાવીસી,
પચીસી, વીસી-એવાં નામો પાઠેલા હોય છે, એટલે એટલા
ગામોમાંજ રહેનારા દસા દસામાં અને વીસા વીસાની સાથે
સંબંધ કરી શકે, ખહાર નહિં. અતાવો, આ સંકુચિતતા-આ
એકડા એ આખી યે જૈનકોમનો મૃત્યુધંટ નથી શું ? જે
નાનકડી કોમમાં આઠલા આઠલા લેદાનુલેદો હોય, આઠલી
ખંડી વાડા-વાડીએ હોય, તે કોમનો દિવસે દિવસે હાસ
થાય તો તેમાં નવાઈ જેવું શું છે ?

આવા એકડાએ. જેમ ગુજરાત-કાઠીયાવાડમાં છે, તેમ દક્ષિણમાં પણ છે. દક્ષિણમાં થોડાં થોડાં ધરોમાં એકડા બોળ અંધાઈ ગયા છે. એના કારણે અનેક ખરાખીએ. ત્યાં ઉલ્લી થયેલી જોવાય છે. પરન્તુ તેજ દક્ષિણમાં હવે લોકો સમજવા લાગ્યા છે. મુરબ્બાડના જૈનેના સાથે વાત થતાં લગભગ ત્યાંના અધારે લોકો આવા એકડાના વિરોધી જણાયા. અને એમના વિચારો ઉપરથી જણાયું કે ખડુ જલ્દી જ તે તરફ એકડાનું અંધારણ તોડી કંઈક વિશાળતા કરશે.

આવી રીતે હવે વિચારકોમાં આ વસ્તુસ્થિતિ સમજવા લાગી છે. હવે લોકો સમજવા લાગ્યા છે કે આ સંકુચિતતાનું જ પરિણામ છે કે, જૈનધર્મનુયાદી ટેટલીએ પેટા કોમેં જૈનધર્મથી વિમુખ થઈ, એટલું જ નહિ પરન્તુ સેંકડો ગરીબ કુંદુએ અને હજારો યુવકો! આજે આર્યસમાજ અને એવી હીજી સમાજેમાં જઈ વસ્ત્યા છે. જૈનધર્મની પ્રગતિમાં નહિં, બલ્કે જૈનધર્મના સ્થિતિ-સ્થાપત્યમાં પણ આ સંકુચિતતાએ ખરેખર કુઠારાધાતનું કામ કરી રહી છે. બાળ લગ્ન અને કન્યાવિકૃય જેવા હુદ્દ રિવાજે શું આ સુંકુચિતતાએને-વાણી વાડીએને આલારી નથી? પાંચ-પચાસ કે સૌ ધરમાંજ સંખ્યાએ જોડાતા હોય, એવી સ્થિતિમાં નહાની ઉમરમાંજ બાળકોનાં લગ્નો એકદમ થઈ જાય, તો તેમાં આશ્ર્ય જેવું શું છે? તેમજ પૈસાદારો ગમે તે લોગે-ગમે તેટલા ખરચે-પૈસા આપીને પણ પોતાના છોકરા માટે કન્યા

ઘસેડવાને તૈયાર થાય, તો તેમાં પણ શી નવાઈ છે ? અને એવા પ્રસંગેમાં-આજકાલના વિષમ સમયમાં, હસ માણુસ ખાનાર અને એક માણુસ મુશ્કેલીથી મહીને પાંચ-પચીસ રૂપિયા કમાનાર ગરીબ માણાપો પોતાની કન્યાને વેચવાને માટે પણ તૈયાર થાય-ધનાખ્યોનાં પ્રલોભનોના શિકાર ણને, તો તેમાં પણ નવાઈ જેવું શું છે ? અને આ ખીચતાણીના કારણે પેકા સાધારણ કે ગરીબસ્થિતિના નવયુવકો પોતાની જ ડોમના-પોતાના જ એકડાના-ધર્મના ડેઢ કુંદુણના સાથે પોતાનો સંસાર વ્યવહાર બાંધવાથી વંચિત રહે, તો તેમાં પણ નવાઈ શી છે ? ત્યારે ડેઢ બતાવશો કે આતું શું પરિણામ આવે ? ધર્મનો ત્યાગ કે ખીજું કંઈ ? કહેવાય છે કે પંનણના અનેક યુવકો, આવા કારણે જ આર્યસમાજ અને ખીજું ખીજું સમાજેમાં લળી ગયા, અને જ્યારે આ વસ્તુ સ્થિતિ પંનણના નૈનોએ જેઠ, ત્યારે તેઓએ એક ભતે આ સંકુચિતતાની સંકળને તોડી નાખી વિશાળ નિયમ અનાવ્યો !

જે સામાજિક બન્ધનો ધર્મનો હંસ કરે, ધર્મથી લોકોને વંચિત અને વિભુખ કરે, એવાં સામાજિક બન્ધનો, આ જાગતા જીવતા જમાનામાં રાખવાં શું ચોણ્ય છે કે ? શું સમાજના નેતાઓએ આ સંબંધી બહુ ગંભીર વિચાર કરવો નથી જેઠતે ! ? મારા નમ્ર ભત પ્રમાણું આ પશ્ચ બહુ વિચારવા જેવો છે. ધર્મની પ્રગતિને માટે વિચારવા જેવો છે. યદ્વાપિ

સમયને ચોળાયો.

આવા સાંસારિક પ્રક્ષણની સાથે મારો કંઈ સંખંધ નથી, પરંતુ સાંસારિક હોવા છતાં પણ, તે ધર્મની સાથે ઘનિષ્ઠ સંખંધ રાખતો હોવાથી અને તેના કારણે જ ધર્મની પ્રગતિ અટકી રહેલી હોવાથી—બદ્લે ધર્મનો—ધર્માનુયાયિઓનો દિવસે દિવસે ઝુસ થતો હોવાથી આ વિષય ઉપર આટલો ઉહાયોહ કરવો ઉચ્ચિત ધાર્યો છે.

આશા છે કે—સમાજના નેતાઓ આ વિષય ઉપર વિચાર કરશે. કમમાં કમ ફરેક એકડાવાળાઓ—દસા—વીસા આદિમાં માનનારાઓ આ વિષય ઉપર વિચાર કરી આ બંધનોને કેમ બને તેમ તત્કાલ તોડી નાખવાની પ્રવૃત્તિ હાથ ધરશે.

શાસનહેવ સર્વને સહભુદ્ધિ આપો અને આવા જે જે બન્ધનો ક્ષારા જૈનધર્મનો ઝુસ થતો હોય તે તે બન્ધનો તોડી જૈનધર્મનું ક્ષેત્ર અતિ વિશાળ બનાવો, એટલું ઇચ્છી વિરસું છું.



(૪૧)

સામાજિક ઉત્ત્રતિ

અઠતી અને પડતી, એ તો કુદરતના નિયમ પ્રમાણે
પ્રત્યેક વસ્તુની, પ્રત્યેક સમાજની થાય છે. પરંતુ જે સમય
પ્રગતિને માટે અલ્યાંત અનુકૂળ હોય, એવા સમયમાં પણ
પ્રગતિનાં સાધનો તરફ પુરુષાર્થ ન કરનાં ચુપચાપ એસી
રહેવું બદકે ‘સમય’ના સદૈશથી ઉલટી જ પ્રવૃત્તિ કરવી, એ
હાથે કરીને આડામાં પડવા જેવું શું ન કહી શકાય ? અને
એ તો ચોક્કસ જ છે કે ફરેક સમાજના નેતાઓ, બદકે એક
અદનામાં અદની વ્યક્તિ પણ પોતાના સમાજની ઉત્ત્રતિને

અવરય ચાહે છે. આવી પરિસ્થિતિમાં જે આપણે પણ નૈન
સમાજની ઉજ્જ્વલિ ચાહુંએ છીએ તો આપણે જરા પ્રગતિ-
શીલ સમાજેની તરફ પણ લક્ષ્ય આપવું જ જોઈએ.

આ સુખ્ય ખાખત ઉપર આવું, તે પહેલાં આપણે એ
જોઈ કેવું જોઈએ કે જૈન સમાજની પ્રગતિ થઈ રહી છે કે
જુસ થઈ રહ્યો છે ? આના સંખ્યામાં લાંબુ વિવેચન ન
કરતાં માત્ર મારા ગતાંકમાં પ્રકટ થયેલા ‘સામાજિક
ખંડનો’ એ કેખ તરફજ વાયકોનું ધ્યાન ખેંચું છું.
તે કેખમાં ગ્રામાણિક આંકડાઓ આપીને એ સ્પષ્ટ કરી
અતાવ્યું છે કે-પ્રત્યેક દશ વર્ષની મર્હુમશુમારી (વસ્તીની
ગણુતરી)માં નૈન સમાજની સંખ્યા ઘટતીજ રહી છે. જ્યારે
ખીલુ ખીલુ સમાજેએ આશાતીત પ્રગતિ કરી છે. તેમાં
અતાવ્યા પ્રમાણે છેલ્લા એ દસકાંચોનાં આર્યસમાજેએ
પોણુચાર લાખ વધ્યા છે, ખૌંડો એકવીસ લાખ વધ્યા છે,
મુસલમાનો પોણીત્રેસઠ લાખ વધ્યા છે, અને કુશ્ચીયનો
અઠારલાખ વધ્યા છે. જ્યારે નૈનો હોઠલાખ કરતાં વધારે
ધટ્યા છે. માત્ર એ દસકાંચોમાં જ.

આ તો છેલ્લાં એ દસકાંચોની જ વાત મેં કહી છે. પરંતુ
જૂના ઈતિહાસો વાંચનારા સારી પેઠે જણે છે કે જૈનોની
સંખ્યા તો કરોડોની હતી. હુમણું છેલ્લા છેલ્લા થોડાક સૈકાંચો
ઉપર પણ કેટલાયે લાખોની હતી. એટલે એ તો નક્કી જ છે

કે જૈનોની સંખ્યા છેલ્હાં કેટલાક સેંકડાએથી દિવસે દિવસે ઘરતી જ રહી છે, હજુ વધવાનો સૈકડો કે દસકડો હેણાયો નથી.

જ્યારે આમ જ છે, અને જૈનસમાજના નેતાઓ આગે-વાનો, ઉપરેશકો તરફથી ખાસ ચોક્કસ પ્રયત્નો પ્રગતિ માટેના નથી હાથ ધરવામાં આવતા, તો પછી એમ માનવું શું એટાં છે કે જે આવીને આવી વિધિ લાંબો કાળ રહી તો એનું અત્યન્ત લયંકર પરિણામ જોવું પડશો ?

એશક, એ વાત ખરી છે કે—જૈનસમાજે પણ ચઢતીના દિવસે અવશ્ય જોયા છે, પરન્તુ જ્યારે જ્યારે જૈન સમાજની ચઢતી થઈ છે, જ્યારે જ્યારે જૈન સમાજે પોતાનું અંગ પુષ્ટ કર્યું છે, ત્યારે ત્યારે તે તે સમયના આચારો અને નેતાઓની ઉદ્ધારતાથી જ થયું છે. એ ઉદ્ધાર જૈનાચારોએ લાંબો ક્ષત્રિયોને જૈનધર્મમાં દાખલ કર્યા, અન્ય કોમોને જૈન અનાવી, બદકે બીક જેવી જાતિને પણ જૈનધર્મી અનાવી.

એ ઉદ્ધારતાના પરિણામે જ જૈન સમાજની સમયે સમયે પ્રગતિ થઈ છે. તે ઉપરાંત હેમચંદ્રાચાર્ય અને હૃત્યાનિની સ્તુરી જેવા પ્રતાપી આચારોએ રાજસત્તાએ ઉપર પોતાનો પ્રભાવ નાખ્યો, અને તે દ્વારા જૈનધર્મ પાળનારાઓની સંખ્યા વધારી. ઉપરાંત જુદા જુદા ધુરંધર વિક્રાન્ત આચારોએ સમયને ઓળખી ઉપરેશ દ્વારા જૈનધર્મ ઝેલાયો.

નિદાન એ નિશ્ચિત વાત છે કે—કોઈ પણ ધર્મના પ્રચાર માટે—સમાજની ઉજ્જ્વલિ માટે ત્રણ સાધનો મુખ્ય છે:

૧ કેદી પણ ધર્મના અનુયાયીને અપનાવી પોતામાં મૈળવવાની ઉદારતા, ૨ રાજસત્તા ઉપર પ્રભાવ, તુ ઉપરેશકો અને સાહિત્યને પ્રચાર.

કેદી પણ સમાજની ઉત્ત્રતિનો ઈતિહાસ તપાસવામાં આવે, આ વ્રણ કારણો દ્વારા મુખ્યત્યા તે તે સમાજની ઉત્ત્રતિ થયેલી—પ્રચાર થયેલો જેવાશે. પ્રાચીન સમયમાંજ નહિ, આધુનિક સમયમાં પણ આ વ્રણ દ્વારા બીજુ બીજુ સમાજે વધી રહી છે.

આ વ્રણ સાધનો પૈકી આપણે કેટલાં સાધનો હુસ્તગત કર્યાં છે અને જરા ઉડા ઉત્તરી વિચાર કરીએ.

સૌથી પહેલાં બીજીએને અપનાવવાની ઉદારતા! આ ઉદારતાથી તો આપણે લગભગ હૂરજ રહ્યા છીએ. જૈન સિવાયનો બીજે માણુસ એટલે મિથ્યાત્વી. અને એ મિથ્યાત્વી, એટલે એની સાથે સભ્યતાપૂર્વક વાત કરતાં પણ જણે અભદ્રાધ્યે. આ આપણી સંકુચિતતાએ—અનુદારતાએ તો આપણુંને ધણું ધણું આધાતો પહેંચાડ્યા છે. આપણી આ સંકુચિતતાએ ધણું વિક્રાનોને પણ આપણે હુશમન બનાવ્યા છે. ‘સમ્યકૃત્વ’ અને ‘મિથ્યાત્વ’ કિંવા ‘આસ્તિક’ અને ‘નાસ્તિક’ ના વિવાહે તો ન કેવળ જૈનસમાજનેજ, ખદકે આખા ભારતવર્ષને પાયમાલ કર્યો છે. એ લાંબા ઈતિહાસમાં હું અત્યારે નથી ઉત્તરવા છયાછો. અત્યારે તો મારે એજ

ભતાવદાનું છે કે—‘સમ્યકૃત્વ’ ની માન્યતાથી—‘સમ્યકૃત્વ’ માં હાધ લાગી જશે, એ લયથી ખરેખર આપણે ઘણું જોયું છે. મને લાગે છે કે આપણા કરતાં આપણા પૂર્વના ધુરંધર મહાન આચાર્યો ‘સમ્યકૃત્વ’ના વધારે શ્રદ્ધાળું હતા, છિતાં આપણે જેમને ‘મિથ્યાત્વી’ માનીએ છીએ, એમને એએ ઉદારતાથી મળતા હતા, ઉદારતાથી વિચારેની આપ લે કરતા હતા. અવસરને એળાખી એમની સ્તુતિ પણ કરતા હતા, અને તેમ કરીને પણ તેઓને પોતાની તરફ આકર્ષિત કરતા હતા. તેમની પાસેથી ગમે તેવું કહિનમાં કહિન કાર્ય કરાવી લેતા હતા, એટલું નહિ પરન્તુ જૈનધર્મ તરફ તેમને ખેંચતા હતા. સંસારનો કાયદો છે કે—જ્યાં સુધી આપણે એક બીજાની સાથે બેઝીએ નહિ, વિચારેની આપ લે કરીએ નહિ, જૈનધર્મની ઉદારતા મધ્યસ્થ દૃષ્ટિ સમજવીએ નહિ, ત્યાં સુધી બીજાને અનુરાગ કહિ પણ ઉત્પન્ન થતો નથી અને જ્યાં સુધી અનુરાગ ન થાય ત્યાં સુધી કેાઈ આપણી તરફ આકર્ષાય પણ નહિ.

આ તે! આપણી ઉદારતાનું પ્રથમ પગથીયું. આ ઉદારતાનું ક્ષેત્ર તો આથીએ ઘણું વિશાળ હેઠું જોઈએ. જૈન ધર્મ તરફ જેએ આકર્ષાય, તેઓને સાચા હિલથી અપનાવવા જોઈએ. ‘સાચાદિત’ ની ભતલખ એ છે કે એની સાથે તમામ પ્રકારનો, જેમ એક પોતાનો જલિલાઈ હોય—સ્વામીલાઈ હોય, એની માદ્રક બ્યવહાર છુટો કરવો જોઈએ. આમ થાય તોન જૈનધર્મમાં આવનારા—જૈન જલિમાં

ભળનારા આસાનીથી પોતાનો વ્યવહાર ચલાવી શકે. જૈન ધર્મમાં આવવા છતાં પણ જે આપણે તેમનાથી પરહેજ કરીએ, તો પછી કોણ જૈનધર્મમાં દિલખુશથી રહી શકે? અને એ તો સ્પષ્ટ છે કે જેના આચાર વિચારો આપણા જેટલાજ શુદ્ધ હોય, જેની રહેણીકરણી આપણા જેવીજ હોય, અને જેનું ધર્માચરણ આપણા જેવુંજ હોય, તો પછી તેની સાથે કોઈપણ જતનો પરહેજ રાખવાનું કંઈ કારણ રહેતું નથી.

આ ઉદારતા ધર્મની વૃદ્ધિને માટે-સમાજની પ્રગતિને માટે અસાધારણું કારણ છે. આર્યસમાજ, ડિશ્ટ્રિબ્યુન અને ખીજનાં, કે જેમણે પોતાના અનુયાયિએ વધાર્યા છે, તેઓ આ ઉદારતાથી જ વધારે ફ્રાવી શક્યા છે. એ હવે કોઈથી અન્યાન્ય નથી. ખુદ જૈન ધર્મમાં આવ્યા પછી એની સાથે કચારે પણ લેદ રાખવામાં આવ્યો નથી. પરન્તુ અઝ્યોસની વાત તો એ છે કે અત્યારે તો આપહાદાઓથી જૈનધર્મ પાળતા આવેલા જૈનો પણ, ચોક્કસ વાડાઓમાં રહી, એક ખીજની સાથે સંબંધ બાંધવાથી ફર રહે છે. જેવી રીતે કે-ગયા અંકમાં ‘સામાજિક બન્ધન’ વાગ્યા લેખમાં ખતાવવામાં આવ્યું છે. આમ છતાં પણ હવે સમય બદલાયો છે, અને જે ઉદારતા હોવાનું હું ઉપર કથન કરી ગયો છું, એ ઉદારતાની જાંખી જૈનસમાજમાં ખરેખર આવતી હેખાય છે. જર્મનશ્રાવિકા એન સુલદ્રાહેવી (ડૉ. મિસ કોર્ઝે. પી. એચ. ડી.)

જ્યારથી જૈનધર્મનાં આચરણો આચરવા લાગી, ત્યારથી અત્યાર સુધીમાં જૈનલાઇઓએ તે એનની સાથે કે વ્યવહાર રાખ્યો છે, એ મારી ઉપરની વાતને પુરવાર કરે છે. શિવપુરીથી મુંબઈ સુધીની મુસાફરીમાં, અને મુંબઈથી ગુજરાત-કાડીયાવાડના પરિભ્રમણમાં હું જેવા પ્રકારની ઉદારતાની આશા રાખું છું એવા પ્રકારની ઉદારતા તમામ જૈનલાઇઓએ ખાનપાનના સંખંધમાં તે એનની સાથે બતાવી છે. આ એક અરેખર શુલ ચિહ્ન છે. આવી જ ઉદારતા, જૈનધર્મમાં દાખલ થતાર તમામ કોકેની સાથે રાખવામાં આવે તો અરેખર એ પ્રશાંસનીય જ કહી શકાય. જૈનધર્મ પાળનારી હજુ પણ એવી કેટલીક જ્ઞાતિયો છે કે જેની સાથે એક સરખો વ્યવહાર રાખવાની જરૂર છે. દાખલા તરીકે લાવસાર, મહિયાર, મોઢ, લાડ, શ્રીમાળી વિગેરે. આ લાઇઓ લાંખા કાળથી જૈનધર્મ પાળતા આવ્યા છે. એમના બાપદાદાનાં કરાવેલાં મંહિરો અને પ્રતિષ્ઠિત કરાવેલી મૂર્તિયો મોળૂદ છે, છતાં હુંને વિષય છે કે-એમની સાથેના વ્યવહારની અંકુચિતતાના કારણે ધણાં ગામેભાં તે લાઇયો વૈણવ કે એવા ભીજી બીજી સમ્પર્દાયેભાં લગી ગયા છે, તેમ છતાં હજુ પણ કેટલાક શુદ્ધ જૈનધર્મ પાળે છે-તેઓની સાથે બરાબર એક સરખો સંખંધ રાખવાની જરૂર છે. જે એ પ્રમાણે સંભાળી રાખવામાં ન આવે તો તેઓ પણ કાળાન્તરે આપણાથી ફૂર થવાના. આવી રીતે કેટલીક છુટક વ્યક્તિઓ પણ એવી છે કે-જે કદૃરતાથી જૈનધર્મ પાળે છે. દાખલા તરીકે પૂનાવાળા લાઇ ભીડી,

સારંગપુરવાળા વકીલ લક્ષ્મીનારાયણજી. આ ભાઈઓ વર્ષોથી જૈનધર્મ પાળે છે. જૈન ધર્મના આચાર, વિચારો દફતાંપૂર્વક પાળવા સાથ જૈનધર્મની અનેક રીતે સેવા ખજની રહ્યા છે. આવા ભાઈઓને, જૈનસંઘે બરાબર અપનાવી રાખવા અને એઓની સાથે તમામ પ્રકારનો સંબંધ રાખવાની ઉદ્દીરનતા રાખવી જોઈએ છે. આવી ઉદારતાથીજ જૈનધર્મ વધી શકશે. જૈન સમાજની ઉત્તરિ થશે.

જૈન સમાજની પ્રગતિનું ખીનું કારણ છે:—રાજસત્તા ઉપર પ્રલાઘ. રાજસત્તા એ ધર્મના પ્રચારનું પ્રથમ કારણ છે. રાજ જે ધર્મનો અનુયાયી હોય, પ્રજા તે તરફ અવશ્ય જૂકવાની. એક સમય હુતો કે સમ્પ્રતિ, શ્રેણિક, કોણિક, કુમારપાળ આદિ અનેક જૈન રાજાઓ, અને વસ્તુપાલ, તેજપાલ, વિમલ, લામાશા વિગેરે જૈન મંત્રીઓ થઈ ગયા કે જેમણે પોતાના માન્ય ધર્મનો પ્રચાર કરવા સતત પ્રયત્ન કર્યે. આજે પ્રત્યક્ષ પ્રમાણ છે કે—કિશ્કીયાનિટીનો પ્રચાર કરવા માટે એના પ્રચારકેને રાજસત્તાનો કેટલો બધો સહારો છે. રાજસત્તાની જેને થોડી ધારી પણ મદદ હોય —એથ હોય, તેઓ શું ન કરી શકે? અને એનુંજ કારણ હતું કે પ્રાચિન સમયમાં આપણા ધુરંધર આચાર્યો રાજાઓને પ્રતિષ્ઠાધવા તરફ વધારે ધ્યાન આપતા હતા. દાખલા તરીકે—આર્થસુહુસ્તિએ સંપ્રતિ રાજને, અપ્લાદુંએ આમરાજને, વાસુ-હેવાચાર્યો હરિકુંડના રાજાઓને, શીલગુણસૂરિએ વનરાજને

અને હેમચંદ્રાચાર્યો સિદ્ધરાજ અને કુમારપાળને પ્રતિએધી જૈનધર્મનો પ્રલાવ આપ્યો જનતા ઉપર પાડ્યો હતો. એટલું જ શા માટે સુહુમંહ તુગલક, દ્વિરાજશાહ, અલલા-ઉદ્દિન, ઔરંગજેબ, અકબર અને જહાંગીર જેવા સુસલમાન ખાદશાહો ઉપર પ્રલાવ પાડીને— તેમને ઉપરેશ આપ્યાને જૈનધર્મની અપૂર્વ છાપ પાડી હતી. આજે આ પ્રયત્ન તરફ જૈન સમાજના ગૃહસ્થ વર્ગનું અને સાધુ વર્ગનું કેટલું હુલ્કદ્ય છે, એ કોઈથી અજણયું છે? આપણા આચાર્યો ઉપાશ્રયની ચાર દિવાલોમાં પોતાના લક્ષ્ણ શ્રાવક-શ્રાવિકા-ઓની આગળ પોતાની વિક્રતાનું જેર જતાવે છે. પરન્તુ કોઈયે આ દિશામાં પ્રયત્ન કરવા તરફ પ્રેરાય છે? અને કદાચિત કોઈ ભૂલ્યા ભટક્યા કોઈ નાનકડા રાજની સાથે કલાક એ કલાક વાતચીત કરવાનો પ્રસંગ મળી જય કે એકાંદ ચિહ્ની પત્રી મળી જય, ત્યાં તો અમારા સાધુઓ કૂલેયે નથી સમાતા! જાણો કે અમે જૈન ધર્મનો એક મહોટો વિજય વાવટો ઝર-કાવ્યો. ખસ આટલામાંજ અમે અમારા કર્તાબ્યની ‘ઇતિશ્રી’ સમજુએ છીએ. આમ રાજસત્તામાં ન તો સાધુઓ પ્રવેશી શક્યા છે. કે ન ગૃહસ્થો. ગૃહસ્થોમાં કદાચિત કોઈ થાડીક લાગવગ ધરાવનાર હોય છે તો તે પોતાની સ્વાર્થ-વૃત્તિમાંજ મસ્ત રહે છે. રખેને માર્દ માન ઘટી જય, રખેને માર્દ ટાઈટલ લદ લેવામાં આવે, રખેને મને તે હોદ્દાથી અલગ કરવામાં આવે, ખસ આ લયથી—આ સ્વાર્થાંધતાથી તે ખુશામતમાં જ પોતાનું જીવન વ્યતીત કરે છે. આવી

સ્થિતિમાં ધર્મનું કે સમાજનું કામ ન થાય, એ દખીતું જ છે. માટે જ્યાં સુધી નહાના મોટા રાજ-મહારાજે જૈનધર્મ તરફ આકર્ષણી નહિ, અને જ્યાંસુધી બીજી બીજી રીતે પણ રાજસત્તા ઉપર પ્રભાવ પાડનારા મહાનું પુરુષો નીકળે નહિ ત્યાં સુધી કેવળ આટો દાળ વેચીને એસી રહેનારા, કાપડ વેતરનારા કે રાત દિવસ છઙ્ગાપંલની ધૂનમાં રહેનારા ગૃહ-સ્થોકારા, તેમજ કેવળ ઉપાશ્રયમાં એસીને કે પોતાના વાડાના બંધનોમાં બંધાઈને-તેણું કાળેણું તેણું સમાણન ના પાડોની આવૃત્તિયો વાણીયાઓની સમક્ષ કરી જનારા મુનિરાજે દ્વારા કંઈ જૈનધર્મ વધવાનો નથી. આર્યસમાજસ્ટોએ થોડા પણ જે નહાના મોટા રાજાઓને આકર્ષ્યો છે, એમની દ્વારા, એમની પ્રગતિને તેટલો બધો ટેકો મળે છે, એ આર્ય-સમાજની પ્રવૃત્તિને જણનારા સારી પેડે સમજી શકે તેમ છે.

આપણા આચાર્યો, ઉપાધ્યાયો, પ્રવર્ત્તો, પન્થાસો અને વિક્રાનું મુનિવરોએ હવે રાજાઓનાં દ્વારે ખટખટકાવવાની જરૂર છે. એમનાં મંહિરોમાં-ભવનોમાં મહાવીરનો સહેશ પહોંચાડવા પહોંચવું જોઈએ છે. માન કે અપમાનની દરકાર રાખ્યા સિવાય પહોંચી જવું જોઈએ છે. હવે પાછી

દીદૂષ્ય મિશ્રેકોસ્તિ વારિતો દ્વારિ તિષ્ઠતિ ।

ની આવૃત્તિ કરવાની જરૂર છે. “હે રાજનું તમારા દ્વારપાળે-ચપરાસીએ રોકેલો એક સાધુ કે જે તમને જેવાની-

મળવાની ઈચ્છા ધરાવે છે, તે દરવાજે ઉલો છે કે નેના હાથમાં ચાર લોડો છે.” એમ ઉદ્ઘોષણા કરવાની જરૂર છે.

ધ્યાનમાં રાખજો કે, અત્યારે તો હવે તે વિકટ સમયથે નથી રહ્યો. અત્યારે તો જગતમાં જિજાસાવૃત્તિ વધી છે. રાજોમાં કે મહારાજોમાં, પ્રાણેણોમાં કે વૈશ્યમાં, ક્ષત્રીયોમાં કે શૂક્રોમાં, યુરોપમાં કે અમેરિકામાં, જર્મનીમાં કે ઈટાલીમાં, હિંદુમાં કે સુસલમાનમાં, કિશ્ચીયનમાં કે આર્થસમાજસ્ટમાં, અભ્યાસમાજ કે દેવસમાજમાં, ભણેદાયોમાં કે અભણેણોમાં-જિજાસાવૃત્તિ જાગી છે. હવે તો સૌ નવું નવું જાણવાની ઈચ્છા રાખે છે. અને જે સત્ય લાગે છે, વિજાનથી મળતું લાગે છે, એનો આદર કરવાને તૈયાર થાય છે. બસ, સમજવનારની જરૂર છે. સમજવનાર જોઈએ. પહોંચી જાઓ રાજકોરોમાં, પરમાત્મા મહાવીર દેવના સિદ્ધાન્તોની અકાટય ચુંચિયોની આગળ લલ ભલા આચ-હિએ. પણ શિર ઝુકાવશે. જૈન સિદ્ધાન્તોની સત્યતા આજે વિજ્ઞાન દ્વારા સિદ્ધ થઈ રહી છે અને અતિષેષ એ સિદ્ધાન્તો ગમે તેવા વિદ્યાનને માટે પણ થાય છે. બસ સમજવવાની જરૂર છે.

હવે ત્રીજે ઉપાય છે ઉપદેશકો અને સાહિત્યનો પ્રચાર. આમવર્ગમાં ઉપદેશકો અને સાહિત્યના પ્રચાર ક્ષારા ધારું કાર્ય કરી શકાય છે. કિશ્ચીયન મીશનરીએ ક્યાં ક્યાં કરે છે, ખખર છે? ગામડાએ અને જંગલોમાં

પણ, પણ ગરીબોના મહદગાર થઈને, અનાથોના નાથ ભનીને, અશિક્ષિતોના શિક્ષક થઈને, રેળીયોનાં રેળો નિવારણ કરીને, અસહાયોને સહાયતા આપીને, અને હુખીયોના એલીને થઈને કિશ્ચીયન મિશનરીઓ આમબર્ગને અપનાવે છે. આપણે એમનું અનુકરણ કેમ ન કરીએ? અને કદાચ એટલું ન કરીએ તો પણ એટલું તો ખર્દ જ છે કે —જૈન ધર્મના તત્વો સમજવનાર ઉપદેશકોને ઠેકાણે ઠેકાણે ફેરવવા, એમાં તો જરાયે અનુચ્છિત જેવું નથી જ, તેમ જ જૈન સિદ્ધાન્તોની પ્રતિપાદકતાવાળાં ટ્રેક્ટો-પુસ્તકો—હુસ્તપત્રોનો પણ જૂણ પ્રચાર કરવો જોઈએ. જૈન સમાજનું ઉપદેશક ક્ષેત્ર એટલું બધું નહાનું છે કે—દેશના દ્વેષોને પહોંચી વળવા માટે રાત કે દિવસની જેમને અડગણું ન આવે, એવી ભોગી સંખ્યાના ગૃહસ્થ ઉપદેશકોની જરૂર છે. આવા ઉપદેશકો—સ્વાર્થત્યાગી ઉપદેશકો—ધર્મની ભાવનાવાળા ઉપદેશકો—સમાજની દાઝ ધરાવનારા ઉપદેશકો તૈયાર કરવા માટે આપણે ખરેખર આર્યસમાજાની પદ્ધતિનું અનુકરણ કરવું જોઈએ છે.

લગલગ પચીસસે વર્ષથી સંગઠિત થયેલ જૈન-સમાજનો અને માત્ર ચાલીસેક વર્ષથી હુયાતિમાં આવેલ આર્યસમાજનો શિક્ષાના ક્ષેત્ર સંખ્યી સુકાળલો કરવામાં આવે, તો ખરેખર જૈનસમાજની કર્તાવ્યશૂન્યતા માટે આપણુને ઉચ્ચ ફુઃખ થવા સિવાય નહિં જ રહી શકે.

આર્થ સમાજમાં શિક્ષાના પ્રચારનાં ને સાધનો છે તે
આવે છે:—

૬ કેલેજે છોકરાઓની	૩૦૦ સંસ્કૃત શાળાઓ।
૬૨ હાઇસ્કુલો।	૨ ચોગમંડળો।
૧૫૦ એંગ્લો વર્નાર્ડયુલર મિડલ સ્કુલો।	૨ સંન્યામીપાઠશાળાઓ।
૧૬૨ પ્રાયમરી સ્કુલો।	૩ કન્યાગુર્ડુલો
૧૪૨ રાન્નિશાળાઓ।	૧ કન્યાંકાલેજ
૨૮ શુરૂકુણો।	૨ કન્યાહાઈસ્કુલ
	૨૬૨ કન્યાપાઠશાળાઓ।

જૈનસમાજ પોતાની સંસ્થાઓ સાથે આનો સુકાખલો કરે. આપણે ત્યાં એક એ ગુરૂકુળો હોય તે પણ ખરી રીતે તાં નામનાં જ. ગુરૂકુળ જેવું એમાં ભાગ્યે જ કંઈ હેખાય. શિક્ષણું, તે પણ સરકારી સ્કુલોમાં અપાય તે જ. એટલે ગુરૂકુળથી આપણે ધર્મભાવનાઓ—સેવાભાવની ને સુંદર છાપ એ અન્ધારિએમાં પાડવી જેધે, એ કેમ પાડી શકાય? કેલેજે અને હાઈસ્કુલો જેવું આપણે ત્યાં શું છે, એ કેંઠથી અનણ્યું નથી. આર્થસમાજમાં ૨૦૦ શાળાઓ તો કેવળ સંસ્કૃત માટેની જ હુયાતિ ધરાવી રહી છે, ત્યારે જૈન સમાજમાં કુરૂકુળ જેવી સંસ્થાએમાં પણ સંસ્કૃત ભાષા ત્યાજ્ય છે. એક એક આગામે કરેડો કરેડો શ્લોકો ને જૈનસમાજને વારસામાં આપ્યા છે, એ જ સમાજ

સંસ્કૃત ભાષણે પોતાનાં શિક્ષાલયોમાંથી અહિંકાર કરી રહી છે ! કેટલોા હુંખનોં વિષય છે !

સાથે સાથે એ પણ ભૂતવું જોઈતું નથી કે આર્ય-સમાજની બધીયે સંસ્થાઓમાં ખાસ કરીને એક વિશેષતા છે. આ વિશેષતા એ છે કે ચાહે ગુરુકુળમાંથી કોઈ ચુવક નીકળશે, ચાહે ડેલેજમાંથી નીકળશે, પ્રાચીન કે નવીન-ગમે તે પદ્ધતિનું શિક્ષણ લઈ બહાર નીકળનાર ચુવક સૌથી પહેલામાં પહેલું પોતાના જીવનનું એક જ ધોય અનાવશે. અને તે એ કે આર્યસમાજનો પ્રચાર કરવો અને આનું જ એ કારણું છે કે—અત્યારે આર્ય-સમાજમાં કુલ ૮૨૮ પ્રચારકો પ્રચારનું કામ કરી રહ્યા છે. જેમાં વૈતનિક ૧૬૫, અવૈતનિક ૨૨૮, સંન્યાસીપ્રચારક ૧૩૦ અને સ્વતંત્ર પ્રચારક ૪૦૦.

જૈન સમાજની સંસ્થાઓમાંથી નીકળનારા મહેઠે લાગે એની એ ગુલામીની સાંકળનો ખીલો શોધતા જ કરે છે. કોઈ વકીલ, સોલીસીટર, એરીસ્ટર, ડૉક્ટર, પ્રેઝીસર, ઇન્જિનીયર, કે એવી કોઈ લાઇનમાં આગળ વધીને નીકળશે તો, તે તો લગભગ ધર્મ-કર્મથી હાથ ઘોઝને જ નીકળવાનો. સંસ્થામાંથી નીકળીને પોતાના ધંધે વળગ્યા પછી દ્વયપ્રાસિની ધુન સિવાય, ન તે સમાજને યાદ કરશે, ન તે દેવદર્શન-પૂજન કરશે, ન તે ગુરુવંદન કે વ્યાખ્યાનશ્રવણ કરશે કે કે ન તે પોતાના જતિસાઈઓની સેવામાં થાડો પણ પોતાનો

સમય આપશે. અને કદાચ આપશે તો પણ અંતરગતમાં પોતાના સ્વાર્થનો ખાડો પૂરવાને માટે જ. જૈન સમાજની આ કમનસીધી નહિં તો બીજું શું છે? આવું પરિણામ આવવાનું કારણું સંસ્કારોની ખામી સિવાય બીજું શું હોઈ શકે? વિદ્યાધ્યયનની સાથે જ્યાંસુધી ધાર્મિક સંસ્કારો ન પાડવામાં આવે, જેવા લાવના સંસ્કારો ન પાડવામાં આવે, એમના વાસ્તવિક કર્તાવ્યનું લાન પ્રતિહિન ન કરાવવામાં આવે, ત્યાં સુધી એ યુવકોમાં એવા સંસ્કારો કર્યાંથી જ આવી શકે!

મારું અનુમાન છે કે કેળવણીના ક્ષેત્રમાં જોઈએ તેવી અને જોઈએ તેટલી સંસ્થાઓ આપણે ત્યાં નથી, છતાં પ્રતિવર્ષ લાણે રૂપિયા જેનસમાજના વ્યય થઈ રહ્યા છે, અને છતાં તેનું પૂરિણામ લગભગ શુન્યતા સિવાય બીજું શું આપણે જોઈ રહ્યા છીએ? આનું કારણું એ છે કે—આપણે પદ્ધતિસરનું કાર્ય કરતાં શીખ્યા જ નથી. અને તેની સાથે સાથે ધાર્મિક કે સામાજિક સંસ્કારો પાડવાપૂર્વક શિક્ષા આપતાં આપણે શીખ્યા જ નથી. બદકે આપણું કેટલાક કહેવાતા કેળવાયલા તો ધાર્મિક સંસ્કારોના નામથી જ લડકી ઉઠે છે. એએ જોલી ઉઠે છે કે—આપણી સંસ્થાઓમાં ધાર્મિક સંસ્કારો શા? શું આપણે સાધુ બનાવવા છે? પરન્તુ એ મહાતુલાવો જરા ઉંડો વિચાર કરે અને બીજું સમાજેની સંસ્થાઓનું નિરીક્ષણ કરે તો તેમને જણુંશે કે ધાર્મિક સંસ્કારો વિના કેવળ શુષ્ક જ્ઞાનથી મનુષ્ય પોતાનું કર્તાવ્ય સરખું પણ સમજુ શકતો નથી. એક તો આપણે શિક્ષણ

આપીએ ભીજાઓના હાથે—સરકારી સ્કૂલોમાં, અને બીજી તરફથી ધાર્મિક કે સામાજિક કર્તાવ્યનું સમરણ માત્ર પણ ન કરાવીએ, આનું પરિણામ નાસ્તિકતા સિવાય ભીજું શામાં આવે વાર્ડ ? અસ્તુ.

કહેવાની મતદખલ કે સામાજિક ઉજ્જ્વલિનો આધાર આજના ખાળકો અને ચુંબકો ઉપર છે. એમને કેળવવાની ધર્ષણી જ જરૂર છે. એ કેળવવાની ખાસ કરીને સ્વતંત્ર આપવવાની ચોજનાઓ ધરણી જોઈએ છે, અને એની સાથે જ સાથે એઓને ધાર્મિક અને સામાજિક સંસ્કારો પાડી એમના કર્તાવ્યનું ભાન એમના શિક્ષણ સમયમાં જ કરાવવાની જરૂર છે.

સાચા પ્રચારકો—ઉપરદેશકો આમાંથી જ નીકળશો, જેઓ પોતાનું કર્તાવ્ય સમજશો, તેઓ જરૂર જૈનધર્મની—જૈનસ્માજની વધાસમય સેવા કરશો.

આવી જ રીતે પુસ્તકો—ટ્રોકટો—પેમ્ફ્લેટોનો પ્રચાર કરવો એ પણ જરૂરનું છે. માર્ગ ના મન્ત્રાંય છે કે પ્રબ્લમાં મહોટાં મહોટાં સાહિત્યનાં પુસ્તકો જે ઉપકાર નથી કરતાં તે નાનાં ટ્રોકટો કરે છે. આવાં ટ્રોકટોનો પ્રચાર કરનારી નાની ગોઠી સોસાઇટીઓ ખંગાલ, ભગધ, પંનાખ, કંચિ, દક્ષિણ અને એવા જુદાજુદા પ્રાન્તોમાં જુદાજુદા ગામોમાં ઘોલવાની જરૂર છે. આવી સોસાઇટીઓ જુદીજુદી લાખાઓમાં ટ્રોકટોનો પ્રચાર કરે, એ એનું કર્તાવ્ય હોવું જોઈએ. અને આ ખધીએ સોસાઇટીઓ સંગઠનપૂર્વકની હોવી જોઈએ. ખધી

સોસાઇટીઓનો પરસ્પર સંબંધ હોવે જોઈએ. આર્થિક સમાજ આવી ૧૯૧૦ સલાહોની હૃદાતી ધરાવે છે. જેમાં ૮૩૪ સલાહોએ તો પોતાનાં સ્વતંત્ર ભવનો પણ બનાવી લીધાં છે. આ સલાહોના સલાસહોની સંખ્યા ઇ લાખ અને અડતાલીસ હળવરની છે. આ બધીએ સલાહો એક જ સંચાલનપૂર્વક ચાલે છે. એક બીજાને પરસ્પર મદદ કરે છે.

કૈનોમાં આવા પ્રકારના બંધારણ પૂર્વકની સલાહો થાય, તો કેટલું બધું કામ કરી શકાય ?

આર્થિક સમાજે પોતાનાં સમાજની ઉત્તુતિના જે અનેક સાધનો હાથ ધર્યો છે તેમાં ૪૮ અનાથાલયો, ૪૦ વિધવાશ્રમો, ૧૪ ઔષધાલયો, ૩૦ પ્રેસ, ૪૦ સમાચાર પત્રો, ૧૦૦ પુસ્તકોની હુકાનો અને ૧ કોઓપરેટીવ એંક પણ છે. એ પણ ભૂલવા જેવાં નથી. આટલાં આંટલાં સાધનો હાથ ધરનાર સમાજ કેમ પોતાની સામાજિક ઉત્તુતિ ન કરે.

આપણે લાખો ખરચીને સંધો કાઢીએ-કઢાવીએ, હળવોનો વ્યય કરીને ઉઝમણું-ઉપધાન મહેત્સવો કરીએ કરાવીએ, પરન્તુ સામાજિક ઉત્તુતિને માટે તેથી વિશેષ શોલાલ છે ? એશાક, શ્રદ્ધાળુ જીવો એની અનુમોદના કરીને પોતાના સમ્યક્તવને શુદ્ધ રાખશો-ઉજ્જવળ કરશો, પરન્તુ જ્યાં જૈતર્ધર્મની લાવનાનું નામ નિશાન નથી, જ્યાં મહાવીરના સિદ્ધાન્તોની ઓળખ સરખી નથી, જ્યાં પરમાત્મા મહાવીરદેવની ઉત્કૃષ્ટ આદર્શતાની પિછાન સરખી નથી, અને

જ્યાં હિંસામાંજ પરમધર્મ મનાઈ રહ્યો છે, ત્યાં આપણું એ ઉત્સવો શરૂ કરી મના છે ? અને જૈન સમાજમાં પણ—જૈનધર્મીઓમાં પણ જ્યાં સુધી હજરોને એક વખતનું અજ્ઞ સરખું મળતું નથી, ધાર્મિક શ્રદ્ધાઓ પેટના કે ગમે તે કારણે હિવસે હિવસે ઘરી રહી છે, ત્યાં પણ એ ઉપાયો શરૂ કરી મના છે ? અત્યારે તો જૈન સમાજને ભચાવવાની અને વધારવાની જરૂર છે. જૈનસમાજ જીવતી હશે, વૃદ્ધિંગત થશે, તો એની પાછળ બધાંએ કાર્યો સમુજ્જીવત દેખાશે. બાકી જીર્ણ—શીર્ણ અવસ્થામાં—અર્થાત્ દાંત પડી ગયા હોય, આંખો ઉંડી પેસી ગઈ હોય, હુથ—પગમાં કંપારી ધૂઠી રહી હોય, ગાલોમાં ખાડી પડી ગયા હોય, શરીરમાં કલોચણીયો પડી ગઈ હોય, અને લાકડીના ટેકા સિવાય એક કદમ પણ ચાલી શકતું ન હોય, આવી લયંકર વૃદ્ધાવસ્થામાં વૃદ્ધ શરીર ઉપર આભૂષણો લાદવાં કયાં સુધી ઉચિત છે, એનો વિચાર સમાજના વિચારકોએ કરવો ધટે છે. પેટમાં વેંતનો ખાડો હોય, ભૂખથી પેટમાં આગ સળગી ઉડી હોય, એવા સમયમાં ગમે તેવું કિંમતી વસ્તુ પણ એઠાડયું શું કરી મનું છે ? તે વખતે તો રોટલાનો સુકો પણ કુકડોજ કરી મનો ? માટે સમયને ઓળખો, અને સામાજિક ઉત્ત્રતિના જે ઉપાયો ઉપર બતાવવામાં આવ્યા છે, તે હાથ ધરી સમાજની ઉત્ત્રતિ કરવા બહાર પડો. એજ.

(૪૨)

સમય ધર્મ.

છેદલા એ અંકોમાં જૈન સમાજની વર્ત્તમાન પરિસ્થિતિનો ખ્યાલ કરાવવામાં આવ્યો છે. બીજુ લાઈઅંડ કેમેડરતાં જૈન કોમ ટેલ્ફોન પાછળ ધર્સી રહી છે, અને એમ પાછળ ધર્સવાનાં કયાં કારણો છે, એ ખતાવવા સાથે, બીજુ કેમેડ કયા સાધનોથી આગળ વધી રહી છે, એ ખતાવી એ સાધનો હૃસ્તાગત કરવા જૈન સમાજના નેતાઓનું ધ્યાન એંચવામાં આવ્યું છે.

એ બધી બાબતોને હુંકી મતલખમાં સમાવીએ તો એમજ કહી શકીએ કે જૈન સમાજે—જૈન સમાજના નેતાઓ, ઉપરેશકોએ ‘સમયધર્મ’ જાણવાની જરૂર છે. ‘સમયધર્મ’ ને જાણ્યા સિવાયની જેટલી પ્રવૃત્તિ કરવામાં આવે છે, તે બધી નિર્થક પ્રાયઃ નિવડે છે. નહાની સરળી કોમમાં સેંકડો ત્યાણી ઉપરેશકો અને ઉપરેશિકાઓ હોવા છતાં, હળવો ખલ્કે લાગોનાં દાન થવા છતાં સમાજનું નાવ પાછળ હડતું જય છે, એજ બતાકી આપે છે કે આપણે સમયધર્મ જાણ્યો નથી. આજે તો હું કેવળ મહાવીરના વહીલ પુત્રો અને પુત્રિઓ—સાધુઓ અને સાધ્વીઓને ઉદ્દેશીને જ કંઈક વિચારો રજુ કરવા દર્શાવું છું.

કાળની અનન્તતાના ઉદ્રમાં જેમ અનન્ત ચોમાસાં પ્રવિષ્ટ થઈ ચૂક્યાં છે, તેવી રીતે વિ. સં. ૧૬૮૪નું ચતુર્માસ પણ અનન્તતાના ઉદ્રમાં પ્રવિષ્ટ થવાનું આજથી પ્રારંભ કરે છે. ચતુર્માસ એટલે જૈનસમાજની તપસ્યાનો અમૂહ્ય સમય. ચતુર્માસ એટલે ઉદાર દિલના દિલાવરોને પરોપકાર કરવાનો પુનિત સમય અને ચતુર્માસ એટલે સાધુ મુનિરાજોને ઉત્કૃષ્ટ ઉપરોગપૂર્વક સમય પાળવાનો, અને ખીજ ભવ્યોને તારવાનો સુંદર સમય. આ ચતુર્માસનો આજથી પ્રારંભ થાય છે. આજથી સાધુ—સાધ્વીઓ, ચાર માસની, ખલ્કે આ વર્ષે તો પાંચ માસની સ્થિરતા માટે નિશ્ચિત કરેલાં ગામોમાં સ્થિર થઈ જવાના. જે ગામોમાં મુનિરાજો

ચતુર્માસ રહ્યા હશે તે તે ગામનાં લોકોના આનંદનો પાર આજ નહિ રહ્યો હોય. તેઓ પોતાને અપૂર્વ લાગ્યશાળી સમજતા હશે. ચોમાસામાં ગુરુ મહારાજના મુખથી પરમાત્માની વાણીનું પાન કરીશું, યથાશક્તિ તપસ્યા કરીશું, જ્ઞાન ધ્યાન ધરીશું, સામાયિક, પौષ્ઠ, પ્રતિકમણુ કરીશું, અને યથાશક્તિ દાનપુરુષ કરીશું. શ્રાવક શ્રાવિકાઓનાં હૃદયો આવી ભાવનાઓથી ઉછળી રહ્યાં હશે. બીજુ તરફથી સાધુ સાધિયો પણ ચતુર્માસની સ્થિતિ દરમ્યાન અનેક પ્રકારનાં કાર્યો કરવાની ઈચ્છાઓ કરી રહ્યા હશે. કોઈ ચતુર્માસ દરમીયાન એક ગૃહસ્થને તૈયાર કરી જાંધ કટાવવાની ઈચ્છા કરી રહ્યા હશે. કોઈ ઉજમણુ-ઉપધાન માટે કોઈ બાઇ-સાઈની શોધમાટે વિચારો કરી રહ્યા હશે. કોઈ પોતપોતાના ઉપરેશથી ચાલતી સંસ્થાઓને પુષ્ટ કરવાની ઈચ્છા કરી રહ્યા હશે, કોઈ નવયુવકો કે છેકરાઓને નસાડવા લગાડવાની ચોજનાઓ ઘડી રહ્યા હશે, અને કોઈ પતિતો દ્રવ્ય-કપડાં લતાં અને એવી બીજુ વસ્તુઓના સંઅહની ઈચ્છા પૂરી કરવાના વિચારોનો પુલ બાંધી રહ્યા હશે. જ્યારે કેટલાકો તે ક્ષેત્રને પોતાનું ક્ષેત્ર બનાવવાની ભાવના કરી રહ્યા હશે. આમ સ્વાર્થ કે પરમાર્થની ભાવનાઓમાં સૌ મશગુલ હશે. અસ્તુ, ગમે તેમ હો, પરન્તુ ખરી વાત એ છે કે- જે મુનિરાજે સમાજના તારણુહાર છે, જેઓએ સમાજ-શાસનના કલ્યાણને માટે જ ઝેકીરી સ્વીકારી છે, અને જેઓએ પોતાનો સ્વાર્થ સાધવામાં જ નહિ, પરન્તુ શાસ-

નની ઉજનવલતામાં જ પોતાનું અને પરનું કદ્વાણુ માન્યું છે, એવા શાસનશુલેચ્છક મુનિરાજે-આચાર્યાદિ પહીધરે, આં ચાતુર્માસમાં જૈનજનતાને કેવળ ‘સમયધર્મ’ જ સમબળવાનો પ્રયત્ન કરે, તો મારું માનવું છે કે-એ લાગી મહાત્માઓના ઉપરેશથી આગી સમાજની કાયાપલટ થઈ શકે. ‘સમયધર્મ’ એ જ છે કે સમય ને જે કાર્યોની આવશ્યકતા સ્વીકારતો હોય, તે તે બાબતો તરફ કોણાનું ધ્યાન ખેંચવું. હું ધણી વળત લખી ગયો છું તેમ એક કાર્ય ગમે તેટલું ઉત્તમ હોય, પરન્તુ તે ઉત્તમ કાર્ય કરવાને માટે પણ સમય અને સ્થાન જેવું જોઈએ છે.

‘રામ’નું નામ ગમે તેટલું ઉત્તમ હોવા છતાં વિવાહના પ્રસંગે “રામ નામ સત્ય હૈ” “રામ નામ સત્ય હૈ” ના ચોકારે ન જ થાય.

અમારો મુનિવર્ગ માત્ર આટલાથીજ વસ્તુસ્થિતિને સમજું હે તો, માત્ર એક જ ચાતુર્માસમાં સમાજના ઉદ્ઘારતું ધણું કામ કરી શકે. પ્રતિવર્ષ લાખો રૂપિયા ખરચાવવા છતાં આપણી એક પણ સંસ્થા-ખાસ કરીને નલાંબી-ટકાવી રાખવા જેવી સંસ્થાઓ, ભીખ માગતી બંધ પડી નથી, આટલી આટલી સખાવતો થવા છતાં હળું એક પણ સુંદર વિધવા-શ્રમ આપણે ત્યાં સ્થપાયું નથી, રોજ નવાં નવાં ખાતાંએ જોલવામાં આવશ્યકતા ઉપરાન્તનાં ઝડ્ઠો થવા છતાં, જ્યૂનાં અને મહાનું ઉપકારી ખાતાંએ હળું જેવી ને તેવી સ્થિતિ

લોગવી રહ્યાં છે. કેટલેક સ્થળે એવું પણ અની રહ્યું છે, કે-કેવળ ભરતીમાં ભરાઈ રહ્યું છે. જરૂરત હોય કે ના હોય, એની કંઈ સાર્થકતા થતી હોય કે ન થતી હોય, પરન્તુ ગાડરીયા પ્રવાહની માઝક એક પણી એક ઝૂક્યા જ કરશે-બીજી તરફથી જોઈએ તો હજારો જૈન લાઈએને પોતાના કુદુંખનું પોષણ કરવું પણ લારે થઈ પડ્યું છે, એંકે પોતાનું પેટ ભરવા નેટલું પણ સાધન નથી. તેઓને ધંધા-રોજ-ગારે ચઢાવવાનું પણ કોઈને સૂઝતું નથી.

આ બધું અનવાનું કારણ એક જ છે. અને તે એ કે ‘સમયધર્મ’ને આપણે લક્ષ્યમાં લેતા જ નથી, કેવળ, આપણી ધૂન, આપણી આદતો અને એથી આગળ વધીને કહીએ તો આપણે આપણા સ્વાધીને આધીન બન્યા છીએ. આ ભાખતોને કોરે મૂકી આપણે કેવળ ‘સમયધર્મ’ જ સમાજને શીખવીએ તો ખરેખર સમાજનો ઉદ્ધાર થાય. સમાજની સ્થિતિ તો એવી છે કે-એને દોરનાર જોઈએ. વાળનાર જોઈએ. સમાજની સ્થિતિ એ તો ફંધીના વેલા જેવી છે. વેલદીને કોઈ છાપરા ઉપર ચઢાવો તો ત્યાં ચઢશો, લીંતે ચઢાવો તો ત્યાં ચઢશો અને જમીન ઉપર જ ફેલાવા દેશે તો ત્યાં પડી રહેશો. એનો તો બધો આધાર એના સંરક્ષક-માણી ઉપર છે. સમાજના માણી-દોરનાર-સંભાળનાર એવા ઉપદેશક-સાધુ-સાધ્વી છે. ચાહે તો તે ઊડા કુવામાં નાખે, ચાહે જગતની બીજી જલ્લિ જલ્લિયેના કિરમેર બનાવે.

પરન્તુ હવે ગધ ગુજરી આપણે ભૂલવી જોઈએ. ગતં ન શોચામિ કૃતં ન મન્યે । ભૂતની વાતોને આપણે ભૂલી જઈએ અને આજથી આપણે નવું પ્રભાત સમજુએ. આ ચર્તુમાસ મુનિરાજેએ જ્યાં જ્યાં કર્યું હોય ત્યાં ત્યાંની જનતાને સમય-ધર્મ જ સમજવે અને સમયને ઓળખીને જ કાર્યો કરાવે.

સૈથી પહેલાં તો આ ચર્તુમાસમાં એ શ્રાવણ મહીના આવેલા છે, એટલે કેટલાક ગઢ્ઘવાળાએ પહેલા શ્રાવણમાં પર્યુષણુનો પ્રારંભ કરવાના, જ્યારે કેટલાક બીજામાં. આ પહેલા અને બીજા શ્રાવણના નિમિત્તે લૈનસમાજમાં કેવા કેવા કલેશો થયેલા છે, એ કોઈથી અનાણયા નથી. ગઢ્ઘેના અગડાએ—આસપાસનાં વૈમનસચો, આવી આવી બાખતોને જ આભારી છે. પરન્તુ આવા અગડાએથી આપણી શક્તિએ કેટલી ક્ષીણ થઈ છે, એ શું આપણાથી અનાણયું છે? આવા કલેશો હણું તો શાન્ત થવાયે પામ્યા નથી, એટલામાં એ શ્રાવણ આવીને ઉલા રહ્યા છે. જે કે આવા પ્રસંગોમાં જેને જે રૂચે, કિંવા પોતે જે પરંપરામાં માનતા હોય, તે તે પરંપરાને અનુસરીને કાર્યો કરી લેતા હોય, તો તો અધ-ડાનો અવકાશ જ નથી રહેતો, પરન્તુ પોતાની માન્યતા-ઓને સિદ્ધ કરવા જતાં બીજાએને જૂડા—ઉતારી પાડવાના જે પયતનો થાય છે, એજ કલેશનું કારણ અને છે. ચાલુ ચોમાસામાં આવેલા એ શ્રાવણ પ્રસંગોએ શાન્તિપૂર્વક કાર્ય કરી લેવાની જરૂર છે. ધણુા ગામોમાં પહેલા અને

બીજા એમ જુદા જુદા શ્રાવણોને માનવાવાળા શ્રાવકો રહેતા હશે. જ્યારે મુનિરાજ કોઈ પણ એક પરંપરાને માનનારા હશે; આવી અવસ્થામાં, સંઘમાં ક્લેશ ન થાય, એવી રીતે સંભાળીને કાર્ય કરી લેવાની જરૂર છે. લદે પોતાની પરંપરા ન મૂકવામાં આવે, પરંતુ સંઘમાં ક્લેશ થાય, એવું તો કમમાં કમ ન થવું જોઈએ. એવી જ રીતે તે તે ગામના સંઘોએ પણ ખડુ હીર્ઘાદિથી કામ લેવાની જરૂર છે. કોઈ પણ મુનિરાજની પક્ષાપક્ષીમાં પડીને પોતાના ગામમાં ક્લેશની જવાળા લભુકાવવી, એ બિલકુલ નહિ ઈચ્છા યોગ્ય જ કહી શકાય. મુનિરાજ તો ચતુર્માસ ઉત્તે વિહાર કરી જય છે, પરંતુ ગામમાં પેસી ગચ્છેલો ક્લેશ વર્ષો સુધી અન્યો રહે છે. અને ક્લેશ દાવાનળથી અત્યારે જૈનસમાજ કેટલી સંતમ થઈ રહી છે? એવી અવસ્થામાં નવા નવા ક્લેશોનાં વાતાવરણો ઉલાં થાય, એ જળહળતી અગ્નિમાં લાકડાં નાખવા જેવું ખને છે. માટે આ વિષયમાં ખાસ સંભાળથી કાર્ય લેવાની જરૂર છે.

ખીજુ ખાખત દાનેપદેશની છે. મુનિરાજે પોતપોતાના ચતુર્માસમાં ગૃહસ્થોને પોતાના દ્રવ્યનો સહૃદ્યય કરવાનો ઉપદેશ આપશો, પરંતુ એ સહૃદ્યય તેવા માર્ગ કરાવવો એ ખાસ કરીને વિચારવા જેવું છે. મુનિરાજે લે સમાજની આવશ્યકતાઓનો વિચાર કરીને જ આ ચોમાસામાં ઉપદેશ આપે તો મારી ખાતરી છે કે સમાજની ધર્ષી આવશ્યકતાઓની પૂર્તિ થઈ શકે તેમ છે.

હું પહેલાં કહી ગયો છું, તેમ આપણી અનેક ઉપકારી સમાજહિતની સંસ્થાઓ આર્થિક ચિંતાથી રીબાય છે. શું એવી સંસ્થાઓને પુષ્ટ કરવી, એ સૌથી પહેલું કર્તાબ્ય નથી? જે સમાજમાં જ્ઞાનનો પ્રગાર નથી, વિક્ષાનોનું ખાડુલ્ય નથી એ સમાજ ભીલ કોમોની સાથે ઉલ્લી રહેવાને કહી પણ ચોણ્ય ગણુંતી નથી. આજે આખા દેશનું ધ્યાન, દેશના ખાગકો અને ખુબકોને શિક્ષિત બનાવવા તરફ એંચાઈ રહ્યું છે. ખુરોપ અને અમેરિકા જેવા દેશોની શિક્ષા પ્રત્યેની સખાવતો વાંચીને આપણે આશ્ર્યમાં ગરકાવ થતા હતા—થઈએ છીએ. પરન્તુ હવે ભારતવર્ષ પણ સમજવા લાગેલ છે, કે જ્યાં સુધી શિક્ષાનો પ્રગાર નહીં થાય, ત્યાં સુધી અમારામાં વાસ્તવિક ચૈતન્ય આવવાનું નથી અને તેનું જ એ પરિણામ છે—ભારતવર્ષમાં આશ્ર્ય ઉત્પજ કરાવનારી સખાવતો થવા લાગી છે. હુમણું જ વર્તમાનપત્રોમાં જાહેર થવા પ્રમાણે આપણે જાણી શક્યા છીએ કે એક મદ્રાસી દાનવીર શ્રીયુત સર સુધૈય, ચેહુમર નામના ગૃહસ્થે મહુરામાં (મદ્રાસ પ્રાંત) એક વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવા માટે ઉપ લાખ રૂપિયાનું દાન કર્યું છે, એક મારવાડી ગૃહસ્થ મિ. ભીરલા શિક્ષાને માટે જે સખાવતો કરી રહ્યા છે, એ કોઈથી અજાણી નથી. આમ દેશના ધનાઢ્યો શિક્ષા માટે આટલું ખધું કરી રહ્યા છે, ત્યારે કમનસીબ જૈનસમાજના ધનાઢ્યોને, સંઘો કાઢીને લાખો ખરચવાનું સુઝે છે. ઉઅમણું અને ઉપધાનોમાં લાખો ખરચવાનો ઉત્સાહ થાય છે, પરન્તુ તે જ ગૃહસ્થોને

શિક્ષા માટે, શાનપ્રચાર માટે જે કહેવામાં આવે તો, અસો પાંચસો આપતાં પણ તેઓ સકોચાય છે. તેઓની આ સંકુ ચિત્તતામાં ન કેવળ શિક્ષા પ્રત્યેની અનલિંગિ જ કારણું છે, અહેં એકથીજના પક્ષાપક્ષીમાં પડી તેઓએ પોતાનું હૃદય ભીજોને ત્યાં વેચેલું હોય છે અને તેથી તેઓ પોતાનો બુદ્ધિનો ઉપરોગ સારાનરસાની પરીક્ષા કરવામાં કરી શકતા નથી. અસ્તુ, ગમે તેમ પરન્તુ શાસનપ્રેમી મુનિરાજેએ આ ચતુર્માસમાં ખીજુ કંઈ બાબતો તરફ લોકેનું ધ્યાન ન આકર્ષિતાં શિક્ષા-ખાસ કરીને એવી શિક્ષા કે ને શિક્ષાથી જૈનસમાજના ચુંબકો પોતાનો કર્તાંય-ધર્મ સમજતા થાય, અને જેઓ ધાર્મિક વૃત્તિ તેમ જ સમાજ-દેશ અને જેઓ ધર્મ પ્રત્યે કર્તાંય સમજે-એવી શિક્ષા તરફ આકર્ષવાનું જરૂર લક્ષ્યમાં લે, એવી આશા છે.

ત્રીજું કર્તાંય ગરીબ શ્રાવક-શ્રાવિકાઓના ઉદ્ઘાર માટેનું છે. જૈનોની આંતરપરિસ્થિતિ અલ્યન્ત ખરાબ છે, એ સમજવવાની હુવે જરૂર રહી નથી. આવા ગરીબ જૈનોને ધ્યાને વળગાવવા માટે લોન પદ્ધતિથી નાણું ધીરી શકાય, એવાં ઝડ્ઢો આ ચતુર્માસમાં ઉલાં કરવવાની જરૂર છે. ધ્યાનમાં પણ એ રાખવાનું છે કે આવા ઝડ્ઢોની સાર્થકતા કેવળ ઝડ્ઢો ઉલાં કરવાથીજ થતી નથી. એની તાત્કાલિક વ્યવસ્થાનો પ્રબંધ પણ સાથે સાથે થવો જ જોઈએ. ધણું વળત મુનિરાજેના ઉપરેશથી ઝડ્ઢો ઉલાં થાય છે. આ

કુંડાનું લિસ્ટ ચોપડાના પાને કિંબા એક કાગળીથા ઉપર હોય છે, ત્યાં સુધી ગૃહસ્થોનો ભાવ જેવો ને તેવો કાયમ હોય છે, પરંતુ જ્યારે તે રકમ એકત્રિત થાય છે, અને એક ખાસ્સી ગાંસડી કે દ્વારા ગૃહસ્થોની આંખ આગળ ઉપસ્થિત થાય છે, ત્યારે તે ગૃહસ્થોનું ચિત્ત ચલાયમાન થાય છે. હાય હાય, આટલી રકમ અમારા ગામમાંથી ચાલી જશો ? અરે આટલી બધી રકમ તે ખરચી શકાય ? નહિં નહિં, વ્યાજ ખરચો ! વ્યાજની રકમ પણ મહોટી જ્યોએ છે ત્યારે પાછી મૂડીને વધારવાની દાનત ઉલ્લી થાય છે. પરિણામ એ આવે છે કે નથી મૂડી ખરચી શકતા, અને નથી વ્યાજ પણ પુંડ ખરચતા. પછી તે ઇપિયા એક પ્રકારના લયંકર કલેશનું કારણું બને છે. એ કલેશ ધીરે ધીરે એટલો બધો આગળ વધે છે કે એ ઇપિયા વકીલો અને ઐરીસ્ટરોને ખીસ્સાં તર કરવાના કામમાં આવે છે. જ્યારે, જેને માટે એ કુંડ લેગું કરવામાં આવ્યું હતું, તેઓની સ્થિતિ તો એક ઈચ્ચ પણ આથી પાછી થયેલી નથી જોવાતી. માટે સૌથી પહેલાં ધ્યાનમાં એજ લેવાનું છે કે કુંડ થવાની સાથેજ તેની વ્યવસ્થા પણ તત્કાળ જ કરવી જોઈએ.

પ્રત્યેક ચતુર્માસમાં ધણું કામો ન કરાવતાં આવાં આવાં એક એક બધે કામો ઉપર જ એક સરખી રીતે ઉપદેશ આપવાનું મુનિરાજે ધ્યાનમાં લે તો એ યાંચ વર્ષમાં તો જૈન સમાજના અંગમાં જે જે સડો પેડો છે એ બધો હુર

થાય અને સમાજનું શરીર નિરોગ-હૃદયપુષ્પ બને. એ ચાર વર્ષ થહિ સંઘો નહિ કાઢવા કઠાવવામાં આવે, તો તથી સામાજિક સ્થિતિમાં કંઈ હાની પહોંચવાનો નથી. પરંતુ જે આવશ્યક કર્તાંયો તરફ બેદરકારી કરવામાં આવશે, લક્ષ્ય દેવામાં નહિ આવે તો તેથી સમાજની પરિસ્થિતિમાં જે હાની પહોંચી રહી છે, એમાં ભયંકર વધારો જ થવાનો.

પ્રભાવશાલી ઉપદેશક મુનિરાજે જે આટલીજ વાત લક્ષ્યમાં લેશે તો તેઓ આજ ચોમાસામાં ધાળું ધાળું કરી શકશે.

ખરેખર ખુશી થવા જેવું એ છે કે આજથી ૮-૧૦ વર્ષો ઉપર કેટલાક મુનિરાજે ને વિચારો ધરાવતા હતા, તેઓના વિચારોમાં આજે ધાળું ધાળું પરિવર્તન ધરેલું જોવાય છે. અને તેઓ સમયધર્મ નો ઉપદેશ આપી રહ્યા છે. જેઓ સમયને એણખી સમાજના ધનાદ્યો વિગેરે પાસે કાર્યો કરાવી રહ્યા છે, તેઓને ભારા ભૂરિ ભૂરિ અલિનંદન છે અને આશા છે કે ખીલ મુનિરાજે પણ તેઓશ્રીનું અનુ-કરણ કર્દા સમાજના ઉદ્ધારમાં મહોટો ઝડપો આપશે.



(૪૩)

સિદ્ધપુત્ર.

કોઈ પણ ધર્મનો પ્રચાર પ્રચારકો વિના નથી થઈ શકતો,
 એ વાત મારા છેલ્લા લેખોથી સ્પષ્ટ સમજાઈ હશે. આર્ય-
 સમાજ, અધ્યાત્મસમાજ, હેવસમાજ, પ્રાર્થનાસમાજ, કિશ્ચીયન,
 અને એવી કોઈ પણ સમાજે પોતાની તરફી કરી રહી છે, તે
 પોતાના પ્રચારકોના સાધનથી જ. આજકાલની તે નવીન સમાજે
 જ શા માટે ? નૈનધર્મ, હિંહુધર્મ અને ઐંદ્રધર્મનો પ્રચાર
 પણ અત્યાર સુધીમાં થયો છે, થાય છે અને થશે, એ પ્રચા-
 રકોના સાધનથી જ. સેંકડો-હળરો ઉપરેશકો-સાધુઓ નૈન :

સમાજમાં હતા, ત્યારે જૈનધર્મનો વિસ્તાર કેટલો અધો હતો, એ ધર્મિણાંનાં પૃષ્ઠો ખુલ્લી રીતે બનાવી રહ્યાં છે. કમનગીએ સાધુઓમાં શિથિલતાએ આવવા લાગ્યો, લાંખ્યા લાંખ્યા વિહારો બંધ પડી ગયા, અને સાધુઓએ પોતાના વિહારનું શેત્ર અમુક મર્યાદામાં જ બનાવી લીધું. પરિણામ એ આવ્યું કે-જૈનધર્મ પણ તેમની સાથે જ જાથે એક ખાંચોચીયામાં જઈ લરાયો.

પરન્તુ આ સ્થિતિ સુધારવાને માટે હવે જાયત થવાની જરૂર છે. એ વાતને પોકાર ચારે તરફથી થઈ રહ્યા છે. એ પોકારની સાથે 'સમય'ના ફેટકા પણ હવે વાગવા લાગ્યા છે. અને તેથી પહેલા કરતાં કંધુક અંશે સાધુઓ સચેત થયા હોય, એમ જોવાય છે. છતાં હજુ પણ સાધુઓનો મહેંદ્રો ભાગ સમાજમાં શાપરદ્ય કાર્ય કરી રહ્યો છે. આખા દેશમાં જ્યારે સંભનું-પ્રેમનું-એકતાનું વાતાવરણ હેલાઈ રહ્યું છે, ત્યારે કેટલાક પોતાને ધુરંધર વિક્રાન્ત અને નેતા તરીકે એળાખાવતા કલેશાચાર્યો કલેશનાં-કુસંપનાં-અધડાનાં ઝડપ ઉગાડી રહ્યા છે. કે વખતે દેશના ખૂણેખૂણુંમાં ઉપદેશકો-પ્રચારકોને ફરવાની-વિચારવાની આવશ્યકતા છે તે વખતે કેટલાક મહાપુરુષો ઉલટા શ્રાવકોની ખુશામતોમાં ફસાઈ શ્રાવકોનાં રમકડાં બની ચોક્કસ શૈત્રોમાં પોતાના રાગીએ બનાવવાની ધૂનમાં પડ્યા છે અને શ્રાવકો પણ પક્ષાપક્ષીમાં પડી, ધર્મના એ ફિરસ્તાઓને-ધર્મના પ્રચારકોને પોતાના

ગામના કે પોતાના કુદુંખના સાધુ-ગુરુ બનાવી રહ્યા છે. માર્ણ તો માનવું છે કે-ગૃહસ્થો, સાધુઓના પક્ષાપક્ષીમાં ન પડ્યા હત, પોતાના જ ગુરુ ન બનાવતાં જગતના ગુરુ તરીકે તેમને વિચરવા હીથા હત, અને જરા પણ આચારમાં વ્યવહારમાં શિથિલતા આવતાં, શાસ્કના નિયમ પ્રમાણે સાધુઓના માતા-પિતા અની, તેમના આચાર-વિચારનું ભાન કરાવતા રહ્યા હત, તો આજે સાધુઓની અને આખા સમાજની આ સ્થિતિ ન જ આવી હત. આજે સાધુઓમાં જે વૈમનસ્ય જોવાય છે, તે જોવાનો પ્રસંગ ન જ આવતે. આજે સાધુસમેલન થવામાં કે વિદ્ધો હેખાય છે, તે વિદ્ધો કદાપિ આડે નહિં આવત. પરન્તુ કેવળ દૃષ્ટિરાગના કારણે, જ્યાં, ગમે તેવી પોલ-પોલ ચલાવનારમાં-શિથિલાચારીયોમાં પણ ચોથા આરાની વાનગીપણું જોઈ રહ્યા હોય ત્યાં સત્ય કયાંથી કહી શકાય? ખુખી તો એ છે કે આજે જેને ચોથા આરાની વાનગીમાં મૂકવામાં આવે છે એને કાલે પાંચમા આરાથીયે આગળ વધી છફ્ટા આરામાં મૂકવાનો પ્રસંગ આવે છે. સમયની અદિહારી છે! અસ્તુ.

કહેવાની ભતલણ એ છે કે-ધર્મના પ્રચારક તરીકે જૈન સમાજમાં સાધુઓ કામ કરી રહ્યા છે, પરન્તુ તેઓ પોતે તો ભેટે ભાગે ચોક્કસ શેત્રોના જગીરદાર બન્યા છે, અથવા ચોક્કસ રાગી શ્રાવકોના શુરૂ બન્યા છે, એટલે, એમનામાં ગમે તેટલી શક્તિયો હોવા છતાં, દેશ-વિદેશમાં જૈનધર્મનો

પ્રચાર કરવાની આપણે જે આશાઓ રામી શકીએ, તે પૂરી પડે તેમ નથી. વળી કેટલાક મુનિરાજે સમયના જાણ, દેશ-વિદેશમાં વિચરનારા, કષોને સહુન કરનારા પણ છે, પરંતુ મુનિરાજેના આચાર-વિચારો જ એવા છે કે-જેથી તેઓ વધારે આજીવી કાર્ય કરી શકે નહિ. રાત્રે મકાન છોડી ખડ્ઝાર ન જવાય, બતી આગળ ન એસાય-કરાય, પરે જ ચાલીને મુસાફરી કરી શકાય, દર્તાહિ આચારો છુટથી-ગમે તે સમયે, ગમે તે દેશમાં, જવાને માટે બાધક હોય છે. અને માર્દાં દઠ માનવું છે કે, આચાર-વિચારોમાં શિથિલતા લાવીને કાર્ય કરવું છે, તે પોતાનું અને પરનું પણ એવા ખરાખર છે, આચારથી હીન થયેલ માણુસ કહિ પ્રલાવ પાડી શકતો નથી. પોતાની હફને ચૂકનાર નથી ઘરનો રહેતો કે નથી ઘાટનો. એમાં દાંલિકતા વધે છે, એટલું જ નહિ પરંતુ એક પગથીચું ચૂક્યા પછી તે નીચે જ આવીને પડે છે. માટે કેદ એમ કહેતું હોય કે-સાધુઓ પોતાના સુખ્ય આચારોમાં પરિવર્તન કરીને-શિથિલતા લાવીને હૂંખ પ્રચારનું કાર્ય કરે, તો તે જિલ્કુલ હુંખક છે. એથી કહિ પણ ક્રાયહો થતો નથી. એશક, સમયને અનુકૂળ માત્ર તેજ પ્રવૃત્તિ આદરી શકાય કે કેથી આચારમાં-પોતાના સાધુધર્મમાં શિથિલતા ન આવે.

આવી રીતે જૈન ધર્મના પ્રચારનું કાર્ય કરનારા મુનિરાજેની આ સ્થિતિ છે. બીજે વર્ગ યત્તિવર્ગ છે. આ વર્ગ

ધારે તો તો પ્રચારનું કાર્ય મુનિરાજે કરતાં પણ કહાચ વધારે કરી શકે. પરન્તુ આ વર્ગમાં મોટે ભાગે એટલી અધી શિથિલતા આવી છે, કે ગૃહસ્થો કરતાં પણ વધારે હુનીતા આવી ગઈ છે. કેટલાક વિદ્ધાન્ અને કંઈક કાર્ય કરી શકે એખા યત્તિવર્યો છે, પરન્તુ તમામ યત્તિવર્ગ ઉપરથી સમાજની શ્રદ્ધા ઉડી જવાના કરણે, તેઓને પોતાના નિર્વાહને માટે અનેક પ્રકારના વંધા-દાવા, દોરા-ધાગા વિગેરે કરવા પડે છે. અને તેમ કરવાથી તેઓ સ્વાર્થવૃત્તિમાં-દોલમાં પડી જય છે, અને દોલમાં પડેલો માણુસ નિઃસ્વાર્થતાથી પ્રચારકાર્ય નથી કરી શકતો. હા, કેટલાક યત્તિવર્યો પ્રચારકાર્ય સારું કરે છે, પરન્તુ તેઓની સંખ્યા અહુજ થાડી-આંગળીના વેઠા ઉપર ગણીયે તેટલી પણ લાગેન છે.

જૈન સમાજમાં અત્યારે જેએ પ્રચારનું કાર્ય કરનારાએ છે, તેઓની સ્થિતિ ઉપર પ્રમાણે છે. આવી સ્થિતિમાં જૈન ધર્મના પ્રચારકેની સંખ્યા વધારવી, અને તે એવી સંખ્યા વધારવી કે જેએ આજદીથી ગમે તે સમયે, ગમે તે દેશમાં જઈ શકે, વાહનો દ્વારા જઈ શકે-આવો એક નવો વર્ગ ઉત્પન્ન કરવાની જરૂર છે. આ નવો વર્ગ ચોક્કસ મર્યાદાનો ત્યાગી હોય, ચોક્કસ આચારોમાં ગૃહસ્થો કરતાં અહીયાતો હોય, અને ચોક્કસ વેષથી આકર્ષક પણ હોય. કરણું કે ત્યાગ વિના છાપ પડતી નથી. આચાર વિના કથન આહુ થઈ શકતું નથી અને વેષની વિચિત્રતા સિવાય આકર્ષાતા વધતી

નથી, આવો એક વર્ગ ઉધક્યા વિના જૈનધર્મના પ્રચારને માટે આપણે સર્વત્ર પહોંચી શકવાને માટે અસર્થ થાએ અને જ્યાં સુધી આપણી એ અસર્થતા હુર ન થાય, ત્યાં-સુધી જૈનધર્મના પ્રચારની આપણે આશા રાખીએ, એ પણ નિરથ્ક છે. આં ગૃહસ્થો પોતાની ધૂનમાં છે. જારી પેઠે લક્ષ્મી એકત્રિત કરી લેવા છતાં અને પ્રચારદાર્ય કરવાની શક્તિ હોવા છતાં, એવા ગૃહસ્થો લોલવૃત્તિથી પોતાના ધંધા-રોજગારને બંધ કરી-ચોક્કસ સમય માટે બંધ કરીને પણ શાસનના હિતની ખાતર થોડો પણ ભોગ આપી શકતા નથી અને અતાચેવ, ન સાધુમાં કે ન ગૃહસ્થમાં-એવો એક વર્ગ ઉલ્લો કરવાની આવશ્યકતા છે.

આવો એક વર્ગ ઉલ્લો કરવો, અને એ વર્ગને કચા નામથી ઓળખવો, તેમ એના આચાર-વિચારો, અને તેઓમાં ચોણ્યતા કેવી હોવી જોઈએ, તે સંબંધી થોડું ક વિચારી લઈએ.

ચરિતાતુવાદના કેટલાક પ્રાચીન અંથોમાં “સિદ્ધપુત્ર” તુનામ આવે છે. આ ‘સિદ્ધપુત્રો’નો વેષ અને આચારવિચાર કેવો હતો, તે સંબંધી હજુ ચોક્કસ વર્ણન મારા વાંચવામાં આવ્યું નથી. પરન્તુ એ તો ચોક્કસ છે, કે જૈનસમાજમાં ‘સિદ્ધપુત્ર’ નામનો એક વર્ગ અવશ્ય હતો. વધારે શોધ કરીને આપણે એ મેળવવું જોઈએ કે એ સિદ્ધપુત્રો કેવાં ક્રતો પાગતા હતા? કેવો આચાર પાગતા હતા? કેવી તેમની વેષ-વિલૂષ્ણ હતી? અને તેઓ શું શું કામ કરતા હતા?

સમયને ઓળખો.

આ સંબંધી વિશેષ હક્કીકત પ્રાચીન અંગ્રેજીમાંથી ન મળે તો આપણે તે સંબંધી ખાસ ચોજના છિલી કરવી જોઈએ. સમયાનુદ્ધળ નિયમો અનાવવામાં કંઈપણ બાધકતા નહીં નથી. પરન્તુ ગમે તે રીતે પણ આવો એક વર્ગ ઉલ્લો કરવો, અને તેઓને પ્રચાર કાર્ય માટે નિયુક્ત કરવા જોઈએ.

આવા વર્ગને માટે જે ચોજના અનાવવામાં આવે, એમાં મુખ્ય પાંચ બાધતોનો સમાવેશ કરવાનો રહે છે ૧ સિદ્ધ-પુત્રોનો વેષ, ૨ સિદ્ધપુત્રોના આચાર-નિયમો, ૩ સિદ્ધપુત્રોને અહૃણુ કરવાના વ્રતો, ૪ ‘સિદ્ધપુત્ર’ તરીકે દીક્ષિત થના-રાઓની ચોભયતા અને ૫ સિદ્ધપુત્રોને કરવાનું કાર્ય.

આ પાંચ બાધતો મુખ્ય છે. પહેલાં કહેવામાં આવ્યું છે તેમ સિદ્ધપુત્રોનો વેષ, સાધુના અને ગૃહસ્થના વેપથી નિરાણો હાવો જોઈએ. બદ્દકે આપણા પ્રાચીન સંસ્કારો સંયુક્ત હાવા જોઈએ. એવીજ રીતે આચાર-નિયમો, વ્રતો વિગેરમાં વચ્ચે માર્ગની પસંદ કરવામાં આવે. જેથી તેઓ વધારે સંકોચમાં-અંધનમાં ન રહે, તેમ વધારે નીચી ફશા-માં પણ ન આવી રહે. દાખલા તરીકે-આ પાંચે બાધતોની રૂપરેખા આ પ્રમાણે અથવા એમાં થોડાક ફેરફાર સાથે રાખી શકાય.

૧ વેષ—

૧ ખુલ્લુ મસ્તક રાખવું અને માથે શિખા રાખવી.

२ जिनेअपवीत राखवी.

३ कपडामां—

(१) सर्वेष धोती

(२) सर्वेष केशनी

(३) पीणु उत्तरासन

४ कपडाना भोज (भूटने स्थाने)

५ हाथमां एक लाकडी. (दं०)

६ छत्री पणु जड़र पडे राखी शके.

२ आचार-नियमो—

१ रात्रिलोग्न अने अखक्षयनो। त्याग.

२ जेटली अनी शके तेटली साहाई.

३ रोज एक सामायिक करवुं. अनता सुधी एक प्रति-
कुमणु पणु.

४ मंहिरनुं साधन होय त्यां पूजा अवश्य करवी.

५ ज्यां सुकान होय, त्यां प्रतिदिन एक कदाक प्रवर्चन
अवश्य करवुं, अथवा अध्यापन करवुं.

६ शरीरशुद्धि अराधर राखवी.

७ नाटको-सीनेमा विगोरे न जेवां. तेम शुंगार न
करवो, तेम होटेलोमां न जवुं.

સમયને એળાંખો.

૮ સાત્પિક ખોરાક—હુધ, હિં, ધી, દાગ, લાત, શાક, રોટલી,
વિગેરે વાપરવું. અધિકતેલ, મરચું, ઘરાશ ન વાપરવાં.

૯ રોજ નિયમિત થાડી યા ધણી કસરત કરવી.

૩ પ્રતો—

૧ લગવાન છેમચંદ્રાચાર્યો ગૃહસ્થોને માટે અહિસાત્રત અતા-
દ્યું છે તેમ—નિરાગસ્વસજન્તુનાં હિંસાં સંકલ્પતસ્ત્યજેત—અથોતુ
નિરપરાધી એવા ગ્રસ લવોને મારવાની બુદ્ધિથી ન મારે.

૨ એવું ભૂષાવચન, કે જેથી ખીજને હુઃખ ઉત્પન્ન થાય,
અથવા જેમાં પરવંચના હોય, તે ન હોલે.

૩ એવી ચોરી, કે જેનાથી રાજ્યદંડ થઈ શકે, અથવા
લોકનિંહા થાય, ન કરે.

૪ ચાવળજીવ શરીરથી પ્રદૂચયર્ય પાણો. મનધી વચનથી
પાળવાનો થતન કરે.

૫ માસિક પચીસ રૂ. નું પોતાનું ખર્ચ નીકળે, એટલો
પરિથિહ રાખે, અને તેથી વધારે પરિથિહ વધારવા
માટે પ્રયત્ન ન કરે. આ ખર્ચમાં મુસાફરી ખર્ચમો
સમાવેશ નથી થતો.

૪ ચોણ્યતા—

‘સિદ્ધપુત્ર’ ધનારમાં કમમાં કમ નીચેની ચોણ્યતા હોવી
જ જોઈએ.

૧ વય—૧૮ ધી એઠાઈ ઉત્તરનો ન હોય.

૨ નિરોગતા—શરીરમાં કોઈ પણ જાતનો
રાજરોગ ન હોય.

૩ અભ્યાસ—એઠાઈમાં એછો અદ્વલો અભ્યાસ
હોવો જોઈએ.

૧ ધાર્મિક—ધાર્મયુત્તીકરણ, જીવવિચાર, નવ
તત્ત્વ, અને ચાર કર્મચંદ.

૨ આચારચંદ—આદ્ધગુણવિવરણ અને ચોગ-
શાસ્ત્રના ચાર પ્રકાશ.

૩ સંસ્કૃતબ્યાકરણ—ન્યાયનું ટીક ટીક જાન.

૪ દાર્શનિક—ધડ્ધર્શનનું સામાન્ય જાન.

૫ વક્તૃત્વ—હિંદી-ગુજરાતીમાં સારી રીતે વ્યા-
ખ્યાન આપી શકે.

૬ અંગ્રેજ—દાખિલાં વાંચતાં ટીક ટીક આવડવું
જોઈએ. (કદાચ ન હોય તો! પણ ચાલો.)

૫ કાય—

૧ કોઈ પણ ‘સિદ્ધપુત્ર’ ઉપદેશકનું અદ્યાપકનું, કોઈ
પણ સંસ્થાનું સંચાલન અથવા સાહિત્ય પ્રવૃત્તિ
(પુસ્તકો લખવાં, સંશોધન કરવાં વિગેરે) આ
ચાર કામો સિવાય બીજું કંઈ કામ ન કરી શકે.

૨ જ્ઞાનપ્રચાર, નૈતિકજીવન તરફ લોકોને વાળવા, ધાર્મિક જીવન અનાવવું, એ ‘સિદ્ધપુત્ર’ નું પ્રચારકાર્ય હોઈ શકે.

૩ અને ત્યાં સુધી જૈન સમાજની સાથે સંખંધ ધરાવતું કોઈ પણ સાહિત્યિક યા જ્ઞાનપ્રચારનું કાર્ય કરવું.

૪ જ્યાં સુધી સંસ્થા દ્વારા પોતાના ગુજરાનની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઉચ્ચિત વેતનથી ઉપર્યુક્ત કાર્યો કરી પોતાનું ખર્ચ નિભાવવું અને સંસ્થા દ્વારા વ્યવસ્થા થયે અવैતતિક કાર્ય કરવું.

‘સિદ્ધપુત્રો’ માટેની આ ચોજના એક માર્ગદર્શક ઈસારો માત્ર છે. આમાં ઘણું ફેરફારો, સંસ્કારો, સુધારા વધારા કરી શકાય.

પરન્તુ એ વાત નક્કી છે કે-આવો એક વર્ગ ઉત્પજ્ઞ કરવાની જરૂર છે. ચારિત્રની ચો઱્યતા મેળવવા માટેની આ સંસ્થા એક સ્કૂલનું કામ કરી શકે. કંઈ પણ જાતની ચો઱્યતા મેળવ્યા સિવાય એકાએક ‘દીક્ષા’ લેવાનાં અને આપવાનાં જે અનિષ્ટ પરિણામો દીક્ષા લેનાર-હેનારને જ નહિં, પરન્તુ આખી સમાજને લોગવવાં પડે છે, તે આ ચોજનાથી ઘણે લાગે નાખુંદ થશે. સિદ્ધપુત્ર તરીકે ચોક્કસ વર્ષો સુધી કામ કર્યો પછી એ સિદ્ધપુત્ર સર્વ વિરતિ ચારિત્રનો સ્વીકાર કરી શકે.

આ યોજના એક અખતરા સ્વરૂપ છે. જૈનસમાજના-જૈનધર્મના પ્રચારકાર્યનું લક્ષ્યબિહું રાખીને આ યોજના લખી છે. થીજા જૈન વર્ત્તમાનપત્રકારો આ યોજનાના અમલમાં રહેલા લાભાલાલનો વિચાર કરી પોતાના વિચારો પોતાના પત્રમાં પ્રકટ કરશે તો જૈનસમાજને ધારું જાળવાનું અને વિચારવાનું મળશે.

મારો તો નાર અલિપ્રાય છે કે-કોઈ પણ માતથર જૈન સંસ્થા, જે આ યોજનાને અમલમાં મૂકવા માટે પોતાના હાથમાં કાર્ય ઉપાડી લેશે તો તે ખરેખર આરીવિદ્વિપ કાર્ય કરી શકશે, અને એ સંસ્થા, જૈનસમાજના એક આવશ્યકીય-પરમ ઉપયોગી કાર્ય કર્યાનું પુણ્ય સમ્પાદન કરી શકશે.

આપણી ફોન્ડેશનસ જેવી સંસ્થા, કે જેને માટે એવા આક્રોષો મૂકાય છે કે-તે પ્રતિવર્ષ હજનરો ઇપિયા નોકરોના પગારમાં ખર્ચવા સિવાય, કોઈની દૃષ્ટિમાં આવી શકે, એવું એક પણ કાર્ય નથી કરતી, તે સંસ્થા બીજી બધી પંચાયતોને મૂકી આવું જે એક કાર્ય ઉપાડી લે, તો તે ખરેખર, જૈન સમાજનું કલ્યાણ કરી શકે. જૈન ધર્મનોં પ્રચાર કરી શકે.

શાસનહેવ કોઈ ને કોઈ સંસ્થાને સહખુદ્વિસ્તુઝાડે, અને આવી યોજનાને અમલમાં મૂકવાનું સામર્થ્ય સમર્પે, એટલું જ કચ્છી વિરભું છું.

(૪૪)

અહિસાનું અજીર્ણ

માણુસ વધારે ખાય છે, ત્યારે અજીર્ણ થાય છે, તેમ કોઈને બુદ્ધિનું અજીર્ણ થાય છે, અને કોઈને માન-પાતનું અજીર્ણ થાય છે અને કોઈને વિદ્યાનું અજીર્ણ થાય છે, તો કોઈને તત્ત્વજ્ઞાનનું પણ અજીર્ણ થાય છે. અને જેને અજીર્ણ થાય છે, એને પછી શાક્યની મર્યાદાઓ કે યુક્તિ-ઓની પ્રભાગતાઓ એ કંઈ જોવાનું ભાન રહેતું જ નથી. એક જ વસ્તુને માટે જે યુક્તિઓ પોતે આપતા હોય, તે જ વસ્તુને માટે તે જ યુક્તિઓ બીજે કોઈ આપે તો અજીર્ણવસ્થામાં એ યુક્તિઓ એને નિર્માલ્ય જ લાગે. નિદાન તે પોતાનો કષ્ણો ખરો કરાવવાને માટે ભરસક કોશીશ કરે.

કેટલાક માણસો એવા પણ હોય છે કે જેઓ એક યા ભીજુ રીતે જગતમાં એક વખતે પોતાનું નામ પ્રાપ્ત કરી લે છે. લોકોની પ્રીતિ-શર્દ્ધા મેળવી લે છે, પછી તે જ માણસ ગમે તેમ લખે કે બાબે, એની સહામે બીજાઓને અવાજ ડિલવવાની પણ હિસ્તમત ચાલતી નથી. એવા પુરુષની સહામે કેમ કંઈ કહું કે લખી શકાય? અથવા ગંડુ તો છેવટે એમ પણ દલીલ કરવામાં આવે કે આપણે એમના વિચારોને-એમની દલીલોને-એમના હાર્દને તપાસવાને હજુ ચોણ્ય જ અન્યા નથી.

ઉપરની બજે બાખતોનો ઉડો વિચાર કરનાર જે મહાત્મા ગાંધીજીની પ્રવૃત્તિઓનો અને વિચારોનો સુકાણલો કરશો, તો અરેખર ઉપરની બાખતોની સત્યતા સ્પષ્ટપણે તેમની પાસેથી મેળવી શકશો.

મહાત્મા ગાંધીજીએ એક યા ભીજુ રીતે અરેખર દેશને લાભ પહોંચાડ્યો છે. ભલે તેઓ પોલીટીકલ પ્રવૃત્તિને માટે કેટલાકોની દસ્તિએ અચોણ નિવડ્યા હોય; પરન્તુ તેમની કેટલીક પ્રવૃત્તિઓથી દેશને લાભ પહોંચ્યો છે એમાં તો કોઈથી ના પાડી શકાય તેમ નથી. અને તેનું જ એ કારણ છે કે તેઓએ સમસ્ત દેશખંડુઓની આટલી પ્રીતિ-ભક્તિ સંપાદન કરી છે. ભીજુ તરફથી તેમણે પોતાની પ્રવૃત્તિમાં એક એવું તત્ત્વ દાખલ કર્યું કે જે તત્ત્વ તરફ આયોવર્ત્તની સમસ્ત પ્રણ ખીંચાયા વિના ન રહે. આ તત્ત્વ છે ‘અહિંસા તત્ત્વ.’

કોઈની સાથે અસહકાર કરવો તો ‘અહિંસાત્મક’, કોઈની સાથે લડાઈ કરવી તો ‘અહિંસામય’, વખ્તો પહેરવાં તો ‘અહિંસા’ થી અનેલાં, હીજુ ચીજે વાપરવી તો ‘અહિંસા’ વાળી.’ દરેક વસ્તુમાં ‘અહિંસા’ ‘અહિંસા’ કરતા ગયા પરન્તુ જગતું જેતું ગયું કે—

‘અહિંસા’ની પ્રત્યેક વસ્તુમાં ઉદ્ઘોષણા કરનાર મહાત્માના અસહકારમાંથી ‘હિંસા’ની જવાલાઓ પ્રકટી રહી છે. ‘અહિંસા’નું રટણું કરી રહેલા મહાત્માજી પણ ‘રાવ-પૂરાજ્ય’ ‘સેતાની સરકાર,’ વિગેરે સુલાષિતો ભાંધી રહ્યા છે. ‘અહિંસા’નો મંત્ર ધરે ધરે ઝૂંકનાર મહાત્માજી પણ લાખોનાં વખ્તોની હોળીએ કરાવી કરાવીને દેશના માથે શાપ લગાડી રહ્યા છે. ‘છતાં એ તો મહાત્માજી! ભારતીય મનુષ્યોના તારણુહાર! અહિંસાની મૂર્તિ! એમના તત્વજ્ઞાનને-એમના અહિંસાને આપણે સમજું પણ કેમ શકીએ? આપણુથી એમની ક્રિંલાસોઝી વિરુદ્ધ એક અક્ષર યે કેમ લખી શકાય?

પરિણામ એ આવયું કે મહાત્માજીને આપરે ‘અહિંસાનું અજૂણું થયું.’ ‘અહિંસા’ના તત્વજ્ઞાનમાં બહુ ઉડા ઉત્તરતાં દુઃખીએને દુઃખી સુક્રતા નહિ, પરન્તુ આણુથી સુક્રતા કરવામાં ધર્મ છે એમ માનવાની અને ખીલાએ પાસે મનાવવાની નોષત આવી.

થોડા વખત ઉપર ગાંધીજીના ‘કૂતરા’એ ગાંધીજીને ચકડોળે ચઢાવ્યા હતા, જ્યારે હમણું ગાંધીજીના વાછરડા

અને વાંદરાઓએ ગાંધીજીને ઔર ચાકડે ચઢાવ્યા છે. ગાંધીજી પોતાની આમાં કસોટી થતી જણાવે છે, અને પોતે પોતાના વિચારોમાં મજ્જમતા જણાવે છે; પરન્તુ એમાં મને જરાયે આશ્ર્ય જેવું નથી લાગતું. ગાંધીજી જેવા મહાત્મા પુરુષને હવે હજારો સમુચ્ચિત યુક્તિઓ અને વ્યાજળી દલીલોની દરકાર કરવી કંઈજ જરૂરની નથી. કારણ કે ગાંધીજી હવે કૃતકૃત્ય છે. એ તો જે વખતે અધૂરાપણું હતું—‘મહાત્મા’ બનવાનું બાકીપણું હતું, તેજ વખતે “મારી પહોંચ જેવી ભૂલ થઈ” “હું મારી ભૂલ સુધારે છું” ઈત્યાદિ વસ્તુએની જરૂર હતી. હવે અત્યારે તેમને તેમાંનું કંઈ બાકી રહ્યું નથી. એટલે તેઓ આર્યવર્તાની આર્ય લાવનાઓનું નિકંદન કરનારા વિચારે રજી કરે, મનુષ્યનું ખરું મનુષ્યત્વદ્યાલુતા—એનો અહિષ્કાર કરાવે, અને તેની સહાયે હજારો સચોટ દલીલો પેશ કરવામાં આવે, છતાં એમનું ઝંવાડું પણ ન કરે, તો તેમાં મને જરાયે અન્યથણી લાગતી નથી. અસ્તુ. તેમ છતાં પણ વિચારકોનું—‘અહિંસા’ના સાચા ઉપાસકોનું અને બીજાને પ્રાણુથી નહિં, પરન્તુ હુંખ્યથી મુક્ત કરવામાં ધર્મ છે, એમ માનનારાઓનું કર્તાબ્ય છે કે— ગાંધીજી માને કે ન માને, પરંતુ એમના વિચારોનો રહિયો તો મધ્યસ્થ દૃષ્ટિથી, શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિપૂર્વક અવશ્ય આપવોઝ. કારણ કે તેમ કરવાથી બીજાઓને એક બીજાના વિચારે જાણીને પછી, પોતાની બુદ્ધિથી નિર્ણય કરવાનો

સમયને અંગારો.

પ્રસંગ મળે છે. ખસ, આ જ વિચારથી ગાંધીજીની ‘પાવકુની જવાણા’ ઉપર વિચાર કરવાને! આ પ્રસંગ લઉં છું.

‘પાવકુની જવાણા’ નો પ્રસંગ શા ઉપરથી ઉત્પત્ત થયો, એ વસ્તુ હવે કોઈથી છાની નથી રહી. ગાંધીજીના આશ્રમનો એક વાછરડો હુઃખથી રીખાતો હતો, ગાંધીજીના પોતાના શાખદોમાં કહુંએ તો “તેને (વાછરડાને) પડખું ઝેરવતાં યે હુઃખ થતું હતું.” ગાંધીજી આ હુઃખને ન જોઈ શક્યા અને આશ્રમના બીજા કેટલાકેંની સલાહ લઈ, એ સલાહમાં વાછરડાને નહિ મારી નાણવાની પ્રથમ ચુક્કિ પૂર્વ-કની દલીલ રણુ કરવા છતાં, તેરની પીયકારીથી અને ઠારકર્યો.

ખસ, આ મૂળ વસ્તુ છે. તેઓ જણાવે છે કે “આવી સ્થિતિમાં આ વાછરડાનો પ્રાણ લેવો એ ધર્મ છે, એમ મને લાગ્યું.”

આપણે આના ઉત્તરમાં માત્ર એટલું જ પૂછી શકીએ કે કોઈ ખણુ પ્રાણિની ઈચ્છા વિરુદ્ધ એના શરીર ઉપર વિના કારણે પ્રહાર કરવો એ શું ધર્મ કહી શકાય? મનુષ્ય જેવી જન્તિ કે જે બેદી શકે છે, પોતાનું હુઃખ, પોતાની ઈચ્છાએ બીજાએ આગળ નિવેદન કરી શકે છે, એના ઉપર પણ, એની ઈચ્છા વિરુદ્ધ કંઈ પણ પ્રવૃત્તિ કરવી એ અનુચ્છિત છે, ગુનંદો છે, ત્યારે પણ જેવું એક અવાયક પ્રાણિ, તે પણ બિમાર, એના ઉપર એની ઈચ્છા વિરુદ્ધ પ્રહાર કરવો, અરે! એન! પ્રાણ લેવા, એ શું

ભયંકર અત્યાચાર નથી ! ‘હક’ ની દિલ્લિથી વિચારીએ તો આપણો હક જ શો છે કે આપણે તેના પ્રાણું સંહારવાને તૈયાર થઈએ ? ગાંધીજી અહિં એ દલીલ પેશ કરે છે કે “જે પ્રાણી અતિ હુઃખી હોય છે, તે મરવાની માંગણી કરે છે.’ પરંતુ ગાંધીજી ભૂલી જાય છે કે, એ માગણી કરે, એ એની સાચી માંગણી નથી, એ તો એની વેદનાનું સૂચન માત્ર છે. ગાંધીજીએ કોઈ મહોટા દવાખાનામાં એવા રોગીએ પણ કદાચ જોયા હુશો કે જેના શરીર ઉપર અનેક ઓપરેશનો થયાં હુશો, શરીર સડી ગયું હુશો, ઇદ્ધિર અને પાસ બહેતું હુશો, છતાં એ રોગી જેની તેની પાસે ખાસ-કરીને ડાક્ટર પાસે એ જ માગણી કરશો કે— “ડાક્ટર સાહેખ, કૃપા કરીને મને જલ્દી આરામ થાય, એમ કરો.” ગાંધીજી ભૂલી જાય છે કે સવે જીવાવિ ઇચ્છાંતિ જીવિતં ન મરિજતં । સમસ્ત જીવો જીવવાની જ આકાંક્ષાવાળા છે, મરણુને કોઈ ચાહુતું નથી. આવી અવસ્થામાં એક અવાચક પ્રાણિ, કે જે પોતાનું હુઃખ, પોતાની દુઃખી વ્યક્તા કરી શકતું નથી એને ‘બહુ હુઃખ થાય છે,’ ‘આ મરવાને જ ચાહુતું હુશો’ ‘એ પ્રાણુથી સુક્ત થશો તો સુખી થશો’ આવી મનઘડંત કદ્વપનાએ. કરીને, એને પ્રાણુથી સુક્ત કરવો, એ ક્યાં સુધી યોગ્ય છે, એનો વિચાર કોઈ પણ બુદ્ધિશાળી કરી શકે છે. ગાંધીજીના સિદ્ધાન્ત પ્રમાણે, જે હુઃખી એવા વાછરડાને મારી નાખવાથી એમણે ધર્મ પ્રાસ કર્યો, તો ગાંધીજીની ભયંકર

ભીમારી વખતે દવા અને ઓપરેશન વિગેરેથી આરામ કરવા બદલ ડાક્ટરો અને એમના મિત્રોએ અધ્યમ્બ્ર પ્રાપ્ત કર્યા છે, એમ માનવાને ગાંધીજી તૈયાર છે શું ?

ગાંધીજી પોતે કહે છે તેમ—એક લાઇએ એવી દલીલ ગાંધીજી આગળ કરી કે “જેને પ્રાણું આપવાની શક્તિ નથી તે ખીજના પ્રાણું હુણી શકે નહિ.” આ દલીલને ગાંધીજી અસ્થાને બતાવે છે. અને એનું સ્થાન સ્વાર્થ-ભાવનાથી ખીજના પ્રાણું હુણવાનો પ્રસંગ હોય, તે બતાવે છે.

પરન્તુ આપણે સહજ વિચારી શકીએ તેમ છીએ કે ગાંધીજીએ એ રીખાતા વાછરડાને મારવામાં ધર્મ છે, એમ માની એને પ્રાણુહિન કર્યો, એ જ ‘સ્વાર્થભાવના’ છે. સ્વાર્થભાવના વિના કયું કાર્ય મનુષ્ય કરે છે ? પુષ્ય મેળવવાની ઈચ્છા, ધર્મપ્રાપ્તિની ઈચ્છા, કોઈનું ફુખ પોતાથી નથી જેવાતું, માટે તેને મારી નાંખી અલગ કર્યું, એ બધી સ્વાર્થભાવનાએ નહિ તો ખીજુ શું છે ? આપણે પૂછીએ કે ગાંધીજીએ વાછરડાને પ્રાણુથી મુક્તા કર્યો, એ શું પરમાર્થભાવનાથી કર્યો છે ? શું એ વાછરડો તમારી પાસે યાચના કરી રહ્યો હતો કે—મને પ્રાણુથી મુક્તા કરો ? એ વાછરડાની યાચના તો ફર રહી, એની ભાવના-ઈચ્છા જણવાનું પણ તમારી પાસે જ્ઞાન નહિં હતું તો પછી આવી અવસ્થામાં તમે પરમાર્થ કર્યો છે એ કહી જ કેમ શકાય ?

ગાંધીજી આવા હુઃખી પ્રાણીઓને પ્રાણુમુક્ત કરવામાં જે ધર્મ માની રહ્યા છે, તે ન કેવળ પશુપદ્ધિઓને માટે જ. તેઓ તો મનુષ્ય માત્રને કે જેઓ અસાધ્ય રોગોથી પીડાઈ રહ્યા છે, અને જેમને કદાચ ડેક્ટરેચે એવી સલાહ આપી હોય, કે હુવે આ સાંજે નહિં થાય, એ બધા-ઓને યમરાજના અતિથિ બનાવવામાં ધર્મ પ્રરૂપી રહ્યા છે.

‘અહિંસા’ ના અજ્ઞાણુંની પરાકાશા આવી પહેંચી. આ ઉત્કૃષ્ટ (!) ધર્મની સહામે દલીલોની જરૂર છે શું? ભારતવર્ષ અને યૂરોપના દેશોમાં હજારો કે લાખોની સંખ્યામાં રક્તપીત, કુષ અને રાજ્યક્ષમા રોગોથી લોકો પીડાઈ રહ્યા છે, કે જેઓને સાંજ થવાની આશા બિલકુલ રાખવામાં આવતી જ નથી, કેટલાક માથાના દર્દના પણ એવા રોગીઓ હુશે કે ને વર્ષો સુધી દ્વારો કરીને થાક્યા હુશે અને પોતાને રોગ મટવાની આશા છોડી એઠા હુશે, કેટલાક વાયુના ગોળાના પણ એવા રોગીઓ હુશે કે જેઓ રાતદિવસ એનાથી પીડાઈ રહ્યા હુશે, અને કદાચ રોગથી કંટાળી બોલી પણ નાખતા હુશે કે અરેરે, હુવે તો છુદું તો સાડું. આ બધાઓને એક ઝપાટે નાશ, એજ ગાંધીજીના સિદ્ધાન્ત પ્રમાણે ઉત્કૃષ્ટ ધર્મ રહેલો છે. ન કરે નારાયણ, અને ભારતવર્ષના સહભાગ્યે કે દુલાંગ્યે જે ભારતવર્ષને સ્વરાજ્ય પ્રાપ્ત થાય, અને કદાચિત્ પહેલે જ ઝપાટે ગાંધીજી જ ભારતના વિધાતા-નાયક

-નેતા-રાજ બને, તો મને લાગે છે કે આ લાખો હુઃખ્યાઓને હુઃખ્યી નહિ, પરન્તુ પ્રાણુથી સુક્ત કરીને અતૂટ ધર્મનો ખજનો ગાંધીજી ઉપાર્જન કરે. અલિહારી છે આહિંસાતત્ત્વના ઉત્કૃષ્ટ ઉપાસકની !

ગાંધીજીના આ સિદ્ધાન્તનો પ્રચાર થાય તો હું નથી સમજી શક્તો કે જે વખતે એક માણુસ લયંકર બિમાર હુશે તે વખતે તે મરવાનો જ છે, એનો નિર્ણય કોણું કરશે ? ધાર્ણી વખત કોઈ બિમાર મનુષ્યને જોવા માટે ચાર ડાક્ટરો જેગા કરવામાં આવ્યા હોય, તો તે ચારેમાં પણ મતલેદ પડે છે. ત્યારે આવી અવસ્થામાં ખરો મત કોનો માનવો ? ગાંધીજીના સિદ્ધાન્ત પ્રમાણે અતિ લયંકર ભીમારીમાં પીડિત મનુષ્યને માટે જે એમ લાગે કે આ હુવે બચનાર નથી, તો તેને ઠાર કરવો; આ સિદ્ધાન્તનો જે પ્રચાર થાય તો એક લયંકર અનર્થ ઉલ્લો થાય. જે મારશે તે એમ જ કહેશે કે “તે એવો પીડિત હતો-હુઃખી હતો કે તેને જીવવાની આશા જ નહોતી. કદાચિતું એકાદ ડાક્ટરનો અલિપ્રાય પણ મેળવી આપે. પરન્તુ આમાં સાચું શું છે ? એનો નિર્ણય કોણું કરી શકે ? અને આતું પરિણામ પણ કેટલું લયંકર આવે ? વળી ગાંધીજીના આ સિદ્ધાન્તની સહાયે કોઈ એ દલીલ ઉલ્લો કરે કે-તમે જીવતા પ્રાણીને મારવામાં ધર્મ માનો છો, તો અમે એ મરેલ મનુષ્યના શરીરનું લક્ષ્ણ કરવામાં ધર્મ માનીએ

છીએ,” તો તેનો જવાબ ગાંધીજી શો આપશો, તે કંઈ જણાવશો?

ગાંધીજી એક એ દલીલ આપે છે કે—“જેમ ડાક્ટર દરદીના સારાને માટે ઓપરેશન કરે છે, તે અહિંસા-ધર્મ પાપે છે, તેમ મારતાં પણ અહિંસાનું પાલન હોઈ શકે” ગાંધીજી જેવા મહાત્મા આવી નિર્માણ દલીલ આપીને પણ પોતાના મતનું સમર્થન કરવા ચેષ્ટા કરે, એ પરેખંર આશ્ર્ય ઉત્પન્ન કરે છે.

ડાક્ટર ઓપરેશન કરે છે, તે પ્રાણુને બચાવવા માટે, મારવા માટે નહિં, એટલા માટે એનો ધરાદો શુલ છે, અને એ ધરાદાના કારણે તે અહિંસક કહી શકાય, પરન્તુ આપ શ્રીમાનું તો પ્રાણુને કાઢવા માટે સહાય પ્રાણુને મારી નાખવા માટે પીચકારી આપો કે કંઈ આપો, એને ‘અહિંસાનું પાલન’ શી રીતે કહી શકાય, ઐશક, એક અત્યન્ત પીડિત પ્રાણુને એવા ધરાદાથી કંઈ દવા આપો કે તે બિચારો બચી જય, પરન્તુ આચુષ્ય પૂર્ણ થયેલું હોવાથી માની વ્યો કે તે પ્રાણી ન બચ્યું, તો પણ તમે અહિંસા-ધર્મ પાખ્યો છે, એમ કહી શકાય. કારણું કે તમારો ધરાદો મારવાનો નહિં હતો—બચાવવાનો હતો; પરન્તુ મારવાના જ ધરાદાથી જેર આપવું, અને પછી કહેવું કે એમાં પણ ‘અહિંસા ધર્મ’ પળાય છે, એ તો સરાસર હિવસને રાત કહેવા બરાબર જ કહી શકાય.

વળી આત્માને હુઃખુઝુક્તા કરવાની ડાક્ટરની ધારણા અને પ્રાણુ હરણુ કરનારની એક સરખી કહેવામાં આવે છે, તે પણ ઠીક નથી. કારણુ કે-ડાક્ટરનો ઈરાદો એ પ્રાણીને હુઃખુઝુક્તા કરવાનો છે, જ્યારે પ્રાણુ હરણુ કરનારનો ઈરાદો પ્રાણુઝુક્તા કરવાનો છે, કદાચિત એમ કહેવામાં આવે કે પ્રાણુઝુક્તા એટલા માટે કરવામાં આવે છે કે તે હુઃખુઝુક્તા થાય, પરન્તુ એ તો આપણી મનધડંત જૂઠી કદ્વયના છે. કારણુ કે પ્રાણુઝુક્તા કરવાથી એ જીવ, હુઃખુઝુક્તા થયો છે, એવું આપણે શા ઉપરથી જાહી શકીએ? એ જાણવાનું આપણી પાસે કંઈ સાધન જ નથી. અને એ તો પહેલાં જ કહેવામાં આંયું છે અને દરેકની લગભગ અનુભવસિદ્ધ વાત છે કે હજારો હુઃખો એ પ્રાણુરક્ષાની આગળ કંઈ ચીજ જ નથી. દરેક પ્રાણી ગમે તે લોગે પ્રાણુની રક્ષા પહેલાં જ ચાહે છે. જ્યારે એજ પ્રાણુને આપણે ફૂર કરીએ અને એમાં ‘અહિંસા ધર્મ’ માનીએ, એના જેટલી વિપરીતતા ખીજુ કર્ય હોય શકે?

ગાંધીજી એક તત્વજ્ઞાન એ પણ પ્રકાશે છે કે “મૃત્યુદંડનો જે ડર અત્યારે સમાજમાં જોવામાં આવે છે તે અહિંસા ધર્મના પ્રચારમાં લારે બાધા કરનારી વસ્તુ છે.”

એશક, એ વાત ખરી છે કે મૃત્યુનો લય મનુષ્યે ન રાખવો. અને જેઓ પોતાની જિંદગી ધાર્મિક વૃત્તિથી, નૈતિક આચરણથી વ્યતીત કરે છે, અને મૃત્યુનો લય રહેતો

પણ નથી, પરન્તુ એથી એ સિદ્ધાન્ત ન બની શકે કે ગમે તે માણુસ ગમે તેને ગમે તે કારણે ભૂત્યુદંડ આપી શકે? માણુસે પોતે ડેમ વર્તાવું, એ પોતાની મુનસ્પ્રી ઉપર આધાર રાપે છે, પરન્તુ બીજે માણુસ પેલાની હુંબિત અવસ્થામાં એમ સમજુને એને પૂરો કરે કે તે બિચારે હુંખ્થી સુક્ત થાય, તો તે એક લયંકર પાપ જ છે. જે ગાંધીજીને આ સિદ્ધાન્ત સર્વબ્યાપિ થાય તો અરેખર સૃષ્ટિ એ એક બીજાના ખુનોનું કેન્દ્રસ્થાન જ બની જાય, અને સંસારમાં ‘અહિંસા’ જેવી વસ્તુનું નામો નિશાન પણ ન રહે.

ગાંધીજી કહે છે કે “આપણા અવિચાર અને આપણી ભીડતાને લીધે હું તો ડગલે ને પગલે હિંસા થતી જેધ રહ્યો છું.”

આપણી અજ્ઞાનતા, અવિચાર કે ભીડતાના લીધે મનુષ્ય સમાજ કદાચ અનેક હિંસા કરી રહ્યો હો, પરન્તુ હુંખી પ્રાણીઓને પ્રાણુથી સુક્ત કરવાની પ્રવૃત્તિથી, એ હિંસા અટકી જો, એમ શું માનો છો? મનુષ્યસમાજમાં અવિચાર છે, તો તેને સદ્ગ્યારનો માર્ગ બતાવો. મનુષ્યો ભીડ છે, તો તેમને નિર્ભય બનવાના ઉપાયો ચોનાઓ; પરન્તુ મનુષ્યો અવિચાર અને ભીડતાથી ઘણી હિંસા કરે છે, માટે હુંખી પ્રાણીઓને પ્રાણુસુક્ત કરવાની પ્રવૃત્તિ આદરાવવી, એ શું પુરુષાર્થ છે? એ શું સાચો ઉપાય છે?

સંક્ષેપમાં કહીએ તો—“કોઈપણ દીણાતા પ્રાણિને જોઈ તેને પ્રાણુથી મુક્ત કરવામાં ધર્મ છે,” એવો જે સિદ્ધાંત નિશ્ચિત કરવામાં આવે, તો સંસારમાં પ્રત્યાની નોભતો વાગતી નજીક જ સંભળાય ? તળાવ, નહીંએ અને કુવાનાં માછલાં અને હેડકાં બહુ રિખાય છે, કારણુકે મહોટાં પ્રાણીએ એઓને હેરાન કરે છે—ગળી જાય છે, માટે એને પ્રાણુથી મુક્ત કરનાં જોઈએ, આ બધું કેટલું જાય કર પરિણુામ છે, એ સમજવું જરાપણું કહિન નથી.

ગાંધીજીના એજ લેખનું એક પ્રકરણ ‘હિસ્ટોરી ગ્રાણુ હરણ’ નું પણ આપ્યું છે. જેમાં ગાંધીજીના આશ્રમને વાંદરાનો ઉપદ્રવ ત્રાસ આપી રહ્યો છે, અને તેથી ગાંધીજ વિચાર કરી રહ્યા છે કે—આ ઉપદ્રવ શી રીતે ફૂર કરવો ?

બિચારા વાંદરાએ હજુ સુધી ભાગ્યશાળી બની રહ્યા છે કે—જેથી ગાંધીજ પોતે કહે છે તેમ હજુ તેઓ ‘ઉપાય’ શોધવામાં જ પડ્યા છે.

ગાંધીજ પોતાને કૃષિકર તરીકે પણ જહેર કરે છે અને તેથી એમને કદાચ ખખર હશે કે એતી કરનારાએને વાંદરાએનો અને ઝીજા જનવરોનો ઉપદ્રવ વખતો વખત થયા જ કરે છે. આથી પણ આગળ વધીને આગ્રા અને મથુરા વૃદ્ધાવનમાં કદાચ ગાંધીજએ જોયું હશે કે ત્યાંના વાંદરા એઠલા ખધા ચાલાક છે કે પચીસ—પચાસ માણુસની પંગત જમવા એટી હોય, એની વચ્ચમાંથી આ વાંદરા ભાણું પીરસેલું ઉપાડી

જય છે એટલું જ નહિ પરન્તુ દરવાળની સાંકળ ઉધાડીને દરવાળે ખોલી ત્યાંના વાંદરાને મકાનમાં પેસતાં અમે જેયાં છે. આટલા ઉપદ્રવમાં પણ એ શહેરોમાં લાખોની સંખ્યામાં કોકો રહે છે, બ્યવહાર ચલાવી રહ્યા છે અને મથુરા-વંદાવનમાં એટલો ઉપદ્રવ હોવા છતાં લાખો યાત્રાળું એ જય છે. છતાં હજુ સુધી કોઈએ એક વાંદરાને પણ મારવાનો કે મરાવવાનો વિચાર કર્યો નથી.

પૂર્વ દેશ, કે જે ગુજરાતની અપેક્ષાએ ‘અહિંસા’માં નીચો નંબર મેળવે, ત્યાં ન કલ્પી શકાય તેટલો ઉપદ્રવ, હુમેશાંનો હોવા છતાં હજુ સુધી એક પણ વાંદરાને મારવાને કોઈ તૈયાર નથી થયું, જ્યારે અહિંસા પ્રધાન દેશમાં, અમદાવાદ જેવી અહિંસા પ્રધાન નગરીમાં અને ગાંધીજીના આશ્રમ જેવી પવિત્ર ભૂમિમાં વાંદરાએનો થોડાક ઉપદ્રવને માટે ગાંધીજી જેવા મહાત્મા છેવટના પ્રયોગની વાતો અને લાવનાએ કરી રહ્યા છે, એના જેવો અત્યન્ત પાપનો પ્રસંગ ખીલો કર્યો હોઈ શકે ?

ગાંધીજી એ ઉપદ્રવના નિવારણ માટે સલાહ માગે છે. હું કહું છું કે એવી બાખતમાં સલાહ માંગવાનો આડંખર કરવો એજ ગાંધીજી જેવાને માટે શોલાસ્પદ નથી. એમાં મહત્વ જેવું એ શું છે ? જે ગાંધીજીના આશ્રમની એતીને ખરેખર વાંદરાએનો ઉપદ્રવ છે, તો તે વાંદરાએમાંના એકનો પણ નાશ ન થાય, એવી રીતે એક એ કે તેથી વધારે

માણુસો રોકી તે ઉપદ્રવ શાન્ત કરી શકે છે અને તેમ છતાં જો ગાંધીજીને છેવટનો જ ઉપાય લેવાની નોંધત આવે તો તે છેલ્લો ઉપાય વાંદરાઓને મારવાનો નહિં, પરન્તુ પોતાની તે એતીની ભૂમિનો ત્યાગ કરવાનો છે. જંગલમાં આનંદ કરી રહેલાં નિર્દેખ પ્રાણીઓનો સંહાર કરવો, એના કરતાં હું તો કહું કે—કદાચ લાઘોની ઈમારતોનો પણ ત્યાગ કરવાનો પ્રસંગ આવે તોથે શું જોડું છે ? એ બિચારા નિર્દેખ પ્રાણીઓને માટે એટલો પણ લોગ આપવો શું ગાંધીજી જેવાને માટે અશક્ય છે ?

અને જો મનુષ્યોને માટે પણ તે વાંદરા ઉપદ્રવકર્તા થતાં હોય તો છેવટ તે સ્થાનનો પણ થાડી ધણી મુદ્દતને માટે ત્યાગ કરવાથી કાર્યસિદ્ધ થઈ શકે છે. પણ તે બધું ત્યારેજ બની શકશો, જો વાંદરાઓને બચાવવાની દૃષ્ટિ હશે.

આશા છે કે ગાંધીજી ઉપરની બાબતોનો પૂર્ણ વિચાર કરશે, અને પોતે માનેલા ‘અહિંસાત્મક’ ધર્મમાં જે હિંસાનું તત્ત્વ છે એને હર કરી શુદ્ધ અહિંસાધર્મનું પાલન કરવા માટે પ્રયત્ન કરશે.



(૪૫)

અહિસાનું અજીવ્ણ

૨

ગયા અંકમાં આ વિષય ઉપર, ગાંધીજીએ કરેલા વાછ-
રડાના પ્રાણુહરણુ સંખ્યે લખવામાં આવ્યું છે. અહિસાના
ઉપાસક ગાંધીજી, સાક્ષાત્ પ્રાણુહરણુ કરવામાં પણ
અહિસા જોઈ રહ્યા છે, માની રહ્યા છે, અને બીજાએઓ
પાસે મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એના જેવું ‘અહિ-
સાનું અજીવ્ણ’ બીજું કયું હોઈ શકે ?

ગાંધીજીના એ કૃત્ય અને એ વિચારો ઉપર ધણા
ભાઇઓએ ચુક્કિપુરઃસર ધણું લખ્યું. તેમાંથી કૃચિત્

ચુક્તિઓનો જવાબ ગાંધીજી વાળી શક્યા છે. એમણે જે જવાબ વાખ્યા છે, એના પ્રત્યુત્તરો પણ નીકળી ચૂક્યા છે, એ બધું તપાસતાં હવે જનતાને એ સમજવા જેવું નથી રહ્યું કે ગાંધીજીએ, આ પ્રકરણમાં ડેવળ લદ્દનું-આચહનું જ શરણું લીધું છે કે જેમ કરવું ગાંધીજી જેવા આજીવિના ઉપાસકને જરાયે શોલારસપદ ન કહેવાય.

આ દરમીયાન, અમદાવાદમાં એક ઔર નાટક લજવાઈ ગયું; એણે તો ગાંધીજીની અને ગાંધીજીના લક્તોની મનોદશાનું એક સુંદર ચિત્ર ખડું કર્યું.

આપણે સૌ કોઈ જાણીએ છીએ તેમ, ગાંધીજી એટલે આ વીસમી સહીના વિચારસ્વાતંત્ર્યના સાચા પૂજારી. એક અદનામાં અદનો માણુસ પણ પોતાના વિચાર જહેર કરવાને અધિકારી છે, એ તો ગાંધીજીની ઉદ્ઘોષણા. ગાંધીજી પોતાના શિષ્યોને તો જરૂર જ આ તાતીમ આપે છે, એમ કહેવાય છે. પરંતુ ગાંધીજીના ઉપર્યુક્ત અહિંસા સંબંધી વિચારોની વિરુદ્ધમાં અમદાવાદમાં જે સભા કવિવર નહાનાલાલાઈના પ્રમુખપણું નીચે લરાઈ, અને તે પ્રસંગે ગાંધીજીના ચેલાચાપટોએ જે ધાંધલ મચાંયું-કવિવરને નહિં સંલગ્ન માટે સભામાં જે લંગાણુ કર્યું, એ ગાંધીજી અને એમના લક્તોની મનોદશા જાણવા માટે શું ઓછું ઉપયોગી છે? ગાંધીજીના ચેલાએ તે વખતે ભૂલી ગયા લાગે છે કે, આ અમે વિદ્ધ નાખતા નથી, પરંતુ

કાલે ખીજી પ્રસંગે—પોતાના જ પ્રસંગે તેમ કરવાનો પાડ શીખવીએ છીએ. અહિંસાના કહેવાતા આદર્શ (!) ની અહિંસામાં તો આવી આવી કેટલીએ ખૂખીએ રહેલી હશે, એને સામાન્ય જનતા શું સમજ શકે ? અસ્તુ.

આ તો એક પ્રસંગોપાત્ર કથન થયું. આને મારે ખાસ જે કહેવાનું છે તે આ છે.

ગાંધીજી પોતાની લગભગ અધી દલીલોમાં નાકામ્યામ નીવહ્યા છે, એમ હવે દીવા જેવું દેખાયું છે. હવે તેમની એક દલીલ ઉપર ખાસ વધારે વિચાર કરવાનો રહે છે.

ગાંધીજીના કથનમાંથી એક લાવાર્થ એનીકળે છે કે—
“ વાઢુરડાને મારવામાં મારા પરિણ્ણામ હિંસા કરવાના નહિં હતા, માટે મને હિંસાનું પાપ ન લાગે. ”

આ ચુક્તિ ખાસ વિચારવા જેવી છે. ગાંધીજી આ ચુક્તિના સમર્થનમાં કહી શકે કે—“ મનએવ મનુષ્યાં કારણ બન્ધમોક્ષયો: ” બન્ધ અને મોક્ષનું કારણ મન છે અથાત् પ્રત્યેક કિયામાં મનુષ્ય જેવા જેવા મનઃપરિણ્ણામ રાખે છે, તેવા તેવા પ્રકારે તેને કર્મબંધન થાય છે. જૈન પરિલાખામાં કહીએ તો પરિણામે બંધ અર્થાત् જેવા પરિણ્ણામ, તેવા પ્રકારનો બંધ છે. અર્થાત् ગાંધીજીના લાવને સ્પષ્ટ શફ્ટોમાં કહીએ તો ગાંધીજીના કથન પ્રમાણે એમના પરિણ્ણામ મારવાના નહિં હતા, પરન્તુ તેને સુખી કરવાના હતા અથવા

હુઃખથી સુકૃત કરવાના હતા, માટે તેમને હિંસાજન્ય પાપ
ન લાગવું જોઈએ. આ ગાંધીજીનો પૂર્વપક્ષ.

આ વાત ઉપર સ્થિર ચિત્તથી વિચાર કરવો જોઈએ છે.

સંસારમાં જેટલી જેટલી હિંસાએ પ્રવર્તી રહી છે, એ
અધીમાં જે જેવા જઈએ તો કોઈ પણ હિંસામાં ‘હિંસા’
નો અલિપ્રાય ભાગ્યે જ કોઈમાંથી નીકળશે. અર્થાત્ જેટલા
હિંસા કરનારા છે, તે ખધાએનો આંતરિક દરાદો તો
ખીંચે જ કંઈ હોય છે. દાખલા તરીકે—

કસાઈએ પશુહિંસા કરે છે, તેએ એમ ધારીને કરે
છે કે એમે પશુએને મારી ગોશ્ઠ ઉત્પન્ન કરીએ, અને
ગોશ્ઠ ખાવાવાળાએને પૂર્ણ પાડીએ. તેઓનું કામ થશે
અને લેગો લેગો અમારો પણ રોટલો નીકળશે.

ગાંધીજીના સિદ્ધાન્ત પ્રમાણે તો આ લોકેને પણ
હિંસાનું પાપ ન લાગવું જોઈએ? ગાંધીજી આમ માનવાને
તૈયાર છે ખરા?

કદાચ ગાંધીજી આમાં સ્વાર્થબુદ્ધિ બતાવે એટલે કે
કસાઈ લોકેનો પેટ ભરવાનો આમાં સ્વાર્થ રહેલો છે, માટે
વાછરડાની સાથે તે ન ધરી શકે. પરન્તુ વાછરડામાં પણ
ગાંધીજીનો સ્વાર્થ સધાતો હતો, એ વાત ગાંધીજી કેમ ભૂલી
જય છે? વાછરડાનું હુઃખ જ્યાંસુધી જોઈ શક્યા, ત્યાંસુધી
તેને બચાવી રાખ્યો પરન્તુ જ્યારે તેનું હુઃખ ન જોઈ

શક્યા, ત્યારે તેને પીચકારી આપી. હવે હુંખને ન જોઈ શકવું એ પણ સ્વાર્થ નહિં તો બીજું શું છે? તેમ છતાં આપણે, બીજું ઉદાહરણ લઈએ, કે જેમાં એકાન્ત પરે-પકાર ભુદ્ધિજ છે.

યજ્ઞાદિ કિયા પ્રસંગે પશુવધ કરવામાં આવે તેમાં તો કેવળ પશુવધ કરનાર-કરાવનારની એકજ દૃષ્ટિ-એકજ અભિ-બ્રાય હોય છે કે, તે યજ કરનાર અને પશુને સ્વર્ગમાં પહેં-ચાડવાં. પરિણામ પ્રમાણે હિંસા-અહિંસાનું કેળ મળે છે, એમ કહેવામાં આવે તો યજાદિમાં પશુવધ કરનારાએને હિંસા-જન્ય પાપ નજ લાગવું જોઈએ, બલ્કે આવી હિંસા કરનારાએ તો કહે છે કે-અમે હિંસા નથી કરતા, બલ્કે ધર્મનું પાલન કરીએ છીએ. ત્યારે આવાએને ગાંધીજ શો જવાખ આપશે? અને જો આમાં પાપ ન લાગતું હોય, હિંસા ન થતી હોય તો પછી ગાંધીજના સિદ્ધાન્ત પ્રમાણે તો અસ્થ-મેધ, નરમેધ જૌમેધ વિગેરે કરવામાં પણ શી હરકત છે! બસ, મનના પરિણામ સારા હોવા જોઈએ. એ જીવોને સ્વર્ગમાં પહેંચાડવાના પરિણામ હોય તો બસ છે.

અને જો આ સિદ્ધાન્ત સત્યજ સમજવામાં આવે તો તો પછી કાલે કોઈ માણુસ, એક બીજા માણુસનું ખુન કરે, અને પછી કહેશે કે-તે માણુસ બહુ હુષ હતો, ઘણા જીવોને તકલીફ આપ્તો હતો-ત્રાસ આપ્તો હતો, આ માણુસને મારીને મેં હંજરે જીવોને ત્રાસથી બચાવ્યા છે. મારે

અલિપ્રાય આ માણુસની હિંસા કરવાનો નહિં હતો, હજરો જીવોને ત્રાસથી બચાવવાનો હતો. એક કસાઈ રોજ સેંકડો જીવોની હિંસા કરે છે, એક માણુસને એ જીવોને ભરતાં દ્વારી અત્યન્ત દ્યા આવી. ખરેખર દ્યા આવી અને તેણે પેલા કસાઈને ઠાર કર્યો. શું તે માણુસને કસાઈના વધનું પાપ નહિં લાગે ? ગાંધીજીના હિસાએ તો નજ લાગવું જોઈએ. એક વેશ્યા સેંકડો નવયુવકોના જીવનોને—ચારિત્રને પાયમાલ કરી રહી છે. એક માણુસને વિચાર ઉક્ખો કે આ એક હૃદાના કારણે સેંકડો યુવકો પોતાનાં જીવનો નષ્ટ કરી રહ્યા છે. એમ ધારી એ વેશ્યાને ડેકાણે કરી નાંખી. તેના પરિણામ વેશ્યાને મારવાના નહિં હતા, પરન્તુ પેલા યુવકોનાં નષ્ટ થતાં જીવનોને બચાવવાના હતા, તો શું આ વેશ્યાને મારવાનું પાતક એ મારનારને ન લાગે ! ગામમાં ફરતા એક દુષ્ટ દોગીને જોઈને ડેઢ વિચારે કે આ ડોગીયો ગામમાં ફરે છે અને હજરો લોકોને ચેપ લગાડશે, એમ ધારી એને મારી નાખે, એને પણ પાપ તો નજ લાગવું જોઈએ.

આવાં સેંકડો ઉદાહરણો આપી શકાય તેમ છે. ડેઢ પણ જીવને મારતી વખતે મનના પરિણામ ગમે તે હોય, પરન્તુ ગાંધીજીએ સમજી રાખવું જોઈએ છે કે—જો હિંસા છે તે હિંસાજ છે. જે વખતે હિંસા થાય છે, તે કષાય-જન્ય થાય છે. કોધ, માન, માયા, લોલ, રાગ, દેખ એ

પૈકી કોઈને કોઈ ક્ષાયથી હિંસા થાય છે. એટલે એ હિંસા તો હિંસા રહેવાની જ અને જે કેવળ પરિણામ સારા છે, માટે મને પાપ ન લાગે, એટલું માત્ર સમજી રાખીને સિદ્ધાન્ત નિશ્ચિત કરવામાં આવે તો આજે જગતમાંથી ‘હિંસા’ નો શાખ જ ઉડી જાય. હિંસા જેવી કોઈ વસ્તુ છે અને એનાથી પાપ લાગે છે, એમ કોઈ સમજે જ નહિં. કોઈના કાયદાઓ અને વ્યવહારનાં નિયમો ઉપર પણ હડતાલ જ દેવી પડે અને એ હિંસકના અભિપ્રાય પ્રમાણે કોઈને હિંસા લાગે પણ નહિં.

ખૂબ સ્મરણુમાં રાખવાનું છે કે બંધ અને મોક્ષનું કારણું મન છે; કિંवા પરિણામે બંધ થાય છે, એ બિલકુલ સહી વાત છે. એમાં જરા પણ કુરુક નથી. માણુસના પરિણામ-અભિપ્રાય ગમે તે હોય, પરન્તુ ‘હિંસા’ એ તો હિંસાનાં પરિણામથી જ થાય છે, એમાં કોઈથી ના પાડી શકાય તેમ નથી. પ્રમાદાત્ પ્રાણવ્યપરોપણ હિંસા । પ્રમાદથી પ્રાણુનો નાશ કરવો, એનું નામ હિંસા છે. હિંસા કરતી વખતે જે કોઈને કોઈ પ્રમાદ હોય તો હિંસા અવશ્ય લાગે છે. પ્રમાદ આ છે:-પ્રમાદ: સ્મર્ત્યનવસ્થાનં કુશલેષ્વનાદરો યોગદુર્ઘણિધાનં ચैષ પ્રમાદ: । (તત્ત્વાર્થાધિગમભાષ્ય અ. ૮, સ્લ. ૧)

સ્મૃતિનું વિસ્મરણુ-અવ્યવસ્થિતપણું, સમુચ્ચિત કાર્યનો અનાદર, મન-વચન-કાયાના ચોગનું વૈપરીત્ય એ પ્રમાદ છે. કોઈ પણ જીવને મારતી વખતે આ પૈકીનો કોઈને કોઈ

પ્રમાદ તો અવશ્ય હોય જ. આમાંની કોઈપણ એક ખાખત સિવાય જીવને ઈરાદા પૂર્વક મારી શકાયજ નહિ.

આજ પ્રમાદના જુહી રીતે પણ પાંચ લેદ અતાવવામાં આંધ્યા છે.

મજ્જ વિસયકસાયા

નિદ્રા વિગ્રહ ય પંચમી ભળિયા

એ પદ્મ પમાયા

જીવં પાડેન્નિ સંસારે ॥

(ચોગશાસ્ક-૩ ને પ્રકાશ)

મહિરા, વિષય (પંચેન્દ્રિયના ત્રૈવીશ વિષયો), ઉધાર્ય (કોધ, માન, માયા, લોલ), નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદો જીવને સંસારમાં પાડે છે—સંસાર પરિભ્રમણ કરાવે છે.

કોણું કહી શકે તેમ છે કે ઈરાદા પૂર્વક-જાહીને જ કોઈ પણ જીવને મારનાર આ પાંચ પ્રકારના પ્રમાદોમાંથી કોઈપણ પ્રમાદને નથી સેવતો ? અને જ્યાં પ્રમાદ છે—અર્થાતું પ્રમાદથી પ્રાણુનો નાશ છે, ત્યાં હિસા અવશ્ય છે.

દુંકામાં કહીએ તો, કોઈપણ જીવને મારવાની બુદ્ધિથી મારવો, એમાં હિંસા જરૂર છે. ગાંધીજીએ વાઇરડને માર્યો, તે મારવાની બુદ્ધિથી—ઈરાદા પૂર્વક જ માર્યો છે. એ તો નિશ્ચય છે. અનિચ્છાથી—આકસ્મિક પ્રાણવધ નથી થયેલો.

અને તેથી તેઓને હિંસાજન્ય પાપ અવશ્ય લાગ્યું કહી શકાય. હા, ગાંધીજી ‘પરિણામે બંધ’ કે ‘મારો ઈરાદો સુખ દેવાનો હતો’ એવું તો ત્યારે કહી શકે અને એનો આક્રય ત્યારે લઈ શકે કે—ગાંધીજી વાછરડાની જૂબ સેવા શુદ્ધિષા કરી રહ્યા હોય, અને એને જીવાડવા માટેના ઉપચારો—દ્વારાઓ વિગેરે કરી રહ્યા હોય, પરન્તુ અક્ષમાત વાછરડો મરી જાય, અને એ દ્વાનું ઉલદું પરિણામ આવ્યું હોય તે વખતે તે કહી શકે કે “મારો ઈરાદો મારવાનો નહિં હતો.” એક સભ્ય બીમાર માણુસને અચાવવાને માટે ડાક્ટર ઓપરેશન કરી રહ્યા છે. અનવા જોગે એજ ઓપરેશનમાં તે માણુસ મરી ગયો. ડાક્ટર જરૂર કહી શકે કે—શું કરું? હું તો સારાને માટે ઓપરેશન કરી રહ્યો હતો, પરન્તુ એનું આચુષ્ય નહિં ત્યાં હું શું કરું મારો મારવાનો અભિપ્રાય નહિં હતો. એક માણુસ પોતાના ભિત્રને લાં ગયો છે. પોતાના ભિત્રના નહાના બાળકને તે હૃદથી રમાડી રહ્યો છે. અક્ષમાત છોકરો હુથમાંથી પડી ગયો અને મરી ગયો. તે વખતે તે કહી શકે કે—શું કરું, હું રમાડતો હતો ને અક્ષમાત પડી ગયો ને મરી ગયો. મારા મારવાના પરિણામ નહિં હતા. (જે કે અહિં રમાડવામાં વધારે ઉપયોગ નહિં રાખ્યો, એટલો પ્રમાણ જરૂર ગણુાય અને એટલા પ્રમાણ પુરતુ પ્રાયશ્રિત્ત કહેવાય, પરન્તુ મનુષ્યનું ખુન કયાંતું તો પાપ ન જ લાગે.) જૈન સાધુઓ આહાર વિહારાદિ કરે છે,

સૂત્રોની આજા પ્રમાણે—ઉપરોગપૂર્વક—વિધિપૂર્વક ભ્રમણુ કરે, આવી અવસ્થામાં પણ કદાચિત્ એમના પગથી કોઈ જીવની વિરાધના થઈ જાય, તો તેઓ કહી શકે કે—“ શું કરું, ઉપરોગ પૂર્વક ચાલતો હતો, પરન્તુ અક્ષમાત્—અનુપરોગથી વિરાધના થઈ ગઈ. મારો ઈરાદો એ જીવને મારવાનો—હુઃખી કરવાનો નહિં હતો” પરન્તુ જે ઈરાદાપૂર્વક જ કોઈ જીવનો વધુ કરી રહ્યો છે, અને કહે છે કે—‘ મારા પરિણામ મારવાના નથી. હિંસા કરવાના નથી.’ તો તે એક પ્રકારનો વહ્તો વ્યાધાત, એટો ભ્રમ અથવા શાખિક છલ નહિં તો ખીજું શું કહેવાચ ? ગાંધીજી વાઢરડાના શરીરાન્ત પછીના સુખનો અભિપ્રાય જણાય છે, પરન્તુ એ તો પહેલા લેખમાંજ અતાવવામાં આવ્યું છે કે વાઢરડો આ શરીર છોડ્યા પછીની અવસ્થામાં આથી વધારે સુખી થશો, એમ નિશ્ચિત રૂપે ગાંધીજી કે કોઈપણ શી રીતે કહી શકે તેમ છે ? કારણુ કે ગાંધીજી પોતે એ વાત સ્વીકારે છે કે—મનુષ્યનું જ્ઞાન, એ મર્યાદિત જ્ઞાન છે. આવી અવસ્થામાં, પ્રત્યક્ષ અનુભવમાં પણ આપણે ઘણ્ણી વખત એટા પડીએ છીએ તો પછી પરોક્ષ—આગામિ જુંદગીના સુખ હુઃખની કદ્વના કરવી, એ નરી અજ્ઞાનતા નહિં તો ખીજું શું છે ? અને આવી આવી આવી કદ્વનાએ કરીને જે હિંસાએ કરવામાં આવે, તો તો પછી ઉપર આપેલાં અનેક દૃષ્ટાન્તોના પ્રસંગોમાં કોઈને પણ હિંસા ન જ લાગવી જોઈએ; પરન્તુ આ માન્યતા ખરેખર

ભૂતલરેલી છે. પરિણામ પ્રમાણે હિંસાનો બંધ તો ત્યારે ન પડે, કે જ્યારે ઈરાદાપૂર્વક કોઈ જીવને દુઃખ અપાતું ન હોય-જીવવધ થતો ન હોય, પરન્તુ એમાંથી આકસ્મિક કંઈ વધ થઈ જાય. આસ ઈરાદાપૂર્વક-મારવાની બુદ્ધિથીજ મારી રહ્યા હોઈએ, અને પછી કહીએ કે મને હિંસાનો બંધ નથી, એ તો ખરેખરી અજ્ઞાનતા છે.

આશા છે કે-આટલા વિવેચન પછી ગાંધીજી ‘પરિણામે બંધ’ અથવા ‘અભિપ્રાય પ્રમાણે ફેલ’ના સિદ્ધાન્તને અરાખર સમજુ પોતાના વિચારો ફેરવશો.



(४६)

“भिक्षुको भिक्षुकं दृष्ट्वा”

क्षेवतो ए प्रवृत्ति-व्यवहारनुं प्रतिभिं अ छे. सारा अने
नरसा व्यवहारे। उपरथी-आचरणे। उपरथी, तदनुदूषा क्षेवतो
पडे छे. आवी सेंकडे-हजारे। क्षेवतोमांनी आ पण् छे:-

“ भिक्षुको भिक्षुकं दृष्ट्वा शानवत् धुर्घरायते.”

एक शेरीनुं कुतइं खीज शेरीना नवा कूतराने हेए,
एटले धुरकीयां करे. ऐनी माझक एक लिक्षुक खीज लिक्षुकने
ज्ञाए, एटले धुरकीयां करे. लिक्षुकेनां आपसनां धुरकीयां
जेहने ज केहि कविने आ प्रभाणे कथन करवुं पडयुं हशे.

આપણે લાંખા સમયને ભૂલી જઈએ તો પણ, આપણી સહમતીજ એવો સમય જરૂર પસાર થયો છે અને કોઈ સ્થળે હજુ પણ પસાર થઈ રહ્યો છે, કે જેમાં આપણે ઉપરની કહેવતની જાંખી કરી રહ્યા હતા, અથવા કરી રહ્યા છીએ.

ભારતવર્ષમાં લિક્ષુકે તરીકે આપણે એ વર્ગને લઈ શકીએ. ખ્રાણણો અને સાધુઓ, ખ્રાણણ, કે જે ચાર વર્ણમાં સર્વેતૃપ્ત વર્ણ—પ્રથમ નંણરનો વર્ણ કહેવાય છે, એએને માટે, એમની વરતણું કેને અનુરૂપ અનેક કહેવતો અને અનેક કથાઓ પ્રચલિત થઈ ગઈ છે, એ કોઈથી અજ્ઞાણી નથી. આમ થવાનું કારણ એજ કે, ખ્રાણણ, કે જેએનું કાર્ય, કેવળ પઠન-પઠનાદિ હતું, અને જેએ વેદ-વેદાદિના અધ્યયનપૂર્વક લોકોને સન્માર્ગ ઉપર લાવતા હતા, તેએએ પોતાનું કાર્ય છોડી દીધું અને નહિં કરવાનાં કામો કરવા લાગ્યા. ખ્રાણણ કે જેએને માટે કહેવામાં આવ્યું છે:—

યે શાન્તદાન્તા: શ્રુતિપૂર્ણકર્ણા

જિતેન્દ્રિયા: પ્રાણિવધાન્ત્રિવૃત્તા: ।

પ્રતિગ્રહે સંકુચિતાગ્રહસ્તા—

સ્તે બ્રાહ્મણાસ્તારયિતું સમર્થાઃ ॥

જેએ શાન્ત, દાન્ત, અને શાસ્ત્રોથી પૂર્ણ કાનવળા છે, જિતેન્દ્રિય છે અને પ્રાણિએના વધથી-જીવ હિંસાથી

નિવૃત્ત છે, તેમ જેએ દાન લેવામાં બિલકુલ સંકુચિત હાથવાળા છે, તે પ્રાક્ષણો તારવાને સમર્થ છે.

શ્રુતિયો અને સમૃતિયો તો પ્રાક્ષણોનાં આ લક્ષણ અને આ કાર્યો બતાવે, જ્યારે બન્યું તેથી ઉલ્લંઘન.

દાન લેવું—ભિક્ષાવૃત્તિ કરવી, એ તો પ્રાક્ષણોનું પ્રધાન કાર્ય બન્યું. છેવટે એમાં સફુળતા ન મળી, અને પાસે વિદ્યા નહીં, એટલે હુલકામાં હુલકા ધંધા પણ પ્રાક્ષણો કરવા લાગ્યા.

ઓને વર્ગ લિક્ષુક તરીકે સાધુઓનો છે. હિંદુ કે જૈન, ઔધ કે મોહમીદન-તમામ જાતના સાધુઓ ભિક્ષાવૃત્તિ ઉપર નિર્વાહ કરે છે. આવા લિક્ષુકોની સંખ્યા વસ્તીની ગાણ્યતરી પ્રમાણે પર લાખથી વધીને જરૂર લાખની થઈ છે. ત્રીસ કરેાડ મનુષ્યો ઉપર જરૂર લાખ સાધુઓ ગુરુ હેવાનો દાવો કરે છે. ગુરુ એટલે સમાજના તારણુહાર, ગુરુ એટલે ગૃહસ્થાને એમના ધર્મનું ભાન કરાવનાર ઉપદેશક, ગુરુ એટલે ત્યાગની મૂર્તિ, ગુરુ એટલે નિસ્પૃહતાનો નમૂનો. આવો ત્યાગી-નિઃસ્પૃહ વર્ગ જનતા પર કેટલો બધો ઉપકાર કરી શકે. પરન્તુ આખા દેશમાં જ્યાં જ્યો લ્યાં એજ ધ્વનિ સંલગ્નાધ રહ્યો છે કે સાધુઓ-લિક્ષુકો લારતનું અજ્ઞ હરામ કરી રહ્યા છે. આમ એક સરખો પોકાર ઉઠવામાં કંઈક કારણ જરૂર હુશો. જરા જ્યો અચોધ્યા, ખનારસ, ગયા વિગેરે સ્થાનોને. એજ ત્યાગી અને નિઃસ્પૃહ, એજ ઉપદેશક અને તારણુહાર સાધુઓ હાથીયો, ઘોડા, મહેલો, મકાનાતો વિગેરે

મિશ્રકો મિશ્રકં દૃષ્ટવા.

રાજા-મહારાજાએના ઠડો લોગવી રહ્યા છે. કરોડોની મિલ-કર્તો ધરાવી રહ્યા છે. મોટરો અને ગાડીઓમાં મોજે કરી રહ્યા છે. દોજ ‘ બત્રીસ-સોજન અને તેત્રીસ શાક ’ ની કહેવતોને ચરિતાર્થ કરી રહ્યા છે. આપસમાં ધુરકાધુરકીએ કરી રહ્યા છે. સ્થીએ અને પૈસા માટે. અને છતાં કહેરાવી રહ્યા છે કે-અમે સાધુ છીએ, અમે ગુરુ છીએ, અમે લિક્ષુક છીએ.

આવી સ્થિતિમાં નરી આંખે જેનારી જનતા એમ કહે કે “સાધુએ દેશને ભારભૂત છે, મિશ્રકો મિશ્રકં દૃષ્ટવા શાનવત્ બુર્ઘુરાયતે ” તો તેમાં નવાઈ જેવું શું છે ?

પરંતુ સમય પલટાણો છે. જમાનાએ એ શાનવત્ ધુર્ધ-રાયમાન થનારા લિક્ષુકો-સાધુએ અને પ્રાક્ષણોની પણ આંખો ઉધાડી છે. જમાનાએ એમના કર્તાંથતું ભાન કરાવવાની સાન એમને આપી છે. એ લિક્ષુકો અને પ્રાક્ષણો ચેત્યા છે. અને પોતાની પ્રાચીન પદ્ધતિ, પોતાના રીત રિવાજો, પોતાની પ્રણાલિકાઓમાં ફેરફારો કરવા લાગ્યા છે, એટલું જ નહિં પરંતુ જે લિક્ષુકો-સાધુએ અને પ્રાક્ષણો-એક ખીજને જોઈ ધુરકીયાં કરતા હતા, એક ખીજને તિરસ્કાર કરતા હતા, એક ખીજને રોટલો છીનવી લેવા પ્રયત્ન કરતા હતા, તેએ એક ખીજની પાસે બેસવાની નોખત ઉપર આવ્યા છે. વિચારોની લેણ દેણ કરવા સુધીની પરિસ્થિતિએ પહોંચ્યા છે. એ આ જમાનાનો પ્રલાવ નહિં તો ખીજું શું છે ?

ગત વર્ષમાં જ્વાલીયર રાજ્ય તરફથી માઝીદારોની કોન્ફરન્સ જ્વાલીઅરમાં ભણેલી, તે વખતે કેટલાક શાંકરાચાર્યો અને મહોટા મહોટા સાધુ સંન્યાસીએ! તે કોન્ફરન્સમાં હાજર થયેલા, અને એ મારીદારોમાં શિક્ષાનો પ્રચાર શી રીતે થાય ? એ સંબંધી પરસ્પર વિચારોની લેણુ દેણુ કરી, જ્વાલીયર રાજ્ય તરફથી શિવપુરીમાં મારીદારોના છોકરાએ માટે એક અભ્યાસયોજન ખોલવું, એવો નિર્ણય કરેલો.

થોડા વખતને માટે માની લઈએ કે આ બધા ચક્રવર્ત્તીએ (શાંકરાચાર્યો અને મહાધિપતિએ) રાજ્યની દૃષ્ટિ નીચે કોન્ફરન્સ લરાએલી, તેથી કદાચ એકપીઠ ઉપર સાથે એઠાં હશે, પરન્તુ હમણું બનારસમાં અભિલાષારતવર્ષીય ખ્રાલણું કોન્ફરન્સ લરાઈ, એણે તો ખરેખર બ્રાહ્મગો બ્રાહ્મણ દૃષ્ટવા અથવા મિશ્રું દૃષ્ટવા શાનવત્ર હુંબુરાયતે એ કહેવતને સર્વથા જૂઠી ઠરાવી છે.

ઉપર્યુક્ત “ અભિલાષારતવર્ષીય ખ્રાલણ મહાસમ્મેલન ” આસો વદ ૧ થી આસો વદ ૧૧ સુધી મળ્યું. તેમાં પ્રારંભના ૮ દિવસો સુધી સભામાં પાસ કરવાના વિષય ઉપર ચર્ચાએ જ કરવામાં આવી, અને છેલ્લા ત્રણ દિવસોમાં ઠરાવો થયા. આ મહાસમ્મેલન, કેવળ કોઈપણ એક જ પ્રકારની ઉપાસના કરવારા ખ્રાલણોનું ન હતું. એલકે ભારતવર્ષમાં હુયાતિ ધરાવતી તમામ જાતના ખ્રાલણોનું આ સંમેલન હતું, આ સંમેલનમાં

न केवण आक्षण्णोऽज, परन्तु शुद्धि, विधवा विवाह, अने
अधुतोऽहार विग्रे अगत्यना प्रश्नोपर विचार करवा भाटे
जुही जुही भीडेना अधिपति शंकराचार्यो, वहललसंप्रदायना
वहललाचार्य श्रीनाथलभहाराज, गोकुलनाथल भहाराज,
रामानुज संप्रदायना कांचीभठाधीश्वर प्रतिष्ठादी लयकर
श्री अनंताचार्यल, आम जुहा जुहा सम्प्रदायना जुहा
जुहा आचार्यो ऐकत्रित थया हुता. ते उपरान्त आक्षण्ण
सम्प्रदायना जुहा जुहा नेताओये पछु आसपासना समस्त
मतलेहोने भाज्ञाए मूळी उत्साहथी भाग लीघो हुतो अने
ते अध्यायोना सिरमोर तरीके कारीनरेश, अने दरलंगा-
नरेशो पछु भाग लाई आ सम्मेलनने सर्वतोलावे सङ्ग
यनावथा प्रथत्न कर्यो हुतो.

आक्षण्णोना आ सम्मेलने कया कया ठरावो कर्यो, अने
तेनो अमल कयां सुधी थशो, ते संभांधी भारे अहिं कंक
पणु कडेवानुं नथी. भात्र हुं तो ऐटलुं ज बताववा ईच्छुं
कुं के जे धर्माचार्यो भालहार छे, पैसो टको राखे छे, मोटरो
अने ट्रोनेभां ऐसे छे, अने पोतपोतानी गाहीयोना अधि-
पत्यने लोगवतां भीज्ञाने पोताथी नीचा पदना समजे
छे, ते धर्माचार्यो-लिक्षुको पणु पोताना सेंकडो मतलेहोने
भूली ऐकत्र थया. हिंदुधर्मनी रक्षाना अगत्यना प्रैनो भाटे
विचारोनी लेणुदेणु करवा ऐकत्रित थया. आसनेनी उच-
नीचनी तुच्छ भावनाने फेशवटो हर्छ साथे ऐठा. ते आक्षण्णो,

જેમના માટે બાર પૂરણીયા ને તેર ચોકાની કહેવતો પ્રચલિત છે, જેઓ ડેવળ એક એ કે ત્રણ તિલક અથવા આડા કે ઉભા તિલકના નિમિત્તે એક ધીજની સહામે ધુરકીયા કર્યા વિના રહેતા નથી, જેઓ ‘સીતારામ’ અને ‘રાધેકૃષ્ણ’ ના શબ્દો માત્રમાં ગંગાના તીરે ગજખના ચુંદો કરે છે, તે આધ્યાત્મા પણ પોતાના ધર્મની રક્ષા માટે એકત્ર થયા. અગ્રી-યાર દિવસ લેગા એસી ચોક્કસ પ્રશ્ને ઉપર વિચારો કર્યા અને જગતને અતાવી આપ્યું કે—બ્રાહ્મણો બ્રાહ્મણ દૃષ્ટવા અથવા મિક્ષું મિક્ષું દૃષ્ટવા શાનવત્ ધુર્ઘારાયતે એ પુરાણી કહેવત ઉપર હુવે હુડતાલ મારો. એ કહેવતને ભૂલી જાઓ. લિન્ન-લિન્ન ઉપાસનાઓ કરવા છતાં, લિન્નલિન્ન પ્રકારનાં તિલકો કરવા છતાં, લિન્નલિન્ન કિયાઓ કરવા છતાં હિંદુ તરીકે—હિંદુધર્મના અનુયાયી તરીકે અમે બધાં એક છીએ, અને એ ધર્મની રક્ષા માટે ગમે ત્યારે પણ અમે લેગા મળીને વિચાર કરી શકીયે છીએ.

હુવે આવો નૈન લિક્ષુકો તરફ. એ તો હું પહેલાં અતાવી ચૂક્યો છું કે આધ્યાત્મા એ જેમ નામનાજ આધ્યાત્મા છે. તેમ હિંદુ લિક્ષુકો—સાધુઓ પણ નામનાજ સાધુઓ છે. ધર્મ લાગે ગૃહસ્થોનાં આચરણો તેઓમાં છે, છતાં તેઓ સાધુ—ગુરુ ગણ્યાય છે. અને લાખો હિંદુઓ તેમને માને છે—પૂજે છે. જ્યારે નૈન સાધુઓ—નૈન લિક્ષુકો તો સાચા લિક્ષુકો છે. હું વખતો વખત કહેતો આવ્યો છું તેમ, આજે

ભારતવર્ષમાં જૈન લિક્ષુકે—જૈન સાધુઓઝ સાચા સાધુ—સાચા લિક્ષુક રહ્યા છે કે—જેએ ભારતવર્ષની પચીસસે વર્ષ ઉપરની સાધુતાને—લિક્ષુકતાને જળવી રહ્યા છે. કંચન—કામિનીના પ્રલોલનોમાં આજે લગલગ આપા જગતના સાધુઓ હણુપણુ તેનાથી સર્વથા વિરક્ત બની રહ્યા છે. પચનપચનાદિ કિયાઓ, કે જે સમસ્ત સાધુઓને માટે સર્વથા વજ્ય છે તે કિયાઓમાં લગલગ સમસ્ત લિક્ષુકવર્ગ લિમ બન્યો છે, લારે જૈન સાધુઓ અધિ, પાણી, ઇલ, કૂલ વિગેરે સચિત દ્રવ્યના સ્પર્શ માત્રથી પણ સર્વથા ફર રહે છે. એટલું જ નહિં પરન્તુ પરિમિત વસ્તોને રાખવાં, લુંચનાદિ કષેને સહન કરવાં, આ બધી પ્રાચીન લાવના—પ્રાચીન કિયાઓ જાગતી—જીવતી જૈન સાધુઓના જીવનમાં દૃષ્ટિગોચર થાય છે. અને લિક્ષુક એટલે મૈધ્યમાત્રોપજીવિનઃ એ, લિક્ષુકના અર્થને ખરેખરી રીતે સાર્થક કરી રહ્યા હોય તો તે જૈન સાધુઓ છે. આવા ત્યાણી—વૈરાણી નિઃસ્પૃહ સાધુઓ હણુ સુધી ચોતાનું સર્વમેલન નથી કરી શક્યા, એ કેટલો ઘેઢનો અને આશ્રયનો વિષય છે ? રાણી સાધુઓ આપસમાં મળો—વિચારોની લેણુદેણુ કરે, જ્યારે ત્યાણી સાધુઓ આવા જાગતા જીવતા જમાનામાં પણ મિશ્રકો મિશ્રકં દૃષ્ટવા ની કહેવતને ચરિતાર્થ કરતા જેવાય, એ શું એ ત્યાણીઓ માટે ઉચિત છે ? શું એછું શરમાવનારું છે ? શાસનના શુલેચ્છકો પૂછી રહ્યા છે કે— અમારા ત્યાણીઓમાં એવી કઈ બાબત આવીને પડી છે કે જેથી તેઓ લેગા મળવામાં આઠલો

વિલંબ કરી રહ્યા છે? મહોટા મહોટા સિંહાસનો ઉપર એસી ‘ખડે જાઓ મહેરખાન’ ની નેકી પોકરવાળા તો આસનોની ઉચ્ચાઈ—નીચાઈનું ભમત્વ મૂડી એક બીજને સાથે મળે અને વિચારોની લેન હેન કરે, ત્યારે સવા હાથના કાંખળીના દુકડા ઉપર એસી જમીન ઉપર ત્યાગ વૃત્તિનો પાઠ શીખવનારા ત્યાગોઓ, એ રાગોઓ કરતાં પણ વધારે ભમત્વમાં સુંઝાય, એના જેવી કમનસીખી બીજુ કષ્ટ હોએ શકે?

આને આખીએ જૈન સમાજ સમક્ષ કેટલા અગત્યના પ્રક્ષો ઉપસ્થિત થયા છે, એ કોણથી અનણ્યા છે શું? લાઇ મહાસુખભાઈ ચુનીલાલે પ્રામાણિક વ્યાંકડાઓથી બતાવી આપ્યું છે તેમ, પ્રત્યેક વર્ષમાં આડ આડ હજર જૈનધર્મ પાળનારાઓ ઘટતાજ રહ્યા છે. ન કેવળ છેલ્લાં પાંચ દસ વર્ષમાંજ ઘટ્યા છે, પરન્તુ છેલ્લા ત્રણુસો વર્ષનો ધૃતિહાસ તપાસતાં સ્પષ્ટ માલૂમ પડે છે કે—ત્રણુસો વર્ષથી આડ આડ હજરની સંખ્યા પ્રતિવર્ષ ઘટતાં ઘટતાં આને સાડા અગ્નિયાર લાખ જેટલી સંખ્યા રહી છે. આ ઘટતીનાં સાચાં કારણો શોધી, એ ઘટતી અટકાવવાના અને જૈન ધર્મોની સંખ્યા વધારવાના ચાંપતા ઈલાજે લેવાની આવશ્યકતા શું નથી? શું જૈન સાધુઓ કે જેઓ મહાવીરના વડા પુત્રો હેલાવાનો દાવો કરી મહાવીરને નામે પોતાની ઓલાખોલા ઓલાવી રહ્યા છે, એમણે એકત્રિત મળીને આ પ્રક્ષ વિચારવો જરૂરનો નથી? આવી જ રીતે જૈન સમાજના ચુવકોમાંથી દિવસે દિવસે ધાર્મિક

ભાવના શા માટે ધરી રહી છે ? જૈન સમાજમાં કેવી કંપ-વણીનો પ્રચાર કરવો આવશ્યક છે ? જૈન સમાજના યુવકોમાં શારીરિક ખળ કેળવવા માટે શાં શાં પગવાં લેવાં જરૂરનાં છે ? જે જાતિભેદ અને વાડાઓના કારણે જૈનધર્મ પણનારાઓ પણ દૂર થઈ રહ્યા છે, તે કયાં સુધી ઉચિત છે ? જૈન સમાજમાં વિધવાઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી રહી છે, તેનું મૂળ કારણ શું ? અને તે અટકાવવા સમાજે શું કરવું જોઈએ ? જૈન તીર્થી ઉપર દિવસે દિવસે ધાડો પડતી જ રહી છે, અને કેટલાંક તીર્થી તો અત્યારે જદાનાં પ્રધાન સ્થાન જની રહ્યાં છે, એ તીર્થીની રક્ષા માટે શું કરવું આવશ્યક છે ? જૈન સમાજમાં બેકારી વધતી રહી છે, ગરીબાઈ વધી રહી છે, અને એ ગરીબાઈના કારણે ધર્મનો ત્યાગ આદિ અનેક આનંદ પરિણામો આવે છે, તો એને માટે શું કરવું જોઈએ ? અન્યે વર્ગમાંથી જૈનધર્મમાં આવનારાઓ માટે કેટલી દ્રોષો અપાવી જોઈએ ?

આ ખંધા પ્રશ્નો શું એછા અગત્યના છે ? શું જૈન સાધુએ કે જેએ સમાજના તારણુહાર છે, તેએએ આ પ્રેરનો વિચારવા જરૂરના નથી ? પરન્તુ આવા અગત્યના પ્રશ્નોનો વિચાર, જયાં સુધી સાધુએ એકત્રિત મળી ન કરે, ત્યાં સુધી તેનો સફળમાર્ગ કંઈ લઈ શકાય જ નહિં. અત્યારે તો કોઈ સાધુ એક પ્રશ્ન માટે કંઈ વિચાર કરે છે તો ખીંચે સાધુ તે વિચારોની રહાએ થાય છે, અને તેને તોડ-

વાને માટે જ લરસક કોશીશ કરે છે. આ શાનવત્ બુરુંરાયતે, નહિ તો થીજું શું છે ?

ત્યાગીએને માટે આ ખરેખર શરમાવનારી બીના છે. જગતના રાગીએ ચેતે, અને ત્યાગીએ, હજુ ઔદ્ધભી સહીમાં લુચે એ તો ખરેખર ભારે હુંખનો વિષય કહેવાય ?

આ પ્રસંગે મારે એ પણ જણાવવું જોઈએ કે જ્યાં સુધી આ વિષયમાં હું વિચાર કરી શક્યો છું, આવા ત્યાગી મુનિએ-લિક્ષુકો-જૈન સાધુએ એકત્રિત મળતા નથી, મુનિ સર્વમેલન કરતા નથી, એમાં કેટલેક અંશે વિદ્ધભૂત ગૃહસ્થો જ છે. કેટલાક ગૃહસ્થોએ, કેટલાક સાધુએન્નાં આગેવાન સાધુએને પોતાના રમકડા બનાવી રાખ્યા છે, એ મહારિયો નેમ નેમ દોરી હલાવે તેમ તેમ તે સાધુએએ વર્તાવું જ જોઈએ. બીજા શાણદામાં કહીએ તો ખુશામતપ્રિય એ વીતરાગના સાધુએ પણ ગૃહસ્થોને એવા આધીન બન્યા છે કે-એમની આજા સિવાય ચ્યાં પણ ન કરી શકે ? અફ્સોસ છે આવી ત્યાગવૃત્તિ પર ! મહાવીરના વેષમાં-નિર્ઝય વેષમાં-ત્યાગીના વેષમાં આવવા છતાં આવી પરાધીનતા !

અને એ ગૃહસ્થોએ પણ વિચારવું જોઈએ છે કે જો તેઓ એ સાધુએના ચારિત્ર ઉપર જ રાગી છે, તો એમનું કર્તાય છે કે-એ સાધુએને વિનયપૂર્વક પણ સત્ય હકીકત સમજવી શાસનહિતનાં કાર્યોમાં-સમાજની ભલાઈના કાર્યોમાં

અત્રેસર થવા પ્રેરણું કરવી. ખરી વાત તો એ છે કે-અને મારો તો લગભગ ૬૬ વિશ્વાસ થઈ ગયો. છે કે જે ગૃહસ્થોએ ચોક્કસ સાધુઓને પોતાના વાડાના સાધુ ન ખનાયા હત, અને એ ગૃહસ્થોએ સાધુઓને શાસનના લદાની ખાતર પણ, ભક્તિપૂર્વક સાચી હકીકતો સમજવી હત-કહી હત, તો આજે સમાજની આ દશા કદિ ન થાત. આજ નહિં પરન્તુ વર્ષો પહેલાં આપણે ‘મુનિ સમ્મેલન’ જેવા લાગ્યશાળી થયા હત અને સમાજના જે વિકટ પ્રશ્નો, અત્યારે વધારે વિકટ થતા આપણે જોઈએ છીએ, તે પ્રશ્નો-માંના ઘણું ખરા તો આપણે કયારનાએ હલ કરી શક્યા હત. પરન્તુ સમાજની કમનસીધી છે કે-જેના ઉપર-જેના દ્વાર ઉપર સમાજનો આધાર છે, તેઓ પોતે અત્યારે જબરદસ્ત નવ્યાણના ફેરમાં પડેલા છે. અને એ તો નક્કી છે કે જે સમાજના નેતાઓ ખાડામાં છે, એ આપીયે સમાજ ખાડામાં છે.

માટે મુનિરાજો, આચાર્યો, ઉપાધ્યાયો ચેતો ! સમાજના લદાની ખાતર ચેતો ! બીજાનું હેખીને પણ ચેતો ! શરમની ખાતર પણ ચેતો અને સંગઠન કરો ! બહેલાં કે મોડાં મરવું તો જરૂર છે. પણ કંઈક કરીને મરો. નામ અમર કરીને મરો. શાસનનો વિજ્યદકો વગાડીને મરો ! હજરો કે લાખો માણુસોને માંસાહાર છોડાવીને મરો ! સમાજના હુદિયાઓનાં હુદિયાઓનાં નિવારણ કરીને મરો ! વિધવાઓની

હજારે ધાઈને ભરો ? અશિક્ષિતોને શિક્ષિત બનાવીને ભરો !
દેશ વિદેશમાં તમારા જ્ઞાનની સુગંધ ફેલાવીને ભરો !

આમ મરશો ત્યારે જ મરણું સફલ છે. મહાવીરના નામે
પોતાની વાહુ વાહુ ગવરાવી મરવામાં મળ નથી. સમાજ-
ધર્મનું લલુ કર્યા સિવાય મરવામાં સુખ નથી ? મર્યાદ
પહેલાં મળો. એક બીજા આપસમાં મળો ! વિચારોની દેણું
દેણું કરો. સમાજનું લવિષ્ય વિચારો. લવિષ્યને માટે સાધુ-
સંસ્થાનું ખંધારણું બાંધો. ઉપહેશની ધારા કેવી રીતે બહેવરાવવી,
અની એક લક્ષીર ખીચો. આપસની કૃષ્ણાચ્ચો અને દેખેનો
ત્યાગ કરી ધો. અને પુનઃ પણ કહું છું કે-મર્યાદ પહેલાં
જરૂર મળો. નહિં તો જીવનની આપણે પણ તમારા ઉપર
એ કલંક ચાંદેલું જ રહેશો કે :—

“ ભિદ્ધુકો ભિદ્ધુકં દૃષ્ટવा
શ્વાનવત् ઘુઘુરાયતે ” ॥



૪૭)

સુધારે.

જ્યારે જ્યારે જે જે વસ્તુ બગડે છે, ત્યારે ત્યારે તે તે વસ્તુને સુધારવાની જરૂર પડે છે. જે તે વસ્તુને ન સુધારવામાં આવે, તો તેનો બગાડો વધતો જાય છે, અને આખરે એ વસ્તુનો સર્વથા નાશ થાય છે.

આ સત્ય એટલું બધું સ્પષ્ટ અને જગળહેર છે કે-એમાં કોઈ પણ માણુસ ‘કિન્તુ’ કહેવાને તૈયાર થઈ શકે નહિં. તેમ છતાં, ધણી વખત જોવામાં આવે છે કે વસ્તુ ગમે

તેટલી સારી હોય, બ્રાહ્ય હોય, આદરણીય હોય જીતાં, કોઈ કોઈ વાતને માણુસને ઓવો હુરાચહુ પડી જાય છે કે જેના પ્રતાપે પેલું હીવા જેવું સત્ય સ્વીકારવા જેટલું પણ ઔદ્ધાર્ય થતું નથી. જૈન સમાજની પરિસ્થિતિનો ભાડો અભ્યાસ કરનાર સહજ સમજ શકે તેમ છે કે—સમાજનો હિવસે હિવસે હૂસ થઈ રહ્યો છે, અનેક પ્રકારના નવા નવા કલેશો ઉદ્ભલવી રહ્યા છે, વીસમી સહી જેવા જગતા જીવતા જમાનામાં પણ—ઉદાર જમાનામાં પણ જૈનધર્મ—જૈનસમાજ નિંદાઈ રહ્યો છે, એ આપણી ઉપર્યુક્ત મૂર્ખીદિના કારણે છે.

રૂઢીના પૂજારીઓ શું એ વાતને નથી સમજતા કે રૂઢી, એ તો સામાજિક પ્રથા છે? જ્યારે જ્યારે જેવી જેવી પ્રથાની જરૂરત પડે છે, ત્યારે ત્યારે સમાજ, પોતાની અનુકૂળજીતાને માટે એક પ્રથા બાંધી લે છે. વળી સમય જતાં એ પ્રથા ઘસાઈ જાય છે, ને નવી ઉત્પન્ન થાય છે. આ વસ્તુ સમજે છે, જરૂર સમજે છે, એટલુંજ નહિં, પરંતુ પોતે પણ કુદરતના એ નિયમને બાધ્ય નિરંતર થતાજ આવે છે. પુરાણી રૂઢીઓ હુર કરાવે છે, નવી રૂઢીઓ ઉત્પન્ન કરાવે છે, જતાં એમની દાખિમાં આવી ગયેલો કોઈ સુધારક એમ કહે તો તેઓ કહેવાને તૈયાર થશે કે—“બિલકુલ ખોટી વાત છે. જૂની રૂઢીનો નાશ થધ જ કેમ શકે. આજકાલના સુધારકો ધર્મનો નાશ કરવા એઠા છે. નાસ્તિકો છે, અધમી છે. એમની સાથે અસહકાર કરવો જોઈએ, ” ઈત્યાદિ ઈત્યાદિ.

આવી આવી મૂર્ખતાલરી વાતો નીકળે લારે વિચારકો અને સમજુ માણુસો, એ મૂર્ખતાઈ ઉપર હુસે, અથવા એવા ધર્મગુડાઓની નિંદા પણ કરે તો તેમાં અન્યથી જેવું શું છે ?

ઇઢીના ગુલામો ગમે તેમ પછાડા કરે, પરતુ શાસનના શુલેચ્છકોએ, ધર્મના પ્રેમીઓએ, સમાજની દાઝ ધરાવનારાઓએ હુંથી સમજુ રાખવાની જરૂર છે કે-સમાજમાં સુધારાની અત્યંત આવશ્યકતા છે. જૈન સમાજની જુદી જુદી સ્થિતિઓનું ખારિકાઈથી અવલોકન કરનાર જોઈ શકશો કે-પ્રત્યેક અંગમાં સડો પેડો છે, કચરો લરાયો છે, મેલ ચઢી ગયો છે, અને હુંકમાં કહીયે તો સમાજના શરીરમાં ખરેખર ક્ષયરોગ લાગુ પડ્યો છે. છે કોઈ સુધારનાર ડાક્ટરો ! છે કોઈ સુધારનાર સાચા સુધારકો !

જરા મંહિરોમાં પ્રવેશ કરો ! એ શાન્તિનાં સ્થાનો અશાન્તિનાં ધામો નથી બન્યાં શું ? પા કલાક એકાન્તમાં બેસીને વીતરાગદેવની મુખમુદ્રા સહામે દૃષ્ટિ રાખી તમે ધ્યાન કરવા માગો તો થઈ શકે તેમ છે ? ધ્યાન રાખજો, દોષ મંહિરનો કે એ વીતરાગદેવની મૂર્તિનો નથી. એ દોષ ભક્તોની ભક્તિની ઘેલછાનો છે. એમના અવિવેકનો છે. ભક્તિની મર્યાદાની અતિરેકતાનો છે. આ ઘેલછા સુધારવી જરૂરની નથી શું ? એ અવિવેક ભટાડવો જરૂરનો નથી શું ? એ અતિરેકતા ઠેકાણે લાવવી જરૂરની નથી શું ?

જરા શ્રમણાલયો—ઉપાશ્રમોમાં જાઓ. જુઓ, એ ઉપાસરા ઉપાસરા છે કે અપાંસરા છે? શાન્ત મુખમુદ્રાવાળા મુનિરાજેનાં દર્શન કરતાંજ તમારી ઈચ્છા ન હોય છીતાં શિર ઝુકી પડે. ‘મહાનુભાવ’ ‘હેવાણુપ્રિય’ ઈત્યાદિ મધુર શાખ્દોથી અને લદે શાખ્દોનું લાલિત્ય ન હોય, પરંતુ સીધા અને સરલ હૃદયના ઊંડાણુમાંથી નીકળતી એ જ્ઞાનમિશ્રિત વાક્યધારાથી તમારાં હૃદયો લીનાં બની જય. પણ આના અદ્ભુતે વિડરાળ સુખાકૃતિવાળા મહામુનિરાજને, શેરને પણ શરમાવી નાણે એવા ડોળા ફ્રાડી ફ્રાડીને તમારી સહામે ગર્જના કરતા મહાત્માને, ‘અદમાસ’ ‘દાંલિક,’ ‘હૃષ્ટ,’ ‘નાસ્તિક,’ ‘ધર્મભ્રષ્ટ,’ અને એથીએ આગળ વધેલી સરસ્વતીનાં સુલાખિતો સંલગ્નાવતા જુઓ, તો તે અપાંસરાએને પાંસરા—સાચા ઉપાશ્રમ—શ્રમણાલય બનાવવાની જરૂર નથી શું?

આ તો ઉપાશ્રમનો ખાદ્ય હેખાવ. પરંતુ આંતરસ્થિતિ તપાસતાં તો મને એમ જણાય કે—આ મુનિરાજ એઠલે મહેારી પેઢીના કારભારી. હિનલર ગૃહસ્થોની સાથે જલ્દરમાં કે ખાનગીમાં ગામગપોડા ચાલી રહ્યા હોય, દીક્ષાના ઉમેદવારોને સંતાડવા, નસાડવા માટે નાનાપ્રકારના પ્રપંચો થઈ રહ્યા હોય, ખાનગી ગૃહસ્થો કારા રૂપિયાની લેવડ—હેવડો થઈ રહ્યી હોય, તેણુ—મંદીના તમાસા ચાલી રહ્યા હોય, પુસ્તક, કપડાં, પાતરાં, એઘા, ઊંડાસણો વિગેરે ઉપકરણોના પટારા ભરાઈ રહ્યા હોય, અને એવા પ્રકારની

ભીજુ-તીજુ ધમાલો ચાલી રહી હોય તો શું તે જવનોમાં,
તે પ્રવૃત્તિઓમાં ફેરફારો કરવાની જરૂર નથી શું ?

હુવે કોઈ ગામમાં કોઈ પન્યાસળ કે આચાર્યજી
મહારાજ ઉપધાન કરાવતા હોય ત્યાં જરૂરને જુઓ. ઉપધાન
એવી આત્મવિકાસ કરનારી તપસ્યા માટે પણ જે ટેક્સ
લેવાતા હોય, અને એવી ભીજુ રીતે જખરદસ્તીઓ કિંવા
ગોટાળાપંચક ચાલતા હોય, તો શું ત્યાં સુધારાની જરૂર નથી ?

આવી જ રીતે ઉજમણું, પ્રતિષ્ઠા, સંઘો, સ્વામિ-
વાત્સલ્યો અને એવી જે જે ધાર્મિક કિયાઓ જે સમયને
નેયા સિવાય, અંધાધુંધી પૂર્વક થતી હોય અને જે
કિયાઓ, લદે ધર્મના એડા નીચે થતી હોય, પરંતુ
એનાથી જે સમાજનું અહિત થતું હોય, તો શું સુધા-
રાની જરૂર નથી ?

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો—આજે એકેએક અંગ સડી
રહ્યું છે. આજે સમાજના ધનાઢ્યો, પોતાની ઉદારતાનો
પ્રવાહ એવા માર્ગ બહેતો કરી રહ્યા છે કે જેથી સામાજિક
દૃષ્ટિએ લાલ થવાને બદલે ઉલટું નુકસાન થઇ રહ્યું છે.
ધનાઢ્યોને ગરીબ કે સાધારણ વર્ગની જરા પણ ચિંતા
નથી. સાધુઓ—ખાસ કરીને આગેવાન સાધુઓ પોતાની
વાહવાહમાં પડ્યા છે. અને પોતાની સત્તાનો હોર ચલાવવા
તનતોડ મહેનત કરી રહ્યા છે. જતિયોની જતિયો આપણી
નાદરશાહી અથવા એદરકારીના પરિણુંમે જૈન ધર્મથી

વિમુખ થઈ ઈતર ધર્મોમાં ભળી રહી છે, સાધુઓમાં સડો ચેડો છે, વૈમનસ્ય વધ્યુ છે, શિષ્યલોકની માત્રામાં એટલો બધો વધારો થયો છે કે એની આગળ ધર્મની નિંદા એ કંઈ ચોજ સમજવામાં આવતી નથી. સંગઠન અને વૈરાગ્યના અલાવે નવયુવક સાધુઓ સમુદ્દરોથી અલગ પડી અનેક પ્રકારના અધર્મો ઇલાવી રહ્યા છે. સામાજિક કુર્દિઓ પણ એટલી બધી વધી પડી છે કે જેના પાપથી આપો નામાજ ઝૂણી રહ્યો છે. ડેળવાયદો વર્ગ વાતો કરવામાં-ખીજનાં છિદ્રો જેવામાં-કાઢવામાં શૂરોપૂરો છે, પરન્તુ કરવું ધરવું કંઈ નથી. ગૃહસ્થોના પક્ષપાતો, અને સાધુઓની ધર્માચારના કારણે આપણી સંસ્થાઓ પણ શિથિલતામાં જીવી રહી છે. એક તરફથી આખા દેશમાં, ખાળકો અને નવયુવકોમાં શારીરિક સમૃપત્તિઓ પ્રાસ કરાવવા માટેનાં આનંદોલનો ચાલી રહ્યાં છે, જ્યારે જૈનસમાજના ધર્મગુરુઓ એમાંથે પાપ માની એનો વિરોધ કરી રહ્યા છે. સાધ્વીઓની સંસ્થા, કે જે સંસ્થા, વ્યવસ્થિત રૂપે અને ઉપયોગિતાપૂર્વક કામ કરતી હોય, તો આખા સમાજની સ્થિતિ સુધારી શકે, તે સંસ્થા તો અત્યારે સાવ નિરૂપયોગી બદકે લયંકર હાનિકર્તાર્દ્દ્ય હોય, એવું કેટલાકોના હિલમાં ભાસી રહ્યું છે. આપણી કોન્કરનસ જેવી સંસ્થા બંધ થવાના પ્રમાદે ચાલી રહી છે. મંદિરોની મિલકતો જૂઓ તો ટ્રસ્ટીઓના તાગડાધનાના કામમાં આવી રહી છે. ન તેના હીસાઓ કે ન તેના ખીતાઓ !

આમ એકે એક અંગનું બાર્ચિકાઈથી અવલોકન કરીયે
તો ખરેખર સમજાય છે કે—પ્રત્યેક અંગમાં સુધારાની
જરૂર છે. પ્રત્યેક અંગમાં પેઠેલો સડો ફર કરવાની જરૂર
છે. પ્રત્યેક અંગમાંથી કૂડો-કચરો કાઢવાની જરૂર છે.

પણ એ સુધારો કરે કોણું ? એ સડો કાઢે કોણું ? સુધારકો-
સાચા સુધારકો જ એ કામ કરી શકે. અને અતિબેલ સાચા
સુધારકોની સમજમાં આવશ્યકતા છે. સાચા વીરેની જરૂર
છે, આત્મલોભીઓની જરૂર છે. અળવાખેણોની જરૂર છે,
એક એક અંગને બારીકાઈથી તપાસનારા દીર્ઘ દાખિઓની
જરૂર છે.

આ સુધારકો સાચા સુધારકો જોઈએ, પરન્તુ સુધારક
થવું એ કંઈ છોકરાઓના ખેલ નથી. સુધારક થવું, એટલે
આદર્શ બનવું, સુધારક થવું એટલે ત્યાગની મૂર્તિ થવું.
સુધારક બનવું એટલે એ દ્વિકર ઇકીર થવું.

જ્યાં સુધી સાચા સુધારક ન બનાય, ત્યાં સુધી પોતાના
કાર્યની સફળતાની આશા રાખવી એ આકાશથી પુણ્ય મેળ-
વવાની આશા રાખવા ખરાખર છે. હુવે સાચો સુધારક તે છે
કે-જે પહેલાં સ્વયં સુધરે છે. પોતાના જીવનને પહેલાં
સુધારવું, એ સુધારકના શૈત્રનું પહેલું પગથીયું છે. અનીતિમય
જીવન ગાળનાર, પોતાના-સાધુ કે ગૃહુસ્થ-ધર્મથી ફર થનાર
સુધારક કહિ બની શકતો નથી. હૃદયની સાચી દાખથી

સુધારક થનારને—સુધારાના ક્ષેત્રમાં ચાહેબ કરનારે પહેલાં પોતાના આત્માને ખૂબ કેળવવાની જરૂર છે.

ભીજુ બાબત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે—સુધારો એનું નામ નથી કે મૂળમાં કુઠાર નાખવો. મૂળ વસ્તુનો નાશ ન કરતાં, જેટલા અંશમાં બગાડો થયો હોય, તેટલા અંશમાં સુધારો કરવો, એનું નામ સુધારો છે. મંહિરોમાં, લગવાન્ની પૂજા વિગેરેમાં વધી ગયેલા અવિવેકના કારણે મંહિર, મૂર્તિ કે પૂજા-પાઠનું ખંડન કરવું, એનું નામ સુધારો નથી. આવી જ રીતે ભીજુ વધી બાણતોમાં સમજવાનું છે.

વળી સુધારો કરાવવા ઈચ્છનારે સ્વયં આચરણ ભતાવવું જેહાએ. સુધારકોએ સ્વામિ વિવેકાનંદે પોતાના શિષ્યને કહેલા શાફ્ફો સમરણમાં રાખવા જેવા છે.

“ જગતને સુધારવાની જે તારા મનમાં ઈચ્છા હોય તો તું પોતે સુધર. ” અવિધિથી થતાં સામાયિકો તરફ સુધારકોને અલાવ થતો હોય અને તેઓ ભીજાઓને શુદ્ધ સામાયિક કરાવવા ચાહેતા હોય, તો તેમણે સ્વયં શુદ્ધ સામાયિક કરી ભતાવવું. એમ જે જે વસ્તુમાં આપણે સુધારો કરાવવા ઈચ્છતા હોઈએ, તે તે વસ્તુનું શુદ્ધ રીતે સ્વયં આચરણ કરવું. મને લાગે છે કે ધાર્ણી ખરી બાબતોમાં તો આપણું અને આપણા મિત્રોનું દેખતાં દેખતાં

વગર બોલે સુધારો થતો રહેશે. કેંદ્ર વસ્તુમાં કદાચ બોલવાની પણ જરૂર પડે, તો તે અહેવા. બધારે નહિં જ.

સુધારકો જે એમ સમજતા હોય કે-એ.જ સાધુ પોતાની આવશ્યકીય કિયાઓને ન કરે, અને સુધારાની વાતો કરે, તેથી તે સુધારક, અને જ્યારે તે મોટર કે રૈલમાં એસવા લાગ્યો, એટલો મોટો સુધારક, તો તે ખરેખર ભૂલ કરે છે. ધર્મનું રક્ષણુ-પાલન, એ સાચું સુધારકપણું છે. ધર્મને છોડવો, ધર્મ કિયાઓથી ફૂર થવું, એમાં બહારૂરી શી છે? બહારૂરી શુદ્ધ રીતે ધર્મના પાલન કરવામાં છે. બગડેલાને સુધારવું, એનું નામ સુધારો છે. બગડેલાને સાવ છેડી હેવું, એનું નામ નાશકતા છે. ઉચ્છેદકતા છે આપણે સુધારક બનવું છે. ઉચ્છેદક નથી બનવું.

સુધારકોની પહેલી હાડી ‘સમયને ઓળખો’ એ હાવી જોઈએ. અને પહેલાં સ્વયં સમયને ઓળખવો જોઈએ. કોટ, પાટલુન ને નેકટાઇ કુલર લગાવવાં, એ સમયને ઓળખાનું લક્ષણું નથી. અથવા કેવળ લેક્યર બાળ જાડી, એ પણ સમયને ઓળખયો ન કહેવાય. સમયને ઓળખનારો તે છે કે-જે સમાજ કે ધર્મને માટે પોતાના દ્રવ્યનો, સમયનો અને શરીરનો લોગ આપવાને યથાશક્તિ તૈયાર થાય. આજના સુધારકોમાંના ધણુા ખરા જેટલી સુધારાની વાતો કરે છે, એમાંનું અહેવાંશે પણ સમાજનું કંઈ ઉકાળવા તૈયાર થતા હોય, તો તેઓ ધણું કામ કરી શકે.

ધણુા ખરા તો ‘સુધારકોના ખાં’ માં ખપવું છે, અને વખત આવે “થઠ જા એટા સ્ફુળીપર, અદ્વા અચ્છા કરેગા” વાળી કહેવતને ચરિતાર્થ કરતા જોવાય છે. સવા ખાંડી આલવા કરતાં સવાપાસેર પણ કરી બતાવવું, વધારે સારું છે.

સુધારકો ! જાયત થાઓ. મહાવીરના શાસનમાં અત્યારે સાચા સુધારકોની ધણી જરૂર છે. ડગલે ને પગલે જરૂર છે. આજે જૈનધર્મ ગુજરાત અને કાઢિયાવાડના એક ખાંખોચિયામાં જઈ પડ્યો છે, તેને બહાર કાઢી હેશહેશાંતરમાં ઝેલાવનારા-પ્રચાર કરનારા સુધારકોની જરૂર છે. જૈન સમાજમાં કેટલાક સાધુઓ અને ધનાઢ્ય ગૃહસ્થો તરફથી જે ગુરુઢમબાદ ચાલી રહ્યો છે, એ ગુરુઢમબાદનો દોર તોડી નાખવા માટે સુધારકોની જરૂર છે. રૂઢીવાહે જૈન ધર્મને ખરેખર આંખો પાડ્યો છે, કલંકિત કર્યો છે, એ રૂઢીવાદનો ઉચ્છેદ કરવા માટે સુધારકોની જરૂર છે.

સુધારકો ! તમારી ક્યાં જરૂર નથી ? મહાવીરની સાચી ભાવના, મહાવીરના ધર્મની સાચી ઉદારતા આજે તમે ક્યાં જૂઓ છો ? એ સાચી ભાવના અને સાચી ઉદારતા પૃથ્વીપર પર મૂકવા માટે બહાર પડો.

પણ જરા ધ્યાનમાં લેશો ? પહેલાં જ કહી ચુક્યો છું કે સુધારક થવું એ સહેલું નથી. પહેલાં સ્વયં આદર્શ ઘનવાતું છે. પહેલાં સ્વયં સુધારવાતું છે, પછી બીજાને કહેવા જવાતું છે. બીજાને કહેવા જતાં ધણી ધણી મુરકેલીઓના

સામના કરવા પડશે. ધણ્ણા ધણ્ણા તિરસ્કારે અને અપમાનો સહવા પડશે. જાતિખાર કે સંઘખારના ડોળા તમને ઉરાવી મારશે. ‘નાસ્તિકો’, ‘અધર્મિઓ’, ‘મિથ્યાત્વીઓ’ ‘ધર્મધ્વંસકો’નાં વજભય બાળ્યો તમારી છાતીમાં સૂસરા નીકળે, એવી રીતે તમને આવી વળગશે. છાતી મજખૂત રાખજો. દફ પ્રતિજ્ઞા થને. સંગઠન બળ વધારીને ખહાર આવજો અને પેલા લૂથર કે લૂથરના સાથી સુધારકોને પૂછીને ખહાર આવજો કે સુધારાના ક્ષેત્રમાં ખહાર પડતાં-મેદાને જગમાં ઉત્તરતાં તેમને કેટલી મુશ્કેલીઓ પડી હતી. ખૂબ ધ્યાનમાં રાખજો કે—

“એ ઝાંઠી-રાક્ષસી મારતાં મહાભારતો લઢવાં પડે,
એ ઝાતિ કિલ્લા તોડતાં ખહુ જંગ ઐડાવા પડે.
સાચ્યું સ્વાતંત્ર્ય સાધતાં કંઈ ખત્રીસા હેવા પડે,
પૂછો લૂથર-સુધારકોને, આગમાં બળવા પડે.

આટલુ સામર્થ્ય, આટલી દફતા હેઠાં તો સુધારક થને અને સુધારા કરવા ખહાર આવજો. વિજય જરૂર છે !



(૪૮)

જંગલી જનવરોની હિસા.

એક દેશી રાજાએ પોતાના શહેરમાંના કૃતરાયોનો
નાશ કરવા ત્રણું ચાર શિકારીએ રાખ્યો ધર્મસ્થાનકે હોય
કે બજાર હોય, હિંદુવાડો હોય કે મુસલમાનવાડો હોય,
જ્યાં કૃતર હેખાય, તેને ગોળીથી વિધી નાખવાનો હુકમ
કાઢેલો. સ્વર્ગસ્થ ગુરુદેવ વિજ્યધર્મસૂરિ મહારાજે, એ
પ્રભના હુશમન રાજાને જ્યારે તેની એ કુરતા-નિર્દ્યતા દ્વર
કરવા સંખ્યી ઉપદેશ આપ્યો, ત્યારે તેણે એક વિચિત્ર
જવાણ આપેલો, આજ પણ અગિયાર વરસે મને યાદ છે.

કૂતરાની જાતિ મનુષ્યની જાતિ સાથે ન હોવી જોઈએ.
રાત્રે ખૂમો પાડે છે, અને તેથી મારી અને પ્રજાની નિદ્રામાં
ભંગ થાય છે ” કેટલો વિચિત્ર જવાબ ? વચ્ચની નિર-
કુશતાની કંઈ હુદ છે ? પોતે તો ગામથી લગલગ ચારેક
માધ્યલ ફૂર રહેતા, છતાં ગામનાં કૂતરાની રંઝડ એમને
હુરાન કરતી. પ્રજા તો જિયારી એ કૂતરાને રોટલા ને
શીરો ખવરાવી પાલન કરતી. આખરે ચુક્કિતવાદમાં એ
રાજજ લાજવાબ બન્યા, ત્યારે કહે: “ લલે હું નરકે જતું ”
બસ ખલાસ ! છતાં ગુરુદેવે તો એ જવાબ આપેલો કે “ ના,
એ નહિ બને. નિઃસ્વાર્થતાપૂર્વક તમને સાચે સાચું સંભ-
ળાવી, અમે તમને સત્યનું ભાન કરાવીશું અને નરકે જતા
આટકાવીશું. ” અસ્તુ.

આ તો માત્ર એક પ્રસંગની વાત હતી. પરન્તુ અહિં
કહેવાનું જે છે તે આ છે. જેએ કૂતરાને મારી નાખી
કૂતરાની જતિનો નાશ કરવા ઈચ્છે છે-ઈચ્છયા છે-હજરે
પ્રયત્નો કરી ચૂક્યા છે, તેએ પોતાની ઈચ્છાને કદિ પણ
પૂરી પાડી શક્યા નથી. એ અને એમના કદાચ બાપદા-
દાએ પણ કૂતરાં મારતા આવ્યા હશે, પરન્તુ કૂતરાં તો
એટલાં ને એટલાં જ, બદ્દે એથી વધારે જ જેવાયાં છે.

એક શિકારી રાજવીની સાથે વાત થતાં, એમને પૂછ-
વામાં આંધું કે—“ તમે હરિણ અને સસલાં જેવાં નિદોષ
જંગલની શોલાડુપ જનવરોનો શિકાર શા માટે કરો છો ?

એ તમારું શું બગાડે છે ? ” પોતે કેવળ શોખની ખાતર જ એ નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરે છે, છતાં જાણે કે યુક્તિ-વાહમાં હું હરાવી દઉં, એમ ધારી જવાબ આપે છે:- “ હરિણ, એ અમારી જેતિને ઘણું તુકશાન પહોંચાડે છે. માટે એ જાતિનો નાશ કર્યેજ છુટકો. ”

આનો ઉત્તર સીધો અને સરલ જ છે. ભારતવર્ષમાં શિકારીઓનો પાર નથી. શિકારો વર્ષેનાં વર્ષેથી થતા આવ્યા છે, છતાં હરિણની જાતિનો કોઈપણ દેશમાંથી નાશ થયો. કોઈએ જાણ્યો છે ? એટલું જ નહિં પરન્તુ જે પ્રાન્તમાં હરિણોનો શિકાર કરવામાં આવે છે, એ પ્રાન્તમાં, બીજા-નહિં શિકારવાળા પ્રાન્તો કરતાં વધારે ઉપજ થાય છે, એમ કહેવાનું સામર્થ્ય તેઓ કરી શકે તેમ છે ? એકજ દેશી રાજ્ય જોધપુર. ચોક્કસ વર્ષો પહેલાં, જ્યારે કે તે રાજ્યમાં હરિણાદિનો શિકાર નહિં થતો હતો, ત્યારે અત્યારની અપેક્ષાએ તે વખતની પ્રજા શું હુઃખી હતી ? શું તે વખતે અનાજ નહિં પાકતું હતું ? ન કેવળ જોધપુર જ, જ્યાં જ્યાં પહેલાં શિકારો નહિં થતા હતા, અને અત્યારે થઈ રહ્યા છે, એ બધાં સ્થાનોમાં અત્યારના કરતાં પહેલાં અનાજ ઓછું પાકતું હતું, અથવા તે વખતના મનુષ્યો હુઃખી હતા, એવું કહેવાને કોઈપણ સમર્થ થઈ શકે તેમ નથી. બદકે વસ્તુસ્થિતિ તો તેથી ઉલટી જ દેખાય છે. એટલે કે પહેલાંનો પાક, એ અત્યારે પાક રહ્યો જ નથી. પહેલાંનું સુખ,

એ અત્યારે સુખ રહ્યું જ નથી. શિકારો કરીને જનવરોનું અસ્તિત્વ ઓછું કરી ખૂબ અનાજ ઉત્પન્ન કરવાની લાવના રાખવાવાળા, એથી ઉલટું જ અનુભવી રહ્યા છે.

આથી જરા આગળ વધીએ. મનુષ્ય જલિમાં એક એવો વર્ગ છે કે-જેએ એમ માને છે કે-વાધ, ચિત્તા, સાપ, વિંધી વિગેરે જનવરો કે-જેએ. મનુષ્યજલિમને ફાડી ખાય છે, મનુષ્યને ડંખ મારીને વેહના ઉત્પન્ન કરે છે, ખદકે પ્રાણું પણ લઈ લે છે, એવાં જનવરોને તો જરૂર મારવાં જોઈએ. અને તેમ કરીને તેનું અસ્તિત્વ ઘટાડી હેવું જોઈએ.

આવું માનતારો વર્ગ ધણો મહોટો છે; ખદકે જેએ માંસાહાર નથી કરતા, શિકાર નથી કરતા, અને જીવદયાના હિંમાયતી કહેવરાવે છે તેએમાંથી પણ છે. ધણો ક્ષત્રિયો, પ્રાચ્યાણો, અને વૈશ્યો પણ કે જેએ શિકારાહિમાં નથી માનતારા, અને પોતાને પરમ ઈશ્વરભક્ત કહેવરાવે છે, તેએ પણ ઉપરની વાતમાં માને છે. અને કદાચિત્ એવા હિંસક પ્રાણીને પોતે નથી મારતા, તો પણ બીજાની પાસે મરાવવામાં, કિંબા કોઈએ માર્યો હોય તો તેની અનુમોદનામાં અધર્મ-પાપ તો નથી જ માનતા. કારણું કે-તે જનવરોનું અસ્તિત્વ એ મનુષ્યજલિમને માટે ભયંકર માને છે. તે જનવરોને, તેએ મનુષ્યજલિમના શુન્હેગાર સમજે છે. અને શુન્હાની શિક્ષા આપવી, એ કર્તાંય સમજે છે.

આવી હિંસાના સંખ્યમાં ખાસ વિશેષ વિચાર કરવો આવશ્યક છે. ખાસ ખાસ વિચારવાની ખાખતો આ છે.

- ૧ આવી હિંસામાં હિંસાજન્ય પાપ લાગે છે કે કેમ ?
- ૨ આવી હિંસા કરવાનો મનુષ્યનો હુક્ક છે કે કેમ ?
- ૩ આવી હિંસાથી જે ક્રાયદા મનુષ્યો ધારે છે, તે ક્રાયદા થાય છે કે કેમ ?

હિંસાનું લક્ષણ બાંધવામાં આંયું છે: દ્વેષ બુદ્ધયા અન્યસ્ય દુઃખોત્સાદનં હિંસા; દ્વેષબુદ્ધિથી ખીજને હુઃખ ઉત્પન્ન કરવું, એનું નામ હિંસા છે.

મનુષ્ય આવા જીવોને માટે વિચારે છે કે-આ જીવો અમારા હુશ્મન છે, અમારી માત્ર-મિત્રકરો કિંવા અમારી મનુષ્ય જીતિને નુકશાન કરે છે. અમારા પ્રાણુ હરે છે, આ ભાવના જ તે જીવો પ્રત્યેનો દ્વેષ જાહેર કરે છે. અને એ દ્વેષ બુદ્ધિથી એ જીવોને હુઃખ પહોંચાડવું, એમાં જ જ્યારે હિંસા છે, તો પછી એ જીવોના પ્રાણુ હરણુ કરવા, એમાં ભયંકર હિંસા હોય, એમાં વિચારવા જેવું જ શું છે ? ખલ્કે પ્રાણોને હરણુ કરવા એ ન કેવળ હિંસા જ છે, ખલ્કે ફૂરતા છે. રૌદ્ર ધ્યાનની પરાકાષ્ઠા છે. એવા રૌદ્ર પરિણામથી જીવ મહાપાપમાં દૂષે, એમાં આશ્ર્ય જેવું જ શું છે ?

હું હિંસાની થીજી વ્યાખ્યા કરીએ: પ્રમાદાત્ પ્રાણવ્ય-પરોપણ હિંસા પ્રમાદથી કોઈ પણ પ્રાણુનો નાશ કરવો, એનું

નામ હિંસા છે. ઉપર્યુક્ત લુચોની હિંસામાં સ્વાર્થ સ્પષ્ટ છે. પોતાના સ્વાર્થની ખાતર નિર્દેખ પ્રાણિઓને મારવામાં પ્રમાદ પ્રત્યક્ષ છે. સ્વાર્થથી કૃષાય ઉત્પજ્ઞ થાય છે. અને કૃષાય એ પાંચ પ્રમાદ પૈકીનો એક પ્રમાદ છે. એટલે એ વ્યાખ્યાની દિશિએ જેતાં પણ હિંસાજન્ય પાપ અવશ્ય લાગે છે.

ભીજે વિચાર હુક્કે સંખંધી કરવાનો છે. મનુષ્ય જાતિ એ એક ઉચ્ચ જાતિ છે. ભીજ પ્રાણિઓ કરતાં મનુષ્ય જાતિમાં કેટલીએક બાળતોની વિશેષતા છે, અને એ વિશેષતાના કારણે તેથી હુલકી ડોટીનાં જનવરોને મારવાનો તેને હુક્કે પ્રાપ્ત થાય છે એ માનવું જ એક પ્રકારની અધિત્ત સ્વતંત્રતા અથવા જુલ્દમ છે. એમ તો મનુષ્ય જાતિમાં પણ એક એકથી ચઢીઆતી શક્તિઓવાળા મનુષ્યો દેખાય છે, પરન્તુ એ અધિક શક્તિઓવાળા મનુષ્યો હિન શક્તિવાળા મનુષ્યોને મારી નાખવાના સિદ્ધાંત પ્રચલિત કરે તો જગતમાં કોઈને લુચવાનું રહેતું જ નથી. મનુષ્ય જાતિનો પણ સંહાર જ થઈ જય. માટે એ ચુક્તિ બિલકુલ બિન પાયાદાર છે કે “અમારી પાસે વધુ શક્તિઓ છે, માટે અમે તેનો નાશ કરીએ.” એ તો પોતાના સંહાર માટેનું નિમંત્રણ છે.

એક દલીલ એમ કરવામાં આવે છે કે “ તે જનવરો અમારું તુકસાન કરે છે, માટે તેને મારવાનો અમારો હુક્કે છે.” આજ ચુક્તિને આગળ કરી સિંહ, વાધ, સાપ,

વિંધી અને છેવટે માંકડ સુધી જ્યોને પણ ધણુા ખરા
કોકો મારવાને ઉદ્ઘૃત થાય છે.

પરન્તુ પ્રાણિઓના સ્વભાવ સબંધી બહુ ભાર્તિકાઈથી
વિચાર કરનારાઓને માલૂમ હુશે કે વાધ અને સિંહ જેવા
કુરમાં કુર પ્રાણિને પણ મનુષ્ય, એક ભયંકરમાં ભયંકર જનવર
તરીકે દેખાય છે. સ્પષ્ટ શાખ્દોમાં કહીએ તો મનુષ્ય જ, એક
એવું ભયંકર પ્રાણી છે, કે સંસારના તમામ પ્રાણિઓ
તેનાથી ભય પામે છે. મનુષ્ય જતિ એક સાથે રહે છે
એટલે એને પરસ્પરસ એક ઝીજનો ભય નથી લાગતો,
પરન્તુ એ જંગલોમાં, કંદરાઓમાં, દરોમાં અને પત્થરોની
શિલાઓની નીચે સુખથી લપાઈ રહેલાં જનવરો જ્યારે
મનુષ્યને જુએ છે, ત્યારે તેના જીવન ઉપર એક ભયંકર
વાદળ ઘેરાઈ આંથું હોય એવું એને જણાય છે. એ વાતની
ખખર મનુષ્યને ભાગ્યે જ રહે છે. અને જ્યાં સુધી એ ઊરીલી
કુહિસક જનવરો પણ આવા ભયથી વ્યાકુલ નથી થતાં ત્યાં
મુખી તે મનુષ્ય જતિ ઉપર હુમલો નથી જ કરતાં. એવાં
હુનરો મનુષ્યો આપણે જોઈએ છીએ કે જેઓ જંગલોમાં રાત
હિવસ વિચરે છે. એવા અનેક મનુષ્યોનાં ઉદાહરણો આપી
શકાય તેમ છે કે જેઓના શરીરો ઉપર સાપ અને વિંધી
કુરી વણ્ણા હુશે પરન્તુ તેઓને કંધક પણ ઈજન નથી
પહોંચાડી. ધણુા માણુસો વીંધીને પોતાના શરીર ઉપર
કુરવે છે. ઝીજનો અજાયખીમાં ગરકાવ થાય છે, કહે છે

કે “આણુ તો મંત્રથી એ વિંધીના ડંખનું જેર મારી નાખ્યું છે, તેથી તે હાથ ઉપર ફેરવે છે.” પરંતુ તે એક જાતનો ભ્રમ છે. વીંધીની ચામડીમાં એક એવા પ્રકારની વિશેષતા છે કે જે તેની પીઠ ઉપર એક અંશ માત્ર પણ સ્પર્શ થશે તો તે અટ પોતાનો ડંખ ઉપાડી એ સ્પર્શ થયેલી વસ્તુ ઉપર મારશે. જ્યાં સુધી એની પીઠ ઉપર સ્પર્શ ન થાય ત્યાં સુધી તે ડંખ નહિં જ ઉપાડે. અને એનું જ એ કારણું છે કે કેટલાક મનુષ્યો ખાડું સાવધાનતાપૂર્વક વીંધીને પોતાના શરીર ઉપર ફેરવે છે. આવી રીતે સાપ વિગેરે જનવરો પણ જ્યાં સુધી કોઈ પણ જાતના લયમાં નથી આવતા ત્યાં સુધી તે ડંખ નથી જ મારતાં.

જ્યારે વસ્તુસ્થિતિ આ છે તો પછી, આપણે, એ જનવરો આપણું નુકસાન પહોંચાડનાર છે, આપણો જીવ કેનારાં છે, એમ માનવું, એ એક પ્રકારનો જુદ્ધમ નહિં તો ખીંચું શું છે? મનુષ્યજલતિને જરા પણ હાનિ ન પહોંચે, એવા પ્રકારના લક્ષ્યથી પોતાનું ગુજરાન ગુજરારી રહેલાં એ નિર્દેષ પ્રાણિઓને, પોતાનું દુઃખ નહિં કહી શકનારાં જનવરોને કેવળ પોતાના સ્વાર્થની ખાતર કે શોખની ખાતર આ સંસારથી વિદ્યાય કરી દેવાં અથવા વિદ્યાય કરી દેવાની બુદ્ધિ રાખવી, એ તો અક્ષમ્ય ગુનહો જ કહી શકાય.

એ જંગલી જનવરોને પોતાનાં શુનહેગાર સમજનારા ખરેખર ભૂલ કરે છે. લયમાં આવ્યા વિના તેઓ કોઈના

ઉપર હુમલો કરતાં નથી, બદકે વાધ, ચિત્તા વિગેરે એ જંગલી જનવરો તો મનુષ્યજ્ઞતિથી હુમેશાં ફરજ જ રહે છે. જેઓ આપણુંથી બિચારાં નાસતાં લાગતાં ફરે છે, અને મનુષ્યજ્ઞતિથી છુપાતાં ફરે છે, તેઓને ગુનહેંગાર માનવાં એ કેટલો અન્યાય છે? હરણ જેવાં જનવરો જંગલનું ધાસ ખાઈને જીવન જ્યતીત કરે છે, તે જેથી મનુષ્ય-જ્ઞતિનું કંઈ નુકસાન જ નથી. બદકે ધાસ ખાવું, એ તો પોતાની ગરીબાઈ-દીનતા પ્રકટ કરવા બરાબર છે. જે રાજ્યે એક રાજના હુનરો માણુસોની કત્તલ કરી હોય, અને લાખો-કરોડો ડ્રિપિયાનું નુકસાન કર્યું હોય, છતાં તે જ રાજ જે મહેંમાં ધાસનું એક તૃણ લઈને સહામે આવે તો તેના ખધા ગુનહારો માર્ઝ કરી તેને અલયદાન આપવામાં આવે છે. એક ક્ષાળુભર ધાસ લઈને આપણી આગળ પશુ બની આવનાર કંદુર ફુર્મનને પણ છોડી હેવામાં આવે છે, ત્યારે હુમેશાં આપણી સામે ધાસ ખાઈને રહેનારાં, અરે આપણુંથી લયસીત થઈને જંગલમાં નાસી જનારાં જનવરોને મારવાનો હક્ક કહેવો, એ કેટલું ખધું ઘોર અન્યાયીપણું છે.

હુવે એક બાખતનો વિચાર કરવાનો રહે છે. અને તે એ કે જંગલી જનવરોની હિંસાથી જે ફ્રાયદો મનુષ્યો ધારે છે, તે ફ્રાયદો થાય છે કે કેમ?

જંગલી જનવરોનો નાશ કરવામાં મનુષ્યો સુખ્ય એ

વિચારે છે કે જંગલી જનવરોને મારી નાખવાથી અસ્તિત્વ ઓછું થઈ જશે, અને તેથી તેના નિમિત્તે થતું મનુષ્યોનું મરણપ્રમાણ ઓછું થશે.

મનુષ્ય જલ્લિ પોતાની મૃત્યુ સંખ્યા કમ કરવાને માટે, એ જીવોનો નાશ કરવાનો જે પ્રયોગ કરી રહી છે, તે આજની નથી. સાપ, વિંધી, વાધ, સિંહ અને એવાં જંગલી જનવરોને મારવાની પ્રવૃત્તિ કંઈ આજની નથી. એ તો અનાદિકાળથી ચાલી રહી છે. છતાં હજુ સુધી એ જંગલી જનવરોની જલ્લિનો સર્વથા નાશ થયો હોય, એ કોઈપણ દેશનો, કોઈપણ સમયનો ઈતિહાસ ખતાવે છે ખરે ? કઢાપિ નહિં. બલ્કે આ પ્રયોગોમાં તો ગમે તેવા હિંસામાં માનનારાને પણ સ્પષ્ટ જણાયું છે કે ‘ખીજના નાશમાં પોતાને સુખ માનવું, એ લયંકરમાં લયંકર ભૂલ છે. જંગલી જનવરોનો નાશ કરીને મનુષ્યજલ્લિ પોતાના સુખની ઈચ્છા રાખે છે, એ અજવાળામાંથી અંધારામાં જવાનો પ્રયત્ન કરે છે.

ધણ્ણા લોકોને ખખર નહિં હોય કે ખુદ ગવર્નર્મેન્ટ મોટાં મોટાં ઈનામો કાઢીને જંગલી જનવરોનો નાશ કરાવે છે. એટલા માટે કે મનુષ્ય જલ્લિનાં મૃત્યુ ઓનાથી ઓછાં થાય.

પરન્તુ આ પ્રયોગમાં એ લોકો કેટલા બધા નિષ્કળ નીવહ્યા છે, એ ‘ગેઝેટ ઓફ ઈન્ડીયા’ માં ગવર્નર્મેન્ટ

સમયને ઓળખો.

ઓઝ ઈન્ડિયા ' ના સેક્ટરીએ ને વક્તાવ્ય પ્રકાશિત કર્યું છે, તે ઉપરથી સ્પષ્ટ થાય છે.

જને ૧૬૨૭માં ગવર્નર્મેન્ટે ૧૩૬૦૦૦ રૂ. જંગલી જનવરોનો શિકાર કરવાવાળાઓને ઈનામ આપ્યા. ૧૨૫૦ રૂ. સાપેને મારવાવાળાઓને ઈનામ આપ્યા. આ ઈનામના પરિણામે ૨૫૫૦૦ જંગલી જનવરોનો અને ૫૭૦૦૦ હુનર સાપોનો નાશ કરવામાં આવ્યો.

આટલો દ્રવ્યબ્યય કરીને આટલા જીવોની હિસાનું પરિણામ શું આંદ્રું છે તે આપણે જેઠાંચે.

જે વર્ષમાં ૧૪૦૨૫૦ રૂપિયા તે જંગલી જનવરો અને સાપોને મારવામાં ખરચાચા છે તેજ વર્ષ એટલે સં. ૧૬૨૭ માં જંગલી જનવરો અને સાપોના કારણે ૨૧૩૫૪ માણુસોનાં મૃત્યુ નોંધાયાં છે, જેમાં ૨૨૮૫ માણુસો વાધ વિગેરે જંગલી જનવરોના કારણે અને ૧૬૦૬૬ સાપોનાં કારણે. ખુલ્લી તો એ છે કે-

સં. ૧૬૨૫ માં ૧૬૬૨ માણુસો જંગલી જનવરોએ ખાધાં, સં. ૧૬૨૬ માં ૧૬૮૫ માણુસો ખાધાં, જ્યારે જે વર્ષમાં એક લાખ ઓગણુચાલીસ હુનર રૂપિયા ખરચીને ૨૫૫૦૦ જંગલી જનવરોનો સંહાર કરવામાં આવ્યો છે, તે વર્ષમાં ૨૨૮૫ મનુષ્યોનો સંહાર તે જંગલી જનવરો દ્વારા થયો છે અને ૧૬૦૬૬ મનુષ્યો સાપો દ્વારા મર્યાદ છે.

ઉપરના સરકારી આંકડાઓ ઉપરથી કોઈ પણ વાચક સહજ સમજ શકે તેમ છે કે પ્રતિ વર્ષ જંગલી જનવરોનો સંહાર જેમ વધારે વધારે કરવામાં આવ્યો છે, તેમ તેમ તે જંગલી જનવરો દ્વારા મનુષ્યોનો સંહાર વધારે વધારે થઈ રહ્યો છે.

અર્થાત् જેમ જેમ જનવરોને વધારે મારવામાં આવે છે, તેમ તેમ તે જનવરોની સંખ્યા વધતી જ જય છે. આન્ધ્રિકાદેશમાં વાધ સિંહ ઘણું થાય છે. લગભગ તે દેશના રહેવાસીઓ મોટે લાગે શિકારી છે. શિકારી ખૂબ થાય છે, છતાં આન્ધ્રિકા તો એવોને એવોજ વાધ-સિંહનો દેશ રહ્યો. એનું અસ્તિત્વ હજુ સુધી એછુ નથી થયું.

મારવાના પ્રયોગમાં આનાથી વધારે નિષ્ટળતા બીજુ કઈ હોઈ શકે ? કહેવાની કંઈક જ આવશ્યકતા નથી કે જેમ જેમ જીવોની હિંસા વધારે કરવામાં આવે, તેમ તેમ તેની ઉત્પત્તિ વધતી જ જય છે. એક સામાન્યમાં સામાન્ય અનુભવની વાત છે કે જે લોકો માંકડને મારતા નથી તેઓના ઘરેઠામાં કુવચિત્ જ માંકડ થતા આપણે જોઈએ ધીએ, જ્ઞાયારે મારનારાઓ લાગ્યે જ માંકડના ઉપરવોથી બચેલા રહે છે. જે પ્રાન્તો અને ગામો હિંસક છે, હિંસા કરનારાઓની વસ્તી વધારે છે, એ પ્રાન્તો અને ગામોમાં એવાં ઊરીલાં જનવરોની ઉત્પત્તિ વધારે જ હોય છે, અને તેનાથી તેનાં મૃત્યુ પણ વધારે થાય છે.

હું અમારો શિવપુરીનો જ થાડો અતુલવ કહું. શિવ-પુરીમાં સ્વાલાવિક રીતે ચોમાસામાં સાપનો અને ઉંહા-ગામાં વિંધીનો ઉપદ્રવ વધારે રહે છે. અને તેમાં શિવ-પુરીનો સીમાડો, કે જ્યાં સ્વર્ગસ્થ ગુરુદૈવ વિજયધર્મસ્કુરો-શરળ મહારાજનું સમાધિમંહિર બન્યું છે, એ એક લયંકર જંગલ હતું. અવાર નવાર ત્યાં વાધ ચિત્તા વિગેરે આવતા. સમાધિમંહિર બનવા લાગ્યું, મકાનો બન્યાં. વસ્તીની આખાઈ થવા લાગી, એટલે તેની આસપાસ બણે ભાઈદિ સુધી હવે એવાં જંગલી જનવરનું નામે ય સંલળાતું નથી. પરન્તુ પ્રારંભનાં કેટલાંક વર્ષો સુધી વીંધીનો અને સાપનો ઉપદ્રવ તો ધણ્ણો રહ્યો. અમે અને વિદ્યાર્થીઓ પ્રતિક્રિમણુ કરતા હોઇએ, તે વખતે ૫-૭ વીંધી એક સાથે ક્રરતા ધણ્ણીવાર જોવાતા. તેમને કંઈપણ છેદછાડ ન કરતાં વિદ્યાર્થીઓ ધીરેથી પકડી જરા ફૂર મૂકી આવે. બસ, આ સિવાય એને જરા પણ કષ્ટ પહોંચાડવાતું કોઈતું મન ન થાય.

આનું પરિણામ એ આવ્યું છે કે આજે ભાગ્યોજ કૃવચિત્ત વિંધી કે સાપ દેખાવ હે છે. હવે તો વિદ્યાર્થીઓ જાળે વીંધી અને સાપના લાઇબંધ બન્યા છે. વિંધીને તો રમતાં રમતાં હુથમાં પકડી ફૂર મૂકી હે છે અને સાપને સાંડસામાં પકડીને. જે કે હવે તો એ જનવરો કૃવચિત્ત જ નીકળેલા દેખાય છે, જ્યારે શિવપુરી ગામમાં આજથી સાત વર્ષ ઉપર જે ઉપદ્રવો જોવાતા, તે જ ઉપદ્રવ અત્યારે પણ

ચાલુ છે. કારણ એ છે કે-જૈનો કે એવા થાડા જ લોકોને છોડીને બાકીના લોકો એવા જીવોની હિંસા કરે છે. અને તેથી તે જીવોની ઉત્પત્તિ વધતીજ રહે છે. ઉપરની હકિકિતો ઉપરથી એ સમજવું જરાય કઢિન નથી કે-કોઈપણ જીવની હિંસાથી, જેઓ એમ માનતા હોય કે તે જીવોનું અસ્તિત્વ ઓછું થાય છે, તો તે લયંકર ભૂલ કરે છે. બલ્કે એ દૃઢતાપૂર્વક સમજ રાખવાની જરૂર છે-જે જીવોની હિંસા જ્યાં વધારે થાય છે, તે જીવોની ઉત્પત્તિ ત્યાં વધારે થાય છે. અતએવ મનુષ્યજલિએ, ચાહે જંગલી હોય કે ચાહે ગમે તેવાં હોય, પરન્તુ કોઈપણ જીવની હિંસાથી ફર રહેલું એમાં જ પોતાનું અને પરનું કલ્યાણ રહેલું છે, એટલું જ કહી વિરસું છું.



(૪૬)

સંદેશ।

મારા વહાલા વીર ચુવકો !

હમણું થોડા દિવસ ઉપર ગુરુકુળ—ગુજરાનવાલાના કેટલાક ચુવકો પરીક્ષા આપવાને અહિં (શિવપુરી) આવેલા, તેઓએ મને કહ્યું હતું કે “ જેન ચુવક મંદળ પંનખ ” નું અધિવેશન થવાનું છે તે ઉપર સંદેશ મોકલશો.

હું શો સંદેશ મોકલું ? સમાજ અને દેશની પરિસ્થિતિ સ્વયં ‘સંદેશ’નું કાર્ય કરી રહી છે, જેને આંખ છે તે

આંસુ વહ્નાવે છે; હૃદય છે તે ઢવે છે, અને બુદ્ધિ છે તે વિચારમાં પડેલ છે. ચિંતામાં ચૂર થઈ રહેલ છે. હું શું બતાવું ? શું સમાજ અને દેશની પરિસ્થિતિ તમારાથી છાની છે ?

લાઈઓ, જગંગુર શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના સમય પણીથી જૈનસમાજની કુમનસીધીનું ચક્ક પ્રારંભ થયું છે. તે દિવસથી આજ સુધી પ્રતિ વર્ષ આડ આડ હળર જૈનોની સંખ્યા ઘટી રહી છે. તે મોટરો અને હવાઈ અહાંનેમાં ઉડવાવાળાઓને નહિ, પરન્તુ તમારા ધર્મગુરુઓને-જૈન મુનિરાજોને પૂછો કે-જૈનસમાજની આર્થિક સ્થિતિ કેવી છે ? તે મુનિરાજોને નહિં, જેએ મહાઠા શહેરોમાં રહીને લક્ષાધિપતિયો અને ડેાયાધિશોના ધરોમાં જ ગોચરી જતા હોય અને જેએ પોતાના માનેલા થોડા લક્તો પાસે ઉજમણું, ઉપધાન, અને સંધ તથા એવી બીજી ધૂમધામો કરાવી પોતાની વાહ વાહ પોકરાવતા હોય. પરન્તુ તે મુનિરાજોને પૂછજો કે-જેએ નહાના મહાઠા બધાં ગામોમાં વિચરે છે અને લુખી રોટલીનો ટુકડો કે જે મજયું તે બહારી ઉદ્દર-પૂર્તિ કરે છે. આજે સમાજના સેંકડો ચુવકો આર્થિક કઠિનતાઓના કારણે શિક્ષામાં આગળ વધી શકતા નથી. આજ હળરો અમારી વિધવા બહેનો પોતાના ચારિત્રની રક્ષા અને ઉદ્દર નિર્વાહ કરી શકે, એવા સાધનોના અલાવથી અત્યાચારિયોના હાથે પડી પોતાનો ધર્મ અને જીવન નષ્ટ કરી રહી છે. આજ હળરો નવચુવકો કોઈ પણ ધંધા રૈજગારના અલાવે એકાર ખનીને નાના પ્રકારના અધર્મેનું

આચરણ કરી રહ્યા છે. આજ અનેક પેટા જાતિઓ અમારી જીતીય સંકુચિતતાના કારણે જૈનધર્મને છોડી છોડીને અન્યધર્મોમાં લગ્ની રહે છે. મિત્રો ! શું બતાવું ? જૈન સમાજના પ્રત્યેક અંગમાં સડો પેઠો છે. આ સડો નહિં હુર કરવામાં આવે તો, મારો પૂર્ણ વિવિવાસ છે કે જૈન સમાજનો મૃત્યુધંટ બિલકુલ નજીદીકજ સાંભળવામાં આવશે.

પરન્તુ લાઈએ, આ સડો કાઢે કોણુ ? એનો સુધારો કરે કોણુ ? એના માટે મારો તો સંપૂર્ણ વિવિવાસ કેવળ તમારા ઉપરજ છે—સમાજના નવયુવકો ઉપર છે. મારી તો આજે વર્ષોથી એ શ્રદ્ધા એઠેલી છે કે—અમારી સમાજના નવયુવકો યદિ સમાજમાં આનંદોદાન ઉલુ કરશે તો અવસ્થય દશ—પાંચ વર્ષોમાં આશાતીત પરિવર્તન જોઈ શકાશે. પરન્તુ મને મારુ કરવામાં આવે, હું આની સાથે સાથે એક ઔર વાત કહી લેવા ચાહું છું

અમારા નવયુવકોમાં ગ્રાયઃ એક દોષ જોવામાં આવે છે. તે આ છે: “ ઓલે છે બહુ અને કરે છે થોડું.” મારું નમ્ર મન્તવ્ય છે કે હુવે ખાલી ઓલવાનોજ સમય નથી રહ્યો. હુવે તો કાર્ય કરવું જોઈએ છે. દાદ્ધિણ્ય અને ભીડીતા એને હુર કરીને સમાજના ઉદ્ધારના જે જે ઉપાયો માલૂમ પડતા હોય, તે તે ઉપાયોને હાથમાં લેવા જોઈએ. અને તે ઉપાયોને—તે વસ્તુઓને સૌથી પહેલાં પોતાના આચરણમાં લાવીને પછી જગતુની સહામે રાખવા જોઈએ.

એક સમય હતો, જ્યારે સાધુઓમાં ધર્મિજ શિથિલતા પ્રવેશ કરી ગઈ હતી. તે વખતે મહાપ્રતાપી આનંદવિમલસૂરિ બહાર આવ્યા, જેમણે ઘોર તપસ્યાઓ અને શુદ્ધ ચારિત્ર પાલન કરીને ચુપ્ચાપ વિચરી જગતને ભતાવ્યું કે ‘સાધુધર્મ’ આ છે.’ કહેવાની કંઈજ આવરણકર્તા નથી કે યદિ તેઓએ આચરણમાં ઉતાર્યા સિવાય ડેવળ ઉપરેશ આપવા-માંજ સાધુ સંસ્થાનો ઉદ્ધાર માન્યો હત તો તેમના આદર્શી જીવનથી જે સુધારો થયો, તે સુધારો એકલા ઉપરેશથી ન જ થાત.

ભાઈઓ, આપણાથી લલે થોડું થાય પરન્તુ કંઈજને કંઈજ કરી ભતાવીને જ બીજાના ઉપર પ્રભાવ નાખવો જોઈએ. ધરમાં ઐસીને વાતો કરીએ, કે સભાઓના પ્લેટફોર્મો ઉપર ચઢીને લેકચરો જાડીએ; એની અપેક્ષા આપણે આપણું કર્તાવ્યથી-આચરણથીજ કંઈક કરી ભતાવીએ, તો તે વિશેષ લાલકર્તા થઈ પડે છે.

એશક, વિચારોનો પ્રચાર કરવાને માટે સમયાનુસાર વ્યાખ્યાનાદિની પ્રવૃત્તિ પણ ઉપરોગી અવશ્ય છે; પરન્તુ તે ત્યારેજ શોખે કે જ્યારે આપણે તે પ્રમાણેનું વર્તન શરૂ કર્યું હોય. આચરણ વિનાનો ઉપરેશ શા કામનો છે?

મિત્રો, ઉઠો, ઉલા થઈ જાઓ. હવે પ્રમાદમાં પડી રહે વાનો સમય નથી. સમાજને માટે સ્વાર્થ ત્યાગી બનો. તમારી શક્તિયોનો-વિચારોનો ઉપરોગ સમાજ અને ધર્મને

માટે કરો. ધર્મના પ્રચારને માટે (સામ્રાજ્યક ધર્મ નહિં પરન્તુ મહાવીરના ઉદ્ધાર ધર્મના પ્રચારને માટે) યાહેબ કરીને બહાર આવો. તમારા ઉપરજ સમાજની નૌકાનો આધાર છે અને વીસમી સફીના વેગથી પાર કરો ?

પરન્તુ એક વાત જરા કહી લેવા હેબે.

તમને માલુમ હશે કે સેવાનું કાર્ય જેવું વિકટ છે, એવું લાગ્યેજ બીજુ કોઈ કાર્ય હશે. સેવાના ક્ષેત્રમાં ભય-કર કાંઠાઓ છે. સેવાના ક્ષેત્રમાં મહોટી મહોટી ખાઈઓ છે. સેવાના ક્ષેત્રમાં મીણના ઢાંતોથી લોઢાના ચણું ચાવવાના છે. ખુખ યાહ રાખજો, કઠિનાધયોના પહાડો પાર કરવાના છે. તમને એવા એવા પ્રસંગો ઉપસ્થિત થશે જે વળતે તમે નિરાશ થઇને તમામ કાર્યોથી અદગ થઇ એસવાની નોખત ઉપર આવી જશો. જેએના કલ્યાણને માટે તમે તમારી આહુતિ આપતા હશો, તેઓ પોતે તમને તિરસ્કારશે. તમારી સેવાને ધૃતકારશે. તમને હુર થવાનું કહેશો; પરન્તુ વીરના પુત્રો ! કંઈ હરકત નહિં. જેણે કાર્ય કરવું છે, જેણે સમાજ ધર્મ અને દેશની સેવા કરીને પોતાના જીવનને સાર્થક બનાવવું છે, તેણે ન સ્તુતિની આશા રાખવી ને ન નિંદાની પરવા કરવી. નિંદા અને સ્તુતિ એ તો લિન્ન લિન્ન મનુષ્યોની લિન્નલિન્ન મિલકતો છે. લલા, પોતપોતાની મિલકતોની તેઓ હુકાનો ખોલે, તેમાં આપણે શા માટે હર્ષ શોક કરવો ? જેની પાસે જે માલ છાય, તે તેજ ધરે. આપણે તો આપણું કામ કરતા રહેવું


જોઈએ. કામ કરવાની ભાવના રાખવાવાળાઓને માટે ક્ષેત્ર ધ્યાન વિશાળ પડયું છે, એટલા માટે ભિત્રો ! આવો, બહાર આવો, અને સમાજ તથા ધર્મની સેવાને માટે મૈદાને જંગમાં ઉત્તરો અને તમે તમારા કર્તાવ્યથી બતાવી આપો કે—

આદર મળો યા ના મળો,
 અમને કરી પરવા નથી;
 ત્યમ કુળ મળો, યા ના મળો,
 તે જાણવા દૃચ્છા નથી.
 કર્તાવ્ય કરવા જન્મ આ,
 દ્વિનિરાત તેમાં રત રહી;
 ઝણુમુક્ત વિશ્વ થકી થવા,
 કર્તાવ્ય કરવું છે અહિં.

શાસનહેવ તમને જૈન સમાજ અને જૈનધર્મની સેવા કરવાનું સામર્થ્ય અપેં અને તમારી દૃચ્છાઓ પૂર્ણ થાય, એજ અંતરની અલિલાખા.



(૫૦)



વધારે નહિં, માત્ર પચીસ વર્ષ ઉપરની જ વાત છે. જે મહાવીરદેવને આપણે જગદુક્ષારક માનીએ છીએ, જેઓને આપણે ચરમતીર્થંકર લગવાન् તરીકે ઓળખીએ છીએ તે મહાવીરનો જન્મદિવસ કર્યો છે, એની ચે ધણુઓને ખખર નહોતી. અને કેટલાક તો એમ જાણુતા હતા કે લાદરવા શુદ્ધ ૧ નો દિવસ એ લગવાનનો જન્મદિવસ છે. કારણું કે તે દિવસે કદમ્બસૂત્રની વાચનામાં જન્મોત્સવ માનવામાં આવે છે. પરન્તુ હવે જૈનસમાજની તે અજ્ઞાનતા ફૂર થઈ છે. આખી ચે ત્રિલોકીમાં જે વખતે દેવલોકના હેવો અને

દેવેન્દ્રોએ તેમ મૃત્યુલોકના મનુષ્યોએ જન્મોત્સવ ઉજવ્યો। હતો, એ દિવસ-મહાવીર પ્રભુનો એ જન્મદિવસ તો ચૈત્ર શુદ્ધ ૧૩ નોંધે, એટલું જ નહિં, પરન્તુ એ ચૈત્ર શુદ્ધ ૧૩ ના દિવસને જૈનસમાજે પોતાનો એક પરમપવિત્ર દિવસ માની, તે દિવસે લગવાન મહાવીર દેવની જ્યન્તી ઉજવવાનો પણ ખાસ્સો પ્રચાર કર્યો છે. કહેવાની કંઈ આવશ્યકતા નથી કે-છેવાં પર્યાસ વર્ષોમાં ‘મહાવીર જ્યન્તી’ લગભગ સર્વત્ર નહાના કે મોટા પાયાથી ઉજવવામાં આવે છે. આ દિવસનું માહાત્મ્ય ન કેવલ સ્વામિવાત્સલ્યાદિ કરવા પૂરતું જ રાખ્યું છે, પરન્તુ આ દિવસ, એ જૈનોના નહિં પરન્તુ આખા ચે આર્યવર્તના એક ઉદ્ઘારક મહાન પુરુષનો જન્મ દિવસ હોવાની ખાતરી રાજ્યાધિકારીઓને પણ કરી આપી છે. અને તેનું જ એ કારણ છે કે-કેટલાક દેશી રાજ્યોએ રાજ્યના જાહેર તહેવાર તરીકે આ દિવસને માન્ય રાખ્યો છે.

આટલું હોવા છતાં પણ આપણે લગવાન મહાવીર દેવની ‘વાસ્તવિક જ્યન્તી’ ઉજવવાથી તો હબ્લરો ગાઉ પાછા છીયે, એ વાત મહાવીરના પ્રત્યેક અનુયાયીએ ખરાખર સમજવી ધેટે છે. લગવાન મહાવીર એટલે કોણું? લગવાન મહાવીરનું મહાત્વ કેટલું? લગવાન મહાવીરના સિદ્ધાન્તો એ કઈ કોટીના સિદ્ધાન્તો? આ બધી ખાખતોનો જ્યારે જ્યારે વિચાર કરવામાં આવે છે, ત્યારે આપણુંને સ્પષ્ટ સમજય છે કે, લગવાન મહાવીરની જ્યન્તી આપણે જે આકારમાં ઉજવીએ છીએ, મહાવીર લગવાનની જ્યન્તી નિમિત્તે આપણે અત્યાર

સુધીમાં કે કાંઈ કર્યું છે, તે સમુદ્રની અપેક્ષાએ એક બિંદુ સમાન પણ નથી. લગવાનું મહાવીર, એ એકેન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના, કીડીથી લઇને ચક્રવર્તી કે ઈન્દ્ર સુધીના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્મી કે ઘોરમાં ઘોર પાપી, ઠાલામાં ઠાલો મિત્ર કે કઠોરમાં કઠોર હુશ્મન, ઝૂલની માળાએ પહેરાવનાર પૂજક, કે ખર્જ લઈ મારવા ધાનાર હત્યારો-હરેકના ઉપર એક સરખો સમલાવ રાખનાર, સૌનું ચે કલ્યાણ ચાહનાર, સૌને કલ્યાણનો માર્ગ ખતાવનાર ફ્યાની મૂર્તિ. લગવાનું મહાવીરના સિદ્ધાન્તો, એટલે રાગ-દ્રેષ્ણની હોળીને શાન્ત કરનાર શીતળ જળ. લગવાનું મહાવીરનો સિદ્ધાન્ત, એટલે જેમાં કોઈના પણ ઉપર આક્ષેપ-વિક્ષેપ વિના માત્ર વસ્તુ-ધર્મનું પ્રતિપાદન કરનાર નિર્દેખ સંદેશ.

આવા પરમ ઉપકારી મહાવીર પ્રભુની જ્યન્તી, માત્ર એક દિવસ સભા લરી ભાષણો કરવામાં પરિસમાપ્ત થાય? પૂજા ભણુવવા કે વરધોડા કાઢવા માત્રમાં એની સાર્થકતા થાય? કદમ્પિ નહિં. લગવાનું મહાવીર જ્યન્તી તો ત્યારે જ ઉજવી કહેવાય, કે જ્યારે આપણે એ મહાવીરનો સંદેશો પ્રત્યેક ગામ, પ્રત્યેક ઘર, પ્રત્યેક મનુષ્યના કાન સુધી પહેંચાડીએ અને લગવાનું મહાવીરની જ્યન્તી તો ત્યારે જ ઉજવી કહેવાય કે, આપણે આપણામાંના રાગ-દ્રેષ્ણને ફૂર કરીએ. લગવાનું મહાવીરની જ્યન્તી તો ત્યારે જ ઉજવી કહેવાય કે આપણે આપણા મમત્વ-અહંપદના કારણે મહાવીરના ધર્મને કલાંકિત કરી રહ્યા છીએ, એનાથી ફૂર થઈએ. આપણા તીર્થોના

અગડાએ શાન્ત કરીએ, આપસનાં વૈમનસ્થોને હુર કરીએ. આપણી તે સંકુચિતતાએ, કે જે સંકુચિતતાએના કારણે મહાવીરના છત નીચે આશ્રય લઈ રહેલા હજરો લાઈ-એનો. તે છતથી હુર થઈ રહ્યાં છે અને જે સંકુચિતતાના કારણે હજરો લાઈ-એનો એ છતની શીતલ છાયાનો આશ્રય લેવા તલસી રહ્યાં છે, પરન્તુ લઈ શકતાં નથી, તે સંકુચિતતાએ હુર કરીએ અને મહાવીર દેવના એ છતને પાછુ ખડું કરીએ કે જેની નીચે કોઈપણ દેશનો, કોઈ પણ જાતનો, કોઈપણ સમુપ્રદાયનો માણુસ, અરે ગમે તે આવીને એનો આશ્રય લઈ શકે.

જ્યાં સુધી આ કાર્ય આપણે ન કરીએ ત્યાં સુધી સાચી મહાવીર જ્યન્તી આપણે ઉજવી છે, એમ કદાપિ માની શકાય નહિ.

પરન્તુ મારે દિલગીરી સાથે જણાવવું પડે છે કે મહાવીર પ્રભુની આવી વાસ્તવિક જ્યન્તી ઉજવવાના પ્રથમ પગથીયે પણ આપણે પહોંચ્યા નથી. આ પ્રથમ પગથીયું છે—મહાવીર લગવાનનું જીવન ચરિત્ર જગતના કર્ણ-ગોચર કરાવવું.

ક્યાં છે લગવાન મહાવીરહેવનું એક પણ લાઘામાં એક પણ મહાવીર ચરિત્ર, કે જે આપણે કોઈપણ અનૈતને હાથમાં ધરી શકીયે ? મહાવીર કોણ હતા ? મહાવીર એ જગહુદ્ધારક શા માટે ? આજથી અહી હજર વર્ષ ઉપર

દેશની પરિસ્થિતિ શી હતી ? તે વખતે મહાવીરે જનમધારણ કરીને શો પુરુષાર્થ કર્યો ? એમના ઉપદેશમાં-સિદ્ધાન્તમાં ખાસ ખુલ્લીએ શી હતી ? આ વસ્તુનું લાન જ્યાં સુધી કેાઈપણું મનુષ્યને ન થાય, ત્યાં સુધી તે મહાવાર કે મહાવીરના સિદ્ધાન્તોનો અનુરાગી બનીજ કેમ શકે અને તેટલા માટે જૈનસમાજનું સૌથી પહેલું કર્તવ્ય કંઈ હોય તો તે મહાવીર ચરિત્ર તૈયાર કરવું તે છે.

જો કે સામાન્યતઃ અનેક મહાવીર ચરિત્રો લખાયાં છે પરન્તુ જો નિષ્પક્ષપાત રીતથી કહેવાની મને થૂટ મળે તો સ્પષ્ટ કહેવું જોઈએ કે-ભગવાન મહાવીરસ્વામીનું ચરિત્ર જો દૃષ્ટિ જેવા સ્વરૂપમાં લખાવું જોઈએ અને અત્યારના જગતને આકર્ષ્યક કરેનારું થઈ પડે, એવું એક પણ ચરિત્ર લખાયું નથી.

ભગવાનું મહાવીર એ કોઈ સામાન્ય વ્યક્તિ નહિં હતા કે-કેના માટે ગમે તેમ એક કથા લખી એઠલે તેનાથી કામ સરે. ભગવાન મહાવીરના જીવન ઉપર ન કેવળ એમના વ્યક્તિત્વનો, પરન્તુ આખા જૈનધર્મની ઉત્કૃષ્ટતાનો આધાર રહેલો છે. ન કેવળ ધર્મનો પરન્તુ આખા ધર્તિ-હાસની સત્યતાનો આધાર રહેલો છે. આવા ચરિત્રને માટે કેવળ એક એ વ્યક્તિએનું જાન અને સમય કંઈ કામ કરી શકે તેમ નથી. આવા ચરિત્રને માટે કંઈ એ પાંચ હજારનો વ્યય કામ કરી શકે તેમ નથી. આવા અપૂર્વ

સર્વાંગપૂર્ણ ચરિત્ર લખાવા માટે મોટી ચોજના હાથ ધરવાની જરૂર છે.

મારા નામ મત પ્રમાણે એક ચોજના હું નીચે ઉપસ્થિત કરું છું.

૧ એક મંડળ એવું સ્થાપન કરવું જે ‘મહાવીર ચરિત્ર મંડળ’ ના નામે ઓળખાય.

૨ આ મંડલના એ વિલાગ રહે (૧) લેખકમંડળ (૨) સહાયકમંડળ.

૩ લેખક મંડળમાં પાંચ કે સાત વિદ્ધાનો જોડાય. જેમાં

૧ આગમના અલ્યાસી,

૨ ઔદ્ધ અને હિંદુસાહિત્યના અલ્યાસી

૩ ઐતિહાસિક વિદ્ધાન્

૪ પાશ્વાત્ય બધી લાખાઓનો વિદ્ધાન્

૫ કસાએલી પ્રોઢકલમનો લેખક

અને એક એ છુટક માણુસો

૬ આ પાંચ સાત માણુસોમાં જેટલા બની શકે તેટલા ઓનરરી કામ કરનારા વિદ્ધાનો જેટલા અને બાકીના પરિમિત પગાર લઈ કામ કરનારા હોય.

૭ આ લેખક મંડળ ચરિત્ર લખવાનું કામ કરે. તેને માટે નીચેનાં કામો અવસ્થ કરવાનાં.

સમયને ઓળખો.

- ૧ ઐતિહાસિક શોધ ખોળો કરવી.
- ૨ તમામ આગમોમાંથી મહાવીર ચરિત્ર તારખલું.
- ૩ બૌધ્ધ અને હિંદુ અંગોમાંથી ઉપયોગી વસ્તુઓ શોધવી.
- ૪ મુસાફરી કરી મહાવીરસ્વામી જ્યાંજ્યાં વિચર્યા હોય, જ્યાં
જ્યાં ચોમાસાં કર્યાં હોય તે તે સ્થાનોની શોધ કરવી.
- ૫ મહાવીરસ્વામીના વિહારનો નકશો તૈયાર કરવો.
- ૬ મહાવીરસ્વામીના જીવનને લગતાં સુંદર લાવવાહી
ચિત્રો તૈયાર કરાવવાં.

અવિચ્છન્નપણે જે ઉપરનું કામ લેખકમંડળ કરે તો
ઓછામાં ઓછાં ગ્રણ વર્ષ એક જીવનચરિત્ર લખતાં
થાય. આ કાર્યને અંગે અનુમાન આ પ્રમાણે ખર્ચ
થવા સંભવ છે.

૬ ખર્ચનો અંદાજ

૧૨૦૦૦ ઓછામાં ઓછા ગ્રણ વિક્રાનો અને એકાદ
સામાન્ય નોકરનો ખર્ચ. ગ્રણ વર્ષનો.

૩૦૦૦ પુસ્તક અને સ્ટેશનરી-સાધનો.

૫૦૦૦ મુસાફરી-શોધખોળ-સાધન.

૫૦૦૦ ચિત્રો અને નકશો તૈયાર કરાવવા વીજે.

૨૫૦૦૦

૧૦૦૦૦ છપાઈખર્ચ

૩૫૦૦૦

અત્યારના અંદાજ પ્રમાણે છપાઈખર્ચ સાથે લગભગ પાંત્રીસ હુલરનો અડસદ્દો ધારવામાં આવે છે.

આ ખર્ચને પહેંચી વળવા માટે અત્યારના સમયમાં એક સાથે મોટી રકમો આપનારા ગૃહસ્થો નીકળે, એ અસંભવિત હેખાય છે, અને તેટલા જ માટે એક સહાયક મંડળ રાખવાની સૂચના કરવામાં આવી છે.

૭ સહાયક મંડળાઃ આ સહાયક મંડળના ત્રણ વર્ગ રહે.

૧ એકી સાથે એક હુલર આપનાર પેટ્રન, જેનો ફેટો તથા ટૂક પરિયય એ મહાવીર ચરિત્રામાં આવે.

૨ એક સાથે હુલર આપનાર મેઝર, જેનો ફેટો અને ફેટો નીચે થોડી લાઇનોમાં પરિયય.

૩ એક સાથે પાંચસો રૂ. આપનાર. જેમનું નામ મદદગારોના લિસ્ટમાં રહે.

આ પ્રમાણેની ચોજનાથી યા થોડો ધર્ષો ફેરફાર કરી મદદગારો મેળવવા.

ઉપર પ્રમાણેની ચોજના જે આપણી કોન્ફરન્સ ઓશ્રીસ અથવા આણુંદળ કલ્યાણુલુની પેઢી કે એવી કોઈ પણ સંસ્થા ઉપાડી લે તો આપણે ખરેખર ગ્રલુ મહાવીરની એક સાચી જ્યન્તી ઉજવવાનું કાર્ય ઉપાડ્યું છે, એમ માની શકાશે. આ કાર્ય ધાણું જ અગત્યનું છે, એ હવે

વારંવાર કહેવા જેવું રહ્યું નથી. કોઈ પણ શાસનપ્રેમી મહાતુલાવોએ આ કાર્ય ઉપાડી લેવાની ખાસ જરૂર છે. અગર કેન્દ્રનસ અથવા પેઢી કે એવી કોઈ સંસ્થા ન ઉપાડે, તો હું અમદાવાહના ચુથલીગના કાર્યકર્તાઓને ભલામણ કરવી ચૂકીશ નહિ કે જેએ શાસનહિતનાં સુંદર કાર્યોમાં જે પોતાનો ઝાણો આપી રહ્યા છે, તેવી રીતે આ અગત્યનું કામ ઉપાડી એક ખરેખરી શાસનસેવા બજાવે.

જે કોઈ પણ સંસ્થા મહાવીરચરિત્રના અંગેતું ‘સહાયકમંડળ’ નું કાર્ય હાથ ધરે તો લેખકમંડળના ચોજના માટે અમારું વિદ્ધાનુ મંડળ પ્રયત્ન કરવા તૈયાર છે. મને આશા છે કે લગભગ એ મહિના સુધીમાં જે કોઈ સંસ્થા સહાયકમંડળનું કાર્ય હાથ ધરવાની હિસ્ત અતાવશે તો લેખકમંડળ માટે અમે બનતું કરવા તૈયાર રહીશું.

શાસનદેવ શાસનશુલેચ્છકોના દિલમાં આ અગત્યની ભાષત સંખ્યી ભાવના જથેત કરાવે અને એક સુંદર મહાવીર-ચરિત્ર જલદી જેવાનું સૌલાગ્ય પ્રાસ થાય એટલું ધર્યી વિરમું છું.



(૫૧)

વિદ્યાર્થી કે વિવાહાર્થી.

સામાન્ય રીતે જોવા જઈએ તો વિદ્યાનો અર્થી એ વિદ્યાર્થી કહેવાય. પછી તે 'વિદ્યા' ગમે તે જાતની હોય, અને તે 'અર્થી' ગમે તેટલી ઉમરનો હોય. કાશીની ગલીઓમાં એક એ પુસ્તકેનું બંડલ ખગલમાં મારીને એક પંડિતને ત્યાંથી ખીજને ત્યાં, ખીજને ત્યાંથી ત્રીજને ત્યાં કેરનાર પચાસથી સાડ વર્ષની ઉમરના માણુસને તમે પૂછો કે તમે કોણ છો ? જવાબ આપશો, મહામહોપાધ્યાય ગંગાધર કે શિવકુમાર શાસ્ત્રીનો 'વિદ્યાર્થી' છું, તે પોતાને વિદ્યાર્થીજ કહેવરાવશો. કારણું કે હજુ તે વિદ્યાનો અર્થી બનીને પંડિતોના

દરવાજાન ખટખટાવી રહ્યો છે. આવા પચાસ કે તેથી મહોટી ઉમરના લાંબી ઢાળિવાળા લગવાં વસ્તુધારી સેંકડો સાધુઓને પણ હું ‘વિદ્યાર્થી’ છું એમ કહેતા આપણે સાંભળીશું.

વિદ્યાર્થી શાખના વ્યુહત્વર્થ પ્રમાણે તે જરૂર વિદ્યાર્થી છે, પરન્તુ અહિં મારો ઉહેશ એ વ્યુહત્વર્થ પરત્વે નથી. ‘વિદ્યાર્થી’માં હું તેમનોજ અહિં સમાવેશ કરું છું કે જેએ એક નહાની સ્કુલથી લઈને કોલેજ પર્યતની શિક્ષણશાળાએમાં અલયાસ કરે છે અને જેએની ઉમર પચીસ વર્ષની અંદરની છે. જેને આપણે બાળક કે ચુવાન ગાણી શકીએ. આ વિદ્યાધ્યયન કરનારા વિદ્યાર્થીએ સાચા ‘વિદ્યાર્થી’ છે કે ખરે-ખર એ ‘વિવાહાર્થી’ છે, એ સામાજિક દાખિએ આપણે વિચાર કરવાનો છે.

આજના વિદ્યાર્થીએમાં કેટલાક સ્વતંત્ર રીતે, પોતાના માતા-પિતાએના આશ્રય નીચે રહી સરકારી સ્કૂલો, હાઇ-સ્કૂલો અને કોલેજોમાં અલયાસ કરે છે; કેટલાક સામાજિક સંસ્થાએમાં-એટલે ઝાર્ડિંગોમાં રહી સરકારી સ્કૂલોમાં અલયાસ કરે છે, કેટલાક પોતાના ધરે રહી સામાજિક શાળા-એમાં અલયાસ કરે છે, કેટલાક સામાજિક ઝાર્ડિંગોમાં રહી સામાજિક શાળાએમાં અલયાસ કરે છે, આમ જુદા જુદા વિલાગોમાં પોતાનું વિદ્યાધ્યયન કરી રહ્યા છે. ગમે તેમ પણ તેએ છે તો વિદ્યાર્થી જ. દ્રવ્યાર્થી, ચેટાર્થી, કે વિવાહાર્થી તો નહિં જ. ભારતવર્ષની પ્રાચીન પ્રણાલિકા-સંકૃતિ

અને રીતરિવાળેનો ઊડો અસ્યાસ કરતાં આપણુને સહજ જણાઈ આવે છે કે-આર્થિવર્ત્તનો કોઈપણ વિદ્યાર્થી ઓછામાં ઓછી પચીસ વર્ષની ઉમર સુધી તે સાચો વિદ્યાર્થી જ રહેતો અને તે વિદ્યાર્થી ‘વિદ્યાર્થી’ જ નહિં, પરન્તુ ખરેખરો ‘અલ્લાયર્થી’ બનતો. આ અવસ્થામાં એની એક જ ભાવના પોષાતી કે ‘હું વિદ્યાર્થી છું,’ ‘હું અલ્લાયારી છું.’ આ ભાવનામાં લગ્ન ન થાય એટલા માટે એ વિદ્યાર્થીઓને એવાજ સંયોગેામાં રાખવામાં આવતા કે જ્યાં બીજી ભાવનાને પ્રવેશ કરવાનો અવકાશ ન મળે. શારીરિક, માનસિક અને બૌધ્ધિક શક્તિઓનો વિકાસ કરવો, એજ એ વિદ્યાર્થી-ઓનું અને એમના સંરક્ષક અથવા વિદ્યાગુરુઓનું લક્ષ્ય રહેતું. વિદ્યાર્થીને કયારે પણ એ વિચાર ન ઉઠેતો કે-‘મારું શું થશે?’ કિંवા ‘મારે કઈ લાઈન લેવી જેધુંએ?’ માત્ર શક્તિયો-કોઈ પણ પ્રકારની અસાધારણ વિદ્યા પ્રાપ્ત કરવી, શરીર ખૂબ મજબૂત અનાવવું, ખુદ્ધિ તીવ્ર કરવી, વાચિક શક્તિ કેળવવી, એ, એ વખતના વિદ્યાર્થીનું મુખ્ય ધ્યેય રહેતું, અને તેજ કારણુથી તેઓ અનાવવાન, તીવ્ર ખુદ્ધિશાળી, પોતાના વિષયમાં અદ્વિતીય વિક્રાન્ત, તેજસ્વી અને પ્રતાપી નિવડતા અને એ પ્રમાણેની શક્તિઓ મેળવ્યા પછી ભાગ્ય અને પુરુષાર્થના બણે જે કોઈ લાઈન હુથમાં આવતી, તે લાઈન સ્વીકારી પોતાનું જીવન સુખમય અનાવવા સાથ પોતાના કુટુંબનું પણ પોષણ કરવાને સમર્થ થતા.

હું આજના ‘વિદ્યાર્થી’ ની પરિસ્થિતિ જુઓ.

આજના વિદ્યાર્થીના મગજમાં, પ્રાથમિક શિક્ષણુથીજ એક કીડો હોડુંહોડા કરવા લાગે છે; “હું શા માટે લણું છું? ભણીને હું કઈ લાઇન લઈશા? ”

યધપિ કેટલાક નહાની ઉમરના બાળકોમાં કદાચિત્ આ ભાવના નથી હોતી, પરન્તુ જ્યાં તે જરાક મહોટી ઉમરના છોકરાઓના સહાયોગોમાં આવે છે, ત્યાં બીજાની વાતોનો એના જીવન ઉપર પ્રલાવ પડે છે. અને ધીરે ધીરે તે પણ એવા વિચારો કરવા માંડે છે. ન કેવળ આ ભાવના આટ-ક્ષેથીજ અટકે છે. આ ભાવનામાં—આ વિચારમાં એક બીજું ઝેર પણ પ્રવેશ કરે છે, અને તે એ કે-લગ્ન સંખાંધી વિચાર. મશકરી અને ઠંડુમાં વિદ્યાર્થીઓ એક બીજાના લગ્નની છેડાડો કરે છે. પરિણામે આ વિદ્યાર્થી પોતાનો વિદ્યાર્થી અવસ્થાને ભૂલી ‘વિવાહાર્થી’ અવસ્થાનો ઉમેદવાર બને છે. કેટલી સામાજિક ઓર્ડિંગો અને સામાજિક સ્કૂલોમાં ત્યાંનું શુદ્ધ વાતાવરણ, શુદ્ધ ચર્ચા અને એવાં કારણોથી વિદ્યાર્થી-ઓમાં પરસ્પર આવું વાતાવરણ નથી ઉલ્લંઘવા પામતું, પરન્તુ બિચારા કમનસીખ એ બાળકો અને ચુવકોના માતપિતાઓની પ્રેરણાઓથી એવાં આનંદોલનો એ બાળકો અને ચુવકોના આ વિદ્યાર્થીજીવનમાં ઉલાં થાય છે.

આ વિષયનો ઉંડો અભ્યાસ કરવાથી તો એ સ્પષ્ટ જણાય છે કે બાળકોના માતા પિતાઓનું પ્રધાન લક્ષ્ય પ્રારંભથી જ એના વિવાહ માટેનું નિર્મણ થયેલું હોય છે. “ છોકરો

જરા હેંશીયાર હેખાશે તો અટ એને કન્યા મળી જશે.” આ લાવના બાળકોના માતાપિતાઓમાં પ્રારંભથી જ હોય છે. આ વાતની ખખર પ્રારંભમાં એ ‘વિદ્યાર્થી’ ને કદાચ નથી હોતી, પરન્તુ ચોક્કસ સમય પછી એની આસપાસ એવું વાતાવરણ ઉલ્લું થાય છે. અને જ્યાં વાતાવરણ ફેલાય છે, એટલે એની ‘વિદ્યાર્થી’ અવસ્થાના શુદ્ધ વાતાવરણમાં અશુદ્ધ વાતાવરણની લેખડો ઉલ્લી થવા લાગે છે. પરિણામ એ આવે છે કે કદાચિત ધણીએ સુંદર લાવના હોવા છતાં એ જેરીલું વાતાવરણ એના ઉપર જેર કર્યા સિવાય રહેતું નથી, તેથી તે ‘વિદ્યાર્થી’ મટી સ્વયં ‘વિવાહાર્થી’ બને છે, અને કાં તો એવા અશુદ્ધ વાતાવરણથી પોતાની નિર્ભળ લાવનાએ. અને ઉચ્ચ અલિલાષાખમાં ઉલ્લી થતી આડખીલીએ પરિણામે ચિત્તને ડામાડોલ બનાવી નાખે છે. આ અને રીતે એ ‘વિદ્યાર્થી’ ‘વિદ્યાર્થી’ નથી રહેતો. એનાથી નથી પૂરૂ વિદ્યાધ્યયન થતું અને તે : નથી કોઈ પણ પ્રકારની હિભમત કરી શકતો.

આ સ્થિતિ ન કેવળ સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓની છે. સામાજિક સ્કૂલો અને એર્ડિંગોની પણ મ્હોટે લાગે આજ દશાઓ છે. ખંડકે સામાજિક એર્ડિંગોમાં—ગુરુકુલો, વિદ્યાર્થી-ભુવનો વિગેરેમાં તો ગૃહસ્થો પોતાના બાળકોને ‘કેવળ પોતાનો છોકરો વિદ્યાર્થી’ નહિં, પણ ‘વિવાહાર્થી’ બને, એટલા માટે જ મ્હોટા લાગે દાખલ કરતા હોય, એમ જેવાય છે.

ધર્ણે લાગે આવી સંસ્થાઓમાં સાધારણું કે ગરીબ સ્થિતિના ગૃહસ્થો પોતાના બાળકોને દાખલ કરાવે છે. આજ કાલનાં સમાજનાશી સામાજિક અંધનોના કારણે સાધારણું કે ગરીબ લોકોના છોકરાઓને કન્યાઓ ઓછી મળે છે. અને તેટલા મારે માતા-પિતાઓ વિચારે છે કે “ છોકરૈ કોઈ સંસ્થામાં રહી જરા હેંશીયાર થશો, તો તેને અટ કન્યા મળી જશો. એમ ધારી તે આશ્રમોમાં મોકલે છે. કેટલાક છોકરાઓ સ્વભાવે એવા તોષાની ખારકસો હોય છે કે-શેરીના લોકોને તેમજ ધરના માણુસોને ખુખ રંભડતા હોય, આવા છોકરાઓના માખાપો, ‘ બહાર જશો તોઝ કંદુકી ઠેકાણે પડશો અને ઠેકાણે પડશો તોઝ કુયાંય ચાંલ્યો થશો.’ એમ ધારી સીધા બાર્ડિંગ લેગા કરે છે.

અસ્તુ, કોઈ હરકત નહિં. ગમે તે નિમિત્તે પણ આજનાં બાળકો પોતાનું જીવન સુધારે અને તેઓ માણુસ બને એ તો સંસ્થાઓનું લક્ષ્ય હોયજ છે. હેલુંજ જોઇએ. પરન્તુ માતા-પિતાઓના હૃદયની પેદી સ્વાર્થવૃત્તિઓ બદ્લે એમ કહેલું જોઇએ કે પોતાના બાળક પ્રત્યેની અહિત બુદ્ધિઓ, એ છોકરાના જીવનને ફ્રાયદો પહોંચાડવાના બદલે ભયંકર નુકસાન પહોંચાડે છે, એ વાતનું લાન તેઓને મુદ્દલે નથી હોતું.

વાત એમ બને છે કેકોઈ પણ સંસ્થામાં એવા બાળકો એક એ વર્ષ રહે છે. સંસ્થાના કાર્યકર્તાઓ તેને પહેલાં તો કેવળ મનુષ્ય અનાવવા જ રાત દિવસ મહેનત લે છે. એની

કુટેવોને હુર કરાવવા સચેષ રહે. એના શરીરની સંભાળ માટે પૂર્ણ કાળજી રહે. એને વિદ્યા પ્રત્યે અલિરૂચિ ઉત્પજ્ઞ કરાવવા પ્રયત્નો કરે. કાર્યકર્તાઓના સતત પ્રયત્ન અને સંસ્થાના સેંકડો ડ્રાપિયાના વ્યયના પરિણામે તે બાળક કંઈક માણુસની લાઇનમાં આવી ‘વિદ્યાર્થી’ અવસ્થામાં પ્રવેશ કરે. વિદ્યાની અલિરૂચિવાળો બને.

તેટલામાં આ કમાવવા મોકલેલા કુંવર કેટલું કમાયા છે, કિંબા કેટલા સ્થિરચિત્તવાળા બન્યા છે, બીજા શર્ષદોમાં કહી-એ તો ‘વિવાહ’ ને ચોગ્ય કેવા થયા છે, એ પોતે જોવાને અને જતિવાળાઓને બતાવવાને તેનાં માખાપ તેને ધરે જોલાવવા માટે પત્રો છોડે છે. છેવટ પત્રોથી કામ સિક્ક ન થાય તો ‘મા’ કે કોઈ ‘ધરડુ ધરડુ લયંકર બીમાર છે, જલદી આવો.’ વિગેરે ભતલખના તારો છુટે. એટલે આ વિદ્યાર્થીઓનું ચિત્ત વિહૃળ બને. આખરે તેણે જવું જ જોઈએ. ગૃહપતિએ તેને રજ આપવી જ જોઈએ. એમ એકાદ વખત ધરે જઈ આવીને પોતાની શાન-શક્ત સંબંધીઓને બતાવીને પોતાનું નામ ‘વિવાહાર્થી’ ના ઉમેદવાર તરીકે નોંધાવી આવે. ખસ ખલાસ, ઉમર ગમે તેટલી હોય, દસ વીસ રી. નો મહીનો લાવવા જેટલી યે લક્ષે શક્તિ ન મેળવી હોય, પરન્તુ એકાદ-એ વર્ષ પછી ‘વિદ્યાર્થી’ ની પરિક્ષામાં નહિં, પરન્તુ, ‘વિવાહાર્થી’ ની પરિક્ષામાં પાસ થાય.

ખસ લણુવાનું ગણુવાનું ઉત્તરડે ચઠાંચું. હુવે તો એકના

એ થયા. માતા-પિતાની સેવા એ, એ ચુવકનું કાર્યક્ષેત્ર અન્યાં. પણ માતા પિતાની સેવા કરે શાથી ? જે દેશમાં લલાલા ઈજિનીયરી અને ડાક્ટરી પાસ કરેલા, અરે બી. એ. એલ એલ. બી. કે. એમ. એ. થયેલા હળડો નવચુવકો પોતાના પેટને માટે માર્યા માર્યા ફરે છે, અરે ટાંગા હાંકીને સાંજ પડે રૂપિયો ભાર આના પેહા કરવાની નોંધતમાં પહ્યા છે, તે દેશમાં કોઈપણ જાતના હુન્દર ઉદ્યોગથી હાથ ધોધ એઠેલ અને નાની ઉમરથી શાહીના શિકાર થયેલા નવચુવકો શું કમાઈને માતા-પિતાની સેવા કરે ? માતા પિતાની સેવા તો હુર રહી, પોતાનું અને પોતાની બીખીનું પેટ લરવું જ મુશ્કેલ હોય, ત્યાં બીજું શું કરી શકે ? પરિણામ શું આવે છે, તે કોઈથી છાનું નથી. વીશ વીશ કે પરીસ પરીસ વર્ષની ઉમર થવા છતાં જે કંઈ કમાતો નથી તો તે છેકરે અને છોકરાની વહુ સગા માતા પિતાને કાળ સમાન લાગે છે. ગૃહકલેશ શરૂ થાય છે. આખરે લાઈને, બીખીને લઈ માતાપિતાથી જુહું થવું પડે છે. પણ જુહા થંડને કરે શું ? દોકાની હુકાનોના ઓટલા તોડવા સિવાય શું કરે ! અને અધુરામાં પુર એ ચુવક જે જિતેન્દ્રિય ન રહ્યો, વિષય દોલુસ થયો તો સંતાનોત્પત્તિ વધતી જ જવાની. એટલે જ્યાં એનું એ પુર નહોતું થતું, ત્યાં બાલખચ્ચયાંની રક્ષાનો ગ્રન્થ ઉલ્લો થયો. ખર્ચ વધ્યાં, આવકનું હેકાણું નથી.

ગાઈ કાલનો વિદ્યાર્થી આને વિવાહાર્થી બની, જ્યોત્રા, પોતાની ખી સાથે કપાળે હાથ દઈ માતાપિતાને અંતઃક-

રણુના ઉંડાણુમાંથી શાપ આપી રહ્યો છે. કહે છે “એ હિતશત્રુઓ ! તમે મારી જંદગી બરખાઈ કરી નાખી. મને, મારામાં શક્તિ આવ્યા વિના પરણુવી, એક ઉંડા કુવામાં નાખી દીધો, લવાન્તરમાં પણ આવા માતા-પિતા ન હોણો. હાય ! હાય ! દેશ, સમાજ અને ધર્મ સેવાનો મારી તે ભાવનાઓ કયાં ગાઈ ? દેશ બંધુઓની સેવા કરવાના મારા કોડો કયાં ગયા ? મારી એ લેખન અને વક્તવ્ય શક્તિઓ કઈ આગમાં લસ્થમીભૂત થઈ ગાઈ ? માર્દ જીવન આજે કોડીનું જીવન નથી રહ્યું. હું એકેમાં ન રહ્યો. મારા જીવનની શી દશા થઈ ? બચાવો, બચાવો, એ પ્રલો ! કેવળ છોકરાની વહુનું સુખ જેવા માટે મારા જીવનની હોળી બનાવનાર આવા માતા પિતાઓથી બચાવો ! ”

અંતરના આવા ઉદ્ગારો તે વિદ્યાર્થી, નહિં નહિં વિવાહર્થી કાઢે છે.

ખરી વાત એ છે કે માતા-પિતાઓએ પુત્ર પ્રત્યેનું ખર્દ હિત શામાં છે, એ સમજવાની જરૂર છે. પોતાના ખાળકને શિક્ષિત બનાવવો, શક્તિશાળી બનાવવો, પુરુષાર્થી બનાવવો, એ માતા-પિતાઓનું કર્ત્તવ્ય છે. પોતાનો છોકરો, પોતાનું અને પોતાના કુટુંબનું પોષણ સારી રીતે કરી શકે, એવી શક્તિ પ્રાપ્ત કરાવવા તરફ માતા પિતાઓએ ધ્યાન આપવું જોઈએ.

અને તેવીજ રીતે આજના ચુવકોએ પણ પોતાના પગ

ઉપર ઉલા રહેવાની શક્તિ મેળવ્યા પહેલાં કોઈના પણ
વિચારોને આધીન નહિં બનવાનું મનોભળ કેળવવું જોઈએ.
આજે પુષ્ટ ઉમરે પહેંચેલા ચુવકો ઉંચી ઉંચી મનોલિ-
લાધાઓ રાખે છે. દેશ સેવા, ધર્મ સેવા, સમાજ સેવાની
ભાવનાઓ ધરાવે છે, છતાં પણ પોતાના માતા-પીતાઓ
કે સંબંધીઓના ઉચ્ચ અભિલાધાઓના ઘાતક વિચારોને
આધીન થવામાં જરા પણ વિદાંખ કરતા નથી. ઐશક, પૂજયોની
આજા માથે ચઢાવવી, પૂજયોની પૂજા કરવી, એમનું ખડુ-
માન કરવું, એ જરૂરનું છે—કર્તાંય છે; પરન્તુ જે પૂજયો
કેવળ પોતાના સ્વાર્થની ખાતરજ, પોતાના પુત્રની શક્તિયોને
જરા પણ વિચાર કર્યા વિના એના જીવનને હાનિ પહેંચે એવાં
કાર્યોમાં પ્રવૃત્તિ કરતા હોય, તો તેઓને વિનયપૂર્વક સમ-
જવવાનું, એમના વિચારોને ફેરવવાનું મનોભળ કેળવવું એ
આજના ચુવકને માટે અતિ જરૂરનું છે. નિર્ધાર, કમમાં
કમ એ કે ત્રણ માણુસોનું શુજરાન ચલાવવાની શક્તિ ન
પ્રાપ્ત થાય, ત્યાં સુધી ચુવકે પોતાના જીવનને “વિવાહાર્થી”
જીવન ન બનાવવાની સંપૂર્ણ કાળજ રાખવી જોઈએ. શાસ-
નહેવ, આજના માતા પિતાઓને સદ્ધારુદ્ધ સુનાડે અને તેઓ
પોતાના છોકરાઓનું હિત સમજતા થાય, એ સાથે આજના
ભાગકો અને ચુવકોમાં ધૈર્ય, સાહુસ અને મનોભળ
કેળવવાની શક્તિ પ્રાપ્ત કરાવે કે જેથી તેઓ પોતાનું હિત
પોતે જ વિચારી શકે, એટલી અંતિમ અભિલાધા સાથે
વિરમુ છું:

(૫૨)

વિદ્વાનોની ખોટ.

એમાં કંઈક શક નથી કે આ જમાનો એ જ્ઞાનના ઉદ્યનો લગભગ આવી લાગ્યો છે. અત્યારે પ્રત્યેક કોમ, જાતિ કે સમુપ્રદાયવાળાઓ, પોતપોતાની કોમ, જાતિ કે સમુપ્રદાયમાં જ્ઞાનનો બહેણો પ્રચાર કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. અને તેના માટે તેનાં સાધનો ઉલાં કરી રહ્યા છે. આપણા સ્થાનકવાસી બંધુઓ, કે જેઓ થોડા વર્ષો અગાઉ આ વિષયમાં સાવ પછીત હતા, હિંગમ્બર કે શ્વેત મૂર્તિપૂજક સમુપ્રદાય કરતાં જેમનામાં સંકુચિતતા અને દૃઢીપૂજકતા બહુ દદ વાસો કરી રહી હતી, તેજ સમુપ-

દાયવાળા લાઈઓ આજે જ્ઞાનપ્રચારના કાર્યો જેસથંધ ઉપાડી રહ્યા છે. હુમણું હુમણું તેમનામાં કેટલાક ગુરુકુળો સ્થાપન થયાં છે, અને તેને માટે સાર્દં ફરંડ તેમજ ચોજનાઓ ઉપસ્થિત કરી ચુક્યા છે. ન કેવળ આટલેથીજ તે બંધુઓએ સંતોષ વાહ્યો છે; પોતાના સમુપ્રદાયમાં ન્યાય, વ્યાકરણ, સાહિલ્ય અને આગમના પણ ઉંડા અલયાસીએ ઉત્પજી કરવાની કેટલાક લાઈઓ ભરસક કોશીશ કરી રહ્યા છે. આ બંધું ખતાવી આપે છે કે તેઓ જ્ઞાનપ્રચાર માટે કેટલા ઉત્સુક છે. આવી રીતે ૧૯૦૦ મૂર્ત્તિપૂજક સમાજમાં પણ જ્ઞાનાલિકાધિતા વધી રહી છે અને તે એટલા ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપણી સંસ્થાઓમાં ફગલાખંધ વિદ્યાર્થી-ઓની અરજીએ આવે છે.

એક તરફથી આમ જ્ઞાન જિજ્ઞાસા વધી રહી છે, નવી નવી સંસ્થાઓ ખુલ્લી રહી છે, ન્યારે બીજી તરફથી જોઇએ છીએ તો આપણે ત્યાં વિક્ષાનોની એટલી બધી કમી છે કે આપણી સંસ્થાઓમાં અધ્યાપનનું કાયં કરાવી શકે એવા અધ્યાપકો મળી શકતા નથી. આપણે ત્યાં અનેક સંસ્થાઓ હોવા છતાં આપણું ગુરુકુળો અને બીજી સામાજિક સંસ્થાઓ તરફથી અધ્યાપકોની માગણીએ ચારે તરફથી છુટે છે; કારણ એ છે કે હું એ તો સૌને જણુાઈ આવ્યું છે કે આપણું ખાળકોને સરકારી સ્કુલોમાં અભ્યાસ કરાવવાથી અમારા કાર્યની સિદ્ધિ થવાની નથી. જૈન સમાજના ખાળકો અને

ચુંકેમાં જે જૈનત્વનું અભિમાન, જૈન સંસ્કારો અને ધાર્મિકતા રાખવાં હોય તો તેઓને આપણી સંસ્થાઓમાં સ્વતંત્ર પાક્ષ્યકરો દાખલ કરી સ્વતંત્ર અભ્યાસ કરાવેજ છુટકો છે. અને તેનુંજ એ કારણ છે કે અત્યારે નવી ઉત્પન્ન થતી ધણી ખરી સંસ્થાઓ ગુરુકુળો વિગેરેમાં સ્વતંત્ર પાક્ષ્યકરોજ દાખલ થાય છે અને કેટલીક જુની સંસ્થાઓ વાળા પણ આ તરફ પોતાનું લક્ષ્ય લઈ જઈ રહ્યા છે.

પરન્તુ આ બધી સંસ્થાઓમાં પહોંચી વળે, એટલા અધ્યાપકો આખી યે સમાજમાં કયાં છે ? એ એક ગંભીર પ્રશ્ન છે. આ સંસ્થાઓ, જેવા અધ્યાપકોની માગણી કરે છે, એવા અધ્યાપકો-વિદ્ધાનો ખનારસ પાઠશાળાએ ઉત્પન્ન કર્યા હતા. પરન્તુ તેઓ બધા એક અથવા બીજી લાઇનમાં કામ કરી રહ્યા છે. તે પછી હાલ તુર્તિમાં આવા ધુરંધર વિદ્ધાનો ઉત્પન્ન કરવાનું કાર્ય ‘શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ’ કરી રહ્યું છે. પરન્તુ આ સંસ્થાનું કાર્ય છેલ્લાં ચાર વર્ષથી રસ્તે ચઢ્યું છે. આટલી દૂંકી સુદૃતમાં પણ આ સંસ્થાએ કેટલાક વિદ્ધાનો ઉત્પન્ન કર્યા છે, પરન્તુ તેઓ હણું સંસ્થામાં રહીને પોતાનો અભ્યાસ આગળ વધારી રહ્યા છે, અને તેની સાથે સાથે સંસ્થામાંજ તેઓને માટે ધણો અવકાશ છે. એટલે અત્યારની લગભગ બધી યે સંસ્થાઓ આવા ધુરંધર વિદ્ધાનોની શોધમાં છે, એમ કહેવું અતિશયોક્તિ લરેલું નહિં કહેવાય. આવી સ્થિતિમાં શું કરવું એ એક વિચારણીય પ્રશ્ન છે.

આ એટ પૂરી પાડવા માટે આપણે પ્રાક્તણું પંડિતોનો આશરો લેતા આવ્યા છીએ અને લેતા રહ્યા છીએ, પરંતુ વધારે વિકટ પ્રક્રિયા તો એ ઉસો થાય છે કે ન્યાય-વ્યાકરણના અંદ્રો ઉપરાન્ત જૈનતત્ત્વજ્ઞાન કે જૈન આગમોના અભ્યાસને માટે શુંક રવું? કારણું કે જૈન તત્ત્વજ્ઞાન અને જૈન-આગમોનો અભ્યાસ—ઉંડો અભ્યાસ આજના જૈન ચુંબકોને કરાવો એ અત્યારે ધણું જરૂરનું છે. આ સંખ્યમાં થોડા વખત ઉપર જયપુરવાળા શ્રીયુત હુર્બલલભાઈ જવેરીએ પોતાની સ્થાન જૈન ટ્રેનિંગ કોલેજના વિદ્યાર્થીઓને ન્યાય અને આગમોનો અભ્યાસ કરાવી શકે એવા એ વિદ્ધાનોની માગણી કરનારો મારા ઉપર એક પત્ર લખેલો, તે પત્રનો જે જવાબ મેં આપ્યો હતો તે ‘ધર્મધ્વજ’ના વાચકોને ઉપયોગી થર્ડ પડ્ડો, એમ ધારી હું અહિં આપું છું.

“ સુશ્રાવક લાઈ હુર્બલલભાઈ !

ધર્મલાલ. તમારો પત્ર મળ્યો. તમે લખો છો, તેવા પંડિતો આપણે ત્યાં સમાજમાં ખુદુજ ઓછા છે. કોનાં નામ લખું? જે છે તેઓ જુદાં જુદાં સ્થાનોમાં ગોડવાઈ ગયેલ છે.

હું તો એજ મતનો છું કે—હવે આવાં આગમો આદિનું અદ્યયન કાર્ય આપણા સુનિરાન્જેએ ઉપાડી લેવાની જરૂર છે. ઉદાર વિચારના વિદ્ધાન સુનિરાન્જ આ કામ વધારે સારું કરી શકે. એક સ્થાને ચોક્કસ સમય રહેવાનો અપવાહ ઉઠાવવો પડે તો લલે ઉઠાવે, સંસ્થાઓની બાધ્ય

સ્થિતિ ઉપર ધ્યાન આપવું, વિદ્યાર્થીઓને ઉપહેશ આપવેા,
લણુંવવા, એમના શિક્ષણ ઉપર હેખરેખ રાખવી, એ કામ
મુનિરાજે પોતાના ચારિત્રમાં રહીને કરે, તો મારી ખાત્રી
છે કે આપણી સંસ્થાઓમાં આવેલાં ખાળકો જરૂર સાચા
શહેરી, સાચા ચારિત્રશીલ નાગરિક અને સ્વાર્થત્યાગી
સમાજ, ધર્મ અને દેશના સેવકો તરીકે ખાડાર પડી શકે.
મુનિરાજેનાં જુથનાં જુથ એક સાથે ફરે, એના
કરતાં યોગ્ય મુનિરાજેને આવી જતનાં યોગ્ય કામો
નાયકો સોંપે, તો કેટલું બધું સુંદર થઇ જશો ?

જે વખતે સમાજને સાચા સ્વાર્થ ત્યાગી, ગૃહુસ્થ ઉપહેશ-
કેની-વિદ્ધાનોની જરૂર છે, તે વખતે અમારો એ ત્યાગી વર્ગ
શા માટે એવા વીરો ઉત્યન્ત કરવા માટે પોતાના જાનનો,
ખુદ્ધિમત્તાનો અને ઉદ્ધારવૃત્તિનો લાલ સમાજના ખાળકોને ન
આપે ? ભિન્ન ભિન્ન શક્તિ ધરાવનારા મુનિરાજે
અધ્યાની સાથે એકજ પ્રવાહમાં ઘસડાઈને પોતાની
શક્તિઓનો વ્યર્થ વ્યય કરે, એના કરતાં એમની
શક્તિઓને યોગ્ય કાર્યો કાં ન કરવા દેવાં ? કાં ન
સોંપવાં ?

મને લાગે છે કે મારા આ વિચારો કહાચ તમને પણ
પસંદ ન હોય, ‘પરન્તુ સ્નેહલાવે હૃદયની વાત લખી
નાખી છે.’”

અત્યારે પણ આપણું મુનિરાજેમાં એવા એવા ધુરંધર

વિદ્ધાનો છે, કે જેએ ધારે તો સેંકડો નવચુવકોને વિદ્ધાનું ખનાવી શકે. મનુષ્ય સ્વભાવજ એવી વસ્તુ છે કે તે લિખ લિખ રૂચિ અને શક્તિનો વિકાસ કરવાનો અવકાશ જો ચોણ્ય મુનિરાજેને આપવામાં આવે તો તેએ દ્વારા સમાજનો ખરેખર ઉદ્ઘાર થઈ શકે. આથી સમાજનું ધાર્થ દ્વય ખચી શકે. ચુવકો અને ખાળકોમાં સુંદર સંસ્કારો પડે, આસ્તિકતા! મજબૂત થાય, અને બીજા પંડિતો દ્વારા જે જ્ઞાન મળે, એના કરતાં કંઈ ગુણું વધારે સારું જ્ઞાન ગુરુગમથી તે ચુવકો મેળવી શકે.

મને જાણુવતાં હર્ષ થાય છે કે ભાઈ હુર્લાલુ જવેરી ઉપર્યુક્ત ભાવનાનો તાત્કાલિક અમલ કર્યાના અને તેમાં કેટલેક અંશો સકૃદાનતા મેળવ્યાના શુભ સમાચાર મને આપે છે. તેએ પોતાની કોલેજના વિદ્યાર્થીઓને ઉચ્ચ કોટીના વિદ્ધાના ખનાવવા ચાહે છે. અને જેવી રીતે કે હું ચાહું છું—આગમાદિનું ઉંચું જ્ઞાન મુનિરાજે દ્વારા આપવામાં આવે તો તે વધારે લાલદાયક થઈ પડે, એ લક્ષ્ય મનમાં રાખી કેઠ કંઈ સુધી તેમણે મુસાફરી કરી. અને સ્થાનકવાસી સમુદ્રપ્રદાયના પ્રસિદ્ધ વિદ્ધાન મુનિરાજશ્રી રત્નચંદ્રલુ સાથે એવી ગોઠવણું કરી છે કે તેએ તેમની કોલેજના વિદ્યાર્થીઓને ન્યાય અને આગમોનો અભ્યાસ આવતા ચાતુર્માસમાં કરાવશે.

શ્વેતાભર મૂર્ત્તિપૂજક સમુદ્રપ્રદાયના મુનિરાજેએ અને

શિક્ષાપ્રેમી મહાતુલાવોએ લાઈ હુર્બલલુ જવેરીની, વિદ્ધાનો ઉત્પજ કરવાની ધગશાળું અવહોંકન કરવું ઘટે છે. હું પ્રારંભમાં કહી ગયો છું તેમ, ૧૯૦ મૂર્ત્તિપૂજક ગમાજમાં ધંઢા વિદ્ધાન સુનિરાજે વિદ્ધમાન છે. તેઓ પાલીતાણા, ભાવનગર, જમનગર, સુંખડ, સૂરત, વડોદરા આદિ શહેરોમાં ચતુર્માસ કરે છે. જ્યાં જ્યાં તેઓ ચતુર્માસ કરે ત્યાં ત્યાંના સંસ્કૃત અભ્યાસી ગૃહસ્� યુવકોને આગમો, જૈનન્યાય અને એવા કઠિન વિષયોનો અભ્યાસ કરાવવાની પ્રણાલિકા રાખે તો કેટલો બધો જ્ઞાનનો પ્રચાર થઈ શકે ? બલ્કે ભાવનગર, જમનગર, લીંખડી, પાલીતાણા અને એવાં જે જે સ્થાનોમાં જૈન સંસ્થાઓ હોય, એ જૈન સંસ્થાઓના વિદ્ધારીઓને ખાસ ઉંડા અભ્યાસ કરાવવાના નિભિત્તે ચોખ્ય સુનિરાજે ચોક્સ ચોક્સ સમયની સ્થિરતા કરી એ યુવકોને પ્રૌઢ વિદ્ધાન અનાવવાનું કાર્ય હાથમાં લે તો પણ હું એમાં કંઈ એદું સમજતો નથી. સમાજમાં ઉંડા અભ્યાસીઓ-વિદ્ધાનો ઉત્પજ કરવાની જરૂર છે, અને તેને માટે સુનિરાજેએ ખાસ તે કામ હાથ ધરવું જોઈએ છે.

પરંતુ ખાસ કરીને એટલું જરૂર ધ્યાનમાં રાખવાનું છે કે એવા વિદ્ધાન અને પોતાના ચારિત્રમાં દદ રહી શકે, પ્રલોલનોમાં ન પડે, શિષ્યહોલો ન હોય, અને કેવળ સમાજની દાજ ધરાવનારા હોય એવાજ સુનિરાજે એ કામને ચોખ્ય હોઈ શકે. અન્યથા તો તે સંસ્થામાં અનેક પ્રકારની ખટપટો

સુમયને એળાંખો.

અને વિદ્યાર્થીઓનાં અને તેમના માણપોનાં મન ઉચ્ક ખની જતાં સંસ્થાના કાર્યને ધક્કો પહોંચાડવાની પણ નોષત આવી પહોંચે. આ વાત ખાસ લક્ષમાં રાખવાની છે.

સુનિરાંજે અને ગૃહસ્થો પોતાના સમાજમાં વિદ્ધાનો ઉત્પત્ત કરવા તરફ પોતાનું લક્ષ્ય લઈ જાય અને તેના સાધનો ઉલાં કરી અનેક વિદ્ધાનો ઉલા કરે એટલું જ શચ્છી વિરસું છું.



(૪૩)

દાન-પ્રણાલી.

‘ દાન ’ નું મહાત્મ્ય જૈનધર્મશાસ્કોમાં ધાર્થું ધાર્થું
વર્ણવવામાં આંદ્રું છે અને એક ચા ભીજુ રીતે, કોઈ પણ
જતના પ્રત્યુપકારની આશા રાખ્યા વિના દાન કરવું લાલ-
દાયક છે, એમ માનીને જ શાસ્કડારોએ ‘ દાન ’ ના પાંચ પ્રકાર
વર્ણવ્યા છે. પરન્તુ એ પાંચ પ્રકારો અથવા ભીજુ જે જે
લેદાનુલેહો થઈ શકે, તે બધાનો આશય એકજ છે કે—જેને
જેની આવશ્યકતા છે, એને એનો લાલ પહોંચાડવો, અને
તે પણ કોઈપણ જતના ઔહિક લાલની આશા વિના.

પોતાની શક્તિથી જેએ રજી શકતા નથી, પોતાનું અને કુદુંખનું પોષણું કરી શકતા નથી, એને અજાહિ આપી એનાં હુઃખ હુર કરવાં. પોતાની શક્તિથી જેએ જ્ઞાન લાલ પ્રાસ કરી શકતા નથી, એમને પુસ્તક પ્રી અને એવાં જોઈતાં સાધનો પૂરા પાડી એને શિક્ષામાં આગળ વધારવા દેવપૂજન, ગુરુલક્ષી, આવશ્યક કિયા અને એવાં ધર્મનાં કાર્યો કરવામાં જેએ પોતાના પગ ઉપર ઉલા રહી શકતા નથી તેમને તેવાં સાધનો પ્રાસ કરી આપવાં. ચ્યાસાને પાણું અને ભુખ્યાને અન્ન, ગરમીમાં શેકાનારને શીતલતા અને ઢંડીમાં ઢરી જનારને કુપડાનાં સાધનો—આજ દાનનું ખડું રહુસ્ય છે. આ રહુસ્યને સમજુને અત્યારે આપણામાં કેટલું દાન થાય છે, એ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.

આજકાલ જૈન સમાજમાં ઓછું દાન નથી થતું. ધર્મ કે પરોપકારના નિમિત્તે પ્રતિવર્ષ લાખો-ખલ્કે કરોડો ડાયિયા બુદ્ધાં બુદ્ધાં કાર્યોમાં ખરચાય છે. આ ખધાનું પરિણામ શું આવે છે ? એનો જો કોઈ બારીકાઈથી વિચાર કરે તો તો ખરેખર લારે ખેદ થયા વિના ન રહે.

આપણે સૌથી પહેલાં એજ વિચારીએ કે અત્યારે જૈન સમાજનો વધુ પેસો શામાં ખરચાય છે ?

અત્યારના દાનનાં કેતે જૈનોને માટે આ છે :—

નવાં મંદિરો, અને પ્રતિષ્ઠાએ, ઉત્તમણા ને ઉપધાનો,

સધો ને સ્વામિવાત્સલ્યો, વરધોડા ને અઠાઈ મહેતસવો, આ ઉપરાન્ત જ્ઞાનક્ષાર, પુસ્તક પ્રકાશન, શિક્ષા પ્રચાર, પાંજરા-પોળ વિગેરે.

આ બધાં કાર્યોમાં જૈનોનું જે દ્રવ્ય પ્રતિવર્ષ ભરચાય છે, એ આપા દેશને અન્યથીમાં નાખે છે. પરન્તુ વસ્તુતઃ હવે જમાનો એવો આવ્યો છે કે-જૈનોના આ પરિણામશૂન્ય દ્રવ્યવ્યય અથવા દાન પ્રણાલીના કાર્યથી જૈનો ઉલટા હાંસીને પાત્ર બની રહ્યા છે. મૂર્ખમાં મૂર્ખ એતીકર પણ એતરમાં અનાજ વાવવા અગાઉ ક્ષેત્રનો, સમયનો વિચાર કરે છે. જ્યારે લાખો ડાનિયાનું દાન કરનાર જૈનો પોતાની દાનધારા ઠેતી મૂકવામાં એટલો પણ વિચાર ન કરે કે-આ વાવવાનું કુળ શું છે ? તો પછી એને માટે સહ્ય જગતું હાંસી કરે, તો તેમાં આક્ર્યા જેવું શું છે ?

હિંદુઓ, પોતાના માનેલા તે સાધુઓ, કે જેઓ લાખો કે કરોડોની મિલકતો ધરાવે છે, સોના ચાંદીની પાલખીઓમાં બિરાજે છે, અને મહેલાતોમાં વાસ કરે છે, તેઓને દાન દેતાં જેમ હાંસીને પાત્ર થાય છે, તેમ આપણે, એવું ક્ષેત્ર કે જે ક્ષેત્રમાં લાખો કે કરોડોની મિલકતો હયાતિ ધરાવે છે, અને જે ક્ષેત્રમાં નાખેલું દ્રવ્ય, ખીણ કોઈ કામમાં વાપરવા દેવાને માટે આપણે સખત સુમાનીયત કરીએ છીએ, એજ ક્ષેત્રમાં બધારોજ કરે જવો, એને કચો ડાઢો માણુસ ઉપચેળી દાન કહી શકે ? જે બખતે સમાજનું અંગે અંગે સરી

રહ્યું હોય, જે વખતે પોતાના બંધુઓના પેટમાં વેંત વેંતનો ખાડો પણ્યો હોય, જે વખતે હજારો ચુવકો છતી બુદ્ધિએ આર્થિક સહાયતાના અભાવે અશિક્ષિત રહી જતા હોય, અને એના કારણે પોતાનો ધર્મ સમાજ કે જલિનો ત્યાગ કરી ભીજાઓ સાથે લગી રહ્યા હોય, તેજ વખતે આપણે એક પક્ષીય ધર્મમાં માની ભરતામાં ભરવાનાં આંધળીયાં કરીએ, એના જેવી મૂર્ખતા ભીજુ કદ હોઈ શકે? આજે જૈનોમાં જેટલું દાન થઈ રહ્યું છે, એ બધું મહોટે લાગે આવું જ-વિવેક વિનાનું થઈ રહ્યું છે. દાખલા તરીકે:—

જૈન પૈસાદારો એ સારી પેઠે સમજતા હોવા જોઈએ કે અત્યારે મંહિરો એટલા બધાં છે કે-જેની રક્ષા કર્વી-સંભાળ રાખવી પણ ભારે થઈ પડી છે. છતાં નવાં મંહિરો ઉલા કરવાને લોકો તૈયાર થાય છે. હા, કોઈ એવા ગામમાં કે જ્યાં જૈનોની ખાસ્તી વસ્તી હોય, અને મંહિરેનું સાધન ન હોય, એવાં સ્થાનમાં સાધનભૂત એકાદ મંહિર બનાવે તો તે કોઈ અપેક્ષાએ ચોગ્ય ગણ્યાય. આવીજ રીતે મૂર્ત્તીયો ભીરાજમાન કરવાનો મોહ પણ એવોજ છે. આવશ્યકતાનો વિચાર કર્યો વિના કેવળ પોતાનું અને બાપદાદાનું નામ મૂર્ત્તિની પલાંડી ઉપર ખોદાશે એ દૃઢાથી જરૂરત હોય કે ન હોય, સુર્તીયો સ્થાપન કરાવ્યા જવું, અને પછી એ સુર્તીયોનો પ્રક્ષાલ સરખો પણ સારી રીતે ન થતો હોય, એના તરફ બેદરકાર રહેવું, એ કેવા પ્રકારનો ધર્મ અથવા દાન પ્રણાલી, એ કોઈ બતા-

વશે કે ? જેના ઉપર મૂર્તિચોની સંલાળ અને પૂજા-પાડનો આધાર રહેલો છે, એવા જૈન ધર્મચોની સંખ્યા તો દિવસે ક્ષિવસે-પ્રતિવર્ષ આડ આડ હજાર ધરી રહી છે, અને બીજી તરફથી મંહિરો અને મૂર્તિઓ વધાર્યા કરવી, એ કંયાં સુધી ચોંચ છે એનો વિચાર સમજદારોએ કરવો ધેર છે.

આવી રીતે ઉજમણુંને ઉપધાન. ઉજમણું નિમિત્તે થતા હજારો ઝાપિયાના છોડો, તે પણ કેવળ આડ દિવસ માટે શોલાના પૂતળાંની માઝેક હુનિયાને બતાવવા પછી પોતાની માલીડીના એક પટારામાં ભરી રાખવાની વસ્તુ સિવાય બીજા શા કામમાં આવે છે ? એ એક છોડમાં હજારો ઝાપિયાનો વ્યય ન કરતાં એજ દ્રવ્યનો મહેઠો ભાગ જ્ઞાનના પ્રચારમાં પુસ્તકો છપાવીને બહેચવામાં-ખર્ચવામાં આવે તો શું એ ઓછું ઉધાપન છે ? પરંતુ બાંધેલા છોડને જોઈને શેક-શેકાણીને ખુશી થવાનો હહાવો પેલા જ્ઞાન પ્રચારથી કેમ પૂરો થાય ?

ઉપધાનમાં પણ કેટલો પક્ષપાત, કેટલી અનુચિત ખુટો અને તેનું લયંકર પરિણામ આવે છે એ કોઈથી અનાશ્ચયું છે શું ? આને માટે પણ થતો હજારોનો દ્રવ્યવ્યય ઓછો કરી બીજી રીતે કરવામાં આવે તો કેટલો બધો લાલ થાય ?

આવી રીતે સંધપ્રણાલી. બેશક, સંધ કે એવી કોઈ પણ શપચુમદિપાદિત ધર્મકિયાનો હું વિચેખી નથી. પરંતુ મારો મતસેદ સમય અને સ્થળને ઓળખવા સંખેખીજ છે.

એક સંધ કાઢવામાં પ કે ૬ લાખ રૂપિયાનો વ્યય થાય પરન્તુ એજ પ કે ૬ લાખ રૂપિયાનો જે વિવેક પૂર્વક જૈન સમાજની દરિદ્રતા ફર કરવા માટે વ્યય કરવામા આવે તો કેટલો અધો લાલ થાય ? સંધ કાઢવાનો હેતુ એ છે કે જે લોડો પોતાના ખરચથી યાત્રાએ ન કરી શકતા હોય એવાએને યાત્રાનો લાલ મળે, અને તેની અનુમોદનાનું ઝેણ એ ખર્ચ કરનારને મળે. પરન્તુ ખરી રીતે આવા સંધોમાં યાત્રા નિમિત્તે તાણી તાણીને—આથડ કરી કરીને—અરે તારો કરી કરીને બાલાવવામાં કોને આવે છે ? પોતાની ખરાખરીના શેડિયાએને, સગાસંખંધીએને. ગરીબો તો બિચારા એક જહેર નિમંત્રણ જોઈને પોતાની મેળે જય તો જદે જય. તેમાં પણ જેટલો લાવ ધનાદ્યોનો પૂછાય એટલો ગરીખનો શાડોજ પૂછાય.

વિચારવા જેવું તો એ છે કે અત્યારે યાત્રા એવી મોંધી નથી કે જેટલી પહેલાં હતી. રેલાદિ અડપી વાહનોનો અલાવ, વિકટ માર્ગો, એ વિગેરે કારણો અત્યારે રહ્યાં નથી. અત્યારે તો ગરીખમાં ગરીખ પણ આસાનીથી યાત્રા કરી શકે છે. હા, સમેતશિખર જેવા ફરના તીર્થને માટે આવો સંધ ઉપરોગી કહી શકાય; પરન્તુ મુખ્યદિના છક્કા પંનામાંથી માંડ માંડ એ ત્રણ અઠવાડીયાં કાઢી તીર્થંકર ગોત્ર ખાંધી લેવાવાળાએને. સમેતશિખર જેટલા ફરના તીર્થની યાત્રા કરવાને અને કરાવવાને મહીનાએની કુરસદ કયાં મળી શકે અને જે ત્રણ અઠવાડીયાંની કુરસદથી તીર્થંકર ગોત્ર ખાંધાતુ

હોય, તો પછી મહીનાએ કોણું કાઢે ? એ પણ એમના મન વિચારવા જેવું જ છે ને ?

ખરી વાત તો એ છે કે જેઓ સંધ કાઢીને લાભો રૂપિયા ખરચે છે, તેઓ તેજ રકમમાંથી હુલરો જૈનોની-કેટલાએ કુદુંભોની રક્ષા કરી શકે છે. અને કુદુંભોની રક્ષા કરતાં જે લાભ થાય, એ એમના સંધ કાઢવાના લાભ કરતાં કંઈ ઓછો લાભ નથી. એમ માર્ગ નખ મન્ત્રથ્ય છે. જૈનો જીવતા હશે, ધર્મધ્યાનમાં રત હશે-મહાવીરના અનુયાયી બની રહેશે, તો તેઓ તેજ તીર્થીની રક્ષા કરશે કે જે તીર્થીને આપણે આપણું તારણુહાર માનીએ છીએ. અને એટલા માટે સૌથી પહેલાં મહાવીરના અનુયાયીએ છે તેની રક્ષા અને નવા વધારવા પ્રયત્ન કરવાની જરૂર છે.

આવીજ રીતે જૈનોતું મહેદું દાન પાંજરાપોળો નિમિત્તે થાય છે. બેશક પાંજરાપોળો દ્વારા જનવરોની રક્ષાનો જેઓ લાવ રાખે છે, તે પ્રશસ્ય છે, પરન્તુ એ પાંજરાપોળો નિમિત્તે ખરચાતા દ્રવ્યના પ્રમાણુમાં બલ્કે એમ પણ કહી શકાય કે જીવદ્યાના પ્રમાણુમાં જીવ હિંસા તે દ્વારા કેટલી થાય છે, એનું લાન એ પાંજરાપોળાના પૂજારીઓને થાય, તો કેટલું સારું ? પાંજરાપોળો જે હેતુથી જનાવવામાં આવે છે, એ હેતુને સર્કળ કરવા માટે પ્રયત્ન કેટલા કરે છે ? કેવળ પાંજરા-પોળનું કે જીવદ્યાતું નામ લઈને કોઈ ઉલો રહ્યો, અથવા જુના પુરાણું ચિત્રો અને જુનાં પુરાણું હેડખીલો પર્યુંખણું

જેવા તહેવારોમાં લાવીને સહામે મૂકવામાં આવે એટલે દ્રવ્યનો વરસાદ વરસાવવો શરૂ કરવો, એ તે કોઈ દાનપ્રણાલી છે ? નથી જેવાતું તેનું કાર્ય કે નથી જેવાતો એ દ્રવ્યનો ઉપયોગ. આમને આમ કેટલાયે ધુતારાઓએ પોતાની હુકાનો જમાવી લીધાનાં લોપાળાં ધીરે ધીરે અહાર પડી રહ્યાં છે. બેશક, સુંભદ્રની જીવદ્યા મંડળી જેવી પ્રતિષ્ઠિત સંસ્થા, કે જે પદ્ધતિસર અને લાલાલાલનો વિચાર કરીને બુદ્ધી બુદ્ધી ચોજનાઓ ક્રારા જીવદ્યાનું કાર્ય કરે છે, એવી રીતે જે કોઈ સંસ્થા કાર્ય કરતી હોય, એને ઉત્સેજન આપવામાં કંઈ પણ અહયણ નથી. પરન્તુ એમાં પણ એક વિચાર અવશ્ય રાખવાનો છે અને તે એકે લરતામાં ન લરવું જોઈએ. આવશ્યકતાનો અને લાલનો વિચાર અવશ્ય કરવો જોઈએ. એક સંસ્થા પાસે લાખો રૂપિયા હોય, અને સારી રીતે ખર્ચ ચાલતું હોય છતાં દ્રવ્ય વધારવાના મોહથી ભીખ માણ્યાજ કરે. અને કોણો લરતામાં લર્યાંજ કરે. જ્યારે ભીજુ એક સંસ્થા, કે જેને ખર્ચને પહોંચી વળવાને માટે જોઈતું કુંડ ન હોય, અને કાર્ય સાર્દ થઈ રહ્યું હોય, તેના તરફ જ્ઞાનો પણ નહિં, પરન્તુ એમ ન કરતાં એની આવશ્યકતાની પૂર્ણ પહોંચાં કરવી, એ જરૂરનું છે. આપણી શિક્ષણ સંસ્થાઓમાં મહોટે લાગે આવી પરિસ્થિતિ હેખાય છે. જ્યાં કાશી દ્રવ્ય છે, ત્યાં દ્રવ્ય વધાર્યો જવાય છે અને તેના પ્રમાણુમાં કાર્ય કરી શકતું નથી. અને ક્યાં કાર્ય કરવાની ધગશ છે, કાર્ય કરનારાઓનો

સહભાવ છે, ત્યાં દવ્યની ચિંતાએ હોય છે, આવી પરિસ્થિતિના પરિણામે જ શિક્ષણ કાર્યમાં પ્રતિવર્ષ લાગે રૂપિઅાનો વ્યય થવા જીતાં જોઈતું પરિણામ આવતું નથી.

આમ જૈનોએ—જૈન આગેવાનોએ પોતાની દાનપ્રણાલી વિવેકપૂર્વક જ આગળ વધારવાની જરૂર છે. ધર્મી વખતે અવિવેકથી—અવિચારથી અથવા એમ કહેવામાં આવે કે અંધ-શ્રદ્ધાના આવેશથી કરેલી ભક્તિ કિંબા દાનથી ભયંકર તુકસાન પણ થાય છે.

સાધુએને સુખરાલીયા ખનાવવામાં જો કંઈ કારણ હોય તો તે શ્રાવકેની અંધશ્રદ્ધાયુક્ત ભક્તિ છે. ભક્તિના મોહમાં નહિ ખપતી વસ્તુએ ગૃહસ્થો ઠેરાવે, સહોષ આહાર જ્હેરાવે, પોતાના જ ગામમાં કે આસપાસનાં ગામોમાં રહેવા માટે એકના એક સાધુએને આશ્રમ કરે, આ બધાનું પરિણામ એ આવે છે કે—સાધુએ શિથિલ થાય છે. “ચોમાસું આવ્યું, પાલીતાણુમાં સાધુ—સાધીએ ધરણાં હશો, ચાલો ખુબ લાલ લઈએ.” એમ વિચાર કરીને ગૃહસ્થો પાલીતાણુમાં રસોડુ એલે. એક નોકર અને એક રસોયો રાખે. બહુ તો એકાદ શ્રાવક ઠેરાવવા વાળો રાખે. રસોડે માણુસ જમે ત્રણ અને સહવારના પઢોરમાં ફૂધ ઉકાળે ઢોઢ મણુ. બ્યોરે રોટલીને આટો બાંધે સવામણુ અલ્કે આખા દિવસ રસોડુ ચાલુજ. સાધુ સાધીએનાં ટોળે-ટોળાં આવતા જતા રહે એ રસોડે. બતાવો આતે લાલ કે

કુણંડુણા ? આપણી આ દાનપ્રણાલી ક્યાં સુધી વ્યાજખી છે, એનો કોઈ વિચાર કરે છે ? માધુકરી કિંવા ગોચરી કરનારા એવા કેટલાયે સુનિરાજે કેવળ ત્રણ માણુસના રસો-દેથી તરપણીએ ભરીને હૃદ અને પાતરાં ભરીને આહાર ઉપાડે, એ અને કેવળ ત્રણ કે ચાર માણુસના રસોએ સાધુ સાધ્વીયોનું જ લક્ષ્ય રાખીને મણુ મણુ કે દોદ દોદ મણુની રોટલીએ। બને એ કુણંડુણા નહિ તો બીજુ શું છે ? ખુખી તો એ છે કે પાછા એજ રસોાં ઓલી સાધુ સાધ્વીયોનાં પાતરાં ભરનારા દાનવીરો (!) સુંખર્યના બજારમાં એસીને પોતાની દાનવીરતાનાં ખણગાં પણ કું કે અને પેલા સાધુ-સાધ્વીયોને હુલકા પાડે.

આવી રીતે કપડાં કંખળીએ બહારાવવાના સંખંધમાં પણ વિવેક રાખવાની જરૂર છે. શા માટે સો સો-દોદસો દોદસોની કંખળો બહારાવવી ? શા માટે ઢાકાની મતલબો શોધવા માટે બજારે ખજાર લટકવું ? લક્ષ્યિતના આવેશમાં કરવું, ને પછી નિદંશ્વા, એ પણ આશ્ર્યજને !

અતએવ કહેવાની મતલબ એટલાજ છે કે-આપણી દાનપ્રણાલીમાં સુધારાની ધણીજ જરૂર છે. આજે જે દાન થઈ રહ્યું છે, એને સામાજિક દસ્તિએ જોઈએ તો વિશેષ લાલ કંઈજ નથી થતો. અને એટલાજ માટે હું તો વારંવાર કહેતો આવ્યો છું કે-જે કંઈ કામ કરે તે દ્વારા ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને કરે અથવા ટુંકમાં કહીએ તો સમયને ઓળખીને કરે.

આજે સમાજની જે કંગાલીયત હાલત અંદરખાનેથી થઈ રહી છે, એ અમારા દાનવીરોએ આંખો ખોલીને જેવાની જરૂર છે. જૈનોની એ આંતરિક હાલત સુધારવા માટે સૌથી પહેલાં પ્રયત્ન કરવાની જરૂર છે. જ્યાં સુધી તે તરફ પુરતું લક્ષ્ય નથી અપાતું, ત્યાં સુધી આપણા સંઘા ને ઉત્સવો, ઉજમણુંને ઉપધાનો, સામૈયા ને સાબેલાઓ, બધુ જગતની દિશિએ હાસ્યાસ્પદ જેવું છે. આપણો એ ઉપરી આડંભર અત્યાર સુધી નભી રહ્યો, પણ હવે અંદરની સ્થિતિ બહાર આવી રહી છે, એટલે વધારે વાર ટકે તેમ નથી. માટે દાન કરનારાઓએ, એ રૂપિયા પણ ખરચતો વખતે ઉપયોગિતાનો વિચાર કરીને ખરચવા, એટલું જ કહેવું કાઢી છે.



(૫૪)

સામાજિક પત્રન.

‘સમાજ’ એ ચોક્કસ માન્યતાઓ ધરાવનારા મનુષ્ય સમૂહનું નામ છે. ‘સમાજ’ નો સંબંધ ‘ધર્મ’ અને રાષ્ટ્રની સાથે રહેલો છે. ચોક્કસ ધાર્મિક સિદ્ધાન્તોનું પાલન કરનારો તે મનુષ્ય સમૂહ હોવાથી, સમાજનો ધર્મની સાથે ધનિષ્ઠ સંબંધ છે. એ ધાર્મિક સિદ્ધાન્તો, રીતરિવાળે તેમજ એ મનુષ્ય સમાજે માનેલા આસ પુરુષની આજાઓનું ઉદ્ઘાંધન થતાંજ એ સમાજકારા ધર્મ નિંદાય છે. ‘ધર્મ’ તો એવી

કોઈ વસ્તુજ નથી કે જેની ‘નિંદા’ કે ‘સ્તુતિ’ થઈ શકે. પરન્તુ એ ‘ધર્મ’ ને-એ ‘ધાર્મિક નિયમો’ ને જે સમાજે સ્વીકાર્ય છે, એ ‘સમાજ’ ની કર્તાવ્યનિપુણતાથી-ધર્મ-પાલનથી ‘ધર્મ’ ની સ્તુતિ થાય છે, અને એ સમાજની કર્તાવ્યબ્લાષ્ટતા કિંબા અપાલનથી ધર્મ નિંદાય છે. જે સમાજના કારણે ધર્મ નિંદાય, એ સમાજ ખરેખર કમનસીખ સમજવો જોઈએ. અને જે વ્યક્તિના કારણે ધર્મની નિંદા થાય, એ વ્યક્તિ પણ ખરેખર અધમજ સમજવો જોઈએ. અને એટલાજ માટે કહેવામાં આવ્યું છે કે મનુષ્યનું પોતાનું ગમે તે થાય, પરન્તુ પોતાના નિમિત્તે ધર્મની નિંદા થાય, એવું કૃત્ય કાળાંતરે પણ ન કરવું જોઈએ. ધીન શાફ્ફોમાં કહીએ તો સો માણુસો ધર્મ ન પામે, એની દરકાર નહિં, પરન્તુ એક માણુસ અધર્મ ન પામવો જોઈએ. અર્થાતું એવું કૃત્ય નજ થવા હેવું કે જેથી એક પણ માણુસને ધર્મ પ્રત્યે છુણ્ણા ઉત્પન્ન થાય.

આવી રીતે ‘સમાજ’ નો રાષ્ટ્રની સાથે પણ ધનિષ્ઠ સંબંધ છે, એટલા માટે કે સમાજ એ રાષ્ટ્રનું એક અંગ છે. ધણ્ણા ‘સમાજે’ નો સમૂહ બનીને એક રાષ્ટ્ર બને છે. કોઈ પણ રાષ્ટ્રના-દેશના એક પણ સમાજનું પતન, એ, રાષ્ટ્રના પતન સમાન છે. આખા શરીરના એક અંગમાં રોગ, એનો અર્થજ એ છે કે એ આખું શરીર દોગી-કુંભી છે.

‘સમાજ’ સંબંધી આટલું અવલોકન કર્યા પછી હવે આપણે જોઈએ કે—‘જૈન સમાજ’ નું સ્થાન અત્યારે ક્યાં છે?

‘જૈન સમાજ’ એ પણ એક સમાજ છે. અગ્નિયાર લાખ મનુષ્યોનો સમૂહ, અતએવ સમાજ છે. ‘જૈન સમાજ’ નો સંબંધ ‘જૈનધર્મ’ સાથે છે. જૈનસમાજની ઉત્ત્રતિમાંજ, જૈન સમાજની કર્તાવ્યનિષામાં અથવા એમ કહીએ કે ‘જૈન સમાજ’ ના આજ્ઞાપાલનમાંજ જૈનધર્મની શોભા અને કીર્તિ છે, જ્યારે જૈનસમાજના પતનમાં જૈનધર્મની નિંદા છે. આવીજ રીતે જૈનસમાજની તરફીમાં રાષ્ટ્રની તરફી છે, અને જૈનસમાજના પતનમાં રાષ્ટ્રને પણ નુકસાન છે. ધર્મ અને રાષ્ટ્ર એ બજેના ગૌરવ કે લઘુતામાં ‘જૈનસમાજનો’ પણ હિસ્સો છે. આ વાત જૈનસમાજની પ્રત્યેક વ્યક્તિએ ભૂતવી જોઈતી નથી.

હવે જોઈએ કે જૈનસમાજનું અત્યારે પતન થઈ રહ્યું છે કે ઉત્થાન !

સૌથી પહેલાં જૈનસમાજની સંખ્યા જીએ. હવે એ તો જરાયે અસ્પષ્ટ જેવું નથી રહ્યું કે—જૈનસમાજ સંખ્યાની દસ્તિએ દિવસે દિવસે નિયે ઉતરી રહ્યો છે. કયાં કરોડોની સંખ્યામાં હૃદાતિ ધરાવતા જૈનો અને કયાં અત્યારે અગ્નિયાર કે ખાર લાખ જૈનો! બહુ લાંખો સમય ન નિહાળીએ તો પણ છેલ્લાં ત્રણુસો સાડા ત્રણુસો વર્ષમાંજ જૈનોની સંખ્યા એટલી બધી ધરી

રહી છે કે જેનો હિસાબ લગાવતાં પ્રતિવર્ષ આડ આડ હજ રનો ઘટાડો ખરાખર નિશ્ચિત થયો છે. જૈનોના સામાજિક પત્રનનું આથી વધારે દુઃખદાયી ઉદાહરણ બીજુ કયું હોઈ શકે ? ત્રણુસો સાડાત્રણુસો વર્ષથી નિયમિત સંખ્યામાં આ પ્રમાણેનો ઘટાડો થતો હોવા છતાં હજુ સુધી જૈનસમાજ તરફથી એ ઘટાડો અટકાવવાના ચાંપતા ઈલાજે નથી લેવામાં આવ્યા, નથી લેવામાં આવતા, એ શું એહી કમનસીથી છે ? ખલ્કે જેવાઈ તો તેથી ઉલટુજ રહ્યું છે. સંખ્યાનો ઘટાડો અટકાવવાને ખલ્કે સંખ્યાના ઘટાડામાં ઔર વધારે થાય એવાજ પ્રયત્નો થતા જેવાય છે.

જૈન સમાજની આર્થિક સ્થિતિનું બારિકાઈથી અવલોકન કરતાં પણ સ્પષ્ટ હેખાય છે કે જૈનો દિવસે દિવસે ઘસાઈ રહ્યા છે. ઘસાઈજ નથી રહ્યા, પરન્તુ હજરોની સંખ્યાના કુંકુંભોમાં ગરીબાઈ આવતી જાય છે, અને એ ભુખનીરાના કારણે અનેક પ્રકારના અનર્થી થવાના કિસ્સા પણ ઘણ્ણી વખત બહાર આવતા જેવાય છે—સંભળાય છે. જૈન સમાજ એ એક મહેઠી વ્યાપારી કોમ ગણ્ણાતી. સંખ્યામાં, આટામાં લુણ ખરાખર હોવા છતાં, હિનુસ્થાનના વ્યાપારનો મહેઠો ભાગ જૈનોના હાથમાં હતો. આજે જૈનોના હાથમાં તે વ્યાપાર ક્યાં છે ? કહાચિત કોઈ ગામના ગર્દ કાલના ગરીબને આજે ધનાઢ્ય થયેલો કે એકાદ બંગલો બંધાવી મોટરમાં મોજ કરતો જોઈને કોઈ એમ માને કે—જૈનોમાં ધનાઢ્યો વધ્યા

સમયને ઓળખો.

છે-વધે છે, તો તે ઓછો ભર્મ છે. એ ધનાંદ્ર્ય ખરેં ધનાંદ્ર્ય નથી, પરન્તુ સો કુદુંઓને ભીખારી બનાવીને પોતાને ધનાંદ્ર્ય બનાવવનારો કૃત્રિમ લક્ષ્મીપુત્ર છે. આજની હિંદુસ્થાનની આર્થિક સ્થિતિનો અલ્યાસ કરવારા હવે તો સ્પષ્ટ પણે પોકારી રહ્યા છે કે-હિંદુસ્થાનિયોના હુથમાં કોઈ પણ વ્યાપાર રહ્યો નથી. અને જે વ્યાપાર અત્યારે હેખાય છે તે કેવળ સદ્ગો છે. આ સદ્ગોમાં અમારાજ દેશના સો કુદુંઓ ભીખારી બને છે, લારે એક ગૃહુસ્થ લક્ષ્માધિપતિ બને છે. આવી સ્થિતિમાં જૈન સમાજમાં ધનાંદ્ર્યો વધવાની કદ્વપના પણ કરી શકાય તેમ નથી. જૈનસમાજનું આંતરજીવન તપાસવું હોય તેણે ગામડાઓમાં ફરવું જોઈએ. હજારો કુદુંઓ શી રીતે પોતાનો જીવનનિર્વાહ કરી રહ્યાં છે, એ જેવું જોઈએ. મતલખ કે જૈનસમાજનું આર્થિક સ્થિતિમાં પણ પતન જ થઈ રહ્યું છે. અરે, જે દેશના મનુષ્યોની, મનુષ્ય દીઠ માસિક આવક સવા એ ઝપિયાથી વધારે ન હોય, તે દેશના એક નાનામાં નહાના સમાજમાં ધનાંદ્ર્યોની વૃદ્ધિ માનવી, એના જેવી અજ્ઞાનતા ખીલ કઈ હોઈ શકે.

આવીજ રીતે કેળવણીના વિષયમાં પણ કેટલું પતન થઈ રહ્યું છે, એતો પેલા મુંખુંવાળા નરોત્તમ બી. શાહ આપ-ણુને સત્તાવાર આંકડાઓથી પુરવાહ કરી આપતાજ રહ્યા છે. તેમાં ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક કેળવણીમાં જ જ્યાં મહેદું ગાખડું પહેલું હોય ત્યાં ઉંચી કેળવણી તરફ તો આપણે દૃષ્ટિપાત યે કુયાંથી કરી શકીએ.


નૈનસમાજનું સાંસારિક ગૃહભૂવન તપાસવામાં આવે તો ત્યાં પણ પતનતા સિવાય બીજું શું દેખાય છે? નૈનધર્મ પાળનારા નૈનસમાજનું ગૃહભૂવન, જે શુદ્ધ પાદના હેઠું જોઈએ, એ કેટલા કુદુંઓમાં દેખાય છે? શ્રી હેમચદ્રાચાર્યે વર્ણવેલ ન્યાયસમ્બળવિમબ: આદિ ઉપ શુણો, કે જે શુણો, એક ધર્મને ચોણ્ય ગણુવનાર ગૃહસ્થમાં આવશ્યક છે, એમાંના કેટલા શુણો કેટલા ગૃહસ્થોમાં દેખાય છે? આ ઉપરાંત વિવાહાદિ સાંસારિક કાર્યોમાં વધી પડેલી સંકુચિતતાએ, અને તેના કારણે ઉલા થયેલાં અનર્થી કોનાથી અન્નાણ્યા છે? સમાજ એક સમાજ રૂપે ન રહેતાં ઓશવાળ, પોરવાળ, શ્રીમાલ, શ્રીશ્રીમાલ, પલ્લીવાલ, અચ્ચવાલ, ખંડેલીવાલ અને એવા અનેક ક્રિકાઓમાં વહેંચાઈ ગયેલ છે. તારીઝ તો એ છે કે-આ બધાઓએ પોતપોતાના વાડા જુદા જુદા બનાવી વિવાહાદિ કાર્યોમાં પણ જુદાઈ કરી નાખેલી છે. આટલેથી નથી અટક્યું. હું ધણી વખત ખતાવી ગયો છું તેમ-એક એક ક્રિકામાં પણ અનેકાનેક ઘાણો-નહાની નહાની વાડીઓ બની ગયેલી છે. આના પરિણામે સામાજિક પતનમાં દિવસે દિવસે વધારોજ થઈ રહ્યો છે. વળી બાળકમ, વૃદ્ધવિવાહ, કન્યા વિક્રિય અને વર વિક્રિય વિગેરે રાક્ષસી રિવાજે એવા તો ખર કરી ગયા છે કે-જેના કારણે સામાજિક પતનની પરિસ્થીમા આવી પહોંચી છે, એમ અહેલું અતિશયોક્તિવાળું નહિ ગણ્યા.

જેવી રીતે જૈન સમાજનું સામાજિક પતન સાંસારિક દૃષ્ટિએ થઈ રહ્યું છે, તેવી રીતે ધાર્મિક દૃષ્ટિએ પણ ખરેખર પતન જ થઈ રહ્યું છે. આજના જૈનસમાજની પ્રત્યેક ધાર્મિક કિયાઓનું અવલોકન કરીએ તો જાણે એમજ જણાય કે-આપણે આત્મ વિનાનો ધર્મ કરી રહ્યા છીએ. જેટલી જેટલી ધાર્મિક કિયાઓ છે, એ બધી એ આત્મકલ્યાણના સાધનભૂત છે, એમાં કોઈથી પણ ‘હા ના’ કરી શકાય એમ નથી, પરન્તુ એ ધર્મકિયાઓ કરનારા મહોટે ભાગે, એ કિયાઓ એવી રીતે કરે છે કે-જાણે એ કિયાની કંઈ હિન્મત જ નથી. સામાચિક, પ્રતિકભણ, પौષ્ઠ, પૂજા, દાન-પુણ્ય, ઉત્સવ, મહોત્સવ, ઉભમણું, ઉપધાન, સંઘ, સ્વામિવાત્સલ્ય, ધર્યાદિ ધર્યાદિ જે કંઈ કિયા કરવામાં આવે, એને સમજવાની અને એનાથી ઉમજ થતા ભવિષ્યના ફળનો વિચાર કરવાની જરૂર નથી શું ? જો કે-આ એ બાળતોનો કેટલેક સ્થળે અલાવ દેખી કેટલાક લોકો કિયાઓથી સર્વથા વિસુધી થાય છે, એ ખરેખર ભૂલ ભરેલું છે. હા, એવી તમામ કિયાઓ શુદ્ધ, સમજપૂર્વક અને ભવિષ્યના ફળનો વિચાર કરવાની પ્રેરણું અને હિન્મતથી અવશ્ય કરવી જોઈએ. કુંકમાં કહીએ તો લગવાનું મહાવીર દેવના શાસનમાં કોઈપણ વસ્તુ એકાન્તે કહેવામાં નથી આવી. અને એટલાજ માટે કહેવામાં આવ્યું છે કે, જે કંઈ કરે તે દ્રોય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને કરે. અથવા સમયને ઓળખીને કરે.

આમ જૈન સમાજનું ખરેખર સામાજિક પતન દરેક રીતે થઈ રહ્યું છે, એ સ્પષ્ટ દેખાય છે. બદ્લે 'જૈનસમાજ' કે જૈન આપણે 'સંધ' ના નામથી ઓળખીએ છીએ, એ 'સંધ' ની સત્તાની દસ્તિએ નિહાળીએ તો તેમાં પણ ખરેખર પતનજ દેખાય છે. 'સંધસત્તા' એ જૈનધર્મમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સત્તા તરીકે ઓળખાવવામાં આવી છે. તીર્થિકરે પણ 'સંધ' ને નમસ્કાર કરે છે. આખા સમૂહની સત્તાનો સ્વીકાર ધુરંધર આચાર્યો, પૂર્વધરો, ગણુધરો અને તીર્થિકરે પણ કરતા આવ્યા છે. એજ સંધની સત્તાનો આજે વિચાર સરખો કરતાં પણ હૃદય ધડકી ઉઠે છે. આજે 'સંધ સત્તા' જેવું કયાંય કંઈ દેખાય છે શું? આ લયંકર પતન નહિં તો બીજું શું છે? આજે સાધુ સમુદ્દરાયમાં મહોટા મહોટા આચાર્યો કે જેએ પોતે પોતાની મેળે પોતાને શાસન સત્તાએ, કલિકાલ સર્વજો. અને ચુગ પ્રધાનો કહેવરાવે છે, વસ્તુતઃ તેઓની સત્તાથી સમાજનું એક પાંદડું પણ હાલી શકે છે કે ખરું કે? આવી જ રીતે સમાજમાં એવા કેટલાયે ગૃહસ્થો છે કે જેએ જમીન ઉપર પગ હેતાં પણ શરમાય છે, પરન્તુ 'જૈન સંધ' માં તેઓનું વજન કેટલું છે, એનો જ્યારે તેઓ પોતે એકાન્ત બેસીને વિચાર કરતા હશે લ્યારે તેમને જ શરમાવું પડતું હશે. આજે સમાજમાં અનેક કેળવાયલા પણ છે; પરન્તુ તેઓ પણ સંધનાં કાર્યોમાં સેકચે પાપડ લાંગવાની

સત્તા નથી રાખતા, એ શું કોઈથી અજણ્યું છે. આ બધું શાથી બન્યું ? નિર્ણયકતાથી. આજે સમાજ છિન્ન છિન્ન થઈ ગયો છે. નથી કોઈ કોઈને કહી શકે તેમ, કે નથી કોઈ કોઈનું માની શકે તેમ ? જૈન સંધમાં-જૈન સમાજમાં હમેશાંથા સાધુઓનું પ્રાધાન્ય સ્વીકારતું આવ્યું છે. પ્રાચીન ઈતિહાસ તપાસતાં સામાજિક, ધાર્મિક કાર્યોમાં સાધુઓ-આચાર્યોના આધિપત્ય નીચે વિચારો પરામર્શો થયા છે. વ્યવસ્થાઓ ગોઠવાઈ છે, પરન્તુ એજ આચાર્યો અને સાધુઓ આજે સમયના શરૂ થઈને શાસનની-ધર્મની અપભ્રાજના થાય એવાં કાર્યો કરે, તો પણી એઓનો પ્રલાવ કેમ પડી શકે ? એજ આચાર્યો અને સાધુઓ આપ-સમાં મળીને સમાજેથાનના વિચારો ન કરે, બદલે..... ઘરુંરાયતે વાળી કહેવતને ચરિતાર્થ કરતા હોય તો એમના ઉપરેશથી જનતાને શાંતિ કેમ મળે ? મતલખ કે-જૈનસમાજ ‘એક સંધ’ છે. ‘સંધ’ એ પચીસમા તીર્થંકર સમાન છે, એનીજ સત્તા આજે ગખડી પડી છે. તો પણી એ સમાજના પંતનનો ખીલો વિચાર કરવો, એ મૂળને છાડી ડાળાં પકડવા જેવું જ ગણ્યાય. અતએવ આવી પતન અવસ્થામાંથી ઉદ્ધાર કરવાની લાવના જૈન સમાજની પ્રત્યેક વ્યક્તિની ધર્મી જોડુંએ. આ સબંધી જૈન આચાર્યો અને સાધુઓએ પણ દીર્ઘ વિચાર કરવાની જરૂર છે. પોતાના મમત્વ-હુરાથણના કારણે જૈનધર્મ નિંદાઈ રહ્યો છે, એ લક્ષ્યમાં લેવાની જરૂર છે. પોતાના માટે નહિં, પરન્તુ કેવળ જૈનધર્મની ખાતર

દીલી દેસીયો મૂકી એક ખીજને મળી વિચારોની લેનદેન
કરી કંઈક સંગઠન કરવાની જરૂર છે. એવીજ રીતે જૈન
ગૃહસ્થોએ પણ કોઈ પણ સાધુ કે આચાર્યના પક્ષમાં ન
પડતાં, તટસ્થપણે જૈનધર્મની ખાતર સંગઠનના ઉપાયો
હાથ ધરવાની જરૂર છે. શાસનદેવ સર્વને સહભુદ્ધિ આપો,
અને જૈન સમાજનો આ પતન અવસ્થામાંથી જલદી ઉદ્ધાર
કરો, એજ અંતિમ આકંશા.



(૫૫)


 યુવકોને.

જ્ઞાલા યુવકો !

કાયાપલટનો જમાનો આવ્યો છે. ગુરૂડમવાદના ખાતમા થવાના દિવસો નજીક હેખાય છે. રૂઢીની શુલામીના બંધનો દીલા પડવા લાગ્યા છે. ધર્મના ઓડા નીચે ચલાવાતી અંધા-ધુંધિયોનાં વાદળો વિખરાવા લાગ્યાં છે. લાગના લેખાસમાં ગમે તેવા ધાર્મિકોની પૂજના-માનતાનાં પોકળો પ્રકાશમાં આવવા લાગ્યાં છે, અને સર્વત્ર સત્ય-સૂર્યના પ્રકાશની પ્રભા અંખી અંખી પણુ પ્રકાશવા લાગી છે. તમે શું જુવો છો ? તમને કેમ હેખાય છે ? જે ઉપરની વાત તમને

ખરેખર દીસતી હોય તો યાહેંમ કરીને બહાર આવો. ખહુ લાંખી ચોડી વેતરડમાં ન ઉત્તરતાં આખી હુનિયાનો ઠેકો ન લેતાં કુમશઃ આગળ વધો. પહેલાં જૈનસમાજનો સડો દૂર કરવાનું કામ હાથ ધરો. આજે જૈન સમાજના પ્રત્યેક અંગમાં જે સડો પ્રવેશ કરી ગયો છે, એ હવે કોઈથી અનણણ્યો નથી. મંહિરામાં લક્ષ્ણના નામે થતી અશાતના, ઉપાશ્રયોમાં લ્યાગના નામે એકઠો થતો પરિથિહ, સાધુઓમાં મહાવીરના નામે વધતો જતો ઐટો આડંખર અને આ ઉપરાંત સત્તાની મારામારી, પાટ ઉપર પડંપડા, પુસ્તકો અને ચેલાઓ માટે લડંલડા. આવીજ રીતે ગુહસ્થવર્ગમાં જે પોદંપડી ચાલી રહી છે, જે સત્તાના મહો ઝરી રહ્યા છે, જે ધર્માચો ઉકળી રહી છે, જે પક્ષપાતનાં ચશમાં ચઢી રહ્યાં છે, એ અધાનો પણ સુધારો કરેજ છુટકો છે. આ સુધારો એ તમારા હોથમાં છે. યુવકો, “યુવાન એ નવ સૃષ્ટિનો સરજનહાર છે.” પરન્તુ મિત્રો, જરા સ્મરણુમાં રાખજો કે, આવા શફ્ફો કાગળો ઉપર છાપવા અને વ્યાખ્યાનોમાં જાડવા, એ એક વાત છે; જ્યારે સાચુ યુવકપણું પ્રાસ કરવું, એ બીજી વાત છે. એક યુવક આવો સરજનહાર, આવો સુધારક કયારે જની શકે, એનો ખાસ વિચાર કરજો અને એટલા માટે હું તમને કહું છું કે, તમે સુધારકના લેખાસમાં કે સરજનહારની કોઈમાં બહાર પડો, તે પહેલાં તેની ચોણ્યતા મેળવજો. વ્યર્ધનો કોળાઙ્ગો કે શફ્ફોની મારામારી એ પાણીને ઘલોવવા જેવું છે. સાચું સંગીન કંઈ પણ ક્રીણ મેળવવું હોય

તો, એ ધાંધકીયાઓની સહામે ધાંધક મચાવવામાં કર્તા-વ્યની 'ઈતિ શ્રી' ન માનતાં સાચી ચોણ્યતા પ્રાપુ કરીને મેદાને જગમાં ઉત્તરને. જવાહર નેહરુ, એ સાચા યુવક તરીકે બહાર પડ્યા છે. સાચા સુધારક તરીકે બહાર પડ્યા છે. પરન્તુ એમને પૂછો તો ખરા કે એમણે સ્વાર્થનો કેટલો ત્યાગ કર્યો છે? એવા ત્યાગ વિના ખાલી શબ્દોનું લાલિત્ય કે ડાહી ડાહી વાતો કંઈ કાર કરી શકતી નથી. મિત્રો, જરા સંભાળને કે જે આશ્રેપો આપણે ભીજ ઉપર મૂકૃતા હોઈએ, તે આશ્રેપોના લાજન આપણે કયાંય ન થઈએ.

હું ધણું વખતથી લખતો અને માનતો આવ્યો છું તેમ-આજનો યુવાન એ સમાજના શરીરનો સડો હૂર કરનાર એક ડાક્ટર છે. પરન્તુ એ ડાક્ટરો! સમાજના શરીર ઉપર એપરેશનનું ચાકુ ચલાવવા અગાઉ તમે તમારા શરીરની શુદ્ધિ કરનો. તમારા શસ્ત્રાને ખૂબ ઉકાળી-તપાવીને સારુ કરનો. અને તમારો હુથ-તમારુ મન સ્થિર રાખવા જેટલી શક્તિ મેળવનો. જો જો કાચુ ન કાપી નાખો, જો જો કયાંય ઉંઘું ન વેતરી મારતા! ભગજનું સમતોદપણું જળવવાની શક્તિ મેળવનો, રૂઢીના ગુલામોની ગમે તેવી ઉશ્કેરણીએ કે હુમલાએ. વખતે તમે શાન્તિથી તમારું પ્રચાર કાર્ય કરવાનું બળ મેળવનો. યુવાનીનો જોશ, એ દીવાનીનો મદ છે. એ મદમાં મસ્ત ન બની જતા. સેંકડો વર્ષોથી ચઢેલા કાટને ધોાવાની તમારી તાલાવેલી, ગલરાટ ભરી ન હોઈએ.

એ કાટ ભલભલા તેજપોને પણ હુજમ કરી જશે. પરન્તુ ચુક્તિ અને બુદ્ધિભળથીજ કામ લેવાનું છે, એ વાતને જરાયે ન ભુલશો !

ભાઇએ, થોડા વખત ઉપર મારા એક 'સુધારા' ના લેખમાં કહી ગયો છું તેમ, સુધારકોએ સૌથી પહેલાં સુધરવાની જરૂર છે. આપણે આપણો મદ ફર કરવો. અને જે સુધારો કરવા આપણે મથતા હોઇએ, એ સુધારાની શરૂઆતં આપણે આપણી જાતથી-શરીરથી-ધરથી કરવી જોઈએ. જરા એ પણ સંભાળો કે-' સુધારક 'ના લેખાસમાં કોઈ ઠગારા પોતાનું કામ ન કાઢી જાય, કે જેથી તમારી આખી યે પ્રવૃત્તિને કલંક લાગે.

આ ઉપરાન્ત એક ખાસ વાત ધ્યાનમાં લેવાની છે, અને તે એ કે-સુધારકોએ-યુવકોએ સૌથી પહેલાં પોતાનું સંગઠન કરવાની જરૂર છે. ગામે ગામના યુવક મંડળોએ એકજ પદ્ધતિથી પોતાની પ્રવૃત્તિ આગળ ધપાવવી જોઈએ. જો ચુવકોએ સંગઠન ન કર્યું, અને જેમ મરળુમાં આવ્યું તેમ ધપાવે રાખ્યું તો સંભવ છે કે, કોઈ વખતે ' લેને ગઈ પૂત ઐ આઈ ખસમ ' વાળી કહેવતને ચરિતાર્થ થતી જેવાનો પ્રસંગ આવશે. અતએવ સંગઠનની પહેલાં જ જરૂર છે.

બીજુ ભાખત એ છે કે ચુવકોએ જે કંઈ પ્રવૃત્તિ આહરવાની જરૂર છે, તેમાં ખાલી ઠરાવો પાસ કરવા, ભાષણો આપવાં કે નિયમાવલીએ બહાર પાડવા માત્રથી કંઈ સાર્થકતા થવાની

આશા કોઈએ નજ રાખવી. આજે ઠરાવો કોણ નથી કરતું ? ઠરાવોમાં કે લાખણ્ણોમાં એટલી બધી અનવસ્થા થઈ ગઈ છે કે જાણે એનો કંઈ કિમત જ નથી રહી. ઠરાવોની હાર-માળાઓ, એટલે જાણે આખા ગામની લેંસો આપી દીધાનું ક્ષારસ. ક્યો પક્ષ ઠરાવો નથી કરતો ? ક્યા પક્ષના ઠરાવોને થોડી કે મહોદી સંખ્યામાં અતુમેદનારા નથી મળતા ? ખરી વાત એ છે કે, વાસ્તવિક પ્રયત્નથી લોકમત કેળવવાની જરૂર છે. જે કે સલાઓ ભરવી, ઠરાવો કરવા, એ પણ લોકમત કેળવવાનું એક સાધન જરૂર છે. પરન્તુ તેની સાથે સમાજના મુખ્ય જે અંગમાં આપણે સુધારો કરવા માગીએ છીએ, એ અંગની જેટલી બની શકે તેટલા અંશો સહાનુભૂતિ વધારવા પ્રયત્ન કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, ચુવકો દીક્ષા સંખ્યી નિયમો ઘડે, અને તે નિયમોનાં કાગળીયાં મુંબઈના બજરમાં કે થોડાં ઘણાં ખહાર પણ ફેલાવે. મારા નામ મત પ્રમાણે તો એવા નિયમો ઘડવામાં કંઈ પણ સાર્થકતા નથી. ખરી વાત તો એ છે કે-જે સાધુઓ ઉદાર વિચારના હોય, જેએ સમયને ઓળખીને દીક્ષા આદિની પ્રવૃત્તિના હિમાયતી હોય, તેએનું સંગઠન અથવા સમ્મેલન કરાવવાની સૌથી પહેલી તક જરૂર છે. તે સાધુઓ જ પોતે પોતાનું સંગઠન કરીને ‘ દીક્ષા ’ કે એવી બીજી પણ આવશ્યકીય ખાખતોના નિયમો-એક બીજાની સાથેના પરામર્શ પૂર્વક બનાવે તો તે નિયમોનો અમલ જલદી થઈ શકે. લલે પ્રારંભમાં આવા ઉદાર વિચારના સાધુઓની સંખ્યા અદ્યપજ હોય. કંઈ હરકત નહિં. ધીરે

ધીરે એમની સંખ્યામાં વધારે જ થવાનો. સમય પોતાનું કામ કરે જાય છે, અને તે પ્રમાણે વિચારોમાં પરિવર્ત્તન થતું જ રહેવાનું. સૌથી પહેલો પ્રયત્ન આ કરવાની જરૂર છે. મારા યુવક બંધુઓને પણ સમય ઉપર અભર પડશે કે સાચા સુધારક સાધુઓ પણ કેટલા છે અને કોણ કોણ છે? સુધારાની ખૂબો મારવી, સુધારાનાં વાખ્યાનો કરવાં અને પોતાનો પક્ષ વધારવા કે ગમે તે કારણે સુધારક યુવકોની ‘હા’ માં ‘હા’ મેળવવી, એક વાત છે, અને સુધારાની સમય પ્રમાણેના પ્રવૃત્તિ આદરવી, એક બીજાને મળવું, વિચારોની લૈન હેઠ કરવી, એ બીજી વાત છે.

સુધારક યુવકો, તમારે એક ઔર વાત પણ ખાસ કરીને ધ્યાનમાં લેવાની છે. અને તે એ કે સુકાના પાપે લીલું ન ખણે, એના ખૂબ સંભાળ રાખજો. ઘોડાની પાયગામાં ઝૂંશી ઘોડો તો એકાદ જ હોય. મહેઠા સમુદ્ધાયમાં અક્ષલના એથમીર તો ગણ્યા ગાંધ્યા જ હોય, પરન્તુ એવી ગણ્યી ગાંધી વ્યક્તિએના કારણે આપો સમુદ્ધાય—આખી સંસ્થાનો છેદ કરવાની અંશમાં પણ પ્રવૃત્તિ ન કરજો. એલવામાં કે લખવામાં, વાતોમાં કે વર્તનમાં એની સંભાળ જરૂર રાખજો કે—નૈનધર્મને—નૈન-સમાજને સાધુ સંસ્થાની ઘણ્યીજ જરૂર છે. સાધુ સંસ્થા વિના આખા સંઘનું નાવ કિનારે નહિં પહોંચે, એ નિશ્ચિત છે. સાધુઓએ નૈનધર્મને ટકાવી રાખવામાં સૈથી મહેઠો ફરજો આપ્યો છે, એ નિર્વિવાદ છે. સાધુઓએ પોતાના ચારિત્રના

પ્રભાવથી જૈનધર્મની કીર્તિ-લતા ખૂબ વિસ્તારી છે. સાધુ-
ઓએ સાહિત્યની સમૃદ્ધિ દ્વારા જૈનધર્મનું રક્ષણ કર્યું છે.
એ ત્યાગી સાધુઓના આચાર વિચારની વાત સાંભળવા
માત્રથી, આજ પણ ગમે તેવા જૈનધર્મના કદર દેખીનાં પણ
રોમરાય ખડાં થાય છે. રાજ-દરખારોમાં એ ત્યાગનાજ કારણે
પ્રભાવ પડી શકે છે. દેશ દેશાન્તરોમાં જ્યાં જૈનોની વસ્તી
લગભગ નથી જ, ત્યાં પણ એજ તમારો ત્યાગી વર્ગ પૂજય
છે અને એ દ્વારા જૈનધર્મની સૌરલ સર્વત્ર ફેલાય છે.
એ ત્યાગ તરફ-એ સાધુ સંસ્થા તરફ ક્યારે પણ ધૂણાની
નજરથી ન જોશો ! ધ્યાન રાખજો, જે દિવસ તમે તમારા
લક્ષ્યને છોડ્યું, તે દિવસ તમે તમારી પ્રવૃત્તિમાંથી લપસ્યા
સમજજો. માટે લક્ષ્યને કંદિ ન છોડ્યો. તમારો વિરોધ
અયોગ્ય પ્રવૃત્તિએ સહામે હોવો જોઈએ. તમારો વિરોધ
શુંડાશાહી પરત્વે હોવો જોઈએ. તમારો વિરોધ આચાર-
પતિતા સહામે હોવો જોઈએ.

એક ખીલુ વાત. તમે તમારા વ્યક્તિત્વથી ગમે તેને શુરૂ
માનતા હો, ભલે માનો, તમે તમારા વ્યક્તિત્વથી ગમે તેને
ગમે તેવાં ઉંચા ભલે માનો, પરન્તુ તમારી જહેર પ્રવૃત્તિમાં-
તમારા આ જહેર જુંબેશમાં એની ગંધ સરખી પણ ન આવવી
જોઈએ. તમારી લડત સાર્વજનિક હોવી જોઈએ. નહિ કે
વ્યક્તિત્વની. તમારી જુંબેશમાં પક્ષપાતને કે અમુક વ્યક્તિ
પ્રત્યેના એંચાણુને જરા પણ સ્થાન ન હોવું જોઈએ. જો

જગતને એમ ખ્યાલ આવશે કે—આ લડત તો અમુક વ્યક્તિના માટેજ છે, આ લડતના ગર્ભમાં તો અમુકનું સંચાલન છે, તો સમાજનો કે તમારી લડતને પાચો મરીયા મેલ થઈ જશે. ગમે તેવો સાચો સુધારક પણુ—તમારા વિચારોનો પ્રશંસક પણુ તમારા એ પક્ષપાતી ચશમાંથી ફરજ રહેશે. તમારા વિચારો ગમે તેટલા સારા હશે, સાચા હશે, સમાજને લાલના હશે, છતાં એની અસર જોઈએ તેવી નહિં જ થવાની. એ વાત ખૂબ દૃઢતાથી સમજ રાખશો. માટે-

૦હાલા સુધારકો ! ચુવકો ! તમારે ધણું ધણું સંભાળવાનું છે. સુધારક તરીકે બહાર પડવું, એ મીણુના દાંતે લોઠાના ચણુા ચાવવા જેવું છે. સુધારક તરીકે બહાર પડવા અગાઉ પોતાની ધણી ધણી શુદ્ધિ કરવાની જરૂર છે. સુધારક થવા અગાઉ ધણી ધણી શારીરિક, માનસિક અને વાચિક શક્તિઓ અખલવવાની છે. ખાસ કરીને મગજનું સમતોલપણું, પક્ષપાત રાહિત્ય અને ખૂબ દૃઢતા; એ ગુણો ખાસ અગત્યના છે. મને સંપૂર્ણ આશા છે કે—આવી ચોખ્યતા પૂર્વક તમે બહાર પડી જૈનસમાજના અંગમાં પ્રવેશેલો સડો ફૂર કરી તમે આ વીસભી સહીના જમાનામાં સાચા કાન્નિકારક તરીકે તમારું નામ અમર કરવા સાથે મહાન् પુણ્ય હુંસલ કરશો.



(૫૬)

ધર્મ અને સમાજ પર સમયનો પ્રભાવ.

સમય એક ચેવી વિચિત્ર વસ્તુ છે, કે જેનો પ્રભાવ સંસારની હુરેક વસ્તુ ઉપર પડ્યા વિના રહેતો નથી. દેશ, જાતિ, ધર્મ, સમાજ, વેષ, વ્યક્તિ, શિક્ષણ, વ્યવહાર યાવત્ સંસારની જેટલી વસ્તુઓ છે તે અધી સમયને આધીન છે. જેવો જેવો સમય આવતો જાય છે, તેવા તેવા પ્રકારના ફેરફારો હુરેક વસ્તુમાં થયાજ કરે છે અને તેટલાજ માટે જુનું તે નખું અને નખું તે જુનું થાય છે. જે કાલે હતું તે આજ નથી, અને જે આજે છે તે કાલે નહિં હોય. સંસારની આ ઘટમાળ નિરંતર ચાલ્યાજ કરે છે. સમયનો આ

પ્રલાવ એ કુદરતી છે. કુદરતના આ નિયમની રહામે થઈને કોઈ એમ કહે કે નહિં “અમે સમય-ખમયને કંઈ માનતા નથી. જેટલું પુરાણું છે તેટલુંજ સાચું છે, અને તેજ અનુસાર ચાલવું જોઈએ,” તો તે કેવળ કથન માત્ર કિંવા બ્યર્થ પ્રલાપ છે. આ સંસારની એક પણ વ્યાકૃત સમયને આધીન થયા વિના રહી શકી નથી અને રહી શકે તેમ પણ નથી. જેઓ ઉપર્યુક્ત કથન કરે છે, તેઓ પોતે પણ ધાણું જુનું છોડી ચુક્યા છે અને નવું આદરતાજ રહે છે. બ્યવહારની બાબતોને તો બાજુ ઉપર મૂકીએ. ધર્મશાસ્કોની રચના પણ સમયને અવલંખીનેજ થાય છે. એ ધર્મશાસ્કોનું હાઈ તપાસવામાં આવે તો જરૂર માલૂમ પડે કે એમાં પણ ‘સમયનો પ્રલાવ’ અવશ્ય રહેલો છે, બલ્કે તે શાસ્કો-પ્રાચીનમાં પ્રાચીન ગણ્યાતાં શાસ્કો પણ સમયને ઓળખવાનો સંદેશ સૌને પહેંચાડે છે.

ઉપર કહેવામાં આવ્યું તેમ ‘સમયનો પ્રલાવ’ ન કેવળ બ્યવહારિક બાબતો પર પડે છે, બલ્કે યાવત્ સંસારની સમસ્ત વસ્તુઓ ઉપર પડે છે.

દેશો, શહેરો, થામો અને ધરેાની રચનાઓનાં પ્રાચીન વણ્ણનો વાંચો અને આધુનિક દેશો, શહેરો, ગામો અને ધરેાની રચનાઓ નિહાળો, કેટલું બધું અંતર જણ્યાય છે? પ્રાચીન મતુષ્યોની વેષભૂષામાં અને અત્યારની વેષભૂષામાં કેટલો બધો તક્ષાવત પડી ગયો છે? આજે પ્રાચીનતાને પકડી રાખવા

માટે આપણે ગમે તેટલી ધમપછાડો કરીએ, છતાં સમય તો પોતાનો પ્રલાવ નાખ્યા વિના રહ્યો જ નથી.

જે કે આનો અર્થ એ નથી કે “જેટલું પ્રાચીન છે તે બધું ખરાબ જ છે, અને નવું બધું સારું છે.” તેમ એમ પણ નથી, કે “નવું નહારું છે અને જુનું સારું જ છે.” અહીં કહેવાનું એ છે કે સમયના પ્રલાવ પ્રમાણે સંસારની પ્રત્યેક વસ્તુમાં પરિવર્તન થયાજ કરે છે. હવે એ પરિવર્તનમાં કેવો વિવેક જળવવો, એ મનુષ્યની બુદ્ધિ ઉપર આધાર રાખે છે. નવીનતામાં યદિ લાભ છે, ઉજ્જવિ છે તો તેનો આદર કર્યો જ છુટકો અને જે તેનો આદર નથી કરતા, તો તેનું પરિણામ એ આવે છે કે તે તે કાર્યોને ભયંકર ધક્કો પહોંચે છે. દાખલા તરીકે એક પ્રાચીન કિયા આપણે કરતા આવતા હોઈએ, પરંતુ તે કિયા આ સમયને બંધાસતી ન હોય, અર્થાત્ એ કિયામાં સમયાનુકૂળ ફેરફાર કરવાની જરૂર જણ્યાતી હોય તો તેવો ફેરફાર કર્યો જ છુટકો. આપણે હઠાત્રી થઈ જે તે કિયાને પકડી જ રહીએ તો તેથી સામાજિક દિને ભયંકર નુકશાન ઊંઘવવું પડે.

પહેલાં કહેવામાં આવ્યું છે તેમ ‘સમયનો પ્રલાવ’ દરેક વસ્તુ ઉપર પઢ્યો છે અને પડી રહ્યો છે. જે કોઈ એમ કહે કે ચાલી આવતી કિયામાં, ઝદીમાં, રીતરિવાજમાં ફેરફાર નજ થાય, તો તેઓ ખરેખર ભૂલ કરે છે, બદકે સૂર્યના પ્રકાશમાં સાક્ષાત દેખાતી વસ્તુને પણ એક તૃણ સમાન

પ્રયત્નથી ઢાંકવા પ્રયત્ન કરે છે. સામાજિક કે ધાર્મિક, રાજ્યીય કે રાજકીય કોઈપણ પ્રકરણનું પ્રાચીન પડ ઉપેડવામાં આવે તો સ્પષ્ટ માલૂમ પડશે કે જુના જમાનાની કિયાએ, દૃઢીએ અને રીતરિવાળેમાં અવશ્ય ફેરફાર થયેલા છે. પૂર્વ પુરુષોએ ફેરફારો અવશ્ય કર્યા છે, બદ્દે આધુનિક સમયના તે દૃઢી-પૂજાઓ કે જેએ પ્રાચીન રીવાળેને પકડી રાખવાનો આગ્રહ કરે છે, તેઓ પોતે પણ જુના રિવાળેમાં ફેરફારો કરી રહ્યા છે. ફરદ માત્ર એટલોઝ છે કે પોતાના ફેરફારો એમની નજરમાં નથી આવતા; જ્યારે ખીંચે કોઈ માણુસ ફેરફાર કરવાનું કહે છે તો તેમાં તેઓ ધર્મનો નાશ સમજે છે. આ ખુદ્ધિની કિંવા સમજની અલિહારી છે. અસ્તુ.

હું આપણે એ જોઈએ કે સમયનો પ્રલાવ ધર્મ અને સમાજની કદ્ય કદ્ય ભાખતો ઉપર અત્યાર સુધી પડી ચુક્યો છે?

એક વાત સ્પષ્ટ કરવી જોઈએ. ‘ધર્મ’ એક એવી વસ્તુ છે કે જેમાં કંઈપણ જાતનો ફેરફાર થઈ શકતોઝ નથી. ‘ધર્મ’ એ તો આત્માની સાથે સંબંધ ધરાવનાર વસ્તુ છે, અને એટલાઝ માટે ‘ધર્મ’ની વ્યાખ્યા આમ કરવામાં આવી છે:—

“ અંતःકરણશુદ્ધિત્વં ધર્મત્વમ् ” અથવા “ કષાયનિવૃત્તિત્વં ધર્મત્વમ् ” અંતઃકરણ શુદ્ધ થવું એનું નામ ધર્મ, અથવા કૃષાયથી નિવૃત્ત થવું એનું નામ ધર્મ. ધર્મ તો કાર્ય છે. ધર્મકિયાએ, પ્રતિકુમણુ, સામાયિક, પैષધ, દાન,

પુષ્ટય, પરોપકાર, જ્ઞાન એ બધાં કારણો છે, સાધનો છે. એ સાધનોમાં ફેરફારો અવશ્ય થઈ શકે. ઐશક ધર્મનાં કારણોને, કારણુનો કાર્યમાં ઉપચાર કરીને, 'ધર્મ' માની શકીએ, પરંતુ એ કારણોમાં ફેરફાર નજ થઈ શકે, એ માનવું સરાસર ભુલ લરેલું છે. હું અહીં 'ધર્મ' અને 'સમાજ' ઉપર સમયનો ગ્રલાવ જે બતાવવા દર્શિં છું તે ધર્મના કારણોમાં છે—ધર્મનાં સાધનોમાં છે. એ ધર્મનાં સાધનોમાં સમય સમય ઉપર ફેરફાર અવશ્ય થયો છે. જુઓ સઉથી પહેલાં આવશ્યક કિયા—પ્રતિકમણું.

આવશ્યક કિયા—

પ્રતિકમણું એ છ આવશ્યકતું નામ છે. પહેલાં છ આવશ્યકમાં પ્રતિકમણુની કિયા સમાસ થતી. પરંતુ સમય સમય ઉપર આચાર્યોએ અમુક અમુક સૂત્રોની રચના કરી અને એ સૂત્રો ધીમે ધીમે પ્રતિકમણુની કિયામાં દાખલ કર્યાં. દાખલા તરીકે એમ કોઈ નહીં કહી શકે કે—અત્યારે પણ્ણી, ચાઉમાસી અને સાંવત્ಸરિક પ્રતિકમણુમાં બોલાતું સર્કલાઈટ શ્રીહૃમચંદ્રાચાર્યની પહેલાં બોલાતું હતું. ચાવીશ તીર્થીકર ભગવાનોની આ સ્તુતિ શ્રીહૃમચંદ્રાચાર્યે બનાવ્યા પછીજ તે પ્રતિકમણુમાં પ્રવેશી ગઈ છે. એ સૌ કણુલ કરશે કે શાંતિ એ માનદેવની બનાવેલી એટલે માનદેવસૂરિ પહેલાં આ સ્તુતિ નહેાતી કહેવાતી. એ સ્પષ્ટ છે. આવીજ રીતે સ્નાતસ્યાની સ્તુતિ હૃમચંદ્રાચાર્યના શિષ્ય ભાલચંદ્રની પહેલાં, સંસારદાવાની સ્તુતિ હરિલદ્રસૂરિની પહેલાં, અજિ-

તરાંતિ નહેથણુની પહેલાં, અરે, થોડાજ વર્ષોની પહેલાં થઈ ગયેલા કૃત્તિવિજયના શિષ્ય જ્યવિજયલુએ બનાવેલું સકલ-તીર્થવંદુ કર લોડ-, એ ગુજરાતી ભાષાની તીર્થવંદના એ બધું એમની પહેલાં કહેવાતું હતું શું ? પ્રતિક્રમણુ જેવી આવશ્યક કિયામાં આમ નવાં નવાં સૂત્રોનો પ્રવેશ એ શું સમયનો ઓછો પ્રલાવ સૂચયે છે ? કેટલાક લોકો પ્રતિક્રમણુમાં થંલણુ પાર્શ્વનાથનું ચૈત્યવંદન કરે છે. ખરતર ગંગાનુયાયી લોકો દાદા સાહેબનો કાઉસાગ્રા કરે છે. લલા જ્યારે દાદાસાહેબ નહિં થયા હતા ત્યારે તે વખતના ખરતર-ગંગાનુયાયીઓ શું દાદાસાહેબનો કાઉસાગ્રા કરતા હતા કે ?

અહીં એ કહેવાનો પ્રશ્ન નથી કે પ્રતિક્રમણુ જેવી આવશ્યક કિયામાં આ સૂત્રો શા માટે ધુસ્યાં ? ગમે તે કારણે ધુસ્યાં. જીવે ધુસ્યાં. પરંતુ જેએ એમ માને છે કે—“પ્રાચીન રીવાજમાં કોઈ પણ જલનો ફેરફાર ન થઈ શકે” એએને આ એક સ્પષ્ટ જવાબ છે. ભૂતકાળના લયંકર ઉદ્દરમાં આવાં તો કેટલાંએ પરિવર્તનો હજમ થઈ ગયાં. તેનો કંઈ હીસાખજ નીકળી શકે તેમ નથી.

સંવત્ಸરિક પર્વ ભાદરવા શુદ્ધી પાંચમનું હમેશાંથી ચાદ્યું આપતું હતું, પરંતુ તે કાલકાચાર્યના સમયથી પાંચમના અદલે ચોથના દિવસે થવા લાગ્યું. આ શું ઓછું પરિવર્તન છે ? સમયનો ઓછો પ્રલાવ છે ? કાલકાચાર્યને કેવો સમય ઓળખવો પડ્યો ?

મંહિરો અને ભૂર્તિઓ.

આવીજ રીતે આપણું તારણુહાર મંહિરોની પરિસ્થિતિઓ જુઓ. મંહિરો ઉપર પણ સમયે કેવો પ્રલાવ નાખ્યો છે? પ્રાચીન સમયમાં આપણું મંહિરોમાં અત્યારની માફક પેઢીઓ ચાલતી હતી, લઈયા અને પડાણો ચોકી માટે રાખવા પડતા હતા, એમ કોઈ કહી શકે તેમ છે?

મંહિરોની બાંધણીઓ તપાસવામાં આવે તો અત્યારે જે જે નવાં મંહિરો બને છે; તેમાં, જેટલી આજ કાલની ફેશનનું તત્ત્વ દાખલ કરવામાં આવે છે, એના કરતાં એની મજબૂતાઈ અને શીદ્વકળાનું તત્ત્વ ઓછુંજ જોવામાં આવે છે. આ પણ સમયનો પ્રલાવ નહીં તો બીજું શું? મનુષ્યના વિચારો, મનુષ્યની બુદ્ધિઓ સમયને અનુસરે છે. તેની પાછળ પાછળ ચાલે છે અને તેનુંજ પરિણામ છે કે મંહિરો અને એવી બીજી બાધતોમાં આજકાલની ફેશનનો ઓપ વધારે ચદ્રાવવામાં આવે છે. જરા ભગવાનના અંગ ઉપર થતી અંગરચ્ચનાઓનું તો નિરીક્ષણ કરો! વીતરાગદેવના ઉપર થતી અંગરચ્ચનાઓમાં પણ કોટ, પાટલુન અને નેકટાઈ, કોલર તેમજ ઘડીઓ મુકવાના છંદ પડી ગયા છે. હજુ હેટ-અંગ્રેઝ ટોપી પહોંચારાવી હોય, એવું જોવામાં નથી આવ્યું! કેટલો સમયનો પ્રલાવ! મંહિરના રંગમંડપો અને દીવાલો જ્યાં સંગમરમરથી સુશોલિત અને મજબૂત થતાં, ત્યાં આજે ધૃતાલીની લાદીઓથી ચમક દમક ખતાવવામાં આવે છે.

મંહિરોની રક્ષા માટે જેટલી આજે ગૃહસ્થોને હાયહાય કરવી પડે છે, તેટલી પહેલાં નહોંતી કરવી પડતી. ગૃહસ્થો આવશ્યકતા પડતાંજ દ્વય લગાવીને જીર્ણુંદ્વારાદિ કરી લેતા. ધીરે ધીરે લોકોની ભાવનામાં ફરક પડવા લાગ્યો. આવકનાં સાધનોભીજાં રહ્યાં નહીં. એટલે પૂજા-આરતી આદિની ઓલીઓ શરૂ થઈ અને એ ઉપજ મંહિરોમાં લઈ જવા લાગ્યા.

પ્રાચીન મૂર્તિઓમાં અને આધુનિક મૂર્તિઓમાં પણ કેવો મોટો ફેરફાર હેખાય છે. અત્યારે મોટે ભાગે મૂર્તિઓ ઉપર નવ અંગે ચાંદીનાં ટીલડાં ચોટાડેલાં હોય છે. આ શું જરૂરનાં છે ? વીતરાગની મૂર્તિ સાથે એનો કંઈ સંબંધ ! પરંતુ આ ટીલડાં શાથી લાગ્યાં ? કોઈ સમયમાં ચંદનથી પૂજા કરતાં કરતાં લોકોનો ખ્યાલ સુંદરતા ઉપર ગયો. સુંદર રંગ ઉત્પજ કરવા માટે ચંદનની સાથે કેશર લેળવવા લાગ્યા. લેળવતાં લેળવતાં કામ વધી પડ્યું. ચંદનની ગૌણુતા થઈ ગઈ અને કેશર વધી પડ્યું. પરિણામે કેશરની ગરમી આરસની મૂર્તિઓ ઉપર અસર કરવા લાગી. મૂર્તિ ઉપર ડાધ પડવા લાગ્યા, તેમ એ આરસને પણ અસર થવા લાગી. એટલે જ્યાં જ્યાં કેશર ચઠાવાતું ત્યાં ત્યાં નવ અંગે ચાંદીનાં ટીલડાં ચોટાડ્યાં. એ ટીલડાં ઉપર પૂજા કરવા લાગ્યા. હું એ ટીલડાં મૂર્તિ ઉપર ન હોય તો અમારા ઝઢીપૂજકો કહેશે કે “ વાહ ! લગવાનના નવ અંગે તો ટીલડાં ચોટાડ્યાં નથી. ” તેમ કેશરની ગરમીથી થતું નુકસાન અને કેશરની

અપવિત્રતાના કારણે કોઈ કેશરને વાપરવાનો નિષેધ કરશે તો દીપીપૂજકો ચીલવાથ ઉઠશે: “ જોયું ! કેશરને બંધ કરી ધર્મનો નાશ કરવા એડા છે. ભીલકુલ નાસ્તિક થઈ ગયા છે ” ઈત્યાદિ. અસ્તુ.

કહેવાની ભતલખ એ છે કે મંદિર, મૂર્તિ, મૂર્તિપૂજા, અંગરચના વિગેરેમાં પણ ઘણ્ણું ફેરફાર થઈ ગયો છે. એ અધ્યા “ સમયનોજ પ્રલાવ ” છે, અને એ પ્રલાવને દીપીપૂજકો સારી રીતે જાણું છે.

પર્યૂષણા પર્વ —

આપણું પરમ પવિત્ર પર્યૂષણા પર્વ ઉપર પણ સમયનો કૃવો પ્રલાવ પહોંચો છે ? એનો કોઈ વિચાર કરે છે કે ? પર્યૂષણા પર્વનો ખાસ દિવસ લાદરવા સુધી પાંચમનો હુતો પરંતુ એ પાંચમની ચોથ કરી. પર્યૂષણા પર્વમાં વંચાતુ કદ્વપસૂત્ર સાધુઓજ વાંચતા અને સાંભળતા. જ્યારે સમયના પ્રલાવે એજ કદ્વપસૂત્ર સલા સમક્ષ વાંચવું શરૂ થયું; એટલું જ નહી પરંતુ એ કદ્વપસૂત્રવાંચનની મહીમા વધતાં વધતાં ત્યાં સુધી વધી કે તેના નિભિતે અનેક ડિયાઓ તેમાં પ્રવેશી ગઈ. દાખલા તરીકે સ્વર્ણ ઉતારવાં, ઘોડીયાપારણું જુલાવવું, તેના નિભિતે ધી બોલવું, કદ્વપસૂત્ર સાધુનું હોવા છતાં તેજ વખત ગુહુસ્થ સાધુ પાસેથી લઈને બોલી બોલીને પછી સાધુને વહેરાવવું, ઘોડીયા-પારણું બોલી બોલીને ઘેર લઈ

જવું. બારસાસૂત્રનાં ચિત્રોનાં દર્શન કરાવવાં, બોલી બોલાવી વોડીયાં-પારણું નિમિત્તે, અનેક માળાએ નિમિત્તે, અનેક રૂમાદો નિમિત્તે બોલીયો બોલાવી, આ બધું પાછળથી નથી વધ્યું શું ? જે વખતે કેવળ સાધુઓઝ કલ્પસૂત્ર વાંચતા હતા તે વખતે આ બધી બોલીયો બોલાતી હતી શું ? સમયના પ્રલાવે આ બધું પ્રવેશી ગયું, એ સ્પષ્ટજ છે.

સાધુના આચારવિચારો—

આવીજ રીતે સાધુઓના આચારવિચારો ઉપર પણ સમયે અવસ્થય પોતાનો પ્રલાવ નાખ્યો છે. સાધુઓ પહેલાં એ પ્રકારના હતાઃ જિનકલ્પી અને સ્થવિરકલ્પી, પરંતુ કાળ-કર્મે સમયના પ્રલાવે શક્તિએ ક્ષીણ થવાના કારણે જિન-કલ્પ વિચ્છેદ થઈ ગયો; એટલું જ નહી પરંતુ સ્થવિરકલ્પી સાધુઓના આચારો જે આચારાંગ અને દશવૈકાલિક આદિ સૂત્રોમાં બતાવવામાં આવ્યા છે, એ આચારોમાં અત્યારે કેટલું બધું અંતર પડી ગયું છે ? એ બધો સમયનો પ્રલાવ નહી તો બીજું શું છે ? સાધુઓએ ‘વસ્તો ન ધોવાં ન રંગવાં’ એવી આજા હોવા છતાં આજે ધોવાની અને રંગવાની પ્રથા નથી પડી શું ? અરે એ સમયના પ્રલાવનું જ પરિણામ છે કે તીર્થંકરોના સમયમાં પણ લિન્ધલિન્ધ તીર્થંકરોના સમયમાં વતો અને આચારોમાં લિન્ધતા હતી, નહી તો મોક્ષમાર્ગ સૌનો એક જ હોવા છતાં એવી લિન્ધતા શાની હોય ? પરંતુ સમયના પ્રલાવે તે તે

જીવોની શક્તિઓ—લાવનાઓ અને બુદ્ધિમાં ફેરફાર હોવાથી આચારે અને વ્રતોમાં ફેરફાર રાખવો પડેલો, એટલે સમયનો પ્રલાવ દરેક વખતે પોતાનું કામ કરે છે.

સાધુઓની નાની નાની કિયાઓમાં પણ જેહાં તો કેટલી બધી કિયાઓમાં ફેરફાર થએલા છે. અત્યારે કંબણીયો અને ઓધારીયાં વિગેરેમાં કેટલાક સાધુઓ સાધ્વીઓ પાસે ગોમુત્રા ભરાવે છે. શું પહેલાંના સાધુઓ એવું કરાવતા હતા? સાધુઓ પહેલાં ખાસ કરીને વાંસના દાંડા રાખતા હતા. અત્યારે એ વાંસનો દાંડા કોઈ રાખે તો એ જાણે સાધુધર્મથી જ પતિત થયો ન હોય, એવો કોલાહલ કરી મુક્વામાં આવે. દાંડા ઉપર ને મોગરા બનાવવામાં આવે છે એની ઉત્પત્તિ પ્રાચીન આચારથિયામાંથી કોઈ બતાવી શકે તેમ છે? આ સિવાય પાત્રાં રંગવાની વિધિ અને એવી સેંકડો ખાખતો છે, જેનો પ્રાચીન રિવાજેની સાથે મુકાખલો કરતાં આકાશ—પાતાળનું અંતર જણ્ણાયા વિના નહીં રહે. આ બધો સમયનો પ્રલાવ નહીં તો બીજું શું? સાધુઓનો નવકલ્પ વિહાર તે આજે રહ્યો છે કે? સમયના પ્રલાવે આજે એમાં પણ કેટલુંએ અંતર પડી ગયું છે.

શાસ્ત્રો—

શાસ્ત્રો એ મનુષ્યની બુદ્ધિ અને વિચારોની સાથે સંબંધ રાખે છે. એક સમય હતો કે ને વખતે મનુષ્યની બુદ્ધિ

તાત્ર હતી. સ્મરણુશક્તિએ અગાધ હતી. તે વખતે તમામ શાસ્ત્રો કંઠસ્થ રાખવામાં આવતાં હતાં. તે સમય પલટાણો. સ્મરણુશક્તિએ ઓછી થઈ. એટલે જેટલું ચાદ હતું તેટલું લખી લેવાયું. લખાયું તે પણ આજકાલની માર્કેક કાગળો. ઉપર નહીં. તાડકાનો અને એવા સાધનો ઉપર તે લખાયાં. સમય બહલાતો ગયો. નવી નવી શોધો થતી ગઈ. પરિણામે તે જ શાસ્ત્રો કાગળ ઉપર લખાવા લાગ્યાં. છાપખાનાં વધ્યાં. જ્યારે થંથે છપાવવા શરૂ થયા, ત્યારે આગમો—સૂત્રો છપાવવા માટે લોકો વિરોધ કરવા લાગ્યા. ‘એવાં પૂજનીય આગમો છપાશો, તો તેની લયંકર આશાતના થશે. ગૃહસ્થો પણ તેને વાંચવા લાગશે. આગમોનું રહુસ્ય બહાર પડી જશે. પ્રેસમાં થતી આરંભસમારંભની કિયાએના નિમિત્તલું તે છપાવનાર થતાં છપાવનાર લયંકર પાપમાં ડુષી જશે. સાધુથી તો એ કિયા તરફ નજર સરખી પણ ન થાય.’ ઈત્યાદિ વિચારેના કારણે જે સમયજો શાસ્ત્રોને—આગમોને છપાવવાના પક્ષમાં હતા, તેમની સામે સખ્ખ વિરોધ કરવામાં આવતો. પરંતુ સમય! તારી બલીહારી છે! તેં ભલભલા હડાયહુંનોની હડોને ડગાવી છે. અને તેં દુદ્ર પ્રતિજ્ઞાધારીએને પ્રતિજ્ઞાએથી ચલાયમાન કરી દીધા છે. આ સમયના પ્રલાવે તે જ વિરોધીએ પોતે આગમો છપાવવા લાગ્યા, મુશ્કેલી શોધવા અને એર્ડરો આપવા પ્રેસમાં ઢોડ્ધામો કરવા લાગ્યા. એમના છપાવેલા આગમો ગાડામાં ભરીને ધારીએ—કુલીએ જોડા પહેરી એ બંડ્લો.

ઉપર ચઢી બેસી એ ગાડીઓ હોડાવતા એ મહાત્માઓ પાસે આવી એ બંડોલા પટકાવવા લાગ્યા. ગઈકાલતા વિરોધી એ મહાત્માઓ, આજે પોતે એ કિયા કરી કરાવી રહ્યા છે. સમયનો પ્રલાવ તે કેટલો !

આવી જ રીતે જૈન સાધુઓની પ્રાર્થીન માન્યતા કે ‘સૂત્રો શ્રાવકોથી ન વંચાય’ તે માન્યતામાં પણ આજે કેટલું અંતર પડી ગયું છે ! “શ્રાવકોથી ન વંચાય અને શ્રાવકોને ન વંચાવાય” એવી માન્યતા ધરાવનાર મહાત્માઓ સ્વયં શ્રાવકોને સૂત્રો વંચાવવા લાગ્યા છે, અને એમ વંચાવવામાં પોતાનુ ગૌરવ-મહત્વ સમજે છે. આ પણ સમયનો પ્રલાવ નહી તો બીજુ શું ? શ્રાવકોની વાત તો ફર રહી, અનૈન વિદ્ધાનો-યુરોપીયનો વિગેરે સૂત્રોનો ઉંડો અલ્યાસ કરે છે, અને તે સંબંધી આશ્ર્યાભરી શોધખોળો કરે છે. આ બધું સમયના પ્રલાવે જ બન્યું છે. આવી જ રીતે જુઓ ઉપરેશ પદ્ધતિ.

ઉપરેશપદ્ધતિ—

ઉપરેશપદ્ધતિમાં પણ સમયના પ્રલાવે ઘણું અંતર પડી ગયું છે. એક સમય એ હતો કે જ્યારે સાધુઓ અહસ્થોના પરિચયથી સાવ નિરાળા જ રહેતા. પોતાના જ્ઞાન-ધ્યાનમાં મસ્ત રહેતાં જગતના જીવોનું કલ્યાણું દર્શાવવા સાથે પોતાનું કલ્યાણું કેમ થાય ? એવી શાંત પ્રવૃત્તિમાં મસ્ત રહેતા.

કેદી લભ્ય પુરુષ કે પુરુષો આવી ચઢતા તો તેઓને થોડા શખ્ફોમાં ગંભીર ઉપદેશ આપતા. પરિણુમે એ લદ્રપુરુષને એ સાધુળુના ચારિત્રના પ્રલાવે થોડા ઉપદેશથી ઘણી અસર થતી. ધીરે ધીરે સમય પલટાયો. સાધુઓ અહુસ્થોના પરિચયમાં વિશેષ આવવા લાગ્યા. ઉપાશ્રોત્યો એ મુનિઓનાં સ્થાન બન્યાં. ઉપદેશ ઉપાશ્રોત્યોમાં થવા લાગ્યો. ઉપાશ્રોત્યની ચાર દીવાલોમાં એમનો ઉપદેશ ગાજવા લાગ્યો. લક્ષ્ણ-શ્રાવકો જી-જીના પડકાર કરવા લાગ્યા. આ સ્થિતિ પણ પલટાઈ. સમયનો વા વાવા લાગ્યો. સમયને અનુકૂળ થઈ કેટલાક મહાત્માઓએ દીવાલો છોડી જાહેર સ્થાનો કે જ્યાં જૈન કે અજૈન કેદી પણ ઉપદેશ સાંભળી શકે, એવાં સ્થાનોમાં ઉપદેશ આપવા લાગ્યા. રૂઢીપૂર્જકો એ વાતનો વિરોધ કરવા લાગ્યા. એટલું જ નહી પરંતુ “ધર્મનો નાશ કરનારા” “શાસનદ્રોહિઓ” ‘નાસ્તિક’ આદ્ય વિશેષણોથી નવાજવા લાગ્યા, પરંતુ એ બિચારાઓને કયાં ખખર હતી કે ખીંબાઓને નાસ્તિક કહેનારા એવા અમારે પણ આવતી કલે ‘નાસ્તિક’ ની પદ્ધતિનું આચરણ કરવાનું છે. ખરેખર એ ‘નાસ્તિક’ કહેનારા પણ સમયને આધિન બન્યા અને જાહેર ભાષણું કરતાં આવડતું હોય ચાહે ન આવડતું હોય, જાહેર સ્થાનમાં ભાષણ અપાયું હોય કે ન અપાયું હોય. ભલે પોતાની રૂઢી પ્રમાણે શ્રાવકોને જ જીન! પડકાર કરાવતા હોય, પરંતુ પેપરોમાં પોતાના વ્યાખ્યાનને ‘જાહેર ભાષણ’ તરીકે છપાવવા લાગ્યા।

અને ઉત્સુકતાપૂર્વક વાંચવા લાગ્યા, ધીરે ધીરે તેમને પોતાની જુની પદ્ધતિમાં ફેરફાર કરવો પડ્યો.

આવી જ રીતે ધાર્મિક કિયાઓમાં રીતરીવાળેમાં સમયનો પ્રલાવ પડ્યો છે અને સમયને અનુસરી ફેરફારો થયા છે.

સામાજિક રીવાળો—

ન કેવળ ધાર્મિક રીવાળો, સામાજિક રીવાળો ઉપર પણ તેટલો જ પ્રલાવ પડેલો છે. દેશ દેશ અને પ્રાંત પ્રાંતના રીવાળો ઉપર સમયનો પ્રલાવ પડ્યો છે અને તેમાં ન કદ્યો શકાય તેવા ફેરફારો થયા છે. એક નાનામાં નાની માસુલી કિયા જ જુઓ.

નમસ્કાર પદ્ધતિ. પહેલાં જે કોઈ પૂજય પુરુષ સામે મળે અથવા તો પૂજય પુરુષના ધરે કોઈ જાય તો હંડવત પ્રણામ કરતા અર્થાત્ લાંબા હંડની માઝે સૂર્ય જઈને પ્રણામ કરતા. તે પછી કાળકુમે ઉલા ઉલા કમરમાંથી લાંકા વળીને ભસ્તક ઝૂકાવીને નમસ્કાર કરવા લાગ્યા, તે પછી સિદ્ધા ટટૂર ઉલા રહેલું અને હાથ જોડી કેવળ માથું નમાવીને નમસ્કાર કરવા લાગ્યા, પછી માથું નમાવવાનું બંધ થયું. કેવળ હાથ જોડવાના રહ્યા. તે પછી એ હાથને અદલે એક હાથ ઉંચો કરી સલામ કરવા લાગ્યા અને અત્યારે સુધરેલાઓમાં એક હાથની સલામ હુર થઈ છે. માત્ર એક આંગળી કે હાથમાં સોટી હોય તો તે ઉંચી કરીને

મુખથી સાહેખળ, નમસ્કાર, પ્રણામથી ઇતીશ્રી આવી ગઈ છે. સમયનો પ્રલાવ કેટલો ! સમયે મનુષ્યના રીતરીવાને ઉપર કેટલી અસર કરી છે.

પહેલાં જૈનધર્મ કોઈ પણ વર્ણાક્રમી પાણી શકતો હતો. અર્થાત્ પ્રાણણુ, ક્ષત્રીય, વैશ્ય કે શુદ્ધ ચારે વર્ણો જૈનધર્મની શીતળ છાયામાં એસતા. કાળડમે આજે વૈશ્યોના હૃથમાં જ જૈનધર્મ રહ્યો અને તેમાં પણ ખાસ કરીને ગણ્યા ગાંધ્યા ઓસવાળ, પોરવાડ, પદ્લીવાળ, શ્રીમાળ આદિમાં જ.

આવી જ રીતે વેષમાં પણ કેટલો ફેરફાર. પ્રાચીન જમાનાનાં જડાં ધોતીયાં, અંગરણાં અને કાંસો બાંધવાની બંડીઓ આજે કયાં દેખાય છે ? આજે તો કોટ, પાટલુન, ટાઈ, કોલર અને બેંગલોર કેપ અથવા ચુરોપીયન ટોપી એ સહૃદસ્થનું ભૂષણું થઈ પડ્યું છે.

આ ઉપરાંત પ્રાંત પ્રાંતની, જુહી જુહી કોમેની, જુહી જુહી ઝિદ્ધિઓમાં આકાશપાતાળનું અંતર થઈ પડ્યું છે. આ ઝિદ્ધિઓ સંખ્યે લંખાણુથી વિવેચન “સમયને ઓળખો” ના પહેલાં ભાગમાં “રૂઢી અને ધર્મ” નામના લેખમાં કર્યું છે. એટલે તેની પુનર્દિક્તિ કરવા અહીં ઇચ્છિતો નથી.

અહીં માત્ર મારો એ જ ખતાવવાનો ઉહેશ છે કે સમયનો પ્રલાવ સામાજિક અને ધાર્મિક રીતરીવાને તેમ જ કિયાઓ. ઉપર નિરંતર પડતો આવ્યો છે, અને પણ્યા જ કરે છે. આપણે મુખથી માત્ર બક્યા કરીએ કે ‘સમય-

અમય શું છે ? પ્રાચીન ચાલી આવતી રૂઢીમાં ફેરફાર કેમ કરી શકાય ? ' એ આપણો વ્યર્� પ્રલાપ છે. આપણે પોતે સમયને આધીન થઈ રીવાજે-રૂઢીઓમાં ફેરફાર કરતા આવ્યા છીએ, અને કરી રહ્યા છીએ, કારણું કે રૂઢી એ તો મનુષ્યની પ્રચલિત કરેલ વસ્તુ છે. સામાજિક કે ધાર્મિક વ્યવહારોનું પાલન થઈ શકે, અને તેમાં અવ્યવસ્થા ઉત્પન્ન ન થાય એટલા માટે બાંધેલા નિયમો છે. એ નિયમો આપણું મનુષ્યના બાંધેલા હોઠ આપણે તેમાં ફેરફાર કરવાના અધિકારી છીએ. તેમ કોઈ રીવાજ આ સમયને અનુકૂળ ન હેખાતો હોય તો તેને સર્વથા હુર કરી શકીએ છીએ. કોઈ સમયમાં કોઈ જલિમાં અમુક કારણોને લઈને બાળકઓ થવા લાગ્યાં હોય, પરંતુ તે પ્રથા આ સમયને માટે પોતાને, જલિને, સમાજને અને આખા રાષ્ટ્રને શાપ રૂપ હોય તો તે પ્રથા શું હુર ન કરવી ? શું તેને વળગી રહેલું ?

આવી જ રીતે તમામ રીવાજેને માટે, રૂઢીઓને માટે સમજવાનું છે. જે રીવાજે જે રૂઢીઓ, સમાજને, દેશને, કે ધર્મને હાની પહોંચાડનારી છે, એ રૂઢીઓમાં અને રીવાજેમાં ફેરફાર કરવો કિંવા એને ભૂળથી હુર કરવો, એ જરૂરનું જ છે. પૂર્વ પુરુષો, આચાર્યો અને સંઘના નેતાઓ એ પ્રમાણે ફેરફારો કરતા જ આવ્યા છે !

રૂઢીપૂર્જકો આવી બાબતોમાં જ્યારે લાજવાખ બને છે લ્યારે માત્ર એક જ શાસ્ત્રની આડ ઉલ્લી કરે છે અને

કહે છે કે “શાસ્ત્રોમાં આમ લગ્ન્યું છે.” પરંતુ તેઓ ભૂલી જાય છે કે જેઓ “સમયને એણાજેણા” ની ઉદ્ઘોષણા કરે છે, તેઓ પણ શાસ્ત્રની આજાને અવલમ્બણીને જ કરે છે. શાસ્ત્રોમાં કોઈ પણ વસ્તુનું એકાંતથી પ્રતિપાદન નથી કરવામાં આવ્યું, એ વાત રૂઢીપૂજકોએ ભૂલવી જોઈતી નથી. બદકે શાસ્ત્રો તો સ્પષ્ટ પ્રતિપાદન કરે છે કે, દ્વય, ક્ષેત્ર, કાળ, ભાવને જોઈને જ કામ કરે ! દ્વય, ક્ષેત્ર, કાળ, ભાવને જોયા વગર જો કોઈ પણ હિયા, કોઈ પણ કામ કરવામાં આવે તો તે લાલને બદલે તુકસાનને પહેંચાડે છે. વળી શાસ્ત્રોના સંબંધમાં પણ ખાસ વિચારવાની જરૂરત છે કે આ વસ્તુ શા માટે કહેવામાં આવી છે ? ક્યા સમયને માટે ઉપયોગી છે ? અંથ ક્યા સમયનો બનેલો છે ? તે સમય કેવો હતો ? આ વસ્તુ તે સમયને માટે કહેવામાં આવી છે કે અનાદિ અનંત કાળને માટે છે ? ઈત્યાદિ બાધ્યતાનો પોતાની બુદ્ધિથી વિચાર અને શોધ કરવાની જરૂર છે. કેવળ પિતાજી દાદાળના શ્રાદ્ધ વખતે ભીલાડી થાંબલવે ખાંધતા હતા, માટે મારે પણ પિતાજીના શ્રાદ્ધ વખતે ભીલાડી ખાંધવી જોઈએ, અને ઘરમાં ન હોય તો ગમે ત્યાંથી લાવીને પણ ખાંધવી જોઈએ, એવું અંધ અનુકરણ કરે જવું એ શું વ્યાજપી કહેવાય ? અને એટલા માટે નીતિકારો કથે છે કે—

કેવળ શાસ્ત્રમાશ્રિત્ય ન કર્તવ્યો વિનિર્ણયઃ ।

યુક્તિહીન વિચારે તુ ધર્મહાનિઃ પ્રજાયતે ॥

કેવળ શાસ્ત્રોનો જ આશ્રય લઈને કોઈ પણ વિષયનો
નિર્ણય ન કરવો જોઈએ, કારણું કે ચુક્તિ વિનાના વિચા-
રથી ધર્મહાનિ થાય છે. માટે બુદ્ધિમાન મનુષ્યોએ
શાસ્ત્રની આજા ઉપર પણ પોતાની પ્રજ્ઞાથી, બુદ્ધિથી લાંબોએ
વિચાર કરવાની જરૂર છે અને તેમ કરવામાં આવે તો જ
શાસ્ત્રોનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરી શક્યા છીએ
એમ માની શકાય. પરંતુ જેઓ પોતાની પ્રજ્ઞાનો ઉપયોગ
કરવા તૈયાર નથી, તેઓને માટે નીતિકારોનું આ વચન
અક્ષરશઃ સાચું ઠરે છે કે—

યस્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રं તસ્ય કરોતિ કિમ् ?

લોचનાભ્યાં વિહીનસ્ય દર્પણઃ કિं કરિષ્યતિ ?

જેને સ્વયં પ્રજ્ઞા નથી, બુદ્ધિ નથી એને શાસ્ત્ર શું
કરે ? જેવી રીતે લોચનથી હીન માણુસને માટે દર્પણ શું
કરી શકે તેમ હતું ?



શ્રી વિજયધર્મસ્તુરિ જૈન ગ્રંથમાળા.

આ સંસ્થાનો ઉદ્દેશ ગુજરાતી, હિન્ડી, સંસ્કૃત, પ્રાકૃત, બંગાળી, અંગ્રેજ આદિ ભાષામાં લોકોપણેણી એવા ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક અને શિક્ષણું સંખ્યે અંધો બહાર પાડવા, એ છે. સંસ્થાનો વહીવટ એક કંભિટી દ્વારા ચાલે છે. સારા સારા વિદ્યાનો પાસે અંધો લખાવી-સંપાદિત કરાવી બહાર પાડવાની યોજના કરી છે. ઉચ્ચા કાગળો, સુંદર ગેટઅપ અને સરસ છપાઈપૂર્વક અંધો બહાર પાડવામાં આવે છે. સાહિત્યની વૃદ્ધિ અને પ્રચાર એજ માત્ર લક્ષ રાખેલું હોઢ સત્તી કિંમતે લોકોને સાહિત્ય પહોંચાડી શકાય એવી યોજના રાખવામાં આવી છે. શ્રીમંતોની સહાયતા, એજ અમૂલ્ય સાહિત્યના સર્જનનો અને પ્રકારાનનો આધાર છે.

એક પંથ એ કાજ-નામનું નામ ને સેવાની સેવા.

૧ સંરક્ષક-એ હજાર આપનાર સંરક્ષક ગણુશે.

લાખ.

૧ આ રકમમાંથી નીકળનારા અંધો ઉપર સંરક્ષકના નામની સીરિજનો નંબર ૧-૨-૩ એમ રહેશે.

૨ વેચાણુંની રકમ બચત રકમમાં ઉમેરતાં તેટલા અંશો અંધતી સંખ્યા વધશે.

૩ દરેક અંધમાં ફોટો રહેશે.

૪ આ રકમમાંથી જે એક અથવા એ મોટા અંધો બહાર પાડવામાં આવશે તો તેમાંના એકમાં સંરક્ષકનું જીવન-ચરિત્ર પણ આપી શકશે.

૫ સંરક્ષકનો ફોટો સંસ્થાના મહાનમાં રહેશે.

૬ સંસ્થામાંથી નિકળતા તમામ અંધોની એક એક
નકલ ભેટ મળશે

૨ લાઇફ મેમબર-એક હજાર રૂ. આપનાર લાઇફ મેમબર ગણુશે.

લાભ

૧ આ રકમમાંથી નિકળનાર અંધોમાં લાઇફ
મેમબરતું નામ સહાયક તરીકે છપાશે.

૨ વેચાણની રકમ અચત રકમમાં ઉમેરાતાં તેટલા
અંશો અંથની સંખ્યા વધશે.

૩ દરેક અંધમાં ફોટો રહેશે.

૪ આ રકમમાંથી જે એક કે બે અંથ બહાર પાડવામાં
આવશે તો તેમાંના એકમાં જીવનચરિત્ર સંક્ષેપમાં
અપાશે.

૫ સંસ્થામાથી નિકળતા તમામ અંધોની એક એક
નકલ ભેટ મળશે.

૩ સહાયક-પાંચસો રૂપિયા આપનાર સહાયક ગણુશે.

લાભ.

૧ સહાયક તરીકે અંધમાં નામ રહેશે.

૨ પાંચસોની રકમમાંથી જે એક ૯ અંથ છપાશે તો
તેમનો ફોટો અને ફોટો નીચે યોડો પરિચય આપ-
વામાં આવશે.

૩ સંસ્થાના દરેક પુસ્તકોની એક એક નકલ ભેટ મળશે.

**નોટ-ઉપરના ત્રણે પ્રકારના સહાયકોએ તરફથી જે જે અંધો છપાશે,
તેની કિંમત લાગત ખર્ચથી પણ એધી રાખવામાં આવશે.**



પ્રકાશિત થયેલા અંથો.

નંબર	નામ	ભાષા	કર્તા યા સંપાદક કિંમત.
૧	વિજયધર્મસુરિ સ્વગંવાસ પઢી.	ગુજરાતી વિદ્યાવિજયજી.	૨-૮-૦
૨	પ્રમાણનયતત્વાલોક સરીકે	સંસ્કૃત ન્યાય	હિમાંશુવિ. ૦-૧૪-૦
૩	ધર્મ વિશોગમાલા	સંસ્કૃત કાબ્ય	, ૦-૨-૦
૪	જ્યન્ત પ્રચંદ	સંસ્કૃત-ગુજરાતી	, ૦-૩-૦
૫	આવકાચાર	હિન્દી	શ્રી વિદ્યાવિ. ૦-૪-૦
૬	વિજયધર્મસુરિકે વચનકુસુમ	,,	, ૦-૪-૦
૭	વિજયધર્મસુરિનાં વચનકુસુમો	ગુજરાતી	,, ૦-૪-૦
૮	સેઠેઝજ ઓાદ વિજયધર્મસુરિ	અંગ્રેજી	ડૉ. કૈએ ૦-૪-૦
૯	વિજયધર્મસુરિ અષ્ટપ્રકારી પૂજા	હિન્દી	શ્રી વિદ્યાવિ. ૦-૪-૦
૧૦	વિજયધર્મસુરિ	ગુજરાતી	ધી. ટેચ. શાહ ૦-૨-૦
૧૧	આખૂ-૭૦ ફોટા સાથે	,,	શ્રીજ્યન્તવિ. ૨-૮-૦
૧૨	સમયને ઓળખો ભા. ૧ લે.	,,	શ્રી વિદ્યાવિ. ૦-૧૪૦૦
૧૩	સમયને ઓળખો ભા. ૨ લે.	,,	૦-૧૨-૦
૧૪	આવકાચાર	,,	, ૦-૩-૦
૧૫	અન આઈડીયલ અંક	અંગ્રેજી એ. જે. સુનાવાલા	૦-૫-૦
૧૬	શાણી સુલસા.	ગુજરાતી.	શ્રી વિદ્યાવિ. ૦-૩-૦
૧૭	પ્રમાણનયતત્વાલોક પ્રસ્તાવના	સંસ્કૃત	શ્રી હિમાંશુવિ. ૦-૩-૦
૧૮	ઉત્તરાધ્યયન સૂત્ર કુમલસંયમી	સંસ્કૃત	શ્રી જ્યન્તવિ. ૩-૮-૦
	ટીકાયુક્ત ચોથો ભાગ		

(જેમણે ત્રણ ભાગો ખરીદ્યા છે, તેમણે ચોથો ભાગ જલદી મંગાવી લેવો.)



પ્રકાશિત કરવાના ગ્રંથો.

૧ અહેતુક પ્રવચન	૮ કલ્પસૂત્ર-મૂળ-સાનુવાદ
૨ ભક્તિનાથ ચરિત્ર	૧૦ હેમય્યાચાય ને કુમારપાલ
અંગ્રેજ અનુવાદ, નોટ સહિત	૧૧ વરસુપાલ તેજપાલ
૩ વિજ્યધર્મસૂત્ર બૃહ્દ્બુદ્ધ ચારત્ર	૧૨ મહાવીર ચરિત્ર
૪ ભારતકે પ્રાચીન વિદ્યાપીડ	૧૩ ગૌતમીય કાવ્ય-ટીકા
૫ તત્ત્વાર્થસૂત્ર અનુવાદયુક્તા	૧૪ આખૂરુસ્તવનાદિ સંગ્રહ
૬ આખૂરુ ભાગ ૨ જો	૧૫ સુલાષિત પદ્ધરતનાકર
૭ આખૂરુના શિલાલેખો	૧૬ દુચાશ્રય-પ્રાકૃત.
૮ નૈન સમપદાર્થી	

સૂચના.

- ૧ રોકડી કિંમતે લેનારા ખુક્સેલરોને સેંકડે ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. જો ૨૫ કે તેથી વધારે કિંમતનાં પુસ્તકો ખરીદ્દી તો (ઉત્તરાધ્યયનને છોડી.)
- ૨ બીજા સામાન્ય આહકોને પચીસ કે તેથી વધારે કિંમતનાં પુસ્તકો ખરીદનારને સેંકડે ૨૦ ટકા કમીશન આપવામાં આવશે. (ઉત્તરાધ્યયનને છોડી.)
- ૩ નં. ૪-૫-૬-૭-૮-૯-૧૦ એ નંબરની ખુક્સો ઠેણવા માટે ૧૦૦ કે તેથી વધારે નક્લો ખરીદનારને અધીં કિંમતે આપવામાં આવશે.
- ૪ દરેક પુસ્તકનું પોર્ટ કે પાર્સલ ખર્ચ ખરીદનારને શિર રહેશે.

લખો—

દીપચંદ બાંઠિયા.

મંત્રી, શ્રી વિજ્યધર્મસૂત્ર નૈન ગ્રંથમાળા.

છોટા સરાક્ષા, ઉજાનૈન. (માલવા)



મળવાનાં ટેકાણાં:-

- १ મંત્રી, વિજ્યધર્મસૂર્તિ જૈન અંથમાળા,
છાટા સરાક્ષા, ઉજઝૈન. (માળવા)
- २ ધીરજલાલ ટેકરશી શાહ,
'જૈનજ્યોતિ' કાર્યાલય,
રાયપુર, હવેલી પોણ, અમદાવાદ.